2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

॥ जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ॥

JANMABHOOMI GROUP

કચ્છમિત્ર

પાના ૧૨+૪=૧૬ સંવત : ૨૦૬૭ ■ અષાઢ સુદ ૭ ■ ગુરુવાર ■ તા. ૭/૦૭/૧૧ ■ કિંમત : ₹ ૩.૦૦

realpatidar.com

KUTCHMITRA ■ BHUJ ■ 7-07-11 ■ THURSDAY ■ વર્ષ : ૬૪ ■ અંક : ૨૯૫ ■ ભુજ ■ Regd. No. G. KCH-3/2008-2011. ■ ફોન : ૨૫૨૦૯૦/૯૧ ■ ફેક્સ : ૨૫૦૨૭૧/૨૫૨૦૮૯. ■ RNI No. 1554/57 ■ Visit us at : www.kutchmitradaily.com

બોંબ ધડાકાનો ખટલો ગુજરાતમાં જ ચલાવાશે

કચ્છમાં આષાઢી છટ્ઠે છડી પોકારતા મેઘરાજા... 'આષાઢી બીજ વીતી ગયા છતાં વરસાદ ખેંચાતાં કચ્છીમાડુ અને ખાસ તો ધરતીપુત્રો, પશુપાલકોના કપાળે ખેંચાયેલી ચિંતાની લકીરો ભૂંસી નાખતાં કચ્છમાં બુધવારે ભુજ, નખત્રાણા, માંડવી, અબડાસા સહિત વિસ્તારોમાં છૂટીછવાઇ મેઘમહેર થઇ હતી. પવન પડી ગયો છે. ગરમી અને ભેજ વાતાવરણમાં પુષ્કળ છે એ જોતાં લોકો મુશળધાર મહેર વરસવાની રાહ જોઇ રહ્યા છે. પ્રસ્તુત વરસાદી દ્રશ્યો દેવપર અને મોથાળાના છે. (વરસાદની તસવીરો : રમેશ રોશિયા, વિનોદ જોષી, સાવન મકવાણા)

નવી દિલ્હી, તા. ૬ (પીટીઆઇ) : સુપ્રીમ કોર્ટે આજે એક ચાવીરૂપ ચુકાદામાં ૫૬ માનવ જિંદગીનો ભોગ લેનાર ૨૦૦૮ના ગુજરાત શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસમાં ૫૦થી વધુ આરોપીઓની સુનાવણીનો માર્ગ મોકળો કરતાં જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી ગુજરાતમાં જ થશે. અમદાવાદનાં મિરઝાપુર સ્થિત ખાસ અદાલતમાં હવે આ કેસ ચાલશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજ્યભરને હચમચાવી નાખનાર ૨૧ જેટલા ધડાકાના પખવાડિયા બાદ એ બોમ્બકાંડમાં 'કચ્છ કનેક્શન' પણ બહાર આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેસને રાજ્ય બહાર લઇ જવાની ૨૦૦૮ના શ્રેણીબદ્ધ વિસ્ફોટના આરોપીઓની અરજી ફગાવી

ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર અને સીરિયાક જોસેફની ખંડપીઠે ભાજપ શાસિત રાજ્યમાં ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ વધુ વકરેલા કોમવાદી માહોલનાં પગલે આ કેસની નિષ્પક્ષ સુનાવણી થશે નહીં તેવી દલીલ સાથે આરોપીઓ દ્વારા કરાયેલી અરજી નકારી કાઢી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ગોધરાકાંડ બાદ પરિસ્થિતિ નોંધપાત્ર રીતે થાળે પડી ગઇ છે. આમ, ગુજરાતમાં ૨૦૦૮ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસની નિષ્પક્ષ સુનાવણી શક્ય ન હોવાનો દાવો માત્ર અટકળ સમાન જ હોવાનું સુપ્રીમે સ્પષ્ટ કર્યું હતું. આરોપીઓએ રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં ટ્રાયલ સ્વતંત્ર રીતે ચાલી શકે નહીં. જો કે, સુપ્રીમ કોર્ટે ફરીવાર કોર્ટમાં જવા આરોપીઓને રદ મંજૂરી આપી હતી. ટ્રાયલ યોગ્ય વાતાવરણમાં ચાલી શકશે નહીં જો એવી પ્રમાણિક દહેશત લાગે તો આરોપી કોર્ટમાં જઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ ૨૦૦૯માં આરોપી સામે ટ્રાયલ સામે સ્ટે મૂકી દીધો હતો. જેમાં આરોપીઓએ રાજ્યની બહાર કેસોને ખસેડવાની રજૂઆત કરી હતી. આરોપીઓની એવી રજૂઆત હતી કે, ફરિયાદ પક્ષ અને તપાસ સંસ્થાઓ શાસક પાર્ટીને સંપૂર્ણપણે પક્ષપાત કરી શકે છે. વર્ષ ૨૦૦૮માં ૨૬મી જુલાઇએ અમદાવાદ શહેરમાં ૨૧ બોમ્બ (જુઓ પાનું ૨)

કચ્છમાં આશા જગાવતો મેઘમાહોલ

અબડાસામાં દોઢથી બે ઇંચ વરસતાં લોકો ગેલમાં : ગરડા પંથકમાં શુકનવંતી પધરામણી : ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા તાલુકામાં ઝરમરથી દોઢ ઇંચ

ભુજ, તા. ૬ : અષાઢના આરંભે કચ્છીઓને વાટ જોવડાવનાર 'મોંઘેરા મહેમાન' મેઘરાજાએ ગઇકાલે માંડવીમાં હાજરી પૂરાવ્યા બાદ આજે કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટીછવાઇ હાજરી પુરાવીને સારા ચોમાસાની આશા જગાવી છે. બુધવારે બપોર બાદ અબડાસામાં વરસેલા મેહુલિયાએ કેટલાક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલી મહેર કરી હતી. આ ઉપરાંત ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાંથી દોઢેક ઇંચ વરસાદી વાવડથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.

કચ્છના વરસાદ માટે એવી કહેવત છે કે જો શરૂઆતમાં અબડાસાના ગરડા પંથકમાં પહેલો વરસાદ થાય તો કચ્છમાં ભયો ભયો. આ વખતે ચોમાસામાં ગરડા સહિત અબડાસાના અમુક ગામોમાં આજે બપોરે મેઘરાજાની પધરામણી થતાં જાણકારોએ વરસાદને શુકનવંતો ગણાવ્યો હતો.

લાંબા સમયથી રાહ જોતા લોકો એવું વિચારતા હતા કે આ વાદળડી કયારે વરસશે, પણ આજે વરસી હતી. ગાજવીજ સાથે ઝાપટાંથી માંડી બે ઇંચ જેટલો વરસાદ થતાં ખાસ કરીને માલધારીઓ અને ખેડૂત વર્ગમાં આશાનો સંચાર થયો હતો.

મોથાળા મથુરા ભયો....

આજે બપોરે મોથાળા વિસ્તારમાં મેઘરાજાનું આગમન કડાકા-ભડાકા સાથે થયું હતું. અમારા પ્રતિનિધિ લક્ષ્મીશંકર જોષીના જણાવ્યા પ્રમાણે સવા ત્રણ વાગ્યાથી શરૂ થયેલા મેઘસવારી સાડા પાંચ સુધી ચાલી હતી, બે અઢી કલાકમાં તો બે ઇંચ જેટલો વરસાદ થયો હતો.

શરૂઆત જોશભેર થઇ હતી પણ વચ્ચે થોડીવાર ધીમો પડયા બાદ ફરી મુશળધાર પડવાનું ચાલુ થયું હતું, રીતસર રસ્તાઓ પરથી ગોઠણ સમા પાણી વહી નીકળ્યાં હતાં. નાના બાળકો મોસમના આ પહેલા વરસાદનો આનંદ લેવા બહાર આવી ગયા હતા.

ખેડૂતો એ પણ આ વરસાદને વાવેતરલાયક ગણાવ્યો હતો, તો આવી શરૂઆતને માલધારીઓએ પશુઓના ચારા માટે આશા દર્શાવી હતી. આસપાસના નુંધાતડ, હાજાપર, સણોસરા, કંઢાય, ભવાનીપર, બેરાખિયા, સરગુઆરા, કનકાવતી વગેરે ગામોમાં પણ એક સરખી હેલી હોવાનું જાણવા મળ્યું હતું.

દરમ્યાન તેમને નરેડીથી મળેલા હેવાલ પ્રમાણે નરેડી-કોટડા વચ્ચેની (જુઓ પાનું ૨)

આજથી ચાર દિવસનું આકાશી ચિત્ર અને કચ્છની વરસાદી આગાહી



ગુરુવાર : હળવો વરસાદ | શુક્રવાર : વાદળછાયું આકાશ | શનિવાર : તડકો-છાંયડો | રવિવાર : હળવો વરસાદ

આજના અંકમાં

- રાપરની સ્થાવર મિલકતોમાં તેજીની આગ -પાનું છેલ્લું
- તબીબોની તપાસ માત્ર પેટ્રોલનો ધુમાડો ? -પાનું છેલ્લું
- પાણી વિના ટળવળતા અબડાસાના ૩૦ ગામ -પાનું ૫
- મુંદરા પી.જી.વી.સી.એલ.ની ૬૬ લાખની વસૂલાત બાકી -પાનું ૫
- વાગડના અમુક ગામોના જંત્રીના ભાવ નક્કી ન થતાં મુશ્કેલી -પાનું ૫
- હવે બહેરા-મૂંગા લોકો ફોનથી વાત કરે છે ! -પાનું ૧૧

હવામાન

	મહત્તમ	લઘુતમ
ભુજ	૩૬.૪° સે.	૨૬.૩° સે.
નલિયા	૩૫.૭° સે.	૨૭.૫° સે.
કંડલા	૩૪.૧° સે.	૨૮.૦° સે.

ભુજમાં ભેજનું પ્રમાણ સવારે ૭૮% અને સાંજે ૭૯% પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિકલાક. દિશા : અનિશ્ચિત.

ટુ-જી સ્પેક્ટ્રમમાં હવે મારનની સંડોવણી

નવી દિલ્હી, તા. ૬ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ આજે સર્વોચ્ચ અદાલતને સોંપેલા તેના હેવાલમાં પૂર્વ ટેલિકોમ મંત્રી દયાનિધિ મારનની ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એમ કહેતાં સંડોવણી કરી હતી કે, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, મારને જાણી જોઇને એરસેલ કંપનીની લાયસન્સ અરજીને દબાવી રાખી હતી.

સીબીઆઇએ કૌભાંડ અંગેનો હેવાલ સુપ્રીમને સોંપ્યો : અરજી દબાવાઇ હતી

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટેલિકોમ ખાતાના અધિકારીઓ તરફથી સર્વાનુમતે ભલામણ છતાં મારને આ ફાઇલને વિલંબમાં નાખી હતી.

સીબીઆઇની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ટેલિકોમ કંપની એરસેલ સાથેના મારનના કાર્યમાં બળજબરીનું તત્ત્વ હતું. ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે, મારને એરસેલના પ્રમોટર શિવાશંકરનને તેની કંપનીનો હિસ્સો મેક્સીસની કંપનીને વેચવા માટે દબાણ કર્યું હતું.

એરસેલના સ્થાપક શિવાશંકરને અગાઉ સીબીઆઇ સમક્ષ એવું નિરીક્ષણ આપ્યું હતું કે, વારંવાર લાયસન્સની ના પાડીને મારને એરસેલનો તેનો હિસ્સો વેંચવા માટે બળજબરી કરી હતી.

શિવાશંકરને છેવટે મેક્સીને પોતાની કંપની વેંચી નાખી હતી. જે મારન બંધુઓની નજીકના કહેવાય છે. પૂર્વ ટેલિકોમ સચિવ જિતેન્દ્ર મિશ્રાએ પણ સીબીઆઇને જણાવ્યું હતું કે, મારને જાણી જોઇને એરસેલની સંબંધિત કંપની વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

સીબીઆઇએ કહ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવાઓ એવું બતાવે છે કે, લૂપ ટેલિકોમ કંપની એ એસ્સાર જૂથની આગળ પડતી કંપની હતી. ટોચની તપાસનીશ એજન્સી સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં લોનની અરજી કરી હતી ત્યારે એસ્સાર તેની કોર્પોરેટ ગેરંટી તરીકે ઊભી હતી.

સીબીઆઇએ જસ્ટીસ જીએસ સિંઘવી અને જસ્ટીસ એકે ગાંગુલીની બનેલી બેન્ચને કહ્યું હતું કે, ૨જી કૌભાંડ કેસમાં તેની તપાસને પરીપૂર્ણ કરવા વધારે સમયની જરૂર છે. સીબીઆઇએ કહ્યું હતું કે, ૨૦૦૧-૦૮ દરમિયાન સ્પેક્ટ્રમ ફાળવણીમાં તમામ ગેરરીતિની તપાસ ત્રણ મહિનાની અંદર પરીપૂર્ણ કરી લેવામાં આવશે. તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રિમ કોર્ટને માહિતી આપી હતી કે તેઓ વિદેશી દેશોમાં ૭ સ્થળો પર તપાસ કરી ચૂકયા છે.

જેલમાં મોબાઇલ અંગે શર્માની અરજી પર ચુકાદો અનામત

પાલારા જેલમાં વધુ પૂછતાછ અટકાવવાનો પણ હાઇ. કોર્ટનો હુકમ

અમદાવાદ, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છના પૂર્વ કલેક્ટર આઇએએસ પ્રદીપ શર્માને હાલ ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યા છે, તેમની પાસેથી તાજેતરમાં જેલમાંથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસે આ અંગે કેસ દાખલ કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી, જેની સામે શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં આ ફરિયાદ બોગસ છે અને તે રદબાતલ કરવા રીટ અરજી કરતાં તેની સુનાવણી બાદ આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે આ બાબતે જેલમાં અટકાયત દરમ્યાન તેમની વધુ પૂછપરછ અટકાવી દેવાનો પણ હુકમ કર્યો હતો. આ ઉપરાંત મોરબીના ટંકારા ખાતેના મામલતદારે પ્રદીપ શર્મા જ્યારે રાજકોટ કલેક્ટર હતા ત્યારે એક પૂર્વ સૈનિકને જમીન આપી દેવાના મામલે કરેલી ફરિયાદ તેમજ ભુજની અન્ય એક ફરિયાદ પણ રદ કરવાની અરજી કરી હતી જે હાલ મોકૂફ રાખી હતી.

નોએડાની સંપાદિત જમીન ખેડૂતોને પરત આપવા સુપ્રીમનો હુકમ

નવી દિલ્હી, તા. ૬ (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડામાં ખેડૂતો પાસેથી ૧૫૬ હેક્ટર જમીનનું અધિગ્રહણ કરીને બારોબાર ગેરકાયદેસર રીતે બિલ્ડરોને આપી દેવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો અને ખેડૂતોને તેમની જમીન પરત કરવાના ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો.અદાલતે ગ્રેટર નોએડા પ્રાધિકરણ પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકારતાની સાથો (જુઓ પાનું ૨)

વિદ્યાસહાયકોની વયમર્યાદા ૩૩ વર્ષ

રાજ્ય સરકારનો પાંચ વર્ષ છૂટછાટ આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની સેવાઓમાં ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં તમામ કક્ષાના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સામાન્યકક્ષાના ઉમેદવારોની ભરતી માટેની હાલની ઉપલી વયમર્યાદા ૨૮ વર્ષથી વધારીને મહત્તમ ૩૩ વર્ષ કરવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ-જનજાતિ, બક્ષીપંચના અન્ય પછાતવર્ગોના ઉમેદવારો માટેની મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષના બદલે ૩૮ વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી જયનારાયણ વ્યાસે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા આ સ્તુત્ય નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૨૧,૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે જેમાંથી ૮૫૦૦ વિદ્યાસહાયકો કાયમી થયા છે. આ વર્ષે વધુ ૧૩,૦૦૦ જેટલા વિદ્યાસહાયકોની સેવાઓ માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેઓને આ પાંચ વર્ષની ઉપલી વયમર્યાદાની છૂટછાટનો લાભ મળવાપાત્ર રહેશે. જો કે આ ઉમેદવારોએ 'ટેટ'ની પરીક્ષા ફરજિયાતપણે ઉત્તિર્ણ કરવાની રહેશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના નવા ધોરણ ૮ માટે અને સને ૨૦૧૦માં ૧૦,૦૦૦ વિદ્યાસહાયકો અંગ્રેજી અને ગણિત-વિજ્ઞાનના વિષય માટે નીમવામાં આવ્યા હતા જેમાં અગાઉના વર્ષમાં આ વિષયો સાથે સ્નાતક થઇ ગયા હોય પરંતુ હાલની (જુઓ પાનું ૨)

હિ પણ હિકડી ગાલ !
-અશોક અદેપાલ

'કોઇ થાકતા નહીં... મુખ્યમંત્રીની ખુરશીમાં રાહુલજી આપણને 'વિશ્રામ' કરાવશે !'

ખાનગી હોસ્પિટલો કંઇ તારાંકિત હોટલો નથી !

સુપ્રીમ દ્વારા ઝાટકણી : ગરીબોને મફત સારવારનું વચન પાળ્યું નથી

નવી દિલ્હી, તા. ૬ : આકરા ચાર્જિસ વસૂલવા બદલ દિલ્હીની કેટલીક મોટી ખાનગી હોસ્પિટલોનો આજે ઉધડો લેતાં સર્વોચ્ચ અદાલતે એવી ટકોર કરી હતી કે તેઓ તારાંકિત હોટેલ પેઠે વર્તી રહી છે અને ગરીબ દર્દીઓ (પચીસ ટકા આઉટડોર અને દસ ટકા ઇન્ડોર)ની વિના મૂલ્યે સારવાર કરવાનાં હોસ્પિટલોએ આપેલાં વચનો તેઓએ પાળ્યાં નથી. ઉકત વચન આપીને તદ્દન સોંઘા દરે સરકાર પાસેથી જમીનો મેળવી હતી. જો તમે ગરીબ દર્દીને દાખલ કરીને પછી તેની પાસેથી દરેક સગવડ માટે ચૂકવણી કરવા ફરજ પાડો તો આમાં વિના મૂલ્યે સારવાર કયાં આવી ? એવી ટકોર કરીને ન્યા. આર. કે. રવીન્દ્રન અને ન્યા. એ. કે. પટનાઇકની બનેલી બેન્ચે અસરકારક એવી નિ:શુલ્ક સારવાર આપવાના સર્વાંગી પ્લાન બે સપ્તાહમાં તૈયાર કરવાનું પણ આ હોસ્પિટલોને ફરમાવ્યું છે.

ગરીબ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવાનું (જુઓ પાનું ૨)

અલીગઢમાં પ્રવેશે તો રાહુલની ધરપકડ સંભવ

લખનૌ, તા. ૬ (પીટીઆઇ) : ભટ્ટા પરસૌલથી અલીગઢ સુધીની રાહુલ ગાંધીની ખેડૂત સંપર્ક પદયાત્રા ઉત્તરપ્રદેશની માયાવતીની સરકારને કણાંની જેમ ખૂંચી રહી છે. તેણે રાહુલના આ અભિયાનને ચૂંટણી પૂર્વેનું કરતબ ગણાવ્યું છે. આટલું જ નહીં યુપીના ગૃહસચિવ દીપક કુમારે તો ત્યાં સુધી કહ્યું છે કે અલીગઢમાં પ્રતિબંધાત્મક આદેશો લાદવામાં આવેલા છે અને રાહુલની ધરપકડ કરવા સહિતના નિર્ણય સ્થિતિને આધિન રહી પ્રશાસને જ લેવાના છે. જો જિલ્લા પ્રશાસનને રાહુલની આ પદયાત્રાથી પ્રતિબંધનું ઉલંઘન અને શાંતિ હણાતી જણાય તો તે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર પગલાં લેવા માટે સ્વતંત્ર છે.

રમખાણના રેકર્ડ અંગે સરકારનું પૂછાણું

રેકર્ડનો નાશ કરાયો હોવાના હોબાળાને પગલે નાણાવટી પંચે પહેલીવાર રાજ્ય સરકારનો ૧-દિ'માં જવાબ માગ્યો

અમદાવાદ, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણો અંગે તપાસ ચલાવી રહેલમ જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય મહેતાના તપાસપંચ દ્વારા આજે ગુજરાત સરકારને કોમી રમખાણો સમયના રેકર્ડ અંગે ખુલાસો કરવા જણાવાયું છે. ૨૭-૨-૦૦૨ના ગોધરાકાંડના બનાવથી ૮મી માર્ચ ૨૦૦૨ સુધીના રમખાણો દરમ્યાનનો રાજ્ય સરકાર પાસે કેટલો રેકર્ડ છે અને કેટલો અને કયો કયો રેકર્ડ નાશ કર્યો છે તે અંગેની સ્પષ્ટતા કરવા અને દસ દિવસમાં તેનો પંચ સમક્ષ જવાબ રજૂ કરવા હુકમ કરાયો છે. ગોધરાકાંડ અને રમખાણોના રેકર્ડ સરકારે નાશ કર્યા બાબતે દેશભરમાં વિવાદ ઊભો થયા બાદ નાણાવટી પંચે પહેલીવાર રાજ્ય સરકાર પાસે આ અંગેનો ખુલાસો માગ્યો હતો.

આઇ.પી.એસ.અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એફિડેવિટના સંદર્ભમાં ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણો અંગે તપાસ ચલાવી રહેલા ન્યાયાધીશ નાણાવટી અને મહેતા તપાસ પંચ સમક્ષ ભટ્ટને બોલાવી તેમની પાસેથી આ અંગેની વિગતો મેળવવા થયેલી અરજીના સંદર્ભમાં નાણાવટી પંચે ભટ્ટને પંચ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યો હતો. ત્યારબાદ સંજીવ ભટ્ટે રાજ્ય સરકાર પાસેથી કેટલોક રેકોર્ડ મેળવવા માંગણી કરી હતી. સરકારી વકીલ શરદભાઇ વકીલે પત્રકારો સમક્ષ (જુઓ પાનું ૨)

Digitially Archived by: www.realpatidar.com/library

Real Patidar Library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format
For Reference See Pages: 1, 9.

See Page 9

realpatidar.com

॥ जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ॥

JANMABHOOMI GROUP

કચ્છમિત્ર

પાના ૧૨+૪=૧૬ સંવત : ૨૦૬૭ ■ અષાઢ સુદ ૭ ■ ગુરુવાર ■ તા. ૭/૦૭/૧૧ ■ કિંમત : ₹ ૩.૦૦

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2025.05.05 18:21:10 +05'30'

KUTCHMITRA ■ BHUJ ■ 7-07-11 ■ THURSDAY ■ વર્ષ : ૬૪ ■ અંક : ૨૯૫ ■ ભુજ ■ Regd. No. G. KCH-3/2008-2011. ■ ફોન : ૨૫૨૦૯૦/૯૧ ■ ફેક્સ : ૨૫૦૨૭૧/૨૫૨૦૮૯. ■ RNI No. 1554/57 ■ Visit us at : www.kutchmitradaily.com

બોંબ ધડાકાનો ખટલો ગુજરાતમાં જ ચલાવાશે

કચ્છમાં આષાઢી છટ્ઠે છડી પોકારતા મેઘરાજા... *'આષાઢી બીજ વીતી ગયા છતાં વરસાદ ખેંચાતાં કચ્છીમાડુ અને ખાસ તો ધરતીપુત્રો, પશુપાલકોના કપાળે ખેંચાયેલી ચિંતાની લકીરો ભૂંસી નાખતાં કચ્છમાં બુધવારે ભુજ, નખત્રાણા, માંડવી, અબડાસા સહિત વિસ્તારોમાં છૂટીછવાઈ મેઘમહેર થઈ હતી. પવન પડી ગયો છે. ગરમી અને ભેજ વાતાવરણમાં પુષ્કળ છે એ જોતાં લોકો મુશળધાર મહેર વરસવાની રાહ જોઈ રહ્યા છે. પ્રસ્તુત વરસાદી દ્રશ્યો દેવપર અને મોથાળાના છે. (વરસાદની તસવીરો : રમેશ રોશિયા, વિનોદ જોષી, સાવન મકવાણા)*

નવી દિલ્હી, તા. ૬ (પીટીઆઇ) : સુપ્રીમ કોર્ટે આજે એક ચાવીરૂપ ચુકાદામાં ૫૬ માનવ જિંદગીનો ભોગ લેનાર ૨૦૦૮ના ગુજરાત શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસમાં ૫૦થી વધુ આરોપીઓની સુનાવણીનો માર્ગ મોકળો કરતાં જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી ગુજરાતમાં જ થશે. અમદાવાદનાં મિરઝાપુર સ્થિત ખાસ અદાલતમાં હવે આ કેસ ચાલશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજ્યભરને હચમચાવી નાખનાર ૨૧ જેટલા ધડાકાના પખવાડિયા બાદ એ બોમ્બકાંડમાં 'કચ્છ કનેક્શન' પણ બહાર આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કેસને રાજ્ય બહાર લઇ જવાની ૨૦૦૮ના શ્રેણીબદ્ધ વિસ્ફોટના આરોપીઓની અરજી ફગાવી

ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર અને સીરિયાક જોસેફની ખંડપીઠે ભાજપ શાસિત રાજ્યમાં ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ વધુ વકરેલા કોમવાદી માહોલનાં પગલે આ કેસની નિષ્પક્ષ સુનાવણી થશે નહીં તેવી દલીલ સાથે આરોપીઓ દ્વારા કરાયેલી અરજી નકારી કાઢી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ગોધરાકાંડ બાદ પરિસ્થિતિ નોંધપાત્ર રીતે થાળે પડી ગઇ છે. આમ, ગુજરાતમાં ૨૦૦૮ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસની નિષ્પક્ષ સુનાવણી શક્ય ન હોવાનો દાવો માત્ર અટકળ સમાન જ હોવાનું સુપ્રીમે સ્પષ્ટ કર્યું હતું. આરોપીઓએ રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં ટ્રાયલ સ્વતંત્ર રીતે ચાલી શકે નહીં. જો કે, સુપ્રીમ કોર્ટે ફરીવાર કોર્ટમાં જવા આરોપીઓને રદ મંજૂરી આપી હતી. ટ્રાયલ યોગ્ય વાતાવરણમાં ચાલી શકશે નહીં જો એવી પ્રમાણિક દહેશત લાગે તો આરોપી કોર્ટમાં જઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ ૨૦૦૯માં આરોપી સામે ટ્રાયલ સામે સ્ટે મૂકી દીધો હતો. જેમાં આરોપીઓએ રાજ્યની બહાર કેસોને ખસેડવાની રજૂઆત કરી હતી. આરોપીઓની એવી રજૂઆત હતી કે, ફરિયાદ પક્ષ અને તપાસ સંસ્થાઓ શાસક પાર્ટીને સંપૂર્ણપણે પક્ષપાત કરી શકે છે. વર્ષ ૨૦૦૮માં ૨૬મી જુલાઇએ અમદાવાદ શહેરમાં ૨૧ બોમ્બ (જુઓ પાનું ૨)

કચ્છમાં આશા જગાવતો મેઘમાહોલ

ભુજ, તા. ૬ : અષાઢના આરંભે કચ્છીઓને વાટ જોવડાવનાર 'મોંઘેરા મહેમાન' મેઘરાજાએ ગઇકાલે માંડવીમાં હાજરી પૂરાવ્યા બાદ આજે કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટીછવાઇ હાજરી પુરાવીને સારા ચોમાસાની આશા જગાવી છે. બુધવારે બપોર બાદ અબડાસામાં વરસેલા મેહુલિયાએ કેટલાક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલી મહેર કરી હતી. આ ઉપરાંત ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાંથી દોઢેક ઇંચ વરસાદી વાવડથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે.

અબડાસામાં દોઢથી બે ઇંચ વરસતાં લોકો ગેલમાં : ગરડા પંથકમાં શુકનવંતી પધરામણી : ભુજ, માંડવી, અંજાર, નખત્રાણા તાલુકામાં ઝરમરથી દોઢ ઇંચ

કચ્છના વરસાદ માટે એવી કહેવત છે કે જો શરૂઆતમાં અબડાસાના ગરડા પંથકમાં પહેલો વરસાદ થાય તો કચ્છમાં ભયો ભયો. આ વખતે ચોમાસામાં ગરડા સહિત અબડાસાના અમુક ગામોમાં આજે બપોરે મેઘરાજાની પધરામણી થતાં જાણકારોએ વરસાદને શુકનવંતો ગણાવ્યો હતો.

લાંબા સમયથી રાહ જોતા લોકો એવું વિચારતા હતા કે આ વાદલડી કયારે વરસશે, પણ આજે વરસી હતી. ગાજવીજ સાથે ઝાપટાંથી માંડી બે ઇંચ જેટલો વરસાદ થતાં ખાસ કરીને માલધારીઓ અને ખેડૂત વર્ગમાં આશાનો સંચાર થયો હતો.

મોથાળા મથુરા ભયો....

આજે બપોરે મોથાળા વિસ્તારમાં મેઘરાજાનું આગમન કડાકા-ભડાકા સાથે થયું હતું. અમારા પ્રતિનિધિ લક્ષ્મીશંકર જોષીના જણાવ્યા પ્રમાણે સવા ત્રણ વાગ્યાથી શરૂ થયેલા મેઘસવારી સાડા પાંચ સુધી ચાલી હતી, બે અઢી કલાકમાં તો બે ઇંચ જેટલો વરસાદ થયો હતો.

શરૂઆત જોશભેર થઇ હતી પણ વચ્ચે થોડીવાર ધીમો પડયા બાદ ફરી મુશળધાર પડવાનું ચાલુ થયું હતું, રીતસર રસ્તાઓ પરથી ગોઠણ સમા પાણી વહી નીકળ્યાં હતાં. નાના બાળકો મોસમના આ પહેલા વરસાદનો આનંદ લેવા બહાર આવી ગયા હતા.

ખેડૂતો એ પણ આ વરસાદને વાવેતરલાયક ગણાવ્યો હતો, તો આવી શરૂઆતને માલધારીઓએ પશુઓના ચારા માટે આશા દર્શાવી હતી. આસપાસના નુંધાતડ, હાજાપર, સણોસરા, કંઢાય, ભવાનીપર, બેરાખિયા, સરગુઆરા, કનકાવતી વગેરે ગામોમાં પણ એક સરખી હેલી હોવાનું જાણવા મળ્યું હતું.

દરમ્યાન તેમને નરેડીથી મળેલા હેવાલ પ્રમાણે નરેડી-કોટડા વચ્ચેની (જુઓ પાનું ૨)

આજથી ચાર દિવસનું આકાશી ચિત્ર અને કચ્છની વરસાદી આગાહી

ગુરુવાર : હળવો વરસાદ | શુક્રવાર : વાદળછાયું આકાશ | શનિવાર : તડકો-છાંયડો | રવિવાર : હળવો વરસાદ

આજના અંકમાં

■ રાપરની સ્થાવર મિલકતોમાં તેજીની આગ -પાનું છેલ્લું
■ તબીબોની તપાસ માત્ર પેટ્રોલનો ધુમાડો ? -પાનું છેલ્લું
■ પાણી વિના ટળવળતા અબડાસાના ૩૦ ગામ -પાનું ૫
■ મુંદરા પી.જી.વી.સી.એલ.ની ૬૬ લાખની વસૂલાત બાકી -પાનું ૫
■ વાગડના અમુક ગામોના જંત્રીના ભાવ નક્કી ન થતાં મુશ્કેલી -પાનું ૫
■ હવે બહેરા-મૂંગા લોકો ફોનથી વાત કરે છે ! -પાનું ૧૧

હવામાન

	મહત્તમ	લઘુતમ
ભુજ	૩૬.૪° સે.	૨૬.૩° સે.
નલિયા	૩૫.૭° સે.	૨૭.૫° સે.
કંડલા	૩૪.૧° સે.	૨૮.૦° સે.

ભુજમાં ભેજનું પ્રમાણ સવારે ૭૮% અને સાંજે ૭૯% પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિકલાક. દિશા : અનિશ્ચિત.

ટુ-જી સ્પેકટ્રમમાં હવે મારનની સંડોવણી

નવી દિલ્હી, તા. ૬ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ આજે સર્વોચ્ચ અદાલતને સોંપેલા તેના હેવાલમાં પૂર્વ ટેલિકોમ મંત્રી દયાનિધિ મારનની ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એમ કહેતાં સંડોવણી કરી હતી કે, પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, મારને જાણી જોઇને એરસેલ કંપનીની લાયસન્સ અરજીને દબાવી રાખી હતી.

સીબીઆઇએ કૌભાંડ અંગેનો હેવાલ સુપ્રીમને સોંપ્યો : અરજી દબાવાઇ હતી

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટેલિકોમ ખાતાના અધિકારીઓ તરફથી સર્વાનુમતે ભલામણ છતાં મારને આ ફાઇલને વિલંબમાં નાખી હતી.

સીબીઆઇની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ટેલિકોમ કંપની એરસેલ સાથેના મારનના કાર્યમાં બળજબરીનું તત્ત્વ હતું. ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે, મારને એરસેલના પ્રમોટર શિવાશંકરનને તેની કંપનીનો હિસ્સો મેક્સીસની કંપનીને વેચવા માટે દબાણ કર્યુ હતું.

એરસેલના સ્થાપક શિવાશંકરને અગાઉ સીબીઆઇ સમક્ષ એવું નિરીક્ષણ આપ્યું હતું કે, વારંવાર લાયસન્સની ના પાડીને મારને એરસેલનો તેનો હિસ્સો વેંચવા માટે બળજબરી કરી હતી.

શિવાશંકરને છેવટે મેક્સીને પોતાની કંપની વેંચી નાખી હતી. જે મારન બંધુઓની નજીકના કહેવાય છે. પૂર્વ ટેલિકોમ સચિવ જિતેન્દ્ર મિશ્રાએ પણ સીબીઆઇને જણાવ્યું હતું કે, મારને જાણી જોઇને એરસેલની સંબંધિત કંપની વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

સીબીઆઇએ કહ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવાઓ એવું બતાવે છે કે, લૂપ ટેલિકોમ કંપની એ એસ્સાર જૂથની આગળ પડતી કંપની હતી. ટોચની તપાસનીશ એજન્સી સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં લોનની અરજી કરી હતી ત્યારે એસ્સાર તેની કોર્પોરેટ ગેરંટી તરીકે ઊભી હતી.

સીબીઆઇએ જસ્ટીસ જીએસ સિંઘવી અને જસ્ટીસ એકે ગાંગુલીની બનેલી બેન્ચને કહ્યું હતું કે, ૨જી કૌભાંડ કેસમાં તેની તપાસને પરીપૂર્ણ કરવા વધારે સમયની જરૂર છે. સીબીઆઇએ કહ્યું હતું કે, ૨૦૦૧-૦૮ દરમિયાન સ્પેક્ટ્રમ ફાળવણીમાં તમામ ગેરરીતિની તપાસ ત્રણ મહિનાની અંદર પરીપૂર્ણ કરી લેવામાં આવશે. તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે સુપ્રિમ કોર્ટને માહિતી આપી હતી કે તેઓ વિદેશી દેશોમાં ૭ સ્થળો પર તપાસ કરી ચૂકયા છે.

જેલમાં મોબાઇલ અંગે શર્માની અરજી પર ચુકાદો અનામત

અમદાવાદ, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છના પૂર્વ કલેક્ટર આઇએએસ પ્રદીપ શર્માને હાલ ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યા છે, તેમની પાસેથી તાજેતરમાં જેલમાંથી મોબાઇલ ફોન અને સીમકાર્ડ મળી આવતાં પોલીસે આ અંગે કેસ દાખલ કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી, જેની સામે શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં આ ફરિયાદ બોગસ છે અને તે રદબાતલ કરવા રીટ અરજી કરતાં તેની સુનાવણી બાદ આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે આ બાબતે જેલમાં અટકાયત દરમ્યાન તેમની વધુ પૂછપરછ અટકાવી દેવાનો પણ હુકમ કર્યો હતો. આ ઉપરાંત મોરબીના ટંકારા ખાતેના મામલતદારે પ્રદીપ શર્મા જ્યારે રાજકોટ કલેક્ટર હતા ત્યારે એક પૂર્વ સૈનિકને જમીન આપી દેવાના મામલે કરેલી ફરિયાદ તેમજ ભુજની અન્ય એક ફરિયાદ પણ રદ કરવાની અરજી કરી હતી જે હાલ મોકૂફ રાખી હતી.

પાલારા જેલમાં વધુ પૂછતાછ અટકાવવાનો પણ હાઇ. કોર્ટનો હુકમ

નોએડાની સંપાદિત જમીન ખેડૂતોને પરત આપવા સુપ્રીમનો હુકમ

નવી દિલ્હી, તા. ૬ (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડામાં ખેડૂતો પાસેથી ૧૫૬ હેક્ટર જમીનનું અધિગ્રહણ કરીને બારોબાર ગેરકાયદેસર રીતે બિલ્ડરોને આપી દેવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો અને ખેડૂતોને તેમની જમીન પરત કરવાના ઇલાહાબાદ હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો.અદાલતે ગ્રેટર નોએડા પ્રાધિકરણ પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકારતાની સાથો (જુઓ પાનું ૨)

વિદ્યાસહાયકોની વયમર્યાદા ૩૩ વર્ષ

ગાંધીનગર, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની સેવાઓમાં ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં તમામ કક્ષાના ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સામાન્યકક્ષાના ઉમેદવારોની ભરતી માટેની હાલની ઉપલી વયમર્યાદા ૨૮ વર્ષથી વધારીને મહત્તમ ૩૩ વર્ષ કરવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ-જનજાતિ, બક્ષીપંચના અન્ય પછાતવર્ગોના ઉમેદવારો માટેની મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષના બદલે ૩૮ વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારનો પાંચ વર્ષ છૂટછાટ આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી જયનારાયણ વ્યાસે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા આ સ્તુત્ય નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૨૧,૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે જેમાંથી ૮૫૦૦ વિદ્યાસહાયકો કાયમી થયા છે. આ વર્ષે વધુ ૧૩,૦૦૦ જેટલા વિદ્યાસહાયકોની સેવાઓ માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેઓને આ પાંચ વર્ષની ઉપલી વયમર્યાદાની છૂટછાટનો લાભ મળવાપાત્ર રહેશે. જો કે આ ઉમેદવારોએ 'ટેટ'ની પરીક્ષા ફરજિયાતપણે ઉત્તિર્ણ કરવાની રહેશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના નવા ધોરણ ૮ માટે અને સને ૨૦૧૦માં ૧૦,૦૦૦ વિદ્યાસહાયકો અંગ્રેજી અને ગણિત-વિજ્ઞાનના વિષય માટે નીમવામાં આવ્યા હતા જેમાં અગાઉના વર્ષમાં આ વિષયો સાથે સ્નાતક થઇ ગયા હોય પરંતુ હાલની (જુઓ પાનું ૨)

હિ પણ હિકડી ગાલ !
-અશોક અદેપાલ

'કોઇ થાકતા નહીં... મુખ્યમંત્રીની ખુરશીમાં રાહુલજી આપણને 'વિશ્રામ' કરાવશે !'

ખાનગી હોસ્પિટલો કંઇ તારાંકિત હોટલો નથી !

નવી દિલ્હી, તા. ૬ : આકરા ચાર્જિસ વસૂલવા બદલ દિલ્હીની કેટલીક મોટી ખાનગી હોસ્પિટલોનો આજે ઉધડો લેતાં સર્વોચ્ચ અદાલતે એવી ટકોર કરી હતી કે તેઓ તારાંકિત હોટેલ પેઠે વર્તી રહી છે અને ગરીબ દર્દીઓ (પચીસ ટકા આઉટડોર અને દસ ટકા ઇન્ડોર)ની વિના મૂલ્યે સારવાર કરવાનાં હોસ્પિટલોએ આપેલાં વચનો તેઓએ પાળ્યાં નથી. ઉકત વચન આપીને તદ્દન સોંઘા દરે સરકાર પાસેથી જમીનો મેળવી હતી. જો તમે ગરીબ દર્દીને દાખલ કરીને પછી તેની પાસેથી દરેક સગવડ માટે ચૂકવણી કરવા ફરજ પાડો તો આમાં વિના મૂલ્યે સારવાર કયાં આવી ? એવી ટકોર કરીને ન્યા. આર. કે. રવીન્દ્રન અને ન્યા. એ. કે. પટનાઇકની બનેલી બેન્ચે અસરકારક એવી નિ:શુલ્ક સારવાર આપવાના સર્વાંગી પ્લાન બે સપ્તાહમાં તૈયાર કરવાનું પણ આ હોસ્પિટલોને ફરમાવ્યું છે.

સુપ્રીમ દ્વારા ઝાટકણી : ગરીબોને મફત સારવારનું વચન પાળ્યું નથી

ગરીબ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવાનું (જુઓ પાનું ૨)

અલીગઢમાં પ્રવેશે તો રાહુલની ધરપકડ સંભવ

લખનૌ, તા. ૬ (પીટીઆઇ) : ભટ્ટા પરસૌલથી અલીગઢ સુધીની રાહુલ ગાંધીની ખેડૂત સંપર્ક પદયાત્રા ઉત્તરપ્રદેશની માયાવતીની સરકારને કણાંની જેમ ખૂંચી રહી છે. તેણે રાહુલના આ અભિયાનને ચૂંટણી પૂર્વેનું કરતબ ગણાવ્યું છે. આટલું જ નહીં યુપીના ગૃહસચિવ દીપક કુમારે તો ત્યાં સુધી કહ્યું છે કે અલીગઢમાં પ્રતિબંધાત્મક આદેશો લાદવામાં આવેલા છે અને રાહુલની ધરપકડ કરવા સહિતના નિર્ણય સ્થિતિને આધિન રહી પ્રશાસને જ લેવાના છે. જો જિલ્લા પ્રશાસનને રાહુલની આ પદયાત્રાથી પ્રતિબંધનું ઉલંઘન અને શાંતિ હણાતી જણાય તો તે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર પગલાં લેવા માટે સ્વતંત્ર છે.

રમખાણના રેકર્ડ અંગે સરકારનું પૂછાણું

અમદાવાદ, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણો અંગે તપાસ ચલાવી રહેલમ જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય મહેતાના તપાસપંચ દ્વારા આજે ગુજરાત સરકારને કોમી રમખાણો સમયના રેકર્ડ અંગે ખુલાસો કરવા જણાવાયું છે. ૨૭-૨-૦૦૨ના ગોધરાકાંડના બનાવથી ૮મી માર્ચ ૨૦૦૨ સુધીના રમખાણો દરમ્યાનનો રાજય સરકાર પાસે કેટલો રેકર્ડ છે અને કેટલો અને કયો કયો રેકર્ડ નાશ કર્યો છે તે અંગેની સ્પષ્ટતા કરવા અને દસ દિવસમાં તેનો પંચ સમક્ષ જવાબ રજૂ કરવા હુકમ કરાયો છે. ગોધરાકાંડ અને રમખાણોના રેકર્ડ સરકારે નાશ કર્યા બાબતે દેશભરમાં વિવાદ ઊભો થયા બાદ નાણાવટી પંચે પહેલીવાર રાજ્ય સરકાર પાસે આ અંગેનો ખુલાસો માગ્યો હતો.

રેકર્ડનો નાશ કરાયો હોવાના હોબાળાને પગલે નાણાવટી પંચે પહેલીવાર રાજ્ય સરકારનો ૧-દિ'માં જવાબ માગ્યો

આઇ.પી.એસ.અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એફિડેવિટના સંદર્ભમાં ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણો અંગે તપાસ ચલાવી રહેલા ન્યાયાધીશ નાણાવટી અને મહેતા તપાસ પંચ સમક્ષ ભટ્ટને બોલાવી તેમની પાસેથી આ અંગેની વિગતો મેળવવા થયેલી અરજીના સંદર્ભમાં નાણાવટી પંચે ભટ્ટને પંચ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યો હતો. ત્યારબાદ સંજીવ ભટ્ટે રાજ્ય સરકાર પાસેથી કેટલોક રેકોર્ડ મેળવવા માંગણી કરી હતી. સરકારી વકીલ શરદભાઇ વકીલે પત્રકારો સમક્ષ (જુઓ પાનું ૨)

Digitially Archived by: www.realpatidar.com/library

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં મેઘસવારી

રાજકોટ, તા. ૬ : અમરેલી, જૂનાગઢ અને ભાવનગર અને રાજકોટ જિલ્લામાં આજે બપોર બાદ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ-ખુશાલ થઇ ગયા છે.

વરસાદનું ધોધમાર સ્વરૂપ જૂનાગઢ જિલ્લામાં જોવા મળ્યું હતું, માણાવદરમાં ૩ ઇંચ વરસાદ, બાંટવા ખારો ડેમમાં નવા જળની આવક શરૂ થઇ ગઇ છે, તો શહેરની અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં.

અમરેલી જિલ્લામાં દામનગર એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો છે, તો ભાવનગરમાં એક અને પાલિતાણામાં બે ઇંચ વરસાદથી ઠંડક વ્યાપી છે.

કોડીનાર તાલુકાનાં છાછર ગામે વીજળી પડવાથી એક ખેડૂતનું મૃત્યુ થયું છે. તો આ જ તાલુકાના વડનગર ગામે એક બળદનું પણ વીજળી પડતાં મોત થયું છે.

રાજકોટ જિલ્લા અને શહેરમાં રાત્રે નવ વાગ્યા પછી કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.

અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ

દરમ્યાન, વડોદરાથી પ્રતિનિધિના હેવાલ મુજબ વડોદરા, ભરુચ, આણંદ અને નર્મદા જિલ્લામાં આજે મેઘરાજની પધરામણી થતાં ગરમીથી ત્રાહિમામ થયેલી પ્રજામાં રાહતની લાગણી પ્રસરી છે.

વડોદરામાં સાંજે ચાર વાગ્યે જોરદાર ઝાપટાં સાથે વરસાદનું આગમન થયું હતું. દાહોદ તથા આસપાસના વિસ્તારોમાં મોડીરાત્રે ઝરમર વરસાદથી લોકો હરખભેર નાચી ઊઠયા હતા. વડોદરા જિલ્લાના નસવાડી તથા આસપાસના વિસ્તારોમાં ઝાપટાં પડયાં હતાં.

વડોદરામાં આજે ૧૫ મિ.મી., ભરુચમાં ૩૧ મિ.મી., વાલિયામાં ૬ મિ.મી., આણંદમાં ૧૭ મિ.મી., આંકલાવમાં ૨, દાહોદમાં ૧૧, ગરબાડામાં ૧૭, લીમખેડામાં ૭ અને ઝાલોદમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વડોદરામાં સાંજે જોરદાર ઝાપટાં સાથે જ વીજળી ગુલ થઇ ગઇ હતી.

ઉત્તરપ્રદેશમાં ભૂમિ અધિગ્રહણથી ખેડૂતોને થયેલી અસરથી માહિતગાર થવા ભટ્ટા પરસૌલથી અલીગઢ સુધીની પદયાત્રાએ નીકળેલા કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી બુધવારે રામપુર પહોંચ્યા તે વખતે એક વૃદ્ધાએ 'યુવરાજ'ને માથે હાથ ફેરવ્યો ત્યારનાં દ્રશ્યમાં ભાવુક બનેલા રાહુલ.

વીજ દરોમાં ટૂંકમાં વધારો ઝીંકવા તૈયારી

નવી દિલ્હી, તા. ૬ : ઇંધણની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ વીજ દરમાં પણ વધારો કરવાની તૈયારી કરી લેવાઇ છે. ઊર્જા મંત્રાલય, કેન્દ્ર અને રાજ્યના રેગ્યુલેટરો તથા ડિસ્ટ્રીબ્યુશન વચ્ચે વાતચીતની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ તમામ સંબંધિતો હવે એવા તારણ ઉપર પહોંચી ગયા છે કે વીજ દરમાં વધારો કર્યા સિવાય સ્થિતિને કાબૂમાં લેવાની બાબત મુશ્કેલરૂપ છે. મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા વીજ વિતરણ અંગેના સ્થિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના ૧૧૦ પાવર ઊર્જા ઉપયોગ કેન્દ્રને સંયુક્ત નુકસાન અંદાજે ૮૬૧૩૬ કરોડની આસપાસ છે. તેમજ ૩૭

ઇંધણ વૃદ્ધિ બાદ ઊર્જા ખાતા અને રાજ્યોની બેઠકો જારી : હાલની ખોટ ૮૬૧૩૬ કરોડ

મુખ્ય વિતરક એકમો છે. જો આ જ દર રહેશે તો નુકસાન વધીને ૨૦૧૪-૨૦૨૫ સુધી ૧૧૬૦૮૯ કરોડ સુધી પહોંચી જશે. તેરમા નાણાપંચ માટે સ્પેનિશ ઊર્જા અંગેની બજાર સલાહકાર કંપની મરકાડોસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સબસિડીનો જો સમાવેશ કરવામાં આવે તો વાસ્તવિક નુકસાન ખૂબ ઊંચું છે. આંકડા દર્શાવે છે કે સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણાં પગલાં લેવા જરૂરી બન્યાં છે.

થોડા વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી સબસિડીમાં ઘટાડો થયો છે. આવનારા દિવસોમાં રાજ્ય સરકારો દરમાં વધારો કરે તેવી શક્યતા છે. પુરવઠાનું સરેરાશ ખર્ચ પ્રતિ એકમ ૩.૪૧ રૂપિયા છે. જ્યારે મળતી સબસિડીના આધાર પર અંતર ૫૦ પૈસાની આસપાસ છે. રાજ્ય સરકારો તરફથી મળતી સબસિડીનો આંકડો ૨૯૬૬૫ કરોડ રૂપિયા છે, ઘણા રાજ્યો એવા છે જે વીજળીના મામલે કટોકટી અનુભવી રહ્યા છે. સરેરાશ વ્યક્તિ ઉપર ઉપયોગ પ્રતિ યુનિટ ૨.૯૧ રૂપિયા છે. સબસિડીની ગણતરી કરવામાં આવે તો વેચાણ કિંમત અને ખર્ચ વચ્ચે ૫૦ પૈસાનું અંતર છે.

રિલાયન્સ-બીપીના સોદાને શરતી મંજૂરીની સંભાવના

નવી દિલ્હી, તા. ૬ : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બ્રિટીશ પેટ્રોલિયમ વચ્ચેના સોદાને કેન્દ્રીય પ્રધાનમંડળને મોકલવાનો કોઈ વિચાર નથી એવું પેટ્રોલિયમ મંત્રાલયના સચિવનું કહેવું છે.આરઆઈએલ-બીપીના પેટ્રોલિયમ સોદાને મંજૂરી આપવા માટે સરકાર અમુક શરતો રાખશે. સરકાર બીપીને ગેસની નિકાસ કરવાની મનાઈ ફરમાવે એવી ધારણા છે. સરકાર કેઈર્ન ઈન્ડિયા-વેદાંત વચ્ચેના સોદાની જેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ-બીપી સમક્ષ પણ અમુક શરતો રાખશે.

પદ્મનાભના ખજાનાની વીડિયોગ્રાફી

નવી દિલ્હી, તા.૬ (પી.ટી.આઇ.) : કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી નીકળી રહેલા હજારો કરોડના ખજાના બાદ તેની સલામતી માટે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને ખજાનો બહાર કાઢવાની તમામ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવાનો નિર્દેશ આપ્યો હતો, તો બીજી તરફ કેરળ સરકારે સદીઓ જૂના આ મંદિરની કાયમી સલામતી માટે યોજના ઘડી કાઢી છે. બિનસત્તાવાર હેવાલો મુજબ આ ખજાનો ૧.૫૦ લાખ કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે.

સુપ્રીમ કોર્ટે આપેલો નિર્દેશ : કાયમી સલામતી અંગે કેરળ સરકારની યોજના

ન્યાયાધીશ આર.વી. રવીન્દ્રન અને એ.કે. પટનાયકની બેન્ચે વીડિયોગ્રાફી ઉપરાંત બહાર આવેલા ખજાનાના સંરક્ષણ માટે મ્યૂઝિયમના ક્યૂરેટરની નિમણૂક કરવા પણ સૂચવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તિરૂવનંતપુરમ સ્થિત મંદિરના ભંડકિયાંઓમાંથી જે ખજાનો નીકળ્યો છે તેની કિંમત એક લાખ ક્રરોડથી પણ વધી જવાની સંભાવના છે. જોકે, સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે, ગણતરીની વિગતો હાલ જાહેર નહીં થાય.

અદાલતે ત્રાવણકોરના રાજા રામ વર્માના વારસદારો દ્વારા કેરળ હાઇકોર્ટના નિર્ણય સામે કરેલી અપીલની સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો.વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે જો કે, સુપ્રિમે એમ પણ કહ્યું કે ગણતરીની વિગતો હાલ જાહેર નહીં થાય.

દરમ્યાન કેરળમાં મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, સરકાર હિન્દુ સંગઠનો ઉપરાંત બહુમતી લોકોનો મત એવો છે કે બહુમૂલ્ય સંપત્તિ મંદિર ખાતે જ રાખવામાં આવે.

મંદિરને હાલમાં આપવામાં આવેલી સલામતી કામચલાઉ છે અને સરકાર આ મંદિરની પરંપરા અને પ્રાચીન સંસ્કૃતિને નુકસાન ન પહોંચે એ રીતે અદ્યતન સાધનોના ઉપયોગ સાથે કાયમી મજબૂત સલામતી યંત્રણા ગોઠવવા વિચારી રહી હોવાનું ચાંડીએ ઉમેર્યું હતું.

પદ્મનાભસ્વામી મંદિરના ખજાનાની માલિકી કોની ?

તિરુવનંથપુરમ, તા. ૬ : કેરળના પદ્મનાભસ્વામી મંદિરમાંથી અબજોની કિંમતના ખજાનાની માલિકીને લઇને હવે અટકળો શરૂ થઇ ચૂકી છે.

મંદિરમાંથી હજુ સુધી એક લાખ કરોડથી વધુનો ખજાનો મળી ચૂક્યો છે. હાલમાં ખજાનાની ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કેટલાક દિશાનિર્દેશ જારી કર્યા બાદ હવે વધુ ચર્ચા છેડાઇ ગઇ છે.

મંદિરના જુદા જુદા ભાગમાંથી મળી આવેલા સોનાના ખજાના બાદ પદ્મનાભસ્વામી મંદિર દુનિયાનું સૌથી અમીર ધાર્મિક સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન એવી ચર્ચા છેડાઇ છે કે આખરે આ ખજાનો કોનો છે. કેરળના લોકો પર આનો અધિકાર છે કે કેમ તેવો પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે માર્તંડ વર્માએ અંગ્રેજોથી બચાવવા આ ખજાનો મંદિરમાં છુપાવ્યો હતો એટલે રાજ પરિવારનો તેના પર હક્ક ગણાય.

અલબત્ત, હિન્દુઓની ભાવનાઓને ધ્યાનમાં લઇને મોટાભાગની રાજકીય પાર્ટી આને પદ્મનાથસ્વામી મંદિર સાથે સંકળાયેલી ગણે છે.

ઘણા નિષ્ણાતો કહે છે કે ત્રાવણકોરના પૂર્વ રાજાઓ દ્વારા કેરળની જનતા પાસેથી કર રૂપે વસૂલ કરવામાં આવેલો ખજાનો છે. આ ખજાનાનો કેરળના સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. કેરળની માળખાંકીય સુવિધાઓ સુધારવા માટે ઉપયોગ કરી શકાય છે. રાજ્યના શિક્ષણના ક્ષેત્રમાં આનો ઉપયોગ કરી શકાય છે. કેરળ ઉપર આશરે ૩૦,૦૦૦ કરોડનું દેવું છે. સરકાર આ ખજાનાને વેચીને દેવાને ઓછું કરી શકે છે. જાણીતા ઇતિહાસકાર પણિક્કરનું કહેવું છે કે, મંદિરમાંથી મળી આવેલો ખજાનો પ્રજાનો છે પરંતુ રાજ્યના વિકાસ માટે આનો ઉપયોગ કરવામાં આવે તે યોગ્ય નથી.

તેલંગાણા માટે ચોક્કસ સમય આપો

નવી દિલ્હી, તા. ૬ (પીટીઆઇ) : સંસદ તેમજ રાજ્ય વિધાનસભામાંથી રાજીનામાં ધરી દેનાર કોંગ્રેસી સાંસદો અને ધારાસભ્યોએ આજે કેન્દ્ર અને પક્ષનાં 'હાઇકમાન્ડ'ને નવાં રાજ્યની રચના માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી આપવા જણાવ્યું હતું. દરમ્યાન કેન્દ્રએ આ સંદર્ભે મંત્રણા ચાલુ થઇ ચૂકી હોવાનું જણાવી આ પ્રક્રિયા અંતિમ નિર્ણય લેવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અમે અલગ તેલંગાણા રાજ્યની રચના માટે બે માસ, ત્રણ કે પછી ભલેને છ મહિના લાગે, પણ ચોક્કસ સમયમર્યાદા ઇચ્છીએ છીએ તેવું રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપી દેનાર તેલંગાણાના કોંગી નેતા કે. કેશવ રાવે પત્રકારોને અહીં જણાવ્યું હતું.

તેલંગાણા ક્ષેત્રના અન્ય સાંસદો, ધારાસભ્યોએ પણ રાવનાં નિવેદનમાં સૂર પુરાવતાં કહ્યું હતું કે, તેલંગાણાની અલગ રાજ્ય તરીકે રચનાની પ્રક્રિયા સત્વરે પૂર્ણ થાય તેવું અમે ઇચ્છીએ છીએ.

સરકાર તેમજ કોંગ્રેસ પક્ષ પર લાંબા સમયથી પડતર આ માંગ પૂર્ણ કરવાનું 'નૈતિક દબાણ' છે. હવે અમે એ વચન પૂરું કરી આપવાની માંગ કરીએ છીએ જે નવું નથી. સરકારે આઠ વરસ અગાઉ આવો કોલ આપ્યો હતો તેવું રાવે ઉમેર્યું હતું.

રાજીનામાં ધરી દેનાર કોંગ્રેસી નેતાઓની માંગ : મંત્રણા શરૂ થઇ ચૂકી છે : પીસી

અલગ રાજ્ય રચવાનું કામ ઊભાઊભું એક કે બે મિનિટમાં જ થઇ શકે નહીં તેવા ચિદમ્બરમ્ અને આંધ્રપ્રદેશના એઆઇસીસી ઇન્ચાર્જ ગુલામનબી આઝાદના નિવેદન બદલ પણ રાવે નારાજગી સાથે હતાશા વ્યક્ત કરી હતી.

અલગ તેલંગણા રાજ્યની માંગ માટે રાજીનામાં ધરી દેનાર કોંગી સાંસદો અને ધારાસભ્યો નવા પક્ષની રચના કરશે તેવી અટકળો સામે તેલંગાણાના કોંગી નેતાએ રોષ વ્યક્ત કર્યો હતો.

દરમ્યાન, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે એક સવાલના જવાબમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આ મામલે ચર્ચાનો દોર ચાલુ જ છે. ચર્ચાની પ્રક્રિયા અંતિમ નિર્ણય માટે મદદરૂપ થશે. તેમણે આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનાં સૂચનો નકારી કાઢયાં હતાં.

ટુ જી : પૂર્વ ટેલિકોમ સચિવોની જેપીસી દ્વારા આજથી પૂછતાછ

નવી દિલ્હી, તા. ૬ : ટુ જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) હાલ તિહાર જેલમાં બંદી એવા સિદ્ધાર્થ બેહુરા સહિત પૂર્વ ટેલિકોમ સચિવો અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના પૂર્વ વડાઓની આવતી કાલથી પૂછપરછ શરૂ કરીને તેઓના પુરાવાઓ રેકર્ડ કરાશે. છેતરપિંડી, બનાવટગીરી અને ગુનાહિત કાવતરાખોરીના આરોપોસર ગયા ફેબ્રુઆરીથી જેલમાં બંદી બેહુરાને તારીખ બારમીએ જેપીસી સમક્ષ રજૂ કરાશે.

નવે. '૯૬થી ઓગસ્ટ '૯૮ દરમિયાન ટેલિકોમ સચિવ રહેલા એ.વી. ગોકાક, વિનોદ વૈશ, શ્યામલ ઘોષ, અનિલ કુમાર, જે.એસ. શર્મા અને નૃપેન્દ્ર મિશ્રાની ચકાસણી જેપીસીની તા. ૭ અને તા.૮ની બેઠકો દરમિયાન થશે. દિનેશ શંકર અને એ.રાજાના મંત્રીપદ દરમિયાન ટેલિકોમ સચિવ રહેલા પૂર્વ સીવીસી પી. જે. થોમસે તા.૧૨ અને તા.૧૩મીએ સમિતિ સમક્ષ હાજર થશે.

પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણેશજીની મૂર્તિ નહીં

અમદાવાદ, તા. ૬ (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, આગામી ગણેશોત્સવ માટે મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવે છે પરંતુ તેનાથી પર્યાવરણને ઘણું મોટું નુકસાન થાય છે અને આ મૂર્તિ પાણીમાં ઓગળતી નથી, આથી આવી મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી નહીં બનાવવી તેવો હુકમ કર્યો હતો.

સુરતના પોલીસ કમિશનરે પર્યાવરણને નુકસાન થાય નહીં તે માટે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણેશજીની મૂર્તિઓ નહીં બનાવવા જાહેરનામું બહાર પાડયું હતું. આથી સુરતના કારીગરો દ્વારા તેને પડકારવામાં આવી હતી અને રજૂઆત કરી હતી કે, પ્લાસ્ટર ઓફ પેરિસથી કોઇ નુકસાન થતું નથી અને હજારો કારીગરોની આ રોજી છે. જો કે સિંગલ જજની બેંચે પોલીસ કમિશનરનું જાહેરનામું યોગ્ય ઠરાવ્યું હતું. જો કે કારીગરોએ ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં તેને પડકારેલો જેમાં આજે ચીફ જસ્ટિસે સિંગલ જજના હુકમને કાયમ રાખ્યો હતો અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણેશજીની મૂર્તિઓ નહીં બનાવવા હુકમ કર્યો હતો. જો કે, ગણેશોત્સવને ધ્યાનમાં રાખી મોટાભાગના કારીગરોએ આ મૂર્તિઓ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને તે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવી છે. કેટલાક કારીગરોએ માટીમાંથી પણ બનાવી છે. જે કારીગરોએ પી.ઓ.પી.માંથી બનાવી છે તે કારીગરોની હવે મુશ્કેલી વધશે એવું મનાય છે.

કેન્દ્ર નકસલગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજશે

નવી દિલ્હી, તા. ૬ (પી.ટી.આઇ.) : છત્તીસગઢમાં માઓવાદીઓ સામે લડવા માટે આદિવાસીઓને જ સશસ્ત્ર બનાવવાને સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય ઠરાવી દેવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં જ જે રાજ્યમાં સ્થાનિક લોકોને નકસલીઓ સામે લડવામાં જોતરવામાં આવ્યા હોય તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજશે. તેવો સંકેત કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમ દ્વારા આપવામાં આવ્યો હતો.

પાંડરવાડા કેસમાં તિસ્તાને નવેસરથી સમન્સ

મુંબઈ, તા. ૬ : લૂણાવાડા પોલીસે તિસ્તા સેતલવાડને તેમની સમક્ષ હાજર થવાના સમન્સ નવેસરથી મોકલ્યા છે. પાંડરવાડામાં કબર ખોદી કાઢવાના મામલે આ સમન્સ મોકલવામાં આવ્યા છે. તિસ્તાએ ગુજરાતના ડીજીપીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પોલીસે ગુજરાત હાઈકોર્ટના આદેશને અનુસરીને ચાર્જશીટમાં સુધારા કર્યા નથી. તિસ્તાને મોકલવામાં આવેલા સમન્સમાં જણાવાયું છે કે ગત ત્રીજી એપ્રિલે સમન્સ અને ચાર્જશીટમાં કરેલા સુધારાની પ્રત સાથે હેડ કોન્સ્ટેબલ તમારી ઓફિસે આવ્યો હતો, પણ ત્યાં એક વ્યક્તિએ એ પરબીડિયું સ્વીકારવાની ના પાડી દીધી હતી. હવે તિસ્તાને પોલીસે ૧૮મી જુલાઈએ હાજર થવા જણાવ્યું છે. આ મામલે પૂછપરછ માટે આગામી ૧૮મી તારીખે સવારે દસ વાગ્યે તિસ્તાને હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. જો તિસ્તા આ સમન્સની અવગણના કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવું આ સમન્સમાં જણાવવામાં આવ્યું છે.

ગેસ પાઇપલાઇનની કંપની વેચવા મુકેશ અંબાણીની તૈયારી

મુંબઇ,તા.૬: દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે પાઇપલાઇન પાથરવાનો વ્યવસાય કરતી પોતાની કંપની રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી વેચવાની તૈયારીમાં હોવાનું જાણકાર સૂત્રોના હવાલેથી વોલ સ્ટ્રીટ જરનલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યા અનુસાર મુકેશ અંબાણીએ આના માટે કેટલીક બેન્કોનો પણ સંપર્ક સાધ્યો છે. જે શરૂઆતી તબક્કામાં છે. આ કંપનીની કિંમત ૪૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ વાતચીત અંગે કંપનીએ કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતની આ કંપની ડી૬માંથી ૪ કરોડ ૮૦ લાખ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન દરરોજ કરે છે. આ કંપની શેલ ગેસના ઉત્પાદનની પણ તૈયારીમાં છે.

પહેલા પાનાથી...

કચ્છમાં મેઘમાહોલ

ગામની મુખ્ય નદીમાંથી જોશભેર પાણી વહેતાં નાના-વાહનો અટકી ગયા હતા. તો વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

ગ્રામીણ વિસ્તારમાં છાંટા

નલિયાથી અમારા પ્રતિનિધિ સતીશ ઠક્કરના હેવાલ પ્રમાણે બપોર પછી તાલુકાના ચિયાસર, હિંગરિયા, રાતાતળાવ, કનકપુર સહિતના વિસ્તારોમાં દોઢેક ઇંચ વરસાદ થયો હતો. તાલુકાના જંગડિયા, ગોયલા, મોખરા વગેરે ગામોમાં એક ઇંચ વરસાદ થયો હતો. કોઠારા, સુથરી વગેરે ગામોમાં હળવા છાંટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી, જેને પગલે ગરમીમાં રાહત મળી હતી. તાલુકા મથક નલિયામાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. લૈયારી ગામે મેલડી માતાના મંદિર પર વીજળી ત્રાટકતાં મંદિરના શિખરને નુકસાન થયું હતું.

વરસાદને પગલે તાલુકાના મોટાભાગના ગામોની વીજલાઇન ફોલ્ટ હોતાં વીજળી પુરવઠો ખોરવાઇ જતાં અસહ્ય ગરમીમાં લોકો અકળાયા હતા. દરમ્યાન અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી સ્થિતિને પગલે વરસાદી આળંગ સાંજે ચાલુ રહ્યો હતો, જેને પગલે વધુ વરસાદની રાહ જોવાઇ રહી છે.

દહીંસરા પંથકમાં દોઢ ઇંચ

દહીંસરા ખાતે દક્ષિણ દિશામાંથી સાંજે ૩.૪૫થી પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. આસપસના ચુનડી, ધુણઇ, સરલી, ગોડપર અને મેઘપરના ધરતીપુત્રો પ્રથમ વર્ષાથી ખુશખુશાલ બન્યા હતા.

માંડવી તાલુકાના રામપર વેકરામાં આજે બપોરે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસતાં લોકો ગેલમાં આવી ગયા હતા. તો દરશડી, લુડવા, રામપર, મમાયમોરામાં અડધાથી પોણો ઇંચ પાણી પડી ગયું હતું.

અંજાર તાલુકાના હીરાપર ગામે ૧ ઇંચ કૃપા વરસતાં ખેડૂતોમાં રાજીપો ફેલાયો હતો, તો નવાગામ, મોડસર અને હીરાપરમાં પણ વરસાદના વાવડ મળ્યા છે.

દરમ્યાન નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ, કોટડા (જ.), જડોદર, ખાંભલા ગામે પણ ઝાપટાંએ સારા ચોમાસાની આશા જગાવી છે.

ગઢશીશા પંથકમાં મહેર

માંડવી તાલુકાના ગઢશીશા પંથકમાં આજે બપોરે ૨.૩૦ વાગ્યા પછી વાતાવરણ પલટાતાં ગાજવીજ સાથે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું અમારા પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યએ જણાવ્યું હતું. ગઢશીશામાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં બજારોમાંથી પાણી વહી નીકળ્યાં હતાં, જ્યારે નજીકના રાજપર ખાતે ગઢશીશાથી પ્રમાણમાં ઓછા વરસાદના અહેવાલ પ્રાપ્ત બન્યા છે. રત્નાપર, મઉં, ભેરૈયા, વિરાણી, દુજાપર, વડવા, વરઝડી, ઘોડાલખ, આશરાણી વિગેરે ગામોમાં પણ વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે.

હમલા-મંજલ, શેરડી, નાની મોટી ભાડઇ, ગાંધીગ્રામ, રતડિયા જેવા ગામોમાં પણ સારા વરસાદ બાદ ખેડૂતવર્ગ વાવણી કામે લાગ્યો હતો તથા આજે સતત બીજા દિવસે પણ આ જ વિસ્તારમાં સારો વરસાદ પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

કેરા પટ્ટીમાં અમીછાંટણા

બપોરે ગોરંભાયેલા આકાશ અને ઉકળાટ પછી ૩ વાગ્યે ઝાપટાંનો દોર શરૂ થતાં જ મોસમના પ્રથમ વરસાદમાં અબાલ-વૃદ્ધ સૌ ભીંજાયા હતા.. પાકા મકાનની 'ધાડી'ના બાકોરાંમાંથી 'ધધડિયા' રૂપે પાણી વહેતાં હર્ષનાદ ગુંજ્યો હતો.

કેરાથી બળદિયા, ભારાપર, નારણપર, દહીંસરા, વડઝર, ખત્રી તળાવ, ગજોડ, બાબિયા, ઝૂમખાથી છેક સુખપર, મિરજાપર સુધી સામાન્ય છાંટાથી અડધા ઇંચ જેટલા વરસાદી વાવડ મળ્યા હતા. કેરા-કુન્દપરની શેરીમાં પાણી વહ્યાં હતાં જેથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં કીચડ ભરેલા ખાબોચિયાએ મુશ્કેલી સર્જી હતી.

શ્રમજીવી વર્ગ અને ધરતીના તાતે ઉમંગભેર પ્રથમ વરસાદને વધાવ્યો હતો. કપાસ, એરંડા, મગફળીના વવાઇ ગયેલા પાકને ફાયદો થયો છે, પરંતુ વાવણી જોગ વરસાદની રાહ જોવાઇ રહી છે તેવું પ્રતિનિધિ વસંત પટેલે જણાવ્યું હતું.

ભુજ તાલુકાની આહીરપટ્ટીના રણકાંધીના ધરમપર અને આસપાસના વિસ્તારમાં વરસાદના એક રાઉન્ડે દોઢ ઇંચ જેટલું પાણી વરસાવ્યું હતું.

ધરમપરથી પાંચાભાઇ આહીર અને વેપારી વાલાભાઇ આહીરે જણાવ્યું કે, ગામમાં શેરીઓ અને સીમાડામાં વોંકળા વહી નીકળ્યા હતા, તેનાં પગલે રણકાંધીના ગામડાઓમાં ખુશી વ્યાપી ગઇ હતી તેવું રાયધણપરથી પ્રતિનિધિ રમેશ આહીરે જણાવ્યું હતું.

માંડવી તાલુકાના દેવપર (ગઢ) પંથકમાં પડેલા મોસમના પહેલા વરસાદથી કિસાનોને વર્ષ સારું જવાની આશા બંધાણી છે. ખબરપત્રી રમેશ રોશિયાના જણાવ્યા પ્રમાણે અડધા ઇંચના પાણી પડવાથી ઉકળાટ તો ઓછો થયો પણ ખેડૂતોને પણ હજુ વધુ વરસાદ થવાની આશા છે. તો આજના વરસાદે નખત્રાણા તાલુકાના વડવા કાંયા, મંગવાણા, પલીવાડ સહિતના ગામડાઓ પર પણ અમીછાંટણા કર્યા હતા.

બોંબ ધડાકાનો ખટલો

બ્લાસ્ટ થયા હતા. જેમાં ૫૬ લોકોનાં મોત થયાં હતાં. માત્ર ૭૦ મિનિટના ગાળામાં આ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અમદાવાદ શહેર સહિત દેશભરમાં દહેશતનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. બેંગ્લોર બ્લાસ્ટના એક દિવસ બાદ જ આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા અને ટીવી ચેનલોએ કહ્યું હતું કે, ત્રાસવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહીદ્દીને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇસ્લામિક ત્રાસવાદી સંગઠન હરકત ઉલ જેહાદ અલ ઇસ્લામીએ પણ હુમલા માટેની જવાબદારી સ્વીકારી હતી.

વિદ્યાસહાયકો

મહત્તમ વયમર્યાદાના કારણે ઉમેદવારી કરી શક્યા ન હોય તેવા સેંકડો વિદ્યાર્થીઓને વિદ્યાસહાયકોની ભરતી માટેની નવી તકો ઉપલબ્ધ કરવાનો મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્તુત નિર્ણય કર્યો છે.

વર્ષ ૨૦૧૦માં પારદર્શી પ્રક્રિયાથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના વિદ્યાસહાયકોની ભરતી કર્યા બાદ હવે આ વર્ષે પણ રાજ્યમાં ૧૩,૦૦૦ જેટલા નવા વિદ્યાસહાયકોની ભરતીમાં તમામ કક્ષામાં યોગ્ય ઉમેદવારોને તક મળી રહે તેમજ પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂર્ણ કરી શકાય તે માટે પાંચ વર્ષની મહત્તમ વયમર્યાદા છૂટછાટમાં વધારા સાથે નજીકના ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

નોએડાની જમીન

સાથ ખેડૂતોને તેમની જમીન પરત કરવાના પણ નિર્દેશ આપ્યા હતાં. ન્યાયમૂર્તિ જી.એસ.સંઘવી અને એ.કે.ગાંગુલીની પીઠે જણાવ્યું હતું કે, ગ્રેટર નોએડા વિકાસ પ્રાધિકરણના નિયમોનું સદંતર ઉલ્લંઘન કરીને બિલ્ડરોને જમીન ફાળવવામાં આવી હતી, જ્યારે જમીન અધિગ્રહણ કરતી વખતે ખોટા બહાના બતાવીને જમીનો ખેડૂતો પાસેથી પડાવી લેવામાં આવી હતી.

રમખાણના રેકર્ડ

એવી જાહેરાત કરી હતી કે રેકર્ડનો વર્ષ ૨૦૦૭માં નિયમ અનુસાર નાશ કરી દેવામાં આવ્યો છે. જો કે ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. રાજ્યના ગૃહસચિવ બલવંતસિંહે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર પાસે આ તમામ રેકર્ડ ઉપલબ્ધ છે, કોઇપણ રેકર્ડનો નાશ કરાયો નથી.

આથી જનસંઘર્ષ મંચ દ્વારા ૪ જુલાઇના રોજ નાણાવટીપંચ સમક્ષ અરજી કરવામાં આવી હતી કે, ગોધરાકાંડ અને રમખાણો બાબતેના રેકર્ડ અંગે સરકારી વકીલનું નિવેદન તેમજ હોમ સેક્રેટરીનું નિવેદન બન્ને વિરોધાભાસી છે, આથી નાણાવટીપંચ દ્વારા રાજ્યના ગૃહસચિવ તથા આઇ. બી.ના એડિશનલ ડી. જી. પી.ને સૂચના આપી તેમનો જવાબ સોગંદનામાં રૂપે રજૂ કરવા સૂચના આપવી. મુકુલસિંહાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેકર્ડ ઉપરાંત ૨૭-૨-૨૦૦૨ના રોજ મુખ્યપ્રધાનને ત્યાં મિટિંગ મળી હતી, તે દિવસે રાજ્યના પોલીસવડા કે. ચક્રવતી, આઇ.બી.ના વડા રાયગર અને સંજીવ ભટ્ટ તેમજ અન્યના વાહનોની લોગબુક પણ મેન્ટેન કરી છે કે કેમ ? અને હોય તો તેની નકલ રજૂ કરવા જણાવ્યું હતું.

ખાનગી હોસ્પિટલો

વચન પરિપૂર્ણ કરવાના દિલ્હી વડી અદાલતના આદેશ સામે આ હોસ્પિટલોએ સર્વોચ્ચ અદાલતમાં ધા નાખતાં આ આદેશને સ્થગિત રાખનાર સર્વોચ્ચ અદાલતે એવી ચેતવણી આપી છે કે નિઃશુલ્ક સારવારનો પ્લાન રજૂ કરવાની બે સપ્તાહની મહેતલને પહોંચી વળવામાં આ હોસ્પિટલો વિફળ જશે તો પેલો સ્થગિત આદેશ હઠાવી લેશું. સારવાર અને દવાઓની ઊંચી કિંમતો જોતાં ગરીબ દર્દીઓને બધું જ મફતમાં આપવામાં આવે તો તો મોટા ભાગની ખાનગી હોસ્પિટલોએ તાળાં મારવાં પડે તેવી આ હોસ્પિટલોની સુફિયાણી અને ખોખલી દલીલ અદાલતે ફગાવી દીધી છે.

મુદ્રક અને પ્રકાશક : **શૈલેષ હંસરાજ કંસારા,** સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી કચ્છમિત્ર પ્રિન્ટીંગ પ્રેસ,ઇન્દ્રાબાઇ પાર્ક પાસે, ભુજ-કચ્છમાં છાપ્યું અને તે જ સ્થળેથી પ્રસિદ્ધ કર્યું છે,મેનેજિંગ એડિટર : **કુન્દન વ્યાસ,** તંત્રી : **કીર્તિ જયંત ખત્રી,** ઇ-મેઇલ : kutchmitra@yahoo.com. / kutchmitra@rediffmail.com. ■ **મુંબઇ ઓફિસ** : જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, ફોર્ટ, મુંબઇ-૧, ટે.નં. (૦૨૨) -૨૨૮૭૦૮૩૧-૩૪, ■ **અમદાવાદ કાર્યાલય** : ૨૦૨, કલિંગ કોમ્પ્લેક્ષ, બાટા શો રૂમ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, ફોન નં. (૦૭૯) ૨૬૫૮૮૭૭૪, ફેક્સ : ૨૬૫૮૯૮૯૧. ■ **દિલ્હી કાર્યાલય** : આઇ.એન.એસ. બિલ્ડીંગ, રફી માર્ગ, નવી દિલ્હી ટે.નં. (૦૧૧) ૨૩૭૧૧૦૦૨. ■ **વડોદરા કાર્યાલય** : બ્લોક નં. ૩-૪ પદ્માવતી શોપિંગ સેન્ટર, ન્યાય મંદિર પાસે, વડોદરા ટે.નં. (૦૨૬૫) ૨૪૧૨૯૦૬, ફેક્સ : ૨૪૩૨૭૫૭. ■ **સુરત કાર્યાલય** : લવ-કુશ, ગ્રાઉન્ડ ફલોર, વિવેકાનંદ બ્રિજ પાસે, અડાજણ રોડ, સુરત-૩૯૫૦૦૯. ટે.નં. : (૦૨૬૧) ૨૭૮૦૮૫૦.

Digitially Archived by: www.realpatidar.com/library

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

ભલે આવ્યો મારા મીઠા મેહુલિયા : કચ્છને બુધવારે બફારામાંથી રાહત આપતાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી વહાલ વરસ્યું હતું. પ્રથમ દ્રશ્યમાં ગઢશીશાથી નખત્રાણા તરફ જતા દ્વિમાર્ગી માર્ગ પર નદી માફક પાણી વહી નીકળ્યાં હતાં, જિલ્લા મથકે વરસાદની ઝરમર ઝીલતાં બીજા દ્રશ્યમાં ભુજના મહાદેવ ગેઈટ તરફ જતા રસ્તે વાહનચાલકોમાં પલળવાનો આનંદ દેખાય છે. તો 'ચોમાસું બેઠું'ના હાશકારા સાથે છત્રીનો ઉપયોગ શરૂ થયો હોવાનું ભુજની જ ત્રીજી તસવીરમાં જોઈ શકાય છે. છેલ્લી તસવીર મોથાળામાં મેઘમહેરની છે.

માંડવી બંદરની અવગણનાનો વસવસો

તસવીર કથા

માંડવી, તા. ૬ : એક વેળાએ દેશ-દેશાવરમાંથી આવતાં-જતાં વહાણોની યાતાયાતથી ધમધમતા આ બંદરનું માનવીય દુર્લક્ષ્યને લીધે નામું નખાઈ જાય તેટલી હદે અવહેલના થતી હોવાના નિઃસાસા સાહસિકોએ નાખ્યા છે. આજે બપોરે દુબઈથી વતનમાં વિસામો લેવા આવેલું ખાલી વહાણ નાળ સફાઈ ના હોવાને કારણે રેતીમાં ખૂંચી જતાં ધંધાર્થી ધંધે લાગી ગયા હતા.

અહીંના સલાયાના હાસમઅલી પલીજાની માલિકીનું હજારેક ટનની ક્ષમતાવાળું એમ.એસ.વી. નંબર ૨૦૬૯થી નોંધાયેલું વહાણ 'આસિફ' બ્રેકવોટરથી કસ્ટમ નજીક આવતાં રેતીમાં ખૂંપી ગયું હતું. પાંચેક દિવસો પહેલાં દુબઈથી નીકળેલા વહાણથી ૧૦૦-૨૦૦ મીટર દૂર કિનારો હતો, તેટલું અંતર વધારે થઈ પડ્યું હતું. દરિયાઈ સાહસિકોના જણાવ્યા મુજબ આવી રીતે વહાણ ફસાતાં મોટી નુકસાની નિશ્ચિત હોય છે. સદ્ભાગ્યે ઉક્ત માલવાહક તાજેતરમાં બન્યું હોવાથી કલ્પના બહારની નુકસાનીમાંથી બચી જવાશે. કરમ યોગે દોઢેક દાયકા પુરાણું વહાણ હોત તો પાણીનું મારણ એને મોટી નુકસાનીમાં મૂકી દેતાં ગત વર્ષે પણ આ વહાણ આવા જ કારણે રેતીમાં ફસાયું હતું.

બારેક વર્ષોના વનવાસ પછી દોઢ-બે કરોડની બંદરે કમાણી કરી આપી છે, તેવા જાજરમાન બંદરની દુર્દશા માટે મેરી ટાઈમ બોર્ડના તંત્રની નિરાશાજનક નીતિ પ્રત્યે ફિટકાર વરસાવાઈ રહ્યો હતો.

(હેવાલ : દેવેન્દ્ર વ્યાસ, તસવીર : લતિફ હુસેન હોડા)

ભડલીમાં ગરીબનાથજીનો બે દિવસીય મેળો યોજાયો

ભડલી (તા. નખત્રાણા), તા. ૬ : અહીં ગરીબનાથનો બે દિવસીય મેળો ધાર્મિક ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. સંતવાણી દરમ્યાન થયેલ આવક સદ્પ્રવૃત્તિઓ માટે વાપરવાની જાહેરાત કરાઈ હતી.

જય દાદા ગરીબનાથ સમિતિ આયોજિત આ બે દિવસીય મેળાની પરંપરાગત ઢબે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે હરિભાઈ ગઢવી, વર્ષાબેન બખતરિયા, રમેશ જોશી દ્વારા સંતવાણી યોજાઈ હતી. જેમાં ઘોર રૂપે મળેલ રકમમાંથી અડધી રકમ ગાયોના ઘાસચારા માટે તથા અડધી રકમ ધાર્મિક કાર્યક્રમો માટે વાપરવા જાહેરાત કરાઈ હતી. બે દિવસ સુધી યોજાયેલા સમૂહપ્રસાદના દાતા પટેલ ગોપાલ ધનજી રહ્યા હતા. પૂજારી શિવનાથ દ્વારા ધાર્મિકવિધિ સંપન્ન કરાઈ હતી. સંચાલન સુરેશપુરીએ તથા આભારવિધિ રણછોડ પટેલે કર્યા હતા.

હાર્દિક શુભેચ્છા

PACL ઈન્ડિયા લિ.
ભુજ-કચ્છ મધ્યે દક્ષાબેન જોષી, ઈબ્રાહીમભાઈ રાયમા, એમ.જી. પરમાર જેઓ છેલ્લા ૧૫ કે તેથી વધુ વર્ષોથી ખંતપૂર્વક ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. એમની શ્રેષ્ઠ કામગીરીથી કંપનીને ફાયદા ઉપરાંત ગ્રાહકોમાં વિશ્વાસ સંપાદન થયેલ છે. તેમની આવી શ્રેષ્ઠ સેવાઓને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ...

રજનીકાંત કે. સોલંકી

ગુવાર ઉગાડો - પૈસા કમાવો

ગુવાર ઉગાડો સુખ સમૃદ્ધિ મેળવો

ગુવાર ઉગાડો જમીનને ઉપજાઉ બનાવો

ખેડૂત ભાઈઓ,
ગુવાર વરસાદ ઉપર આધારીત, ઓછી મૂડીએ તેમજ ઓછા વરસાદી પાણીમાં ઉગાડવામાં આવતો મહત્વનો ખેતીનો પાક છે. ગુવારનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ થવાથી તેનું મહત્વ ખૂબ જ વધી ગયું છે.

ગુવારનાં ઉત્પાદનથી થતાં વિશિષ્ટ ફાયદાઓ :-
- ★ ગુવાર ઓછી મૂડીએ તેમજ ઓછી સારસંભાળ કરવાંથી થતો પાક છે.
- ★ ગુવાર પાકની વાવણી લાંબા સમય સુધી (મધ્ય જૂન થી મધ્ય ઓગષ્ટ સુધી) કરી શકાય છે.
- ★ ગુવારની ઉપજથી તેની કિંમત તો વધારે મળે જ છે, સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ વધી જાય છે. અને તેનાં પછી ઉગાડવામાં આવતા પાકનું ઉત્પાદન અને ગુણવતામાં પણ વૃદ્ધી થાય છે.
- ★ ગુવારનાં ઉત્તમ જાતનાં બિયારણ માટે ની વધુ જાણકારી માટે નજીકનાં કૃષિ કાર્યાલય નો સંપર્ક કરો. ગુવારના પાકમાં બીમારી, કીડા, જીવજંતુ જેવી તકલીફો બીજા પાકની સરખામણીમાં ઘણી ઓછી જોવા મળે છે.
- ★ ગુવાર આધારિત ઉદ્યોગો, તમારો ઉત્પાદીત "ગુવાર" હંમેશા સારા ભાવથી ખરીદવા માટે તત્પર છે.
- ★ ગુવારનાં સ્ટોરેજ, માર્કેટીંગ, વેચાણની સગવડ બધાજ ગંજ બજારમાં સરળતાંથી ઉપલબ્ધ છે.
- ★ ગુવાર થી ઉત્પાદીત થતાં ગુવાર ગમ ને ભારતની બહાર નિકાસ કરવામાં આવે છે. જેનાથી દેશને મૂલ્યવાન વિદેશી ચલણ મળે છે.
- ★ ગુવાર ચૂની અને કોરમા, જે ગુવારનું ગૌણ ઉત્પાદન છે. તેમાં ઘણી માત્રા માં પ્રોટીન હોય છે. તેનો ઉપયોગ પશુનાં ચારા માટે કરવામાં આવે છે.

આથી ખેડૂત ભાઈઓ આપની, રાષ્ટ્રની તેમજ જમીનની સુખ-સમૃદ્ધી માટે વૈજ્ઞાનિક ટેકનોલોજી અપનાવી વધુ ને વધુ જગ્યામાં ગુવાર ઉગાડો.

ઈન્ડીયન ગુવાર ગમ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન
મો. [illegible], ઈ-મેલ : iggma.2008.association@gmail.com
સૌજન્ય : એન્કોર નેચરલ પોલીમર્સ પ્રા.લી., અમદાવાદ.

Mahindra Rise.

XYLO OFFERS GREAT VALUE FOR MONEY

OUTPERFORMS OTHER MUVs ON PRICE, SPACE & FEATURES

Benefit upto ₹ 51,000/-*

Starting from ₹ 7.74# lacs

Xmart
• ABS • Comfortable 3 Row Theatre Style Seating • Digital Drive Assits Systems (DDAS)
• Surround Cool Dual ACs with Individual Vents • 2 Din Audio System
XYLO THE TIME OF YOUR LIFE

* This scheme is not valid on Xylo D2 model. In benefit includes Insurance @ Rs.1, Extended warranty & X-mart exchange bonus & conditions apply. # Ex-showroom Gujarat price of Xylo E4 - BSIII.

B. Mangatram & Co. :
• BHUJ : 254803, 254804, 9909027337, 9913374132 • GANDHIDHAM : 235465, 229005, 9925245245
For More Information SMS <Xylo> space <Name> space <City> to 54242



પીએસીએલ ઈન્ડિયા લિમિટેડ સ્પષ્ટતા કરે છે

પીએસીએલ ઈન્ડિયા લિમિટેડ કંપની સ્વરૂપે ૧૯૯૬માં રજિસ્ટ્રાર ઓફ કંપની જયપુર સાથે નોંધાયેલ. તેની રજિસ્ટર્ડ કચેરી ૨૨, ૩જો માળ, અંબર ટાવર સંસાર ચંદ રોડ, જયપુર–૩૦૨ ૦૦૪ ખાતે અને કોર્પોરેટ ઓફિસ : ૭મો માળ, ગોપાલદાસ ભવન, ૨૮, બારાખંભા રોડ, નવી દિલ્હી–૧૧૦ ૦૦૧ ખાતે છે.

અમે આથી ગેરમાર્ગે દોરતા અને ઉપજાવી કાઢેલા અહેવાલોની નિંદા કરીએ છીએ જે અમારા વિરોધીઓએ મીડિયાના એક વર્ગમા પ્રસિદ્ધ કર્યા છે જેમાં અમારા માટે એવું કહેવાયું છે કે રોકાણકારોના નાણાં લઈ અમો ગાયબ થઈ ગયા છીએ.

આવી કોમેન્ટ અનેક વ્યકિતઓ અને સરકારી અધિકારીઓએ ગ્વાલિયરની નામદાર હાઈકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીની બાબતના પૂર્વગ્રહથી પ્રેરાઈ કરી છે.

અમે એ વાતની પણ નિંદા કરીએ છીએ કે અમારી કંપનીનું નામ અન્ય લેભાગૂ કંપનીઓ સાથે મૂકી અમોને બદનામ કરવામાં આવ્યા છે જે કંપનીઓ ગ્રાહકોના નાણાં લઈ ગુમ થઈ છે.

અમારી જમીનની બેંક કિંમત રૂા. ૭૫૦૦૦ કરોડથી વધુ છે. તે પ્રતિષ્ઠિત એજન્સીઓના મૂલ્યાંકનના અહેવાલથી ફલિત થાય છે.

દેશભરમાં અમારા અનેક પ્રતિષ્ઠિત પ્રોજેકટ સાકાર થઈ રહ્યા છે. એક માત્ર ગ્વાલિયરમાં અમે ગુરુવાર ૩૦ જૂનના રોજ દાવાઓના સેટલમેન્ટ થતા ૫૧૦૦૦થી વધુ ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યા છે.

અમો ફરી દોહરાવીએ છીએ કે અમારો કોઈ સંબંધ કોઈ ચિટફંડ કંપની સાથે નથી, કોઈ નૉન બેંકિંગ ફાઈનાન્શીયલ કંપની અને કલેકટીવ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ સાથે પણ કોઈપણ પ્રકારનો સંબંધ નથી, જેના માટે અમો રાજસ્થાન હાઈકોર્ટમાં કેસ પણ જીત્યા છીએ જેમાં કહેવાયું છે કે અમે સીઆઈએસ નોર્મ્સમાં આવતા નથી, અમારો મેનેજમેન્ટ સ્ટાફ અને અમારા એડવાઈઝરોને ખાસ જણાવાયું છે કે તેઓ અમારા ગ્રાહકોની પૂછપરછ વગેરે માટે હંમેશ ઉપલબ્ધ રહે અને તેમની શંકા–કુશંકા તુરંત દૂર કરે. આથી અમો અમારા તમામ હિસ્સેદારોને અને સત્તાધિકારીઓને અપીલ કરીએ છીએ કે અમારી તમામ પ્રકારની કામગીરી પારદર્શી છે, અમારે કંઈપણ છુપાવવાનું નથી, કોઈપણ જાતની અફવા સાંભળવા મળે તો તુરંત સંપર્ક કરવા જણાવાય છે.

કોઈપણ વ્યક્તિની નજીકની કચેરીનો અથવા બ્રાન્ચ મેનેજર અથવા મેનેજમેન્ટનો કોઈપણ પ્રકારની માહિતી માટે ગમે ત્યારે સંપર્ક કરી શકાશે. અમારા ગ્રાહકો સાથેના સંબંધો અકબંધ છે અને તેમની સાથે થયેલી સમજૂતીઓ અમોને સદા બંધનકર્તા રહેશે.

તમે સંપર્ક કરી શકો અમારા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૭૩૧૪ (એમટીએનએલ એન્ડ બીએસએનએલ ઉપયોગકર્તા માટે)
૦૧૧-૪૩૬૫૦૦૦૦ (અન્ય માટે)

પીએસીએલ ઈન્ડિયા લિમિટેડ
ડાયરેકટર

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જતા ગતિરોધક કેટલા વાજબી : *ભારતના મહાબંદરમાં ટોચનું સ્થાન કંડલા બંદર ધરાવે છે. ત્યાંથી નેશનલ હાઈવે-૮ ચાલુ થાય છે અને સામખિયાળી ટોલગેટ ઉપર તેનું ટોલ પણ ઉઘરાવાય છે. રસ્તાની જાળવણીમાં જેવી માવજત નેશનલ હાઈવે ઓથોરિટીએ લેવી જોઈએ તે લેતું નથી. કંડલા જતા માર્ગ ઉપર નકટી પુલ ઘણો જૂનો થયો છે. તે પુલ ઉપર વાહનોની ઝડપ ઓછી થાય તેના માટે તેનાથી ૧૫ ફૂટ પહેલાં જ સ્પીડબ્રેકરો મુકાયા છે. જેના ઉપર કોઈ માર્કિંગના સફેદ પટ્ટા, રેડિયમ બોર્ડ કે વાહનચાલકોને અગાઉથી જાણ થાય તેવા સિગ્નલો મુકાયા ન હોવાથી ઓચિંતાનું સ્પીડબ્રેકર આવે અને વાહનોને ઉછળતા બચાવવા માટે ઓચિંતી બ્રેક મારવી પડે જેના લીધે વાહનચાલક કન્ટ્રોલ ખોઈ બેસે. તેટલું જ નહીં, પણ પાછળ આવતું વાહન પણ અકસ્માત સર્જે છે. બુધવારે સાંજે ૬ વાગ્યે મહાકાય ટ્રેઈલર આ સ્પીડબ્રેકરનો ભોગ બની સાઈડમાં ઊતરી ગયું હતું. સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી.*

તુલસીદાસજી ક્યારેક પૂરા ક્રાંતિકારી લાગે છે : બાપુ

નીતિન વડગામા દ્વારા

ન્યૂયોર્ક, તા. ૬ : અમેરિકા ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં આજે સેન્ટ એન્થનીઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બ્રધર ગેરીએ બાપુનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, મોરારિબાપુ કેવળ તમારી કમ્યૂનિટી માટે જ નહી, પરંતુ અમારી કમ્યૂનિટી માટે પણ અત્યંત આદરણીય છે. એમણે પૂરેપૂરો સમય કથામાં ઉપસ્થિત રહીને તથા રામાયણજીની આરતી ઊતારીને વ્યાસપીઠનો આદર કર્યો હતો. યજમાન હેતલ પંચોલીએ એમને બાપુના વરદ્ હસ્તે 'રામચરિત માનસ'ની અંગ્રેજી આવૃત્તિ ભેટ અપાવી હતી અને બાપુએ વ્યાસપીઠને આદર આપવા બદલ બ્રધર ગેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. કથાના આરંભમાં બાપુએ આજે શ્રોતાઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપીને શ્રોતાઓની જિજ્ઞાસા સંતોષી હતી. ચાર ઘાટથી કહેવાયેલી કથાના ચારેય વકતાઓની વિશેષતા કઈ છે ? એવા પ્રશ્નનો ઉત્તર આપતા બાપુએ જણાવ્યું હતું કે,

અમેરિકાની રામકથામાં અનેક દેશોમાંથી ભાવિકો ઉમટ્યા : બ્રધર ગેરીએ આરતી ઉતારી

એક વકતા શિવજી પાસે આંખ છે, ત્રણ આંખ- ત્રિનેત્રમ્- છે. જ્ઞાનની પીઠ પર કથા કહે એની પાસે વિધવિધ દૃષ્ટિકોણ હોવાં જોઈએ. શિવજી પાસે જ્ઞાનદૃષ્ટિ, યોગદૃષ્ટિ અને વૈરાગ્ય દૃષ્ટિ છે, એ રીતે વિશાળ દૃષ્ટિકોણ છે.

મોરારિબાપુએ ગોસ્વામી તુલસીદાસજીના સંદર્ભમાં એમ પણ કહ્યું હતું કે, તુલસી ક્યારેક એવાં સૂત્રો આપે છે કે એ પૂરા રેશનાલિસ્ટ લાગે છે. વૈકુંઠ 'લોક' નથી, એવું તુલસીનું નિવેદન ક્રાંતિકારી છે. વૈકુંઠ ભૂમિ નથી, પણ અવસ્થા છે. જેમણે આ કંઠ રસ પીધો છે એ જ્યાં જાય ત્યાં વૈકુંઠ છે. બાપુએ એવી ટકોર પણ કરી હતી કે 'માનસ' ખોલ્યા વિના જ 'માનસ'ની ટીકા કરનારની મને દયા આવે છે ! કેટલાક લોકો તો મને પરેશાન કરવા માટે રામાયણની ટીકા કરે છે !

પાણી-સફાઈની રાવ : *ભુજના પંચહટડી-આશાપુરા મંદિર વિસ્તારમાં અપૂરતા પાણી અને સફાઈ ન થવાની રાવ સાથે સુધરાઈ કચેરીમાં બુધવારે નાગરિકોનો મોરચો ધસી આવ્યો હતો. તંત્ર સમક્ષ સુવિધા પૂરી પાડવા રજૂઆત કરી હતી. પ્રમુખ નરેન્દ્રભાઈ ઠક્કરે પાણીની લાઈન ચેક કરાવી દેવા તેમજ યોગ્ય દબાણ મળે તે માટે વાલ્વમેનને સૂચના આપવાની ખાતરી આપી હતી. તેમજ સફાઈ કરાવવાની હૈયાધારણા આપી હતી. (કચ્છમિત્ર ફોટો.)*

ઉમેદનગરમાં નળ વાટે ગટરના પાણીની ફરિયાદનું નિરાકરણ

ભુજ, તા. ૬ : ગઈકાલે શહેરના ઉમેદનગર, કવિનગર, મંગલમ વિસ્તારમાં નળ વાટે ગટરનું પાણી આવવાની ફરિયાદ બાદ આજ સવારે પાણી પુરવઠો આપીને ક્ષતિનું નિરાકરણ કરાયાનું સુધરાઈએ જણાવ્યું હતું.

બે દિ' પૂર્વે શિવકૃપાનગરથી મંગલમ તરફ આવતા માર્ગ પર નળની લાઈનમાં ભંગાણ પડતાં ગટરના દૂષિત પાણી તેમાં ભળી જતાં ગઈકાલે સપ્લાય વખતે ઘેર ઘેર ગટરના પાણી મળતાં હોબાળો થયો હતો. દરમ્યાન આજે વહેલી સવારે ફરીથી પુરવઠો શરૂ કરતાં ફરી ચોખ્ખું પાણી મળ્યું હોવાનું પા.પુ. શાખાના રમેશ સોલંકીએ જણાવ્યું હતું.

કરાચીમાં વંશીય હિંસાના બનાવોમાં ૨૨ મૃત્યુ

કરાચી, તા. ૬ (પી.ટી.આઈ.): પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં રાજકીય હિંસા ફરી ભડકી ઉઠી છે. શહેરના વિવિધ ભાગોમાં છેલ્લા ૪૮ કલાકમાં લક્ષિત હત્યાઓ અને તે સંબંધિત હિંસક બનાવોમાં બાવીસ જણા માર્યા ગયા છે અને અન્ય ૩૦ને ઈજા થઈ છે.

યુનિ.માં આઠમીએ પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો માટે પ્રવેશકાર્ય

ભુજ, તા. ૬ : કચ્છ યુનિવર્સિટીમાં હાલમાં ચાલતી બી.એડ્.ની પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન અનુ. જાતિ-જનજાતિ વર્ગના છાત્રોને પૂરતી બેઠકો ફાળવણી ન કરાતી હોવાનો તેમજ ઓપન કેટેગરીમાં લઈ જવા પહેલાં પૂરતી જાણ ન કરાતી હોવાનો આક્ષેપ ઊઠ્યો હતો. જો કે, યુનિ. દ્વારા જણાવાયું હતું કે, રાજ્ય સરકારના ધારાધોરણો અનુસાર ૨૨ ટકા અનામત બેઠકની ફાળવણી કરાઈ છે અને અત્યાર સુધી જેટલા અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી થઈ છે તે બધામાં ખાલી રહેલી જગ્યાઓ કે તેને ઓપન શ્રેણીમાં રૂપાંતરિત કરવા માટેની એક સાથે જાહેરાતો પ્રસિદ્ધ થવાની જ છે. આઠમી તારીખે એમ.એડ.ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થવા સાથે પહેલો તબક્કો પૂર્ણ થશે અને બાદમાં ખાલી જગ્યા ભરવા તક અપાશે.

છાત્રોના આક્ષેપ મુજબ યુજીસીના નિયમોનુસાર અનુ. જાતિ માટે ૧૫ તેમજ જનજાતિ માટે ૭.૫ ટકા અનામત દરેક કોર્સમાં હોવી જોઈએ. જો કે યુનિ.ના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું કે, યુજીસીના નિયમો સામે વસતીના ધોરણો અનુસાર દેશભરની રાજ્ય સરકારો જરૂરી નિયમો ઘડે છે એ અનુસાર ગુજરાતના ૧૪+૭ના નિયમને અનુસારવામાં આવે છે.

ગાંધીધામમાં વરલી મટકા રમાડતો શખ્સ ઝપટમાં

ગાંધીધામ, તા. ૬ : શહેરના ચાવલા ચોક વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા-રમાડતા એક શખ્સને પકડી પોલીસે રોકડ રૂા. ૧૩૫૦ કબજે કર્યા હતા. ચાવલા ચોક નજીક લોહાણા મહાજનવાડી પાસે વરલી મટકાનો જુગાર લેતાં આત્મારામ રામજી મહેશ્વરી (રહે. જનતાનગરી)ને પકડી પાડયો હતો. આજે બપોરના આ દરોડામાં તેની પાસેથી રોકડ રૂા. ૧૩૫૦ તથા પેન, બુક વગેરે આંકડાનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું.

ભચાઉમાં ૧૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. ૬ : ભચાઉના ભટ્ટ ફળિયામાંથી પોલીસે એક શખ્સની અટક કરી તેની પાસેથી અંગ્રેજી દારૂની ૧૮ બોટલ જપ્ત કરી હતી. ભટ્ટ ફળિયામાં રહેતા રાજેશ કાનજી વાઘેલાને આજે સાંજે ૫.૧૦ વાગ્યાના અરસામાં પોલીસે ઘરબોચી લીધો હતો. આ શખ્સ પોતાના વિસ્તારમાં હતો ત્યારે તેની પાસેથી અંગ્રેજી શરાબની ૧૮ બાટલી કિંમત રૂા. ૫૪૦૦નો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

પર્લ્સ સામે આરોપો બાદ ચિંતાનો રેલો કચ્છ સુધી

ભુજ, તા. ૬ : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા રહેણાંક, શોપિંગ સેન્ટરોના પ્રોજેક્ટ ધરાવતી પીએસીએલ કંપની સામેના નાણાકીય ગેરરીતિઓના આરોપો બાદ તેની ચિંતાનો રેલો કચ્છભણી પણ પ્રસર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ કચ્છમાં પર્લ્સ નામે જાણીતી આ કંપનીમાં આ જિલ્લામાંથી પણ કેટલાક રોકાણકારોએ લાખો રૂપિયા રોક્યા હોવાનું બહાર આવ્યું છે અને સંબંધિતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ધંધાદારી ધંધાદારી

બાંધણીની દરેક વેરાયટી પર સેલ જયશ્રી સિલેકશન દરબારગઢ રોડ, ભુજ.

જ્યોતિષી ભાસ્કર મારાજ Mo : 99987 79569 મફત સલાહ-સચોટ નિદાન સર્ટીફિકેટવાળા રીયલ રત્નો દ્વારા ગ્રહદોષ નિવારણ કાર્યાલય : નિલકંઠ સોસાયટી, નવાવાસ-માધાપર

શક્તિમાન... શક્તિમાન... ખેતીના કામ માટે ઉપયોગી રોટાવેટર ખરીદવા માટે મળો શ્રી હરિ ટ્રેડર્સ નારણપર, તા. ભુજ. મોઃ ૯૯૨૫૪ ૨૬૬૨૧

ભાવ ઓછા ફાયદો વધારે સ્ટોક ક્લિયરન્સ SALE ઉદય શરાફ બજાર, ભુજ.

લગ્નસંબંધી ઉ.નં.૧૪૪૧ બ્રાહ્મણ યુવક, ઉ.વ.૩૪, છૂટાછેડા, મિલ્કત ધરાવે છે, મા.આ.૨૦ હજાર, જ્ઞાતિબાધ નથી, વિદેશ જવા ઈચ્છુક કન્યા/યુવતીએ મળવું. સંપર્ક : સ્વ.શ્રી ચંપકલાલભાઈ જયંતીલાલ મહેતા સંચાલિત વિનામૂલ્ય શ્રધ્ધા મેરેજ બ્યુરો C/o શ્રી અશોક માંડલિયા-એડવોકેટ ન્યુમિન્ટ રોડ, ભુજ. મો.૯૮૨૫૧ ૬૬૬૦૬

ફ્રી..ફ્રી..ફ્રી..ફ્રી..ફ્રી જ્યોતિષ તાંત્રિકોથી નિરાશ થયા છો ? તો આપ આપના ધાર્યા કામ માટે એક વાર અવશ્ય ફોન કરી રૂબરૂ મુલાકાત લ્યો... મો. ૯૬૦૧૮ ૦૬૦૨૫

KESARI World Class Travel Company હવે... ભુજમાં... अरिहंत ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ 98 98 56 98 11 રેલ્વે/એર /બસ ઈ-ટીકીટ બુકીંગ માટે મળો.

નેટવર્કર માટે અણમોલ તક ૨૫૦૦/-ના જોઈનીંગ પર મહિને ૨૪૦૦/-થી ૧,૨૦,૦૦૦/- કમાવવાની તક વહેલા તે પહેલાના ધોરણે ફ્રેન્ચાઈઝી આપવાની છે ૭૮૭૮૮ ૫૫૩૩૩

ડો. વસંત ડી. નકુમ એમ. ડી. (સ્કીન) બહારગામ જતા હોઈ તા. ૮-૭-૧૧થી ૧૦-૭-૧૧ સુધી મળી શકશે નહીં. તા. ૧૧-૭-૧૧થી નિયમિત મળશે.

પ્રવાસ પુસ્તક નવી પમી આવૃત્તિ લેખક : ડો. નલિન હોટલના મોંઘાં ભાડાંથી બચો, જાતે ભારતભરમાં પ્રવાસનું આયોજન કરો. મો. ૯૮૯૮૧ ૩૩૧૮૯

ગેસના ભાવ વધશે ? નો પ્રોબ્લેમ !! કારણ કે, અમો એવરેજ વધારી આપશું શ્રીજી ઓટો ગેસ-ભુજ મનસુખ કક્કા : 93768 18001

Annual Sale MICKEY MOUSE KIDS HI - FASHION 20% to 50% Discount Hospital Road, Bhuj. Old Court Road, Gandhidham.

PACIFIC FAMILY SHOP Ladies Wear - Kids Wear - Mens Wear FLAT 20% OFF Anam Ring Road, Bhuj - Kutch.

■ સ્કુલ બેંચ ■ નોટિસબોર્ડ ■ લાઈબ્રેરી કબાટ ■ બ્લેક બોર્ડ, વાઈટ બોર્ડ ■ ચેર સમતા ફર્નિચર લાલ ટેકરી, ભુજ. ફોનઃ(૦૨૮૩૨) ૨૫૪૯૯૮ મો. ૯૪૨૯૩ ૪૨૯૨૩

મહા રુદ્ર જ્યોતિષ એક જ ફોનમાં ઘરેબેઠાં સમાધાન ૧૦૧% ફૂલ ગેરંટી સ્પે. N.R.I. પ્રોબ્લેમ, લવ પ્રોબ્લેમ, દારૂ છોડાવો છૂટાછેડા, ભૂમિદોષ, પ્રેમલગ્ન, વિદેશયોગ જ્યોતિષને લગતા તમામ કાર્યનો માત્ર ૨૪ કલાકમાં નિકાલ. દરેક વાત ગુપ્ત રહેશે. ૯૯૨૫૭ ૩૪૪૯૧

મોડ્યુલર કિચન EURO The Stile Station સરપ્રાઈઝ સેનીટેશન પ્રા. લી. ૪૯, જ્યુબિલી સર્કલ, ભુજ.

સેલ સેલ સેલ બોમ્બે ફેશન કિંગ નવો સ્ટોક આવી ગયેલ છે • જીન્સ પેન્ટ, નેરો, બુટકટ, કોટન જીન્સ માત્ર રૂા.૧૫૦/- • કોટન શર્ટ : રૂા.૧૫૦/- • લેડીસ ટોપ : રૂા.૮૦/- • લેડીસ કોટન નેરો જીન્સ : રૂા.૧૦૦/- • ટી-શર્ટ : રૂા.૧૨૦ આશાપુરા રીંગ રોડ, સુમરાડેલી ચાર રસ્તા, ભુજ-કચ્છ Mo : 98252 92999

કચ્છ આવતાં જતાં પ્રવાસીઓ માટે ડિલક્ષ પેક લંચ ફક્ત રૂા. 75 PARK VIEW The Royal Restaurant એન.કે. ટાવર, જિલ્લા પંચાયત સામે, ભુજ.

તદ્દન નવો સ્ટોક અવનવી વેરાયટીઓનો ખજાનો એટલે.. વુડસીટી ફર્નિચર શોરૂમ સોફાસેટ ઓફિસ ફર્નિચર બેડરૂમ સેટ સ્ટીલ ફર્નિચર સેન્ટર ટેબલ ડ્રેસીંગ ટેબલ ડાયનીંગ ટેબલ રીવોલ્વીંગ ચેર શોપ નં. ૩, હર્ષ પ્લાઝા, માંડવી ઓક્ટ્રોય સામે, કોલેજ રોડ, ભુજ. મો. ૯૯૦૯૬ ૬૩૨૪૯

મહારાજ માર્કેટીંગ તાલપત્રી પ્લાસ્ટીક તથા કોટનની વેચાણથી મળશે ભુજ : માધાપર હાઈવે, કાર્ગોની સામે, ૦૨૮૩૨ ૨૯૯૩૪૨, ૯૮૭૯૬ ૪૮૨૩૪ ગાંધીધામ : વિપુલભાઈ : ૯૯૭૯૫ ૪૫૧૪૭ રાજકોટ : કુવાડવા રોડ ૦૨૮૧ ૨૪૭૪૮૦૮

કચ્છમિત્ર 'ટચૂકડી-ધંધાદારી' કોલમમાં વિજ્ઞાપનદાતાએ આપેલી માહિતી સાચી અથવા ખોટી હોવા અંગે 'કચ્છમિત્ર' બાંહેધરી લેતું નથી. જાહેરખબરમાં આપેલી માહિતી ઉપર વિશ્વાસ મૂકતાં પહેલાં વાચકે પૂરતી ખરાઈ કરી લેવી. - મેનેજર

કબાટ.. કબાટ.. કબાટ.. ૭ દિવાલ કબાટ ૭ ૧ ફૂટના માત્ર Rs. 170 ૨૦ ગેજ ઘર બેઠા ઓર્ડર આપો. હોમ ડિલેવરી ફ્રી દસ વર્ષથી પ્રખ્યાત મિરર, સોકેશ, ફિટીંગનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં સંદિપ સ્ટીલ ફર્નિચર હોટલ પ્રિન્સ સામે, સર્વિસ સ્ટેશન બાજુમાં, ભુજ Mo : 97265 24520/21

હવે મળી શકશે ડો. ભવ્ય એમ. દોશી (B.D.S.) દાંત-પેઢાના રોગોના સ્પેશ્યાલિસ્ટ રાપર દર રવિવારે 'નયની' આંખની હોસ્પિટલ, પટેલ વાડીની સામે. ખાવડા દર શુક્રવારે, ડો. રાજદેના દવાખાનામાં, દેના બેંકની બાજુમાં, સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ કલાકે સ્માઈલ એન્ડ શાઈન ડેન્ટલ કેર હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ. મો. ૯૯૭૯૭ ૨૭૦૦૩

: જાહેર ખબર માટે સંપર્ક : ફોન : ૨૫૨૦૯૧ ફેક્સ : ૨૫૨૦૮૯

ટચૂકડી

વેચવાની છે અલ્ટો LX 2007 ઝેન VXI LPG 2001 ફ્રન્ટી AC 2006 ફ્રન્ટી (LPG) AC 2003 સંપર્ક : 98259 65504 94293 41714

જાણકાર માણસ જોઈએ છે સેલ્ફ ડાયનેમો રીપેરીંગ માટે કારીગર જોઈએ છે શ્રી હરિ ટ્રેડર્સ નારણપર, તા. ભુજ. મોઃ ૯૯૨૫૪ ૨૬૬૨૧

તાત્કાલિક વેચવાના છે ■ લોખંડના ઘોડા નંગ - ૮ ■ દાલબાટીનો બાટીનો મશીન - ૧ (કેપેસીટી ૧૫૦ બાટી) મો. ૯૯૦૯૫ ૭૨૪૨૨- ભુજ

જોઈએ છે ગુજરાતી ટાઈપીંગમાં સ્પીડ ધરાવતા યુવક/યુવતી ફોટો અને બાયોડેટા સાથે દિવસ ત્રણમાં રૂબરૂ મળવું. ૦૧, આઈયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલ સામે, Mo. 8866240205

મેહુલપાર્ક મેહુલપાર્કમાં પ્લોટ ખરીદવાના છે M.9925049700

જોઈએ છે (ભુજ માટે) ફેમીલી ડ્રાઈવર Mo : 98253 45450 સવારે ૧૦:૩૦ થી ૧ વાગ્યાની વચ્ચે સંપર્ક કરવો

જોઈએ છે ટેલિકોલર (ફિમેલ) ધો.૧૦ પાસ (આકર્ષક પગાર) રૂબરૂ મળોઃ ક્રિષ્ના ડેવલોપર્સ ઓ.૨૩, ગાંધી માર્કેટ, ૧ લા માળે, ગાંધીધામ Ph. 02836-295635

મુન્દ્રા રિલોકેશન સાઈટ ભુજ મધ્યે વૃદ્ધા દાદીની સંપૂર્ણ સેવા કરી શકે તેવા બહેનની જરૂર છે M. 99255 72888

ગાંધીધામમાં આધુનિક બંગલો વેચવાનો છે સેક્ટર - 5, પોષ એરીયામાં 4 BHK (સ્ટોર રૂમ અલગ) ગ્રાઉન્ડ + પ્રથમ માળ M: 9375438633

મેહુલપાર્ક મેહુલપાર્કમાં પ્લોટ જોઈએ છે M.9429821666 અમૃત એસ્ટેટ

મેહુલપાર્ક સહજાનંદ પાર્ક બાજુમાં આવેલા મેહુલપાર્કમાં પ્લોટ લેવા તથા વેચવા માટે મળો M.9687422581

મેહુલપાર્ક મેહુલપાર્કમાં પ્લોટ ખરીદવાના છે M.9879524684

મેહુલપાર્ક મીરજાપર ૧૧૨-૧૧૪ મેહુલપાર્કમાં પ્લોટ લેવા તથા વેચવા માટે મળો M.9825176753

મેહુલપાર્ક ભુજ-મુન્દ્રા રોડ પર આવેલા મેહુલપાર્કમાં પ્લોટ લેવા તથા વેચવા માટે મળો M.9033391686

મેહુલપાર્ક કોઈવઈનગર નવનીતનગર પાસે આવેલા મેહુલપાર્કમાં પ્લોટ લેવા તથા વેચવા માટે મળો M.9067635940

વેચવાની છે સ્કોરપીયો મોડેલ ૧૧/૨૦૦૫, CRDI, પાવર વિન્ડો, ડબલ એ.સી., એલોય વ્હીલ, ટીપટોપ કંડીશન M. 99984 67427

મેહુલપાર્ક મેહુલપાર્કમાં અને ભુજ સર્વે નં. ૧૭૧/૧ શીવાજી પાર્કમાં રોકડે પ્લોટ જોઈએ છે M.9067710419

પ્લોટો જોઈએ છે સુર્યાપાર્ક : ૯૪ ૯૬ ઉમ્મીદે : ૫૨-૫૩, મુશ્ક : ૬૧-૬૨ મન્નતે : ૫૫૯, સપનાનગર : ૫૬૧ સંપર્ક : ૯૯૨૫૦ ૪૯૭૦૦

મેહુલ પાર્ક સુર્યા પાર્ક : ૯૪ ૯૬ રતીયા : ૫૨-૫૩/૬૧-૬૨/૧૬૨ નાગોર રોડ : ૫૫૯ - ૫૬૧ કોઈપણ સ્કીમના પ્લોટો લેવા/વેચવા મળો : ૯૦૩૩૩ ૯૧૬૮૬

મેહુલપાર્ક મુન્દ્રા રોડ U.K. લાયન્સની સામે આવેલા મેહુલપાર્કમાં પ્લોટ ખરીદવાના છે M.9825777510

પ્લોટ જોઈએ છે શિવમ પાર્ક માધાપર મધ્યે 150 મી. ની આજુબાજુ M.98257 32409

ડ્રીમ પાર્ક પ્લોટ જોઈએ છે મો. ૮૭૫૮૫ ૪૪૯૦૯

ભુજ સર્વે નં. 561 સપનાનગર ભુજ સર્વે નં. 206 ચંદનનગર પ્લોટ લેવા તથા વેચવા માટે મળો M. 89803 99338

પ્લોટો ખરીદવાના છે • સેડાતા : સર્વે નં.૯૪-૯૬ • રતીયા : સર્વે નં.૬૧-૬૨ • નાગોર રોડ : સર્વે નં.૫૫૯-૫૬૧ જીનેશ તન્ના : 99139 69996

ભાડે આપવાનું છે સંસ્કારનગર સ્થિત બંગલો 2BHK 24 કલાક પાણી M.8469720721 M.9925571228

મેહુલપાર્ક ભુજ મુન્દ્રા રોડ પર આવેલા મેહુલપાર્કમાં પ્લોટ ખરીદવાના છે M.9824340940

700-1000 સ્કવેર ફૂટની ઓફિસ અને 1BHK ફ્લેટ/ ટેનામેન્ટ ગાંધીધામમાં જોઈએ છે દલાલ માત્ર આવકાર્ય કો. નં. 96621 93848

જોઈએ છે • ડ્રાઈવર • મેનેજર (એકાઉન્ટન્ટ) • હેલ્પર સંપર્ક : મો. ૯૮૨૫૨ ૨૫૪૦૭

વેચવાનો છે પ્લોટ નં. ૧૫ સનસિટી-એફ બ્લોક મુંદરા રિલો. સાઈટ Cont. No. 98256 79311

મેહુલપાર્ક મેહુલપાર્કમાં પ્લોટ લેવા તથા વેંચવા માટે મળો M.9925571228

જોઈએ છે ગુજરાત રાજ્ય સેવા સમિતિ હોમિયોપેથિક દવાના સર્વે માટે છોકરા તથા છોકરીઓની જરૂર છે પગાર + કમિશન + પ્રમોશન સ્થળ : પ્રથમ ગુજરાત શિક્ષણ અભિયાન અંજાર ગ્રીનલેન્ડ સોસાયટી, અંજાર આદિપુર રોડ ટાઈમ બપોરે ૧૨થી ૪ Mo. 99254 47054, 98240 68295

બંગલો વેચવાનો છે ઓધવ એવન્યૂ-૧ સંપર્ક : ૯૯૨૫૮ ૫૪૦૪૦

વેચવાના છે BMCB ના શેર કોન્ટેક્ટ નં. 98252 35507

જોઈએ છે • ટેલિકોલર • સેલ્સ પર્સન ઈન્શ્યોરન્સ પ્રોડક્ટના માર્કેટીંગ માટે • ટીમ લીડર્સ માત્ર B.B.A. અને M.B.A. ઈન્ટરવ્યુ માટે સંપર્ક 98259 88101

જોઈએ છે ડ્રાઈવર - ઓફિસ બોય કોમ્પ્યુટર ઓપરેટર મળો : આર. મહેતા બિલ્ડર્સ રમ્યકલા, ૧લે માળે, પૂજન હોસ્પિટલની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ (કચ્છ) સમય : ૧૧થી ૧ અને ૪થી ૭

વેચવાના છે વર્ધમાન નગર સાઉથમાં સંભવનાથ ૧૦૦ વારનો મકાન-૧ માધાપર નવાવાસ સર્વે નં. ૫૪૯/૧ ઉમિયાનગરમાં રોડની નજીક ૨૦૦ મીટરનો પ્લોટ-૧ ભાડે આપવાનું છે માધાપર 'હિલવ્યૂ'માં મકાન-૧ Mo. 99796 23075

બંગલો ભાડે આપવાનો છે ગાંધીધામ મધ્યે ગુરુકુળ એરિયામાં ૫૦૦વારના પ્લોટમાં બનેલો 5BHK + સર્વન્ટ રૂમ + ગેરેજ + ગાર્ડન સાથે ફુલી ફર્નિશ્ડ બંગલો ભાડે આપવાનો છે. અગર કંપનીને ગેસ્ટ હાઉસ માટે જોઈએ તો તે પણ આવકાર્ય છે. જલિયાણ એસ્ટેટ Mob : 98242 21159

Digitially Archived by: www.realpatidar.com/library

તસવીરે બયાં

આષાઢી બીજના કલ્યાણી મહિલા મંડળ, લોટસ સોસાયટી, ભુજના નેજા હેઠળ ગરબા હરીફાઇ યોજાઇ હતી. તેમાં બેસ્ટ પ્લેયર અને સુંદર વસ્ત્ર પરિધાન કરનારી બહેનોનું ઇનામોથી સન્માન થયું હતું. ભાગ લેનાર સર્વ બહેનોને આશ્વાસન ઇનામો અપાયાં હતાં. બેસ્ટ પ્લેયર તરીકે નેહલબેન પંચાસરા અને અમિતાબેન સંઘવી રહ્યા હતા. જ્યારે સુંદર વસ્ત્ર પરિધાનમાં જાગૃતિબેન સંઘવી, અર્ચનાબેન ઉમરાણિયા વિજયી થયા હતા. સંસ્થાના પ્રમુખ કોકીલાબેન ઉપાધ્યાય, દમુબેન મોરબિયા તેમજ અમિતાબેન સંઘવી તરફથી ઇનામો જાહેર થયાં હતાં. નિર્ણાયક તરીકે રૂપાબેન શાહે સેવા આપી હતી.

માધાપર નૂતન કેળવણી મંડળ – કન્યા શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળાની બાલિકાઓને ઇન્નરવ્હીલ કલબ ઓફ માધાપર દ્વારા દફતર, પાટી, પેન, અંકોડી વગેરેની શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલબના પ્રમુખ રેખાબેન ટાંક, ફાલ્ગુનીબેન રાઠોડ, પ્રવીણાબેન બુદ્ધભટ્ટી સાથે કલબની બહેનાએ બાલિકાઓનું સ્વાગત કર્યું હતું. દાતા અરજણ વાલજી વોરા તરફથી તેમની ધર્મપત્ની સ્વ. કેસરબેનની યાદમાં આ કિટ અર્પણ કરાઇ હતી.

'દંતાર' પણ વરસાદના ઇંતજારમાં : અષાઢ મહિનાનો આરંભ થઇ ચૂકયો છે પણ હજી સુધી વાવણીલાયક વરસાદ ન થયો હોવાથી મેહુલિયાની ગેરહાજરી માનવી હોય – પશુ, પક્ષી કે સૃષ્ટિનો કોઇપણ જીવ મેઘરાજાની ગેરહાજરીથી વ્યાકુળ બન્યો છે. એવા જ એક દ્રશ્યમાં વાવણીકાર્યમાં વપરાતું દંતાર પણ જાણે મેહુલિયાની વાટ જોતું હોય એમ કયારે મેઘરાજા પધારે અને હું પણ મારું કાર્ય શરૂ કરી દઉં તેવી અદામાં દેખાય છે. (તસવીર : માણેક ગઢવી)

ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની પ્રદેશ કારોબારીની બેઠક વડોદરા ખાતે મળી હતી. કચ્છના બક્ષીપંચ મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય રમેશ વાઘેલા, અધ્યક્ષ સતીશ છાંગા, મહામંત્રી ડો. કે. જી. વૈશ્નવ અને મનોજ ગોસ્વામીએ ભાગ લીધો હતો. મોરચાના પ્રદેશ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલે મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાળુ નાણું વગેરે વિષયે જણાવ્યું કે, ગુજરાતની અંદર ૫૮થી ૬૦ ટકા વસ્તી બક્ષીપંચની છે અને તેને આ પ્રશ્નો સીધા અસર કરે છે. પ્રભારી શ્રી વિજય રૂપાણીએ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં મોરચાની જવાબદારી ચોક્કસ રીતે વધી જાય છે માટે આજથી કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. સંચાલન પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને દિયોદરના ધારાસભ્ય અનિલભાઇ માડીએ આભારદર્શન પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીએ કર્યું હતું.

ભુજ : વનવિભાગ અને માનવજ્યોત સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે ભુજની રેવેન્યુ કોલોનીમાં હિંમતપાર્કમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પેન્શનર્સ એસો.નાં પ્રમુખ પ્રતાપભાઇ આશર, વિજયભાઇ પુરોહિત, ઉમિયાશંકરભાઇ અજાણી, જયંતિભાઇ ચૌહાણ અને તખુભા જાડેજાનાં અતિથિવિશેષપદે યોજાયો હતો. માનવ જયોતના પ્રબોધ મુનવર તથા વનવિભાગનાં એ. જે. પંડયાએ વૃક્ષારોપણનું મહત્ત્વ સમજાવ્યું હતું. પ્રેમજીભાઇ ભટ્ટી, છગનભાઇ ઠક્કર, પ્રબોધભાઇ નયગાંધી તથા ઉપસ્થિત આગેવાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરી રક્ષણ માટે ટ્રી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા. સંચાલન ભવાનજી ઠક્કર અને આભારદર્શન શંભુભાઇ જોશીએ કર્યા હતા. દિનેશ રાઉ, પૃથ્વીરાજસિંહ જાડેજાએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.

પાણી વિના ટળવળતા અબડાસાના ૩૦ ગામ

કાંઠાળ વિસ્તારની સમસ્યા માટે જવાબદાર સામે ફરજ મોકૂફીના પગલાં ભરવા તા.પં. પ્રમુખની માંગ

નલિયા, તા. ૬ : અબડાસા તાલુકાના છેવાડાના કાંઠાળ વિસ્તારની છેલ્લા એક અઠવાડિયાથી પાણી યોજના બંધ હોતાં ૩૦ ગામોના વીસેક હજાર માણસોને અસર થઇ છે. આ પાણી સમસ્યા માનવસર્જિત હોવાનો તા.પં. પ્રમુખે આક્ષેપ કરી ફરજમાં બેદરકાર રહેનાર એક અધિકારીને ફરજમોકૂફ કરવાની માગણી સાથે ગામડાઓનો પાણી પુરવઠો નિયમિત કરવાની માગણી કરી છે.

તાલુકા પંચાયતના પ્રમુખ મૂળરાજભાઇ ગઢવીએ ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલી અને પા.પુ.ના ઉચ્ચ અધિકારીઓ પાસે કરેલી રજૂઆતમાં કાંઠાળ વિસ્તારના ગામો કડુલી, કમન્ડ, આરીખાણા વગેરે ત્રીસેક ગામોમાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાઇ છે. પાણી પુરવઠાના સોર્સ લાઇટ ન હોય તો ડી.જી. સેટ છે. એટલું જ નહીં ટેન્કરની પણ સુવિધા હોવા છતાં નલિયા પા.પુ. બોર્ડની કચેરીના એક જવાબદાર અધિકારીની ગુનાહિત બેદરકારીના કારણે ગામડાઓમાં પાણી પુરવઠો બંધ કરતાં લોકો પીવાનાં પાણી માટે ટળવળી રહ્યાં છે.

અબડાસામાંથી બદલવા માટે તાજેતરમાં એક અધિકારી ફરજમાં બેદરકાર રહેતાં તેની બદલી કરાઇ હતી. આવી જ બેદરકારી રાઠોડ નામના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર દાખવી રહ્યા હોવાનો આક્ષેપ કરી હવે બદલી નહીં પણ ફરજ મોકૂફી અથવા ફોજદારી રાહે પગલાંની માગણી કરતાં શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે, કચેરીમાં કોઇ ફોન ન ઉઠાવે, મોબાઇલ કરાય તો સ્વીચ બંધ આવે આવો જાત અનુભવ પોતાને થયો હોવાનું ઉમેર્યું હતું.

ધારાસભ્યે ઉચ્ચ અધિકારીઓને અબડાસાના કાંઠાળ વિસ્તારના ગામોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવાની તાકીદ કરવાની સાથે બેદરકારી દાખવનારા અધિકારી સામે પગલાં લેવાની પણ તાકીદ કરી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

મુંદરા પી.જી.વી.સી.એલ.ની ૬૬ લાખની વસૂલાત બાકી

બાકીદારોમાં સરકારી જોડાણોની સંખ્યા નોંધપાત્ર : એક સપ્તાહમાં ૭ લાખની વસૂલી

મુંદરા, તા. ૬ : બંદરીય મુંદરા નગરનો ભૂકંપ બાદ ઔદ્યોગિક વિકાસ થતાં નવા બાંધકામોના કારણે વીજ વપરાશ વધતાં વીજના ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ મુંદરા પી.જી.વી.સી.એલ.ના કુલ ૩૭૧૬ ગ્રાહકોના રૂા. ૬૬ લાખ, ૨૦ હજાર રૂા.ની વીજ વસૂલાત બાકી છે. ત્યારે મુંદરા પી.જી.વી.સી.એલ.એ કડક કાર્યવાહી કરી છેલ્લા એક સપ્તાહમાં ૫૫ જેટલા વીજ જોડાણો કાપી અંદાજે ૭ લાખ રૂા. જેટલી વસૂલાત કરી હતી. તે પૈકી જે ગ્રાહકોએ નાણાં ભરી દેતાં જોડાણો ચાલુ કરાયા હતા.

મુંદરા પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેરશ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, બાકી રહેલા રૂા. ૬૬ લાખની વસૂલાતમાં પોલીસ કવાર્ટર, વોટર વર્કસ, ગ્રા.પં.ની સ્ટ્રીટલાઇટ અને અન્ય સરકારી વિભાગની ૧૨ લાખ રૂા.ની વસૂલાત બાકી છે. છેલ્લા એક સપ્તાહમાં ૫૫ જેટલા વીજ કનેકશનો કાપીને અંદાજે ૭ લાખ રૂા.ની વીજ વસૂલાત કરવામાં આવી હતી. તેમજ તેમણે વીજ ગ્રાહકોને બાકી રહેતાં બીલની રકમ તાત્કાલિક ભરવા તાકીદ કરી હતી.

શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ ૨૦૦ જેટલા નવા વીજ મીટરો આવ્યા છે. જે ગ્રાહકોની અરજી પ્રમાણે લગાડવાની કામગીરી ચાલુ છે. તેમજ બાકી રહેતાં ૨૫૦ જેટલા ગ્રાહકોની જે અરજીઓ પેન્ડીંગ છે, તે લગભગ ૧૦ દિવસમાં બીજા મીટરો આવી જતાં લગાડી દેવાશે.

કચ્છ ઇતિહાસ પરિષદ બંધારણમાં ફેરફાર કરશે

ભુજ, તા. ૬ : કચ્છ ઇતિહાસ પરિષદની મળેલી બેઠકમાં સંસ્થાના બંધારણમાં ફેરફાર કરવા સામાન્યસભા યોજવા ઉપરાંત સંશોધન પ્રવાસનું આયોજન કરવા સહિતના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સંસ્થાના પ્રમુખ સાવજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે સંસ્થાના બંધારણમાં અમુક ફેરફારો જરૂરી હોઇ તે અંગે આગળની કાર્યવાહી કરવા નક્કી કરાયું હતું. આ ઉપરાંત સ્થાપત્ય સહિતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળનો પ્રવાસ યોજવા નિર્ણય લેવાયો હતો. વાર્ષિક હિસાબો ઉ.પ્ર. શંભુભાઇ જોષી, ચન્દ્રદુર્ગેશ જોષીએ રજૂ કરતાં બહાલી અપાઇ હતી. માનદ્ ઓડિટર આઇ. એચ. દેસાઇની સેવાની નોંધ લેવાઇ હતી. હરીશ સોની, જયવીરસિંહ સોઢા, વિઠ્ઠલભાઇ, એ. કે. શેઠ, ગોપેન્દ્ર ગઢવી વિ.એ ચર્ચામાં ભાગ લીધો હતો.

ભુજોડીમાં ગૌશાળાનું ભૂમિપૂજન કરાયું

ભુજોડીમાં ગૌશાળાનું ભૂમિપૂજન કરતા દાતા માનુબેન ભીમજી વેકરિયા.

ભુજોડી, તા. ૬ : અહીંના વાછડાદાદાના મંદિર પાસે આવેલા વર્ષો જૂના વથાણમાં ગૌશાળાનું ભૂમિપૂજન મુખ્યદાતા પરિવારના ભીમજીભાઇ શામજીભાઇ વેકરિયા અને માનુબેન ભીમજી વેકરિયાના હસ્તે કરાયું હતું.

ભુજોડી ગામના નાથાલાલ મારાજના મંત્રોચ્ચારથી અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દાતા પરિવારના ભીમજીભાઇ વેકરિયા, માનુબેન વેકરિયા, કિશોરભાઇ પટેલ, લાલજીભાઇ પટેલ અને ગામના આગેવાનો રબારી વંકાભાઇ કાનાભાઇ, રબારી રામાભાઇ દેવશીભાઇ, રબારી હમીરભાઇ વંકાભાઇ, વિશ્રામભાઇ વાલજીભાઇ સીજુ, દેવજીભાઇ વાલજીભાઇ સીજુ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ગૌશાળા બની ગયા બાદ ગાયમાતાને ઉનાળામાં તડકાથી, શિયાળામાં ઠંડીથી, વરસાદમાં પાણી, મચ્છર, માખીથી પડતી મુશ્કેલીઓ દૂર થઇ જશે તેવું સામાજિક કાર્યકર વંકાભાઇ રબારીએ જણાવ્યું હતું.

ભુજ રેલવે સ્ટેશને અગવડતાની ફરિયાદ

માંડવી, તા. ૬ : ધરતીકંપ બાદ કચ્છ અને કચ્છીઓએ ઘણી પ્રગતિ કરી છે પણ કોઇ કચ્છના પાટનગર ભુજના રેલવે સ્ટેશન પર પહોંચે તો તેને ૧૯મી સદીમાં પહોંચી ગયાનો અનુભવ થાય એમ કચ્છી અગ્રણી શ્યામ શાહે જણાવ્યું હતું.

વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને આધુનિક રેલવે સ્ટેશન બનાવવાનો વિચાર હોય પણ તે કામ અધવચ્ચે મૂકી દેવાયું હોય તેમ પાયાની સુવિધાનો અભાવ છે. સલામતી સુરક્ષા કર્મીઓની સંખ્યા કાં તો ઓછી છે અથવા એ લોકો ફરજની અવગણના કરતો મથક રામભરોસે અને અસામાજિક તત્ત્વોના ભરોસે હોય તેવું તેમણે ફરિયાદ કરતાં જણાવ્યું હતું.

રિક્ષા અને છકડાવાળાઓ ખોટા લાભ ઊઠાવે છે. જાણે એકલા પ્રવાસીઓને જ ગરજ હોય તેમ મનચાહે ભાડાં લૂંટે છે, જેનો સૌથી સહેલો શિકાર મોટી ઉંમરની વ્યક્તિઓ અને સ્ત્રીઓ બને છે.

વાગડના અમુક ગામોના જંત્રીના ભાવ નક્કી ન થતાં મુશ્કેલી

ધારાસભ્યની રજૂઆત બાદ મંજૂર થયેલા એસ.ટી. સ્ટોપનો પણ અમલ નથી થતો

પલાંસવા (તા. રાપર), તા. ૬ : રાપર તાલુકાના અમુક ગામોને જમીનના જંત્રીના ભાવો હજી સુધી તંત્ર દ્વારા નક્કી કરવામાં ન આવતાં જમીન લે-વેચની તેમજ દસ્તાવેજોની કામગીરી ખોરવાઇ છે તો ધારાસભ્યની રજૂઆતનાં પગલે મંજૂર થયેલા એસ.ટી.ના સ્ટોપનો અમલ ન કરાતાં અંતરિયાળ ગામડાંના પ્રવાસીઓની મુસીબત યથાવત રહી છે.

જમીન ભાવ અંગેની સરકારી જંત્રીની લાંબા સમયથી જાહેરાત છતાં આ વિસ્તારના અમુક ગામોના ભાવ નક્કી ન કરાતાં જમીન લે-વેચના સંખ્યાબંધ વહેવારો અટવાયા છે. દસ્તાવેજ નોંધણી ન થતાં કેટલાક સોદાઓની સમયાવધિ પૂરી થવા છતાં જમીનમાલિકો અને ખરીદનારાઓ વચ્ચે અંટશ સર્જાય તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગેની તંત્ર સમક્ષ લેખિત-મૌખિક અનેક રજૂઆતો છતાં તંત્ર કોઇ કાર્યવાહી ન કરતું હોઇ લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે.

ઉપરાંત કાંઠાળપટ્ટીના મેવાસા પાટિયેથી નીકળી જતી ભુજ-શામળાજી બસનો સ્ટોપ અહીંના ધારાસભ્યની રજૂઆત બાદ મંજૂર થયા છતાં તેનો અમલ થતો નથી પરિણામે પ્રવાસીઓને પાટિયા સુધી સરસામાન અને બાળકો સાથે આવવું-જવું પડે છે, તો ધારાસભ્યની જ રજૂઆત બાદ ભુજ-વણોઇવાંઢ બસને વજેપર ગામમાંથી ચલાવવાના નિર્ણય છતાં અહીં પણ લોકોની સુવિધા ઝૂંટવાઇ ગઇ છે. આ બાબતે એસ.ટી. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવું ગામલોકો ઇચ્છી રહ્યા છે.

ભુજમાં મારૂ કંસારા સોની જ્ઞાતિના વિવિધલક્ષી સંકુલની પાયાવિધિ કરાવતા મંત્રી દિલીપ કાનજી બગ્ગા દંપતી, બાજુમાં જ્ઞાતિ પ્રમુખ કિશોરભાઇ ચનાણી અને જ્ઞાતિ અગ્રણીઓ.

ભુજમાં મારૂ કંસારા સોની જ્ઞાતિના વિવિધલક્ષી સંકુલની પાયાવિધિ કરાઇ

ભુજ, તા. ૬ : અહીંના મારૂ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ચંદાબેન જાદવજી બુદ્ધભટ્ટી તરફથી દાનમાં મળેલા પ્લોટ પર વિવિધલક્ષી સંકુલની પાયાવિધિ કરાઇ હતી.

રવિવારે આ પાયાવિધિ જ્ઞાતિના મંત્રી દિલીપભાઇ કાનજી બગ્ગા દંપતીના યજમાનપદે સંકુલના બાંધકામના દાતા જ્ઞાતિ શ્રેષ્ઠી પ્રભુદાસભાઇ ખેતશીની ઉપસ્થિતિમાં સુમનભાઇ ગોરના આચાર્યપદે કરાઇ હતી.

જ્ઞાતિ પ્રમુખ કિશોરભાઇ જે. ચનાણી, મહિલા મંડળના પ્રમુખ લતાબેન આઇ. સોલંકી, યુવક મંડળના પ્રમુખ અનિલભાઇ કે. છત્રાળા, જ્ઞાતિના ઉપપ્રમુખ સુનીલભાઇ માધવજી પોમલ સહિતના હોદ્દેદારો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્રભાઇ વી. બુદ્ધભટ્ટી, પ્રદીપભાઇ બિજલાણી અને નીતિનભાઇ હેડાઉએ માર્ગદર્શન આપ્યું હતું.

શિક્ષકોના સમયમાં ફેરવિચારણા કરવા રાજ્યકક્ષાએ રજૂઆત

સાઇઠ ટકા ઉપર બહેનોનો સ્ટાફ હોતાં જિલ્લા પ્રા. શિક્ષક સમાજે માંગ કરી

ભુજ, તા. ૬ : રાઇટ ટુ એજ્યુકેશન-૨૦૦૯ અંતર્ગત રાજ્ય સાથે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના સમયમાં થયેલા ફેરફાર અંગે ફેરવિચારણા કરવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે રાજ્ય પ્રા. શિ. સંઘ સમક્ષ રજૂઆત કરી છે.

જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનો સમય સોમથી શુક્ર ૮ કલાક અને શનિવારે પાંચ કલાકનો કરાયો છે. પાળીય પદ્ધતિવાળી શાળામાં પ્રથમ પાળીનો ૭.૩૦થી ૩.૩૦ અને બીજી પાળીનો સમય ૧૦થી ૬નો કરાયો છે જ્યારે બિનપાળી શાળાઓનો સમય ૧૦થી ૬નો કરાયો છે. જેથી પાળીવાળી શાળામાં સવા ત્રણ અને બિનપાળી શાળામાં બે કલાકનો વધારો કરાયો છે જ્યારે વિદ્યાર્થીઓનો સમય યથાવત રખાયો છે. જિલ્લામાં ૬૦ ટકાથી વધારે બહેનોનો સ્ટાફ હોતાં વધારાનો સમય સુધારો કરવા તા. શિક્ષકોની જિ.શિ. સમાજ પાસે ટેલિફોનિક રજૂઆતો કરી હતી.

વિદ્યાર્થી વગર શિક્ષકોને શાળામાં બેસાડી રાખવાનો કોઇ અર્થ નથી તેમજ રાઇટ ટુ એજ્યુકેશન-૨૦૦૯ની કલમ ૧૯ અને ૨૫માં દર્શાવેલા શૈક્ષણિક કાર્યના દિવસો અને કલાકોથી વધારે શૈક્ષણિક કાર્યના દિવસો અને પ્રવર્તમાન સમયમાં કરાય છે તેથી આઠ કલાકનો આગ્રહ અસ્થાને છે. જેથી ૧ જુલાઇથી કરાયેલા સમય વધારા અંગે ફેરવિચારણા કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવા ક. જિ.પ્રા.શિ.સંઘના પ્રમુખ ચંદુભાઇ જોશી, મહામંત્રી બળદેવભાઇ ચૌધરીને ફેકસથી માગણી કરી હોવાનું જિ.પ્રા.શિ. સમાજના પ્રમુખ રશ્મિભાઇ પંડ્યા, મહામંત્રી દિનેશભાઇ શાહ અને કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું હતું.

બિહારીલાલ મંદિરે સપ્તમૂર્તિ પાટોત્સવની ભાવભેર ઉજવણી

ભુજ, તા. ૬ : અહીંના બિહારીલાલ મહાદેવ મંદિરમાં સપ્તમૂર્તિઓનો પાટોત્સવ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં હોમ-હવન-પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ગણપતિજી, હનુમાનજી, સાંઇબાબા સહિતની દેવ-દેવીઓના પાટોત્સવ પ્રસંગે મહંત પૂ. મૌનિબાપુના સાંનિધ્યમાં હોમ-હવન યોજાયા ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.

ભુજમાં મહિલાના કાર્યક્રમમાં બોલતા મદનકુમાર અંજારિયા બાજુમાં પ્રા. સૂર્યકાંત ભટ્ટ, મંડળના પુષ્પાબેન વૈદ્ય.

ભુજમાં મહિલા મંડળ દ્વારા ભરત કામના વર્ગોનો કરાયેલો પ્રારંભ

ભુજ, તા. ૬ : અહીંના છક્ષીબારી મહિલા મંડળ દ્વારા કચ્છી ગીત, લોકગીત અને ભજન સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે ભરતના વર્ગોનો પ્રારંભ થયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષપદે થી મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'એ કચ્છી નવા વર્ષનો મહિમા ગાતા, મહિલા મંડળમાં 'કચ્છી ભરત વર્ગ'નું નવું પગરણ શરૂ થતાં સંસ્થાને તથા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સંસ્થામાં થતી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. અતિથિવિશેષ પદેથી પ્રા. સૂર્યકાંતભાઇએ મહિલા મંડળ સાથેના જૂના સંસ્મરણો વાગોળતાં સ્વ. ઇન્દિરા ગાંધીની આ મંડળની મુલાકાતને યાદ કરી હતી. બંનેના હસ્તે સીવણવર્ગના પ્રમાણપત્રો આપ્યા હતા.

આરંભે સંગીત શિક્ષક કિશોરભાઇ જોશી તથા સાગર દવે અને બહેનોએ પ્રાર્થના કરી હતી. મહેમાનોનો પરિચય પુષ્પાબેન વૈદ્યે તથા પ્રવૃત્તિઓનો અહેવાલ સરસ્વતીબેન સોલંકીએ આપ્યો હતો.

દીપ પ્રાગટ્ય બાદ સ્પર્ધામાં ૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેના અ વિભાગમાં દક્ષાબેન દેવજી રાબડિયા, લીલાવંતી વરસાણી, ગોરસિયા મીના જ્યારે બ વિભાગમાં હેમલતાબેન ગઢવી, દમયંતીબેન રાયસોની અને હંસાબેન વૈશ્નવ અનુક્રમે વિજેતા થતાં મહેમાનોને હસ્તે પારિતોષિક મેળવ્યા હતા. ઉપસ્થિત યોગગુરુ રમેશભાઇ ઝરૂ તથા સ્વ. દીપક મહેતાના સ્મરણાર્થે વીણાબેન મહેતા તરફથી ઇનામોની રકમ મળી હતી. ઉપસ્થિત શ્રી ઓઝાભાઇએ કચ્છના પ્રાચીન ભરતકામ આહીર, પક્કો અને રબારી ભરત અંગે સમજણ આપી હતી. મંડળ દ્વારા ભરત શીખડાવવામાં આવશે એમ જણાવ્યું હતું.

સંચાલન કુ. વીણાબેન મહેતાએ તેમજ આભારવિધિ રેખાબેન વોરાએ કરી હતી. કવિ રમેશભાઇ વૈદ્ય, બ્રિજેશ, મંડળના ઉષાબેન રાચ્છ, કમળાબેન પરમાર, નયનાબેન મહેતા, કમળાબેન રાઠોડ, મૃદુલાબેન ત્રિપાઠી, નીતાબેન જોશી, જુલીબેન ઠક્કર, આરબ હમીદાબેન હાજર રહ્યા હતા. ધાત્રીબેન માંકડ અને ફોરમબેન રાણા નિર્ણાયક રહ્યા હતા.

કુલદીપ શર્માનો ચાર્જ લેવા બદલ કચ્છી અધિકારીને ગડગડીયું

ભુજ, તા. ૬ : ઘેટાં અને ઉન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ શર્માનો ચાર્જ લેવા બદલ મૂળ ભુજના ઉચ્ચ અધિકારી ભરત મહેતાને તાજેતરમાં ફરજ મોકૂફ કરાતાં ચકચાર પ્રસરી છે.

શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે શ્રી મહેતાની પ્રથમ જામનગર બદલી કર્યા બાદ સરકારે ત્યાંથી જ સસ્પેન્ડ કર્યા હોવાનું માહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.

સીસીસી પરીક્ષાની મુદ્દત છ માસ વધી

ભુજ, તા. ૬ : રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ માટે ફરજિયાત બનાવેલી કોમ્પ્યુટર પરીક્ષા ઉત્તીર્ણ કરવા વધુ છ માસનો સમયગાળો વધારતાં કર્મચારી સંગઠનોએ નિર્ણય આવકાર્યો હતો.

કર્મચારી અગ્રણી પ્રફુલ્લ ઠક્કરે સરકારી વેબસાઇટનો હવાલો ટાંકીને કહ્યું હતું કે, મુદ્દતમાં છ માસનો એટલે કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ સુધી વધારો કરવામાં આવ્યો છે તેમ વધુમાં એવી પણ સ્પષ્ટતા પણ કરાઇ છે કે હવે કોઇપણ સંજોગોમાં મુદત વધારવામાં નહીં આવે, વળી આ ગાળામાં શરતી પ્રમોશન આપી શકાશે તેમજ શરતી હાયરગ્રેડ પણ મંજૂર કરી શકાશે. વિવિધ કર્મચારી સંગઠનોએ નિર્ણયને આવકાર્યો છે.

કચ્છમિત્ર ડેવલોપર્સ કોર્નર

શુભમ્ પ્રોપર્ટીઝ પહેલા માળે, આકા કોમ્પલેક્ષ, સવાસેર નાકા, અંજાર-કચ્છ. ફોન : ૦૨૮૩૬ ૨૪૫૧૪૪

૪૨ મી મિટીંગ તા. ૯.૭.૧૧, શનિવાર
સમય : સાંજે ૫.૩૦ કલાકે
સ્થળ : રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર.

૪૨ મી મિટીંગના મુખ્ય ૮ ઈનામ તથા ૫૦ આશ્વાસન ઈનામો

(૧) યુનિકોર્ન (૫) ૩૨૦ લી. ફ્રિઝ
(૨) ચાંદી (રૂા. ૨૫,૦૦૦) (૬) રૂા. ૧૫,૦૦૦ રોકડા
(૩) ગીફ્ટ ખજાના (૭) હોમ થીયેટર
(૪) ૨૯' કલર ટી.વી. (૮) લ્યુના

Reg. No. GUJ/RJT/66795
SUN developers
સનસીટી
ચૌદમી મીટીંગના મુખ્ય પાંચ આકર્ષણ
હિરોહોન્ડા સીડી ડોન - કોમ્પ્યુટર - હેન્ડીકેમ
ફ્રિઝ - આટામેકર તથા ૮૦ આશ્વાસન
તા. ૯-૭-૨૦૧૧, શનિવાર, સાંજે ૫.૦૦ કલાકે
સ્થળ : એકમ ભવન, રવિ સિનેમા પાસે, ભુજ.
નોંધ : જે મેમ્બરમિત્રોનો હપ્તો ભરેલ નહીં હોય તે મેમ્બરના ટોકન ડ્રોમાં નાખવામાં આવશે નહીં.
૧૧૪, પહેલા માળે, ધવલ કોમર્શીયલ, છક્ષીબારી રીંગરોડ, ભુજ-કચ્છ. મો. ૯૯૦૯૬ ૪૭૯૫૩

જાહેર નોટીશ

આ નોટીશથી જણાવવામાં આવે છે કે, કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના મોજે ગામ રતાડિયાની સીમમાં આવેલ ખેતર-૧ નામે 'ઉતરો', રે. સર્વે નં. ૪૨/૧, ક્ષેત્રફળ એકર ૮-૧૪ ગુંઠા, તે હેકટર ૩-૩૭-૯૧ આરે વિઘોટીનો વાર્ષિક આકાર રૂા. ૧૧-૮૧ પૈસાવાળો તેમના માલિક શ્રી હિરાણી પ્રવિણ કાનજી, રહે. ગામ રામપર-વેકરા, તા. માંડવી-કચ્છવાળા પાસેથી અઘાટ હક્કે વેચાણ લેવા અમારા અસીલે સોદો કરેલ છે. જેથી ઉકત ખેતર પર કોઇપણ વ્યક્તિનો કોઇપણ જાતનો લેણું, લેખો, હિત-સંબંધ, વર વાંધો કે તકરાર કે ભાગ પાતી, કોઇપણ વ્યક્તિનો ગીરો છોડાવવાનો હક્ક વિગેરે હોય તો દિવસ-૭માં અમારી ઓફિસે લેખિત આધારો રજૂ કરી તેની ખરાઇ કરી જવી. મુદ્દત વિત્યે સદરહુ ખેતરનો અમારા અસીલ રજી. દસ્તાવેજ બનાવી લેશે. ત્યારબાદ આવેલા વાંધા અંગે સદરહુ ખેતર તથા અમારા અસીલની કોઇપણ જાતની જવાબદારી રહેશે નહીં. જેની સર્વે નોંધ લેવી.

વી.એમ. ટાપરીયા
તે ખરીદનારના એડવોકેટ

અમારી મારફતે :
વિજાણંદ એમ. ટાપરીયા - એડવોકેટ,
૧૫-આદર્શ ટાવર, પહેલા માળે, અંજાર રોડ, મુંદરા-કચ્છ. મો. ૯૮૨૪૨ ૧૧૭૯૮

જાહેર નોટીશ (મોજે ચુંબડક, તા. ભુજ રે.સર્વે નં. ૬૪/૨)

મોજે ચુંબડક, તા. ભુજ મધ્યે આવેલ ખેતીની જમીન જેના જૂના રે.સર્વે નં. ૧૫૯, ક્ષે. એકર ૨-૩૮ ગુંઠા જેના નવા રે.સર્વે નં. ૬૪/૨, ખેતર નામે 'પાસાડો' (બેકડિયો), ક્ષે. હેકટર ૧-૨૭-૦૦ ચો.મી. તે એકર ૩-૦૬ ગુંઠા જે જૂની શરતના હક્કોનું આવેલ છે તે ખેતરના માલિક શ્રી નારાણ હીરા કરશન, રહે. રતનાલ, તા. અંજારવાળાએ આ ખેતરની મૂળ માલિકી તથા ઘરખેડ હક્કો કરશન તેજા ત્રિકમના રહેલા તેમજ બાદ વારસાઇ હક્કે હિરા કરશન તથા રામજી કરશનના નામે નોંધાયેલ તેમજ તે બાદ કૌટુંબિક હક્ક ભાગમાં આ ઠામ તેઓ નારાણ હિરા કરશન તેજા માતાને ભાગે આવેલ છે અને તે રીતે તેઓ આ ઠામના એકલા માલિક કબ્જેદાર ભોગવટેદાર હોવાનું જણાવતા અમારા અસીલે આ મિલ્કત ખેતર તેમની પાસેથી અઘાટ હક્કોથી ખરીદ કરવા નક્કી કરેલ છે. આ મિલ્કત બાબતે કોઇપણ વ્યક્તિ, બેંક, સંસ્થા કે અન્ય કોઇ ત્રાહિતનું લેણું, લેખું, ભાર, બોજો, ચાર્જ, લિયન, ભરણ પોષણના હક્કો, ગણોત હક્કો કે કોઇપણ પ્રકારના હક્કો રહેલા હોય કે પોષાતા હોય તો તેમણે દિવસ-૮માં નીચે જણાવેલ સરનામે લેખિત આધાર પુરાવા સાથે રજૂઆત કરવી. અન્યથા આ મિલ્કત સંબંધી અમોના અસીલ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવી લેશે જેની નોંધ લેવી.

તા. ૬/૭/૨૦૧૧
(કે.આર. મઢિયાર)
સૂચિત ખરીદનારના એડવોકેટ

સરનામું :
કે.આર. મઢિયાર - એડવોકેટ,
પોસ્ટ ઓફિસ સામે, અંજાર-કચ્છ. ફોન : ૨૪૨૧૧૪, મો. ૯૮૨૫૪ ૪૫૭૭૭

જાહેર નોટિસનો જવાબ

આથી અમો નીચે સહી કરનારાઓ પ્રભાતસંગ સરદારસંગ જાડેજાના વારસદારો (૧) હરીસિંહ પ્રભાતસંગ જાડેજા (૨) મહોબ્બતસંગ પ્રભાતસંગ જાડેજા (૩) જીતેન્દ્રસિંહ પ્રભાતસંગ જાડેજા, રહે. તમામ અંતરજાળ, તા. ગાંધીધામ–કચ્છ વાળા સર્વે જાહેર જનતા તથા લાગતા વળગતાઓને આ નોટિસના જવાબથી જાણ કરીએ છીએ કે મોજે ભદ્રેશ્વર, તા. મુન્દ્રા–કચ્છની સીમમાં આવેલ ખેતીની જમીન રે.સ.નં. ૫૯૦/૧ જમીન એકર ૭–૧૦ ખેતર નામે 'તરાઇ' વાળી સબંધે એડવોકેટશ્રી મેહુલ એમ. વ્યાસ વિગેરે અંજાર–કચ્છ વાળાઓને તેમના અસીલ મારફતે ભીખા લખમણ મઉર, રહે. મુન્દ્રા–કચ્છ વાળા પાસેથી વેચાણ લેવા સબંધે દૈનિક પેપર 'કચ્છમિત્ર' તા. ૫/૭/૧૧ના રોજ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવેલ છે તે નોટિસ સત્યથી વેગળી અને ગેરકાયદેસરની છે. સદરહુ મિલ્કતના અમારા પિતા પ્રભાતસંગ સરદારસંગ વર્ષો જૂના ખેડુત–ગણોતીયા હતા અને તેઓ આ મિલ્કત વેચાણ લેવા માંગતા હતા તેથી તેઓએ આ મિલ્કત આજથી ૨૫ વર્ષ પહેલા સાકરબાઇ મેઘજી જોષી પાસેથી વેચાણ લીધેલ છે અને તે અંગે સાકરબાઇ મેઘજી જોષીએ લખાણ કરી આપેલ છે. પરંતુ અમારા પિતા અભણ હોવાથી આ મિલ્કતનો દસ્તાવેજ કરાવી શકેલ નહીં આજપણ આ મિલ્કતનો સ્થાનિકે પ્રત્યક્ષ કબ્જો ભોગવટો અને જાતખેડ અમારા છે. જેથી આ મિલ્કત કોઇએ પણ ભીખા લખમણ મઉર કે અન્ય કોઇપણ પાસેથી અમારા હક્કોને બાદ આવે તે રીતે વેચાણથી કે અન્ય રીતે લેવી નહીં તેમ છતાં આ મિલ્કત પરત્વે કોઇપણ વ્યવહાર કરવામાં આવશે તો આવો વ્યવહાર ઉપરોક્ત મિલ્કત કે અમોને બંધનકર્તા રહેશે નહીં અને આવા વ્યવહાર સબબ અમો કાયદેસરની કાર્યવાહી કરીશું જેની નોંધ લેવી. અંજાર.તા.૬/૭/૧૧

(૧) હરીસિંહ પ્રભાતસંગ જાડેજા
(૨) મહોબ્બતસંગ પ્રભાતસંગ જાડેજા
(૩) જીતેન્દ્રસિંહ પ્રભાતસંગ જાડેજા

અમારી મારફતે :–
દિનેશ જે.રાવલ, શૈલેષ સી. હર્ષ,
સામતભાઇ ડી.ગઢવી,હાર્દિક એચ.રાવલ
હરેશ ડી. ચાવડા એડવોકેટસ
તુરીયાવાડ, અંજાર–કચ્છ. ફોન : ૦૨૮૩૬–૨૪૬૫૪૪

જાહેર નોટીશ

આથી સર્વેને જાણ કરવામાં આવે છે કે, ભુજ તાલુકાના પેટા **ગામ સેડાતાના રે.સર્વે નં. ૧ (એક)**ની જૂની શરતની જમીન હે. ૩.૫૧.૦૦ આરે તેના સંયુકત માલિક અને કબ્જેદારો **(૧) હનિફાબાઇ આમદ હાસમ રાઠોડ (૨) અબુબકર આમદ હાસમ રાઠોડ (૩) જાકબ આમદ હાસમ રાઠોડ (૪) ઈલિયાસ આમદ રાઠોડ (૫) ઈસ્માઇલ આમદ હાસમ રાઠોડ (૬) જુણસ આમદ હાસમ રાઠોડ તથા (૭) લતીફ આમદ હાસમ રાઠોડ,** બધા મૂળે રહે. સેડાતાના નામે, સેડાતા રેવન્યુ દફતરે **ખાતા નં.** ૪માં નોંધાયેલ છે તે ખેતીની જમીન ઉકત સંયુકત માલિકો પાસેથી અમારા ગ્રાહકે ખરીદ કરવા નક્કી કરેલ છે.

અમારા ગ્રાહકે સદર વેચાણ લેવા નક્કી કરેલ જમીન પર કોઇનો કોઇપણ જાતનો હક્ક, હિસ્સો, લાગ-ભાગ, હિત સંબંધ કે અધિકાર હોય કે કોઇના ગીરો કે જામીનગીરીના લિયન હોય તો આ નોટીશ પ્રસિધ્ધ થયેથી દિન-૮માં નીચે જણાવેલ સરનામે આધાર-પુરાવાઓ સહિત જાણ કરવી. મુદ્દત વિત્યે અમારા ગ્રાહક અઘાટ વેચાણનો પાકો દસ્તાવેજ કરાવી લેશે. ત્યારબાદ સદર ખેતીની જમીન કે અમારા ગ્રાહકની કોઇ જવાબદારી રહેશે નહીં જેની સર્વેએ નોંધ લેવી. તા. ૭-૭-૨૦૧૧

દિનેશ એલ. જોબનપુત્રા
ઠે. **રામ કોમર્શીયલ,** ઓધવધામ એપાર્ટમેન્ટ,
૭, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ-કચ્છ. મો. ૯૯૧૩૮ ૩૯૭૯૯

જાહેર નોટીસનો વાંધા જવાબ તથા ચેતવણી

મોજે ગામઃ માધાપર તા. ભુજના રે.સ.નં. ૩૪૫ જે ભરપે માપે એકર ૯-૨૨ ગુંઠા વાળી જમીનમાં રહેણાંકના હેતુ માટે પાડવામાં આવેલ પ્લોટસ જે વિસ્તાર "શિવમ પાર્ક" તરીકે ઓળખાય છે. જેના પ્લોટ નં. ૪૬ તથા સદરહુ ઠામના તમામ પ્લોટસ સબંધે.

હું બી.જે. ચાવડા, રહે. ગાંધીધામ-કચ્છ વાળા તે હીરા બુધા હરીજનનાં વારસોનાં જનરલ પાવરદાર આથી સર્વે લાગતા વળગતાઓને આ વાંધા જવાબ સાથે ચેતવણી આપી જણાવું છું કે,

મોજે ગામઃ માધાપર તાલુકો ભુજનાં રે.સ.નં. ૩૪૫, ભરપે માપે એકર ૯-૨૨ ગુંઠા વાળી જમીન નાયબ કલેકટરશ્રી ભુજના હુકમથી સ્વ. હીરા બુધા હરીજનને નવી શરતે મંજુર કરવામાં આવેલ જેનો શાંત અને પ્રત્યક્ષ કબ્જો તેમણે સંભાળી લીધેલ ત્યારથી સદર જમીનનો કબ્જો, ભોગવટો સ્વ. હીરા બુધા સાથે તેમના વારસોનો રહેલો, સદર જમીનના શરતભંગ અન્વયે તા. ૧-૩-૯૫ ના રોજે નાયબ કલેકટરશ્રી ભુજે સદર જમીન અંગે નોંધો રીવીઝનમાં લેવા કલેકટરશ્રીને પત્રથી જાણ કરેલ, સદરહુ ઠામનો નાયબ કલેકટરશ્રી ભુજ દ્વારા તા. ૧૫-૫-૯૭ ના રોજે આ ઠામ ભવાનીશંકર પ્રાણશંકર બાવાને માત્ર ત્રણ પટની રકમ ભરપાઇ કરવાની શરતે જુની શરતે કબ્જા હકક સોંપેલ છે. આ હુકમ કરવા નાયબ કલેકટરશ્રીને સત્તા હતી કે કેમ? તેની ખરાઇ અંગેના આધારો મેળવવા અમોએ કાર્યવાહી કરેલ છે. ઉકત હુકમ કરતા પહેલા નાયબ કલેકટરશ્રીએ સ્થળ સ્થિતિનું પંચનામું કરી સ્વ. હીરા બુધા હરીજનના વારસોને નાયબ કલેકટરશ્રીએ કોઇ નોટીસ કરેલ નથી કે તેમને સાંભળવામાં આવેલ નથી તે રીતે ભવાનીશંકર પ્રાણશંકર બાવાની તરફેણનો સદર જમીન મંજુર કર્યા અંગેનો હુકમ ગેરકાયદેસર અને રદ થવા પાત્ર છે. સદર જમીન મંજુર થયાના માત્ર "દસ માસ" ના ટુંકા સમય ગાળામાં સદર ઠામ બિનખેતીમાં ફેરવાયેલ છે. જે "શિવમ પાર્ક" તરીકે ઓળખાય છે. ઉકત બિનખેતીનો હુકમ પણ પુરતા આધારોની ખરાઇ કર્યા વિના કરવામાં આવેલ તથા ગેરકાયદેસરના રેવન્યુ રેકર્ડના આધારે કરવામાં આવેલ હોઇ સદર ભવાનીશંકર પ્રાણશંકર બાવાની તરફેણનો જમીન મંજુરીનો હુકમ તથા બિનખેતીનો હુકમ બન્ને રદ થવા પાત્ર છે. જેને તમામ આધારો મેળવ્યા બાદ અમો સક્ષમ ઓથોરીટી સમક્ષ પડકારીશું જેના ભાગ રૂપે જે તે ઓથોરીટી પાસે અમોએ રેકર્ડની માંગણી કરેલ છે.

આમ તમામ હકકીતે સર્વેને જણાવવાનું કે, ઉકત રેવન્યુ સર્વે નંબર ૩૪૫ વાળી જમીન સ્વ. હીરા બુધાના વારસોની છે જેથી તેમા પાડવામાં આવેલ પ્લોટના વેંચાણ દસ્તાવેજથી હીરા બુધાના વારસોના હીત, હકક કે અધિકાર ખરીદનારને તબદિલ થતા નથી તથા વેંચાણ સબંધે કરવામાં આવેલ તમામ દસ્તાવેજો રદ થવા પાત્ર છે જે અંગે પણ અમો યોગ્ય કાનુની કાર્યવાહી કરશું, સબબ ઉકત જમીનમાં પાડવામાં આવેલ પ્લોટસ સબંધી કોઇપણ વ્યવહાર કે દસ્તાવેજ કોઇએ કરવા/કરાવવા નહી.

તા. ૦૬/૦૭/૨૦૧૧ ભુજ-કચ્છ
અમારી મારફતેઃ-

બી.જે.ચાવડા તે
સ્વ. હીરા બુધા હરીજનના વારસોના
જનરલ પાવરદાર

બી.એસ.મહેશ્વરી
એમ.એન.મહેશ્વરી-એડવોકેટસ
૧૦૬, પ્રથમ માળે, ધવલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ
જીલ્લા પંચાયતની સામે, ભુજ-કચ્છ. મો. ૯૮૭૯૩ ૭૯૨૧૨

કચ્છમિત્ર લીગલ ડેસ્ક ૦૭-૦૭-૧૧

જાહેર નોટિસ

આથી સર્વે લાગતાવળગતાને જાણ કરવામાં આવે છે કે, મુંદરા તાલુકે ગામ : વાંકીની સીમે આવેલી ખેતીની જમીન જે સર્વે નં. ૧૫૦વાળી હેકટર ૨-૬૧-૦૨ આરેની છે તથા સર્વે નં. ૧૫૧/૨ વાળી હેકટર ૦-૯૦-૦૪ આરેની છે. આ જમીન ખાતા નં. ૩૧૫માં દાખલ છે. આ ખેતીની જમીન તેના માલિક અને કબજેદાર રબારી સુજા પચાણ, રહે. વાંકી, તા. મુંદરાવાળા પાસેથી અઘાટ વેચાણ લેવાનો અમારા ગ્રાહકે સોદો કરેલ છે. આ ખેતીની જમીન ઉપર કોઇનું કોઇપણ પ્રકારનું લેણું-લેખું બાકી હોય કે કોઇનો કોઇપણ પ્રકારે હક્ક-ભાગ-હિસ્સો હોય તેમણે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ-૧૦માં અમારા નીચે લખ્યા સરનામા ઉપર લેખિત આધાર-પુરાવા સાથે રૂબરૂ જાણ કરવી, મુદ્દત વિત્યા બાદ સદરહુ જમીનનો અઘાટ વેચાણનો દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવી લેવામાં આવશે. ત્યારબાદ આ જમીનની કે અમારા ગ્રાહકની કોઇપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.

તા. ૬-૭-૧૧
સરનામું :
વિજાણંદ માણશી ટાપરિયા
એડવોકેટશ્રી, મુંદરા

જાહેર નોટિસ

અમારા અસીલે માંડવી (કચ્છ)ના રહીશ મીનાક્ષીબેન પરસોત્તમ ગોસ્વામી પાસેથી તેણીની માલિકી, કબજા તથા ભોગવટાનો રહેણાકનો ખુલ્લી જમીનનો પ્લોટ જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માંડવી રૂરલની સીમના રેવન્યુ સર્વે નં. ૧૪૯ પૈકી **'શ્રી ઘનશ્યામ નગર'**વાળી બિનખેતી જમીનમાં આવેલ **પ્લોટ નં. ૧૫, ક્ષેત્રફળ ૧૬૩.૬૫** ચોરસ મીટરવાળો જે અઘાટ હમીરાવાર વેચાણ લેવાનો સોદો કરેલ છે. સદરહુ પ્લોટમાં જે કોઇ શખ્સનો કશો હક્ક, હિસ્સો, હિતસંબંધ, લિયન, ચાર્જ કે સુખાધિકાર હોય તેમણે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ ૭-સાતની અંદર અમારી ઓફિસે લેખિત વાંધા આધારો સાથે રજૂ કરવા. તેમ કરવામાં કસૂર થયેથી સદરહુ પ્લોટમાં અન્ય કોઇનો કશો હક્ક, હિત અને અધિકાર નથી તેમ માની મુદ્દત પૂરી થયા બાદ અમારા અસીલ સદરહુ પ્લોટનો અઘાટ હમીરાવાર વેચાણ લીધાનો પાકો દસ્તાવેજ કરાવી લેશે ત્યારબાદ અમારા અસીલ કે સદરહુ પ્લોટ કોઇને જવાબદાર રહેશે નહીં. જેની આથી સર્વેએ નોંધ લેવી.

મારી મારફતે :
રમેશચંદ્ર એલ. શાહ
તે ખરીદનારના એડવોકેટ
ઠે. રાજ ચેમ્બર્સ, પહેલે માળે,
જૂની પોસ્ટ ઓફિસ રોડ,
માંડવી-કચ્છ. તા. ૦૬-૦૭-૨૦૧૧

જાહેર નોટિસ

આથી સર્વેને આ જાહેર નોટિસથી જણાવવાનું કે, કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગામ ફરાદીના (૧) સીમ સર્વે નં. ૯૪૩/પૈકી ૨૧૭, જેના હેકટર ૧-૧૯-૩૮ આરેવાળો ઠામ મેઘરાજ કલ્યાણ સંગાર અને (૨) સીમ સર્વે નં. ૯૪૩/પૈકી ૨૧૭/પૈકી ૧, હેકટર ૦-૮૨-૯૬આરેવાળો ઠામ દેરાજ કલ્યાણ સંગાર રે. બન્ને પીપરી, તા. માંડવી-કચ્છવાળા તે ઠામોના અલગ-અલગ માલિકો તથા કબજેદારો પાસેથી અમારા અસીલે અઘાટ વેચાણ લેવાનો લેખિત કરારથી સોદો કરેલ છે. જેથી સદરહુ ઉપરોકત ખેતીની જમીનો સંબંધે કોઇપણ વ્યક્તિનો કોઇપણ જાતનો હક્ક, હિસ્સો કે વર વાંધો હોય તો દિવસ ચાર (૪)માં દસ્તાવેજી આધારો સાથે નીચેના સરનામે વાંધો રજૂ કરવો. મુદત દરમ્યાન કોઇ વાંધો રજૂ નહીં થાય તો કોઇ વાંધો ન હોવાનો કે વાંધો જતો કરેલ હોવાનું માની અમારા અસીલ આગળની વેચાણ બાબતની કાર્યવાહી પૂર્ણ કરશે જેની સર્વે નોંધ લેવી.
માંડવી-કચ્છ.
તા. ૨૯/૬/૨૦૧૧

(એન. કે. ગઢવી)
તે ખરીદનારના એડવોકેટ

મારી મારફતે :
મો. ૯૮૭૯૬ ૦૦૦૭૪
નારાણ કાનજી ગઢવી
રઘુવીરસિંહ એમ. જાડેજા
એડવોકેટસ, જૈન ધર્મશાળા રોડ,
માંડવી-કચ્છ.

જાહેર નોટિસ (ગામ : ગુંદિયાલી, તા. માંડવી-કચ્છ)

અમારા અસીલે ગામ રાયણ, તા. માંડવી-કચ્છના રહીશ ધોળુ લખમશી રામજી પાસેથી તેમની માલિકી, કબજા, ભોગવટા તથા ઘરખેડ હેઠળનો ખેતી આકારનો કપીત ઠામ, જેના રેવન્યુ સર્વે નં. ૮૩૩/૧૦/પૈકી ૧૦ છે, જેના એકર ૧૦-૦૦ ગુંઠા છે. જેના હેકટર ૪-૦૪-૬૯ આરે છે. જેનો આકાર રૂા. ૫.૦૦ પૈસા છે. જે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગામ ગુંદિયાલીની સીમમાં આવેલ છે, તે અઘાટ હમીરાવાર વેચાણ લેવાનો સોદો કરેલ છે. સદરહુ ઠામોમાં જે કોઇ શખ્સનો કશો હક્ક, હિસ્સો, હિતસંબંધ, લિયન, ચાર્જ કે સુખાધિકાર હોય તેમણે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ ૭-સાતની અંદર અમારી ઓફિસે લેખિત વાંધા આધારો સાથે રજૂ કરવા. તેમ કરવામાં કસૂર થયેથી સદરહુ ઠામમાં અન્ય કોઇનો કશો હક્ક, હિત અને અધિકાર નથી તેમ માની મુદ્દત પૂરી થયા બાદ અમારા અસીલ સદરહુ ઠામનો અઘાટ હમીરાવાર વેચાણ લીધાનો પાકો દસ્તાવેજ કરાવી લેશે ત્યારબાદ અમારા અસીલ કે સદરહુ ઠામ કોઇને જવાબદાર રહેશે નહીં. જેની આથી સર્વેએ નોંધ લેવી.

મારી મારફતે :
રમેશચંદ્ર એલ. શાહ
તે ખરીદનારના એડવોકેટ
ઠે. રાજ ચેમ્બર્સ, પહેલે માળે,
જૂની પોસ્ટ ઓફિસ રોડ,
માંડવી-કચ્છ. તા. ૦૬-૦૭-૨૦૧૧

જાહેર નોટીશ

આથી સર્વેને આ નોટીશથી જાણ કરવામાં આવે છે કે, શ્રી રજીસ્ટ્રેશન જિલ્લે કચ્છ, તાલુકે ભુજના ગામ ભુજના રે.સર્વે નં. ૫૮૫ પૈકી ૧, ૫૮૫ પૈકી ૩, ૫૮૫ પૈકી ૪, ૫૮૬/૧, ૫૮૬/૨ તથા ૫૮૮ પૈકી વાળી જમીન રહેણાંક હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલ છે. જે 'રાજધાની પાર્ક' તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં. ૨, પ્લોટ નં. ૧૦ અને ૨૯ વાળી જમીન જે કુલ્લે ભરપે માપે ૩૬૮.૨૦ ચો.મી. જે બરોબર માપે ૪૪૦.૩૭ ચો.વાર વાળી જમીન દેવરાજ કરશન વરસાણીના જનરલ પાવરદાર મનજી દેવજી ધનાણી, રહે. ભુજ વાળા પોતાની સ્વતંત્ર કબ્જા ભોગવટા અને માલિકીની હોવાનું જણાવી અમારા અસીલને વેંચાણ આપવા સોદો કરેલ છે. ઉપરોકત મિલ્કત અંગે કોઇપણ શખ્સનું કોઇપણ પ્રકારનું લેણું, લેખું, હક્ક, હિસ્સો, હિત સંબંધ, વારસાઇ હક્કો કે ભરણપોષણના હક્કો તેમજ કોઇપણ પ્રકારના હક્કો પોષાતા હોય કે આ વેચાણ વ્યવહાર સામે વાંધો હોય તો આ જાહેર નોટીશ પ્રસિધ્ધ થયેથી રોજ દિવસ-૧૦માં નીચે જણાવેલ સરનામે લેખિત આધારો સહિત જાણ કરવી. નહિંતર મુદ્દત વિત્યે કોઇના કોઇપણ જાતના હક્ક રહેલા નથી અથવા તમામ હક્કો જતા કરેલ છે તેમ માની અમારા અસીલ અઘાટ વેંચાણનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી લેશે. અને ત્યારબાદ સદરહુ મિલ્કત કે અમારા અસીલ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં. જેની લાગતા વળગતા સર્વેએ સ્પષ્ટ નોંધ લેવી.

તા. ૬-૭-૨૦૧૧, ભુજ-કચ્છ.
એ.એમ. ખત્રી
તે ખરીદનારના એડવોકેટ

સરનામું : **એ. એમ. ખત્રી** - એડવોકેટ,
અતુલ એમ્પોરીયમની ઉપર, છઠ્ઠીબારી રીંગરોડ, ભુજ-કચ્છ. મો. ૯૮૭૯૯ ૫૧૪૬૬

જાહેર નોટિસનો જવાબ

આથી અમો સર્વેને જણાવીએ છીએ કે તા. ૧/૭/૧૧ના રોજ કચ્છમિત્ર ન્યૂઝ પેપરમાં કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ગામ બારોઇની સીમમાં આવેલા ખેતર-૧ સર્વે નં. ૧૧૫/૨ના માલિક વાઘેર હુશેન આમદની વેચાણ સંબંધે જે જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેલ છે તેની હકીકતો ખરી કે કાયદેસરની નથી.

ઉપરોક્ત ખેતરનો અમોએ તા. ૨૫/૪/૨૦૦૮ના રોજ સાટા કરાર કરેલ છે અને સદરહુ પેપર ટાઇટલ ક્લિયર કરાવી આપવાની જવાબદારી વાઘેર હુશેન આમદની રહેલ છે અને તેમણે સાટા કરારની રૂએ અમારી પાસેથી મોટી રકમ સૂથી-બાના પેટે મેળવેલ છે અને તેમણે સદરહુ ટાઇટલ ક્લિયર કરાવી આજદિન સુધી અમોને જાણ કરેલ નથી અને ઉપરોક્ત ખેતર અન્યને વેચસાટ કરવાની તજવીજ કરતા હોઇ અને અમારા સાટા કરારનું અમલ ન કરતા અમો તેમની વિરુદ્ધ મિલકત સંબંધે સિવિલ કોર્ટમાં કરાર પાલન તથા કાયમી મનાઇ હુકમનો દાવો કરી રહ્યા છીએ જેથી ઉપરોક્ત મિલકત સંબંધે તેમનાથી કોઇએ વ્યવહારો કરવા નહીં.

તા. ૬/૭/૧૧, મુંદરા-કચ્છ.
અમારી મારફતે :
બાબુલાલ પી. સોંધરા
કે. સી. ગણાત્રા (એડવોકેટ)
મુંદરા-કચ્છ. મો : ૯૮૨૪૨ ૩૦૩૭૮

જાહેર નોટિસ

આથી જાહેર જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે, અંજારના ગામશ્રી તુણાની સીમના રેવન્યુ સર્વે નંબર ૧૮૧/૧ જમીન હેકટર ૧–૪૮–૭૨ પ્રતિઆરે વાળી ખેતીની જમીન શ્રી દાનાભાઇ કરશનભાઇ હુંબલ, રહે. ગામઃ તુણા, તા. અંજાર – કચ્છ વાળાની માલિકી હોવાનું જણાવી અમારા અસીલે ખરીદ કરવાનું નક્કી કરેલ છે. ઉપરોક્ત ખેતીની જમીન પર કોઇપણ શખ્સનું કોઇપણ પ્રકારનું લેણું, લેખું, કોઇપણ બેન્ક કે આસામીનો ગીરો હક્ક તથા હિસ્સો, વારસાઇ હક્કો કે ભરણ પોષણના તેમજ અન્ય કોઇપણ પ્રકારના હક્કો પોષાતા હોય તો દિવસ–૭ (સાત)માં નીચે જણાવેલ સરનામે લેખિત આધારો સહિત જાણ કરવી. (લેખિત આધારો સિવાયની વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.) ઉપરોક્ત મિલ્કતમાં કોઇનો પણ લેખિત વાંધા તકરાર લેવામાં નહીં આવે તો તેઓએ પોતાના હક્કો જતા કરેલ છે અથવા વેઇવ કરેલ છે તેવું માની મુદત વિત્યે અમારા અસીલ ઉપરોક્ત જમીનનો અઘાટ વેચાણનો દસ્તાવેજ બનાવી લેશે. ત્યારબાદ ઉપરોક્ત ખેતીની જમીન તેમજ અમારા અસીલ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં તેમજ અમારા અસીલ પ્રમાણિત ખરીદનાર ગણાશે જેની સર્વેએ નોંધ લેવી. ઉપરોક્ત મિલ્કત અંગે લેવામાં આવેલ વાંધાઓ સાથે લેખિત દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં નહીં આવે તો તેઓના વાંધા માન્ય કરવામાં આવશે નહીં જેની પણ સ્પષ્ટ નોંધ લેવી.

સ્થળઃ અંજાર – કચ્છ. તા. ૦૬/૦૭/૨૦૧૧
મનોજ ડી. ચૌહાણ
એડવોકેટ એન્ડ નોટરી

અમારી મારફતેઃ
મનોજ ડી. ચૌહાણ એડવોકેટ એન્ડ નોટરી **અક્ષત એમ. મહેશ્વરી** એડવોકેટ
"શ્યામ કુંજ", ટી.પી. સ્કીમ નં. ૩, અંતિમ ખંડ નં. ૫૭૬/બી, અંજાર – કચ્છ.

જાહેર ચેતવણી

સ્વ. શ્રીમતી કસ્તુરબાઇ ભાણજી ગંગર ગામ છસરા તાલુકા મુંદ્રાના વતની (પૂર્વે કસ્તુરબાઇ રવજી સવા - કુંદરોડી)તથા સ્વ. શ્રીમતી લક્ષ્મીબાઇ ઉર્ફે કસ્તુરીબાઇ કેશવજી રાંભિયા ગામ ગુંદાલા તાલુકા મુંદ્રા જિલ્લા કચ્છના વતની (પૂર્વે લક્ષ્મીબાઇ રવજી સવા - કુંદરોડી)એ બંનેના વિદ્યમાન વારસો મારા અસીલો શા ભોગીલાલ ભાણજી ગંગર અને અન્યો સાતની સૂચનાથી આથી જણાવવાનું કે મોજે કુંદરોડીની સીમમાં સ્થિત મિલકતો ખેતીની જમીન ખેતર નંગ ત્રણ ક્રમવાર નામે (૧)'મેગવારવારો' રેવેન્યુ સર્વે નંબર ૧૧૦ હિસ્સા નંબર ૧, (૨)'ખડીણ' રેવેન્યુ સર્વે નંબર ૩૬૧ અને (૩) 'ખારો' રેવેન્યુ સર્વે નંબર ૩૭૭ ધરાવતા ઠામ આજ પર્યંત કસ્તુરબાઇ રવજી સવા અને લક્ષ્મીબાઇ રવજી સવાના નામે જમીનની ખાતાવહી ગામ નમૂનો નંબર ૮એ તથા ગામ નમૂનો નંબર ૭ અને ૧૨થી એલ. આર. સી. ઇ-ધરા મુંદરા (કચ્છ)ના રેવેન્યુ પ્રોપર્ટી રજીસ્ટરમાં નોંધાયેલ છે. સદર મિલકતો સંબંધે મારા અસીલોના સંયુક્ત નામ વારસાઇ હક્કે એલ. આર. સી. ઇ ધરા મુંદરા (કચ્છ)ના રેવેન્યુ પ્રોપર્ટી રજીસ્ટરે દાખલ કરવાની કાર્યવાહી થઇ છે. મારા અસીલોને માહિતી પ્રાપ્ત થયેલ છે કે કોઇક ભળતા ઇસમોને કસ્તુરબાઇ તથા લક્ષ્મીબાઇ તરીકેની કૃત્વી, બનાવટી, તરકટી ઓળખાણ બનાવી બતાવી સદર મિલકતો પૈકી ખેતર 'ખારો ' ગેરકાયદે, ગેરકાનૂની, બિનઅધિકૃત રીતે ઓળવવા પચાવવાની કોશીષ પેરવીમાં છે તે માટે જાુઠા છેતરપીડીવાળા દસ્તાવેજ લખી લખાવી સબરજીસ્ટ્રાર મુંદરા સમક્ષ રજીસ્ટર કરાવી ખેતીની જમીન ખેતર 'ખારો' ફેરબદલી તબદીલ કરાવવાના પ્રયત્નોમાં છે.

આથી જાહેર ચેતવણી આપવાની કે કોઇપણ વ્યકિત, શખ્સો, ઇસમો, સંસ્થાઓએ ઉપરોકત મિલકતો અને અથવા એમાંથી કોઇ એક તથા કોઇ એકના અંશને ખરીદવા બાબતે મારા અસીલો સિવાય અન્ય કોઇપણ સાથે લેતી-દેતીના વ્યવહારથી દૂર રહેવું તેમજ મારા અસીલોની પ્રત્યક્ષપણે અપાયેલ લેખીત રજા, મંજુરી, સંમતિ વગર જો કોઇપણ સદરહુ મિલકતો કે તેનો કોઇ અંશ વેંચાણ લેવા અન્ય રીતે તબદીલી ફેરબદલીથી કબજો ધારણ કરી પોતાના નામે નોંધ દાખલ કરવા કરાવવા જે કાંઇપણ સોદા વ્યવહાર કાર્યવાહી કરશે તો તે સઘળું ફોક રદ ગણાશે અને તે સઘળું તેમના હિસાબે જોખમે રહેશે એમ સ્પષ્ટ જાણવું.

આ ચેતવણીથી વિરુધ્ધ ઉપરવટ જઇ ઉપરોકત મિલકતો મોજે કુંદરોડીની સીમમાં સ્થિત ખેતીની જમીન ખેતર નંગ ત્રણ (૧)'મેગવારવારો' રેવેન્યુ સર્વે નંબર ૧૧૦ હિસ્સા નંબર ૧, (૨)'ખડીણ' રેવેન્યુ સર્વે નંબર ૩૬૧ અને (૩)'ખારો' રેવેન્યુ સર્વે નંબર ૩૭૭ ધરાવતા ઠામ સઘળા અથવા કોઇપણ એક સંબંધે જે કોઇ વ્યકિત, શખ્સો, ઇસમો, સંસ્થાઓ કોઇપણ અનધિકૃત વ્યકિત ઇસમો સાથે કાંઇપણ રીતે લેતી-દેતી, ફેરફાર તબદીલીની પ્રક્રિયામાં સામેલ થશે સહકાર કરશે તો તે સઘળું ગેરકાયદે, ગેરકાનૂની, અનધિકૃત, નિરર્થક હોતાં મારા અસીલો કે તે મિલકતોને માન્ય બંધનકર્તા રહેશે નહી તે જાણવું.

તારીખ : ૫મી જુલાઇ ૨૦૧૧.
ધીરેન હેમેન્દ્ર નંદુ, (એડવોકેટ અને સોલિસિટર)
૫૧૫, સર વિઠલદાસ ચેમ્બર્સ, ૧૬, મુંબઇ સમાચાર માર્ગ,
હોર્નિમન સર્કલ, મુંબઇ ૪૦૦ ૦૦૧

ટાઇટલ કલીયરન્સ બાબતે નોટીશ

મુંદરા તાલુકાના ગામ મુંદરાની સીમના રે.સર્વે નં. ૧૦૦ રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાતા 'વૈભવ પાર્ક' તરીકે ઓળખાય છે. તેમાં પાડવામાં આવેલ કુલ્લ ૧૧૫ પ્લોટો પૈકી પ્લોટ નં. ૮૭ પૈકીનો ઉત્તર બાજુનો અડધો ભાગ, ગ્રામ પંચાયત આકારણી રજીસ્ટર નં. ૨/૪/૫૫/૮૭-૧, સીટી સર્વે નં. ૩૦૨૨/૮૭ પૈકી, ક્ષેત્રફળ ૬૩.૦૦ ચો.મીટર ઉપર ગ્રાઉન્ડ ફલોરનું મકાન બાંધકામ ક્ષેત્રફળ ૫૪.૮૩ ચો.મીટરથી આવેલ છે તેના (૧) શ્રીમતિ દમયંતીબેન અજયભાઇ ઝાલા તથા (૨) અજય ખટાઉભાઇ ઝાલાના કબ્જા ભોગવટા અને માલિકીમાં આવેલ છે તે મકાન બાબતે તેમણે ટાઇટલ કલીયરન્સ સર્ટિફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરહુ મકાન પર કોઇનો પણ કોઇપણ જાતનો હક્ક, અધિકાર, લિયન રહેલ હોય તો દિવસ-૭ ની અંદર નીચે જણાવેલ સરનામે લેખિત આધાર પુરાવા રજુ કરવા. મુદ્દત વિત્યા બાદ કોઇ આધાર રજુ કરવામાં નહીં આવે તો સદરહુ મકાનનો ટાઇટલ કલીયરન્સનો સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

સ્થળ : મુંદરા-કચ્છ. તા. ૬/૭/૨૦૧૧
મારી મારફતે
એમ.ઓ. ખત્રી

સરનામું :
ખત્રી મહમદબિલાલ ઓસમાણ, ઇકબાલ એચ. માંજલીયા, હેતલ ડી. વેદાંત, નફીસુલહસન અબ્બાસી, અનવરહુસેન એન. ખત્રી,
એડવોકેટ્સ, ૯, મૈત્રી કોમ્પ્લેક્ષ, ફર્સ્ટ ફલોર, મુન્દ્રા-કચ્છ. મો. ૯૪૨૬૯ ૪૧૬૯૨

જાહેર નોટિસ (અંજાર)

આથી સર્વેને જણાવવાનું કે, ડિસ્ટ્રીકટ કચ્છ, સબ ડિસ્ટ્રીકટ અંજારના શહેરશ્રી અંજારના નગરપાલિકા વોર્ડ નં. ૫માં મચ્છીપીઠ તરીકે ઓળખાતા વિસ્તારમાં રતેશ્વર ડેલી મધ્યે આવેલ મિલકત જેના અંજાર સિટી સર્વે કચેરીના સીટ નં. ૧૪૬, સિટી સર્વે વોર્ડ નં. ૧, સિટી સર્વે નં. ૧૩૭, ક્ષેત્રફળ ૨૯.૫૮ ચો.મી. તથા સિટી સર્વે નં. ૧૨૯માં સંયુકત મજમુ આંગણાના માલિકી હક્કો વાળી મિલકત દિલીપ બાબુલાલ પલણની માલિકીની આવેલ છે. ઉપરોકત મિલકત દિલીપ બાબુલાલ પલણ પાસેથી અમારા અસીલ અઘાટ હમીરાવાર વેચાણ લેવા માંગે છે. જો કોઇપણ વ્યક્તિ, સહકારી મંડળી, નાણાકીય સંસ્થા કે કંપની સદરહુ મિલકતમાં પોતાનો હક્ક, હિસ્સો, લહેણું, લેખું, સુખાધિકારનો હક્ક-ભરણપોષણ તથા વારસાઇ હક્ક હોવાનું માનતી હોય તો તેઓએ આ નોટિસ પ્રસિદ્ધ થયે દિવસ ૭ (સાત)ની અંદર તે અંગેના લેખિત આધારો સાથે નીચે જણાવેલ સરનામે જાણ કરવી. મુદત વિત્યે અમારા અસીલ સદરહુ મિલકતનો અઘાટ હમીરાવાર વેચાણનો દસ્તાવેજ રજિસ્ટર કરાવી લેશે. ત્યારબાદ અમારા અસીલની કે સદરહુ મિલકત અંગેની કોઇપણ કાયદેસરની જવાબદારી રહેશે નહીં જેની સર્વેએ નોંધ લેવી.

તા. ૭/૭/૨૦૧૧
કિરણ ડી. પટેલ (એડવોકેટ)
૧૧૨, નગરપાલિકા કોમ્પલેક્ષ, એસ. ટી. બસ સ્ટેન્ડ સામે,
અંજાર (કચ્છ) મો. ૯૮૨૪૫ ૪૫૩૨૮

જાહેર નોટિસ

આથી આ જાહેર નોટિસ આપીને જણાવવાનું કે અમારા અસીલે ગામ પ્રાગપર-૧, તા. મુંદરા-કચ્છના રહેવાસી વેરશી નથુ ભીલના પાવરદાર શ્રી જગદીશ હરશીભાઇ મહેશ્વરી (સીંચ) રહે. ગામ : પ્રાગપર-૧, તા. મુંદરા-કચ્છ પાસેથી તેમની માલિકી, કબજા, ભોગવટા અને ઘરખેડ હેઠળની જમીન મુંદરા તાલુકાના ગામ પ્રાગપર-૧ની સીમમાં આવેલ છે. જેના સર્વે નં. ૧૨/પૈકી ૨. એકર ૩-૦૦ ગુંઠા એટલે કે હેકટર ૧-૨૧-૪૧ આરે જેનો આકાર રૂા. ૧.૯૪ પૈસા તથા દેવશી બાબુ હરિજન, રહે. ગામ ટોડા, તા. મુંદરા-કચ્છ સર્વે નં. ૧૨/૧/પૈકી ૧ એકર ૨-૧૯ ગુંઠા એટલે કે ૧-૦૦-૧૬ આરે જેનો આકાર રૂા. ૨.૯૦ પૈસાવાળો અઘાટ હક્કે વેચાણ લેવા સોદો કરેલ છે. સદરહુ જમીનમાં જે કોઇ શખ્સનો કશો હક્ક, હિસ્સો, હિત-સંબંધ, લિયન ચાર્જ કે સુખાધિકાર હોય તેમણે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ-૭ની અંદર અમારી ઓફિસે લેખિત આધારો સાથે રજુ કરવા લેખિત દસ્તાવેજી આધારો વગરનો વાંધો ગ્રાહ્ય રહેશે નહીં. મુદત પુરી થયેથી અમારા અસીલ સદરહુ જમીનનો પાકો અઘાટ વેચાણનો દસ્તાવેજ કરાવી લેશે ત્યારબાદ અમારા અસીલ કે સદરહુ જમીન જવાબદાર રહેશે નહીં. જેની આથી સર્વે નોંધ લેવી.

તા. ૬-૦૭-૨૦૧૧
મુંદરા-કચ્છ.
વી. આર. ગઢવી તે
ખરીદનારના એડવોકેટ

અમારી મારફતે :
વિશ્રામ રાજદે ગઢવી, એડવોકેટ & નોટરી
સામરા પી. બાટી, ભાવના કે. બારોટ, એડવોકેટ્સ
મુંદરા-કચ્છ. ફોન નં. (ઓ) ૨૨૩૫૩૬ (રે) ૨૨૨૬૪૬

જાહેર નોટીસ : તા. રાપર

આ નોટીસથી દરેકને જાણ કરવામાં આવે છે કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નીચે જણાવેલ ગામોની જમીનો તેની સામે જણાવેલ નામ વાળા માલીકો પાસેથી અમારા ગ્રાહકે અઘાટ વેચાણ રાખવાનો સોદો કરેલ છે.

ક્રમ	ગામ	સર્વે નં.	ક્ષેત્રફળ–હેકટર	માલીકનું નામ
૧	વિજાપર	૧૩૩/૨	૧–૦૦–૧૬	સેવંતીલાલ જસકરણ આજબાણી
૨	વિજાપર	૧૩૩/૪	૧–૦૯–૨૭	જમાલ હુસેન હિંગોરજા
૩	વિજાપર	૧૪૦/પૈકી ૧	૧–૨૭–૪૮	રહેમતુલ્લા અલીમામદ હિંગોરજા
૪	લોદ્રાણી	૮૧૩/પૈકી ૪	૨–૬૩–૦૫	રમેશ કરસન કોલી

જેથી ઉપરોકત જમીનો પરત્વે કોઈનું પણ કાંઈપણ જાતનું લહેણું, લેખું કે, હકક–હિસ્સા કે લાગ – ભાગ, ગીરો કે વરવાંધો કે તકરાર હોય તો તે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ–૭ (સાત)માં અસલ આધારો સાથે નીચેના સરનામે જાણ કરવી. મુદત વિત્યે સદરહું જમીન ઉપર અન્ય કોઈનો પણ કોઈ જાતનો હિસ્સો કે લાગ – ભાગ નથી અગર તો જતો કરેલ છે તેમ માની અમારા ગ્રાહક ઉપરોકત જમીનોનો અઘાટ વેચાણનો પાકો રજીસ્ટર્ડ દસ્તાવેજ બનાવી લેશે. ત્યાર બાદ કોઈપણના વરવાંધા બાબતે અમારા ગ્રાહક કે સદરહુ જમીનોની કોઈ જવાબદારી રહેશે નહી. જેની આથી દરેક વ્યકિતએ નોંધ લેવી.

તા. ૬–૭–૨૦૧૧
મનુભાઈ પી. રાજગોર
દસ્તાવેજ લખનાર, એસ.ટી.ડેપોની પાસે,"મોમાય ઝેરોક્ષ" રાપર–કચ્છ.,
ફોન : ઓ. ૨૨૦૪૫૧ મો. ૯૮૨૫૪–૫૦૪૫૧

જાહેર નોટિસ

આથી (૧) **બાલુભા વીરમજી જાડેજા** (૨) **સુરતસંગ ટપુભા જાડેજા** (૩) **વનરાજસિંહ ભાવુભા જાડેજા,** રહે. ત્રંબૌવાળાની સૂચના અને ફરમારસથી જાહેર નોટિસ આપવામાં આવે છે કે રાપર તાલુકાના ગામ : ત્રંબૌના નીચે લખ્યા સર્વે નંબરોવાળા ખેતરોમાં અમારા દાદા વેલુભા સરદારસંગને ગીરો છોડાવવાનો હક્ક છે જેથી તે ખેતરો ઉપર જણાવ્યા શખ્સોની સંમતિ વગર કોઇએ વેચાણ કે બીજી રીતે વહેવાર કરવો નહીં તેવી આથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે છતાં કોઇ વહેવાર કરશે તો અમારા અસીલ તેઓની સામે કાયદેસર પગલા લેશે. તેની આથી નોંધ લેશો. જમીનની વિગત નીચે મુજબ છે.

અનુ.ક્રમ	સર્વે નં.	હે. આરે.	ગામનું નામ
૧.	૨૨૩/૧	૦/૪૫/૫૩	ત્રંબૌ
૨.	૫૦૯/પૈકી ૧	૨/૫૫/૯૭	ત્રંબૌ
૩.	૫૦૯/પૈકી ૨	૨/૮૩/૨૮	ત્રંબૌ
૪.	૫૧૦/પૈકી ૧	૧/૦૯/૩૮	ત્રંબૌ
૫.	૫૧૦/પૈકી ૨	૧/૧૯/૩૯	ત્રંબૌ

ઉપર મુજબની નોંધ લેવાની વિનંતી છે.

અમારી મારફતે :
એચ. બી. ઝોટા
એડવોકેટ એન્ડ નોટરી
બસ સ્ટેન્ડ રોડ, રાપર-કચ્છ.
મો. ૯૯૧૩૧ ૬૮૩૨૩

એચ. બી. ઝોટા
(એડવોકેટ એન્ડ નોટરી)
બાલુભા વીરમજી જાડેજા
તથા સુરતસંગ ટપુભા જાડેજા
વનરાજસિંહ ભાવુભા જાડેજા
સૂચના આપનારાઓના એડવોકેટ

ગામ કોડાયની જાહેર નોટીસ

માંડવી તાલુકાના ગામ : કોડાય સીમના રે.સર્વે નં.૩૨૭ પૈકી ૧ વાળી જમીન બીનખેતી રહેણાંક હેતુમાં ફેરવાયેલ છે. જે વિસ્તાર 'શ્રીજી પાર્ક' તરીકે ઓળખાય છે. તેમાં પાડવામાં આવેલ રહેણાંક હેતુના પ્લોટો નં.૧૨૧ તથા ૩૪૭ વાળા શેઠ મહેન્દ્રકુમાર રસીકલાલ તથા શાહ નાનાલાલ શાન્તીલાલની સંયુક્ત માલીકી તથા કબ્જા ભોગવટાની આવેલ છે. તેઓ પાસેથી અમારા ગ્રાહકે ખરીદ કરવા સોદો કરેલ છે. આ પ્લોટો ઉપર વેચનારા સિવાય અન્ય કોઇનો કોઇપણ જાતનો હક્ક, હિસ્સો, લાગ, ભાગ, ગીરો, હક્ક, લીચન, ચાર્જ, બોજો કે ભરણપોષણ કે બેંક લેણું હોય તો દિવસ-૭ (સાત) માં દસ્તાવેજી આધારો સાથે નીચે જણાવેલ સરનામે રૂબરૂ રજૂ કરવું. મુદત દરમ્યાન જો કોઇ વાંધો નહીં આવે તો અઘાટ વેચાણનો દસ્તાવેજ બનાવી લેવામાં આવશે. ત્યારબાદ અમારા ગ્રાહક કે સદરહુ ઠામોની જવાબદારી રહેશે નહીં.

તા.૬/૭/૨૦૧૧, ભુજ
મારી મારફતે : **ભરત જે.પરમાર**
લાભ એન્ટરપ્રાઇઝ
૩, કેપીટલ પ્લાઝા, મહાદેવ ગેઇટ, ભુજ
મો.૯૮૨૪૦ ૯૩૮૮૨

લગ્નવિચ્છેદ થયા અંગે નોટીસ

અમો નીચે સહી કરનાર નયનાબેન તે મોહનલાલ ભાણજી સીતાપરાની પુત્રી, ઉ.વ.૨૮ આ., રહે. ગુર્જર સુતાર હંગામી આવાસ, નવા અંજાર વાળા આથી જાહેર કરીએ છીએ કે, મારા કિરણ ડાયાભાઇ ઉર્ફે દયારામભાઇ ઝાલાપરાના, રહે. હાલે આદિપુર, તા.ગાંધીધામ વાળા સાથેના લગ્નનો નામદારશ્રી પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ સાહેબ અંજાર સમક્ષના એચ.એમ.પી. નં.૨૬/૨૦૧૦ વાળા કામે થયેલ હુકમ અને હુકમનામા મુજબ લગ્નવિચ્છેદ થયેલ છે. જેની સંબંધકર્તા શખ્સોએ નોંધ લેવી.

અંજાર. તા.૮/૭/૨૦૧૧
નયનાબેન મોહનલાલ સીતાપરા

અમારી મારફતે :
ધનંજય જે.વ્યાસ
મોહન જે.પ્રજાપતિ
કમલેશ એચ.પંડ્યા (એડવોકેટ્સ)
૧૧૦, નગરપાલિકા કોમ્પલેક્ષ,
બસ સ્ટેશનની સામે, અંજાર-કચ્છ.
ફોન : (ઓ) ૨૪૨૮૫૭

જાહેર નોટીસ

આથી સર્વેને જણાવવાનું કે, કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના શહેરશ્રી ભુજ મધ્યેના વિજયનગર વિસ્તારના પ્લોટ નંબર ૭૩, ભરપે માપે ૩૭૧.૩૪ ચો.મી. તે સીટી સર્વે વોર્ડ નં.૫, સીટી સર્વે નં.૧૦૭૬ વાલા પ્લોટ્ના કબ્જા, ભોગવટા માલીકી હક્કો ધરાવતા કેશરબેન પુનશી શાહ, રહે. ભુજ વાલાના પાવર ઓફ એટરની હોલ્ડર તે તેમના પુત્રી ગીતાબેન રમેશ શર્મા, રહે. ગાંધીધામ વાળા પાસેથી અઘાટ વેચાણ લેવાનું મારા અસીલે નક્કી કરેલ છે. ઉપરોકત મિલ્કત કે તેના દસ્તાવેજો અંગે કોઇનું લેણું, લેખું, હક્ક, હિસ્સો, બોજો, ચાર્જ, લીયન, સુખાધિકાર વિગેરે હોય અથવા તે મિલ્કતના વેચાણ સામે કોઇના વર, વાંધા, તકરાર હોય તો તેમણે દિવસ-૭ માં નીચેના સરનામે લેખીતમાં આધાર પુરાવા સાથે જાણ કરવી. મુદત વિત્યે મારા અસીલ ઉક્ત મિલ્કતના અઘાટના વેચાણનો રજી. દસ્તાવેજ બનાવી લેશે. ત્યારબાદ કોઇ વાંધા તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં અને મારા અસીલ બોનાફાઇડ ખરીદદાર બનશે તથા મારા અસીલ કે ઉપરોક્ત મિલ્કત કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં. જેની સર્વેએ સ્પષ્ટ નોંધ લેવી.

તા.૬/૭/૨૦૧૧
મારી મારફતે :
વિજય આર.ગઢાઇ (એડવોકેટ)
૧૦૪, વિજયનગર, હોસ્પિટલ રોડ,
ભુજ-કચ્છ.

જાહેર નોટીસ

આથી લાગતા વળગતાઓ સર્વેને વિદિત થાય કે, અમો (૧) બીજલભાઇ નથુભાઇ ચાંઉ (૨) ભાઇલાલભાઇ નથુભાઇ ચાંઉ (૩) અમૃતલાલ નથુભાઇ ચાંઉ (૪) શાન્તીબેન નથુભાઇ ચાંઉ વાળા આ નોટીસ આપી જાહેર કરીએ છીએ કે, ગામ : વીરા, તા.અંજાર-કચ્છના રેવન્યુ સર્વે નં.૩૯૮/૧/૨ તથા ૩૯૮/૧/૩ વાળા ખેતર અમારા પિતાશ્રી નથુભાઇ ભારમલભાઇ ચાંઉના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલ અને અમારા પિતાશ્રી એકમાત્ર તેના માલિક અને ભોગવટેદાર, કબ્જેદાર હતા. ત્યારબાદ અમારા અન્ય ભાઇ શામજીભાઇ નથુભાઇ ચાંઉ, રહે. વીરા, તા.અંજાર-કચ્છ વાળાએ અમોને અજાણ રાખીને કોઇપણ રીતે પોતાના નામ દાખલ કરાવી દીધેલ છે. જે અંગેની તપાસ અને કાર્યવાહી અમારા તરફે ચાલુમાં છે. અમો કાયદેસરના વારસદારો છીએ. સદરહુ મિલ્કતમાં અમારો સંયુક્ત હક્ક, હિસ્સો રહેલો છે અને આ શામજીભાઇ નથુભાઇ ચાંઉ સદરહુ મિલ્કતને વેંચસાટ કરવાની પેરવી કરી રહેલ છે. જેથી કોઇપણ શખ્સ આ મિલ્કત માટે કોઇપણ પ્રકારનો સોદો કે વ્યવહાર કરવો નહીં. અમારો તેમાં સખ્ત વાંધો છે અને તે અંગેની અમારી આગળની કાર્યવાહી ચાલુમાં છે. તેમ છતાં પણ જો કોઇપણ વ્યક્તિ આ મિલ્કત બાબતે સોદો કે વ્યવહાર કરશે તો અમને કે અમારી મિલ્કતને બંધનકર્તા રહેશે નહીં. જેની સ્પષ્ટ નોંધ લેશો.

બીજલભાઇ નથુભાઇ
ભાઇલાલભાઇ નથુભાઇ
અમૃતલાલ નથુભાઇ
શાંતીબેન નથુભાઇ

અમારી મારફતે :
ગીતા વી.જોષી (એડવોકેટ)
પોલીસ સ્ટેશનની બાજુમાં,
ગણેશ બિલ્ડીંગ, પ્લોટ નં.પ૯૨,
વોર્ડ-૧૨-સી, ગાંધીધામ-કચ્છ.

ભુજ શહેરના સી.સ.નં.૪-૫-૬-૭ વાળી મિલ્કતની જાહેર નોટીસ

હું જયરામગર ગંગાગર ગુંસાઇ તથા પૃથ્વીગર ગંગાગર ગુંસાઇ, રે.ભુજ-કચ્છ વાળાઓ જાહેર કરીએ છીએ કે, ભુજ શહેર મધ્યે પાટવાડી નાકા પાસે સી.સ.નં.૪-૫-૬-૭ વાળી મિલ્કત અમારી વડિલોપાર્જીત માલીકી હક્કની રહેલ છે. આ મિલ્કતમાં કપટવાળા વીલથી અમારા ભાઇ ઇશ્વરગર ગંગાગર ગુંસાઇ તથા અનોપગર ગંગાગર ગુંસાઇના નામે સીટી સર્વે કચેરીમાં અનિયમિત કાર્યવાહીથી નોંધાયેલ છે. જે અંગે અમારી નાયબ કલેકટરશ્રી, ભુજ-કચ્છ સમક્ષ અપીલ ચાલુમાં છે તેમજ આ મિલ્કતના વિભાજન તથા હક્ક માટે કાનૂની કાર્યવાહી હાથ ધરેલ છે. જેથી આ મિલ્કતો કોઇએ કોઇ પ્રકારે તબદીલીમાં લેવી નહીં. જેની સર્વે લાગતા વળગતાએ નોંધ લેવી. ભુજ-કચ્છ. તા.૬/૭/૧૧

લિ. જે.જી.ગુંસાઇ
પૃથ્વીગર ગંગાગર ગુંસાઇ

અમારી મારફતે :
એમ.એચ.રાઠોડ (એડવોકેટ)
સંજોગનગર, ભુજ-કચ્છ.

જાહેર નોટિસ

આથી સર્વેને જાણ કરવામાં આવે છે કે, અમારા અસીલે ગામશ્રી શિવલખા, તા. ભચાઉ-કચ્છની સીમમાં આવેલ ખેતીની જમીન જેના રેવન્યૂ સર્વે નંબર : ૨૮૨ પૈકી જમીન એકર ૪-૧૯ ગુંઠા તે હેકટર ૧-૮૧-૦૯ આરેવાળી તેના માલિક અને કબજેદાર જાડેજા રામસંગજી ડોસાજી પાસેથી વેચાણ લેવા સોદો કરેલ છે.

ઉપરોકત મિલ્કત પર કોઇનું કોઇપણ જાતનું લેણું-લેખું, ભાર-બોજો, હક્ક-હિસ્સો, હિત-સંબંધ હોય કે કોઇના ચાર્જ-લિયન, ગિરોના કે અન્ય કોઇપણ હક્કો આવેલા હોય તેમણે દિવસ ૫ (પાંચ)માં લેખિત આધારો સાથે નીચે જણાવેલ સરનામે જાણ કરવી. મુદત વિત્યે કોઇના કોઇપણ જાતના હક્કો આવેલા નથી અથવા તો જતા કર્યા છે. તેમ માની અમારા અસીલ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવી લેશે. ત્યારબાદ કોઇના કોઇપણ વાંધા ચાલશે નહીં કે અમારા અસીલ કે ઉપરોકત મિલ્કતોને તે બંધનકર્તા રહેશે નહીં. જેની સર્વેએ નોંધ લેવી.

કિશોર જે. રાવલ
એડવોકેટ એન્ડ નોટરી

સરનામું : **કિશોર જે. રાવલ,**
નિરૂભા બી. જાડેજા,
ભાવેશ બી. ઠક્કર એડવોકેટસ
એસ.બી.આઇ. અરિહંત શાખાની બાજુમાં,
ભચાઉ-કચ્છ.
ફો. નં. : ૦૨૮૩૭-૨૨૪૧૦૦

જાહેર નોટિસ

આથી સર્વેને જાણ કરવામાં આવે છે કે, અમારા અસીલે ગામશ્રી શિવલખા, તા. ભચાઉ-કચ્છની સીમમાં આવેલ ખેતીની જમીન જેના રેવન્યૂ સર્વે નંબર : ૨૮૨ પૈકી જમીન એકર ૪-૦૦ ગુંઠા તે હેકટર ૧-૬૧-૮૮ આરેવાળી તેના માલિક અને કબજેદાર જાડેજા રામસંગજી ડોસાજી પાસેથી વેચાણ લેવા સોદો કરેલ છે.

ઉપરોકત મિલ્કત પર કોઇનું કોઇપણ જાતનું લેણું-લેખું, ભાર-બોજો, હક્ક-હિસ્સો, હિત-સંબંધ હોય કે કોઇના ચાર્જ-લિયન, ગિરોના કે અન્ય કોઇપણ હક્કો આવેલા હોય તેમણે દિવસ ૫ (પાંચ)માં લેખિત આધારો સાથે નીચે જણાવેલ સરનામે જાણ કરવી. મુદત વિત્યે કોઇના કોઇપણ જાતના હક્કો આવેલા નથી અથવા તો જતા કર્યા છે. તેમ માની અમારા અસીલ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવી લેશે. ત્યારબાદ કોઇના કોઇપણ વાંધા ચાલશે નહીં કે અમારા અસીલ કે ઉપરોકત મિલ્કતોને તે બંધનકર્તા રહેશે નહીં. જેની સર્વેએ નોંધ લેવી.

કિશોર જે. રાવલ
એડવોકેટ એન્ડ નોટરી

સરનામું : **કિશોર જે. રાવલ,**
નિરૂભા બી. જાડેજા,
ભાવેશ બી. ઠક્કર એડવોકેટસ
એસ.બી.આઇ. અરિહંત શાખાની બાજુમાં,
ભચાઉ-કચ્છ.
ફો. નં. : ૦૨૮૩૭-૨૨૪૧૦૦

જાહેર નોટીસ

આથી સર્વે લાગતા વળગતાઓને જાણ કરવામાં આવે છે કે, અમારા ગ્રાહક એ ભુજ તાલુકાના ગામશ્રી રતીયાની સીમમાં આવેલ (૧) રે.સર્વે નં.૧૫૭/૧/પૈકી-૨ વાળી ભરપે માપે હેકટર ૧-૦૨-૫૦ આરેના માપની જૂની શરતની કપિત ખેતીની જમીન નામે 'પાસી' વાળી તેના માલિક રમેશ ગાંગજી હરજી ગોરસીયા, રહે. ગામ : સુખપર, તા.ભુજ-કચ્છ તથા (૨) રે.સર્વે નં.૧૫૭/૧/પૈકી-૨/પૈકી-૧ વાળી ભરપે માપે હેકટર ૧-૦૨-૫૦ આરેના માપની જૂની શરતની કપિત ખેતીની જમીન નામે 'પાસી' વાળી તેના માલિક ભીમજી ગાંગજી હરજી ગોરસીયા, રહે. ગામ : સુખપર, તા.ભુજ-કચ્છ આમ ઉક્ત બે જમીનો ઉક્ત જણાવેલ માલિક કબ્જા, ભોગવટા અને અઘાટ હક્ક માલીકીની છે. આ જમીન તેમની પાસેથી અમારા ગ્રાહકે અઘાટ હક્કે ખરીદવા નક્કી કરેલ છે.

આ જમીનના વેચાણ સામે કોઇપણ શખ્સ કે બેંક, નાણા ધીરનાર સંસ્થાનો હક્ક, ભાગ, કે લેણો, લેખો યા વર, વાંધો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ-૭ (સાત) માં લેખીત આધાર પુરાવા સાથે નીચેના સરનામે રજૂ કરવા. અન્યથા સદરહુ જમીન ઉપર કોઇનો લેણો, લેખો નથી કે કોઇ હક્ક, હિસ્સો બાકી નથી અને હોય તો જતો કરેલ છે તેમ સમજી અઘાટ વેચાણનો દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવી લેશે. ત્યારબાદ સદરહુ જમીન અંગે અમારા ગ્રાહકની કોઇ જવાબદારી રહેશે નહીં. જેની સર્વે લાગતા વળગતાઓએ નોંધ લેવી. તા.૬/૭/૧૧

જવાહર એલ.મોતા (પીટીશન રાઇટર)
બાલકૃષ્ણ એલ.મોતા (M.Com.LL.B.)
દસ્તાવેજ લખનાર
C/o. **જીત કન્સલ્ટન્ટ,** ૯, હેપી કોમર્શીયલ કોમ્પલેક્ષ, ન્યુ સ્ટેશન રોડ, ભુજ-કચ્છ.

ટાઇટલ કલી.સર્ટી. અંગેની જાહેર નોટીસ

આથી જાહેર નોટીસ આપીને જણાવવાનું કે, કચ્છ જીલ્લાના મુન્દ્રા તાલુકાના મોજે ગામ : બારોઇના સીમના સર્વે નં. ૧૮૫, જમીન એકર ૭.૧૦ ગુંઠા વાલી જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવાયેલ અને તેમાં પાડવામાં આવેલ પ્લોટો જે વિસ્તારને 'આશાપુરાનગર' તરીકે ઓળખાય છે. તેમાં આવેલ પ્લોટો પૈકી નીચે જણાવેલ શિડ્યુલવાળા પ્લોટો નીચે જણાવેલ વ્યક્તિઓના સ્વતંત્ર કબ્જા, ભોગવટાને માલીકીના છે. જે સંબંધી અમારી પાસે ટાઇટલ કલીયર સર્ટી. આપવા માટે માંગણી કરેલ છે. જેથી નીચે જણાવેલ શિડ્યુઅલવાળા પ્લોટો સંબંધી અન્ય કોઇપણ વ્યક્તિનો હક્ક, હિસ્સો, હિતસંબંધ, લેણો, લેખો, બોજો, ગીરો, તકરાર બક્ષિસ કે અન્ય કોઇપણ સુખાધિકારો હક્કો હોય તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૫ માં અમારી ઓફિસે લેખીત આધાર પુરાવા સહિત જાણ કરવી. નહીં તો મુદત વિત્યે ટાઇટલ કલીયર સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.

: શિડ્યુઅલ :

ક્રમ	પ્લોટ નંબર	ક્ષેત્રફળ	માલિકનું નામ
૧	૪૧/બી	૫૬.૦૦ ચો.મી.	અમિતકુમાર જયનારાણ ઠાકુર
૨	૪૧/સી	૫૬.૦૦ ચો.મી.	વિશાલ અરવિંદભાઇ પરમાર

તા.૬/૭/૨૦૧૧
અમારી મારફતે :
વિશ્રામ રાજદે ગઢવી (એડવોકેટ એન્ડ નોટરી)
ભાવના કે.બારોટ, શામરા પી.બાટી (એડવોકેટ્સ)
બારોઇ રોડ, મુન્દ્રા-કચ્છ. ફોન : (ઓ) ૨૨૩૫૩૬ (રે) ૨૨૨૬૪૬

વી.આર.ગઢવી
તે અમિતકુમાર ઠાકુર અને
વિશાલ પરમારના એડવોકેટ
(મુન્દ્રા-કચ્છ)

Digitially Archived by: www.realpatidar.com/library

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

જાહેર નોટિસનો જવાબ તથા પ્રતિ નોટિસ
મોજે ગુંદાલા-મુંદરા

આથી લાગતાવળગતા સર્વેને જણાવવાનું કે, કચ્છમિત્ર દૈનિકમાં તા. ૬-૭-૧૧ના રોજ કે. સી. ગણાત્રા એડવોકેટશ્રીએ તેમના અસીલ જેઠાલાલ મુળજી દેઢિયા વતીથી મુંદરા તાલુકાના ગામ : ગુંદાલાની સીમના રે. સર્વે નં. ૪૯૪, હે. ૪-૯૫-૭૪ આરે પ્રતિઆરે ખેતર નામે 'હીલાઇની કટકી'વાળા ઠામ સંબંધે ખોટી રીતે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવેલ છે. તે નોટિસ ખરી કે કાયદેસરની નથી. સદરહુ ઠામએ અમારા અસીલો તે સ્વ. નાગજી મૂરજી દેઢિયાના વારસો (૧) કસ્તુરબેન ડો/ઓ નાગજી દેઢિયા વા/ઓ ચીમનલાલ શામજી તથા (૨) લીલાવંતીબેન ડો/ઓ નાગજી દેઢિયા વા/ઓ નાગજી મીઠુભાઇના કાયદેસરના કબજા ભોગવટા માલિકી તથા ઘરખેડમાં રહેલ છે. તેમજ સદરહુ ઠામ અમારા અસીલ ખાતા નં. ૬૫થી ધારણ કરે છે. તેમજ અમારા અસીલ જેઠાલાલ મુળજી દેઢિયાને ઓળખતા નથી તેમજ સદરહુ નોટિસમાં તેમનું પૂરું સરનામું લખેલ નથી. આથી પ્રતિનોટિસ આપી જણાવવાનું કે આપના અસીલનો સદરહુ ઠામમાં કોઇપણ હક્ક-હિત હોય તો તેવા આધારો દિવસ-૭માં પૂરા પાડવાની સૂચના આપશો. અન્યથા આપના અસીલે ખોટી રીતે અમારા અસીલના માલિકીના ઠામમાં વાંધાઓ નોંધાવેલ છે તેમ માની તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની લાગતા-વળગતા સર્વેએ નોંધ લેવી.

તા. ૦૬-૦૭-૧૧ — ભરત જે. જોશી તે

પી. એસ. કેનિયા, ભરત જે. જોશી, — કસ્તુરબેન ડો/ઓ નાગજી દેઢિયા વા/ઓ

હર્ષ પી. જોબનપુત્રા (એડવોકેટસ) — ચીમનલાલ શામજીના એડવોકેટ

૨૦, ગ્રાઉન્ડ ફ્લોર, આદર્શ ટાવર, મુંદરા-કચ્છ.

જાહેર નોટિસ (ચાંદ્રાણી)

આથી સર્વેને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે, મોજે ચાંદ્રાણી, તા. અંજારની સીમ મધ્યે આવેલ નીચે દર્શાવ્યા મુજબના કપીત ખેતરો અમારા અસીલે અઘાટ વેચાણ લેવા સોદો નક્કી કરેલ છે.

અનું. નં.	સર્વે નં.	હે. આરે. પ્ર.	માલિકનું નામ
(૧)	૫૨	૧-૨૫-૪૬	અરજણ કરસન મેતા (આહીર) રહે. ગામ : ચાંદ્રાણી, તા. અંજાર
(૨)	૫૨/પૈકી ૨	૧-૨૫-૪૬	ભીમજી કરસન મેતા (આહીર) રહે. ગામ : ચાંદ્રાણી, તા. અંજાર

એ રીતની ઉપરોક્ત મિલકતો પર કોઇનું કોઇપણ પ્રકારનું લેણું, લેખું, બોજો, હક્ક, હિસ્સો, સુખાધિકારનો, ગણોતનો, ગીરો છોડાવવાનો હક્ક, ભરણપોષણનો કે વારસાઇ હક્ક કે કોઇપણ પ્રકારના હક્કો પોષાતા હોય તો દિવસ-૭ (સાત)માં નીચે જણાવેલ સરનામે લેખીત આધારો સહિત જાણ કરવી. મુદત વિત્યે અમારા અસીલ સદરહુ મિલકતોનો અઘાટ વેચાણનો પાકો રજીસ્ટાર દસ્તાવેજ કરાવી લેશે. ત્યારબાદ સદરહુ મિલકતો કે અમારા અસીલ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં. જેની સર્વેએ નોંધ લેવી.

અંજાર - કચ્છ. — (નઝીમ આઇ. જત)

તા. ૬-૭-૨૦૧૧ — તે ખરીદનારના એડવોકેટ

અમારી મારફતે : **નઝીમ આઇ. જત,** એડવોકેટ

૫, પ્રભુ ભવન કોમ્પ્લેક્ષ, સ્ટેટ બેન્કની સામે, દેવળિયા નાકા, અંજાર-કચ્છ.

ફોન નં. : ૦૨૮૩૬-૨૪૪૨૫૦, મો. ૯૮૨૪૮ ૮૫૮૩૪

જાહેર નોટીસના જવાબ તથા ચેતવણીનો પ્રતિજવાબ તથા પ્રતિચેતવણી
મોજે હટડી, તા. મુન્દ્રા-કચ્છના રે.સર્વે નં. ૧૪૩/૨

આથી હું નીચે સહી કરનાર માવજી મેમા ખટારીયા, રહે. પ્લોટ નં. ૧૨૫, સેકટર નં.૩, ગાંધીધામ-કચ્છ વાળા સર્વે જાહેર જનતા તથા લાગતા વળગતાઓને જાહેર નોટીસના જવાબ તથા ચેતવણીના પ્રતિજવાબ તથા પ્રતિચેતવણીથી જાણ કરૂ છું કે, મોજે હટડી, તા. મુન્દ્રા-કચ્છના રે.સર્વે નં. ૧૪૩/૨ વાળી જમીન અમોએ વેંચાણ કરવા સોદો કરેલ છે, અને જેથી આ મિલ્કતના વેંચાણ સામે કોઇને પણ વાંધો હોય તો દિવસ-૭ માં રજુ કરવો તેવી જાહેર નોટીસ કચ્છમિત્ર દૈનિક પેપરમાં તા. ૧૭/૬/૨૦૧૧ ના રોજ પ્રસિધ્ધ કરાવેલ જે નોટીસ નો જવાબ એડવોકેટશ્રી ગજરાજસિંહ કે. જાડેજા મારફતે હટડી રામ મંદિરનાં વહીવટદારોએ તા. ૨૩/૬/૨૦૧૧ ના કચ્છમિત્ર દૈનિકમાં પ્રસિધ્ધ કરાવેલ છે. અને આ જમીન રામ મંદિરની આવેલ હોવાનું જણાવેલ છે. આ મિલ્કત રામ મંદિરની આવેલ નથી અને અમારી સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબ્જા, ભોગવટાની આવેલ છે, અને આ ઠામનો વહીવટ રામ મંદિરના વહિવટદારો કે પૂજારી કયારેય કરતા આવેલ નથી કે હાલે પણ કરતા નથી. તેમ છતાં અમારી જમીનના વેંચાણને અટકાવવા ખોટી રીતે આ જવાબ રામ મંદિરના વહિવટકર્તાઓએ પ્રસિધ્ધ કરાવેલ છે. જેથી આ મિલ્કત રામ મંદિરનું આવેલ છે. તેવા કોઇ જ આધારો દિવસ-૭ માં નીચેના સરનામે રજુ કરવામાં નહી આવે તો અમો ઉપરોક્ત મિલ્કતનો દસ્તાવેજ કરી આપીશું, અને અમારી મિલ્કતના વેંચાણને અટકાવવા સબબ રામ મંદિરના વહીવટકર્તાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું જેની સર્વેએ નોંધ લેવી.

અંજાર-કચ્છ તા. ૦૬/૦૭/૨૦૧૧ — માવજીમેમા ખટારીયા

અમારી મારફતે:-

દિનેશ જે. રાવલ,
શૈલેષ સી. હર્ષ,સામતભાઈ ડી. ગઢવી
હાર્દિક એચ. રાવલ, હરેશ ડી. ચાવડા-એડવોકેટસ
તુરીયા વાડ, અંજાર-કચ્છ, ફોન નં. (ઓ) ૨૪૬૫૪૪

જાહેર નોટીસ કમ ચેતવણી
સુજાપર, તા.અબડાસા, ખાતા નં.૪૭, રેવન્યુ સર્વે નં.૭૬-૧૨૮

અમારા અસીલ કોલી સીધીક નાથા, રહે. લૈયારી, તા.અબડાસા વાળાએ તા.૨/૨/૨૦૧૧ ના રોજ ગામ : સુજાપર, તા.અબડાસાના ખાતા નં.૪૭, રે.સર્વે નંબર ૭૬ ક્ષેત્રફળ હેકટર ૨-૧૨-૪૬ આરે ખેતર નામે 'હપતલ' અને રેવન્યુ સર્વે નંબર ૧૨૮, ક્ષેત્રફળ હેકટર ૨-૪૮-૮૮ આરે ખેતર નામે 'ટુકરી' નો લેખીત સાટાકરાર મૂળ રહે. સુજાપર, તા.અબડાસા, હાલે મોટી ખોંભડી, તા.નખત્રાણાના રહે. જાડેજા બચુભા શિવુભા તથા ગામ : નેત્રા, તા.નખત્રાણાના મેઘજી થાવર હરિજન સાથે કરેલ હતો અને તે સાટાકરાર સાથે અમારા અસીલે ઉક્ત નામ વાળાને સુથી પેટે મોટી રકમ અમારા અસીલ પાસેથી મેળવેલ છે. અને સાટાકરારની મુદત તા.૩૦/૪/૨૦૧૧ ના રોજ પૂરી થતાં તે જ તારીખે સાટાકરારની મુદત વધારવા બન્ને પક્ષકારોની સંમતિથી નવો સાટાકરાર નોટરી રૂબરૂ કરેલ છે. જેની મુદત તા.૧૪/૬/૨૦૧૧ ના રોજ પૂર્ણ થયેલ છે. અમારા અસીલ તેમજ ઉક્ત વ્યક્તિઓના સારા સંબંધો હોવાના નાતે અમારા અસીલે અવાર નવાર ઉક્ત વ્યક્તિઓને સાટાકરાર મુજબ વર્તવવા મૌખિક રીતે જણાવેલ. પરંતુ ઉક્ત વ્યક્તિઓ બન્ને જણા ચેનકેન પ્રકારે વખતગત કરી તેમજ રોજ નવા કુનવા કાઢી સાટાકરાર મુજબ વર્તવવા કસૂર કરેલ છે અને અમારા અસીલને હાલમાં જાણવા મળેલ છે. તેમ ઉક્ત ઠામો ઉક્ત નામના વ્યક્તિઓ સાટાકરાર ચાલુમાં હોવાં છતાં અન્યોને વેંચસાટ કરવા તજવીજ હાથ ધરેલ છે. જેથી ઉક્ત ઠામો સંદર્ભે આજે પણ સાટાકરાર ચાલુમાં હોઇ અને અમારા અમારા અસીલ સાટાકરાર મુજબ વર્તવવા તૈયાર રાજીખુશી હોઇ અને સાટાકરારની બાકીની રકમ ઉક્ત વ્યક્તિઓને ચૂકવી દસ્તાવેજ કરાવવા રાજીખુશી અને તૈયાર હોઇ જેથી ઉક્ત ઠામો અંગે અમારા અસીલની લેખીત પરવાનગી વગર સદરહુ ઠામો વેંચસાટ કરવુ-કરાવવું નહીં. તેમ છતાં થયેલ આવા ગેરકાયદેસરના વ્યવહાર માટે અમારા અસીલ કે ઉક્ત ઠામોની કોઇપણ જાતની જવાબદારી રહેશે નહીં તેમજ જવાબદારો સામે નાછૂટકે અમારા અસીલ ફોજદારી તેમજ દિવાની રાહે પગલા ભરશે. જેના થનાર તમામ ખર્ચ અને પરિણામોની જવાબદારી અમારા અસીલ કે ઉક્ત ઠામોની રહેશે નહીં. જેની આથી સર્વે લાગતા વળગતાઓએ સ્પષ્ટ નોંધ લેવી.

નલીયા-કચ્છ. તા.૬/૭/૨૦૧૧ — બી.બી.જાડેજા

અમારી મારફતે : — તે કોલી સીધીક નાથાના

બી.બી.જાડેજા (એડવોકેટ એન્ડ નોટરી) — એડવોકેટ

એલ.એલ.કટુઆ, કે.એ.ગોસ્વામી (એડવોકેટ્સ)

નલીયા-કચ્છ. મો.૯૪૨૭૨ ૪૯૮૯૯

જાહેર નોટીસનો જવાબ તથા ચેતવણી
ગામઃ કુકમા, તા. ભુજ. ગામતળની જમીન સબંધે

આથી સર્વેને આ જાહેર નોટીસના જવાબથી ચેતવણી આપી વિદિત કરવામાં આવે છે કે, કચ્છમિત્ર દૈનિક તા. ૩૦/૦૬/૨૦૧૧ વાળાના પાના નં.૧ પર ગામ- કુકમા તાલુકો ભુજના ગામતળ પૈકી ઔદ્યોગિક હેતુ માટેની જમીન જે નોંધ નં. ૪૩૦ થી નોંધાયેલ છે. તે જમીન શ્રી યજ્ઞેશ કરશનદાસ વેલાણી, રહેવાસી ભુજ-કચ્છ વાળા સાથે વેંચાણ લેવા સબંધે શ્રી હરેશભાઇ એન. ફુફલ એડવોકેટશ્રી ભુજ વાલા તરફથી તેમના અસીલ વતી પ્રસિધ્ધ કરાવેલ જાહેર નોટીસ ખરી અને કાયદેસરની નથી આ જમીનના એકલા માલિક મુળશંકર હંસરાજ ઝાલા કયારે પણ હતા નહી કે છે પણ નહી. આ જમીનમાં અમારો ૧/૪ ભાગ એટલે કે ૨૫ % હિસ્સાના માલિક અને કબ્જેદાર અમો છીએ. આ મિલ્કત સબંધે અમારા તરફથી નામદારશ્રી પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ સાહેબ, ભુજ-કચ્છની કોર્ટમાં સ્પેશીયલ દિવાની દાવા નંબર ૩/૨૦૦૮ વાલો આણવામાં આવેલ છે. જે પેન્ડીંગ છે. અને એ રીતે મેટર સબજયુડીશ છે. તેમજ આ મિલ્કત સંબંધે લીસપેન્ડસી અંગેની જાહેર નોટીસનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી જાહેર જનતાને જાણ કરવામાં આવેલ છે. તેમજ શ્રી હરેશભાઇ એન. ફુફલને પણ તા. ૦૨-૦૭-૨૦૧૧ ના રોજ લેખિતમાં વાંધા આપવામાં આવેલ છે. આમ આ મિલ્કત સંબંધે કોઇએ પણ વેંચાણનો કે અન્ય કોઇપણ વ્યહાર કરવો કરાવવો નહી. આ જાહેર ચેતવણી છતાં જો કોઇપણના તરફથી આ મિલ્કત સંબંધે વેંચાણનો કે અન્ય વ્યવહાર કરવામાં આવશે તો તે પ્રથમથી જ ગેરકાયદેસરના ઠરશે અને તે અમોને કે અમારા આ મિલ્કતના હકક-હિતને બંધનકર્તા થશે કે રહેશે નહી અને આવા વ્યવહારો કરનાર તથા તેમાં સીધી કે આડકતરી મદદગારી કરનાર દરેક સામે અમો દિવાની તેમજ ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરીશું. શ્રી યજ્ઞેશ કરશનદાસ વેલાણીને પણ આ સ્પેશ્યલ દિવાની દાવા નંબર ૩/૨૦૦૮ ના કામે પક્ષકાર તરીકે આમેજ કરવા અમારા તરફથી નામદાર કોર્ટ સમક્ષ અરજી રજુ કરવામાં આવતા નામદાર કોર્ટ મજકુર સામે નોટીસ ઇસ્યુ કરવા હુકમ ફરમાવેલ છે. જે સર્વેને વિદિત થાય.

ભુજ-કચ્છ તા.૦૬/૦૭/૨૦૧૧ — અરૂણ લીલાધર ઠકકર

અમારી મારફતેઃ-

જગદીશ આર. મહેતા
આનંદ જે. મહેતા, તૃષ્ણા જે. પંચોલી-એડવોકેટસ
''મંગળા ભવન'' પંચમુખા હનુમાન શેરી, ભુજ-કચ્છ
ફોન નં. ૨૨૩૨૦૮

મેઘપર (ખાવડા)માં પંચવટી યોજના તળે તૈયાર થયેલા બાગનું રિબિન કાપી લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન જાટ તથા અન્ય અગ્રણીઓ તસવીરમાં નજરે પડે છે. (કચ્છમિત્ર ફોટો)

સરપંચ સક્રિય હોય તો સાંસદની જરૂર ન પડે

મેઘપર (ખાવડા)માં દોઢ લાખના ખર્ચે તૈયાર થયેલા બાગનું લોકાર્પણ કરાયું

ખાવડા, તા. ૬ : મેઘપર (ખાવડા) ખાતે ભુજ તા.પં.ના અનુદાન અને ખાવડા ગ્રા.પં.ના લોકફાળાથી રૂા. દોઢ લાખના ખર્ચે પંચવટી યોજના તળે નિર્માણ થયેલા બાગ (વાટીકા)ના લોકાર્પણ પ્રસંગે જિલ્લા સાંસદ પૂનમબેન જાટે ગામનો સરપંચ સક્રિય હોય તો સાંસદની જરૂર ન પડે તેમ જણાવી અમેરિકાના પ્રવાસે વિમાનમાં કચ્છી જોડિયાપાવાની માહિતી અપાઇ હોવાનું કહ્યું હતું. આ વિસ્તારની હાથવણાટની શાલો અમેરિકાના સેનેટરોને આપી ત્યારે કળા-કારીગરીથી મુગ્ધ બન્યા હતા. સાંસદની ગ્રાન્ટ પાંચ કરોડ થઇ હોઇ ગરીબ સમાજમાં વધુ ગ્રાન્ટ ફાળવવાની ઇચ્છા વ્યક્ત કરી કચ્છની નારીશકિતને બિરદાવી હતી. દશ વર્ષમાં કચ્છમાં દર ૧૦૦૦ પુરુષો સામે ૯૧૧ મહિલાનું પ્રમાણ હોઇ આ સંખ્યા વધારવા જણાવ્યું હતું.

ખાવડા ગ્રા.પં.ના સરપંચ પ્રાણલાલ ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્ય અને એ.પી.એમ.સી.ના ચેરમેન હઠુભા જાડેજાએ ૩૧ ગામોમાં બીએડીપીમાં ગ્રાન્ટ ફાળવાઇ હોવાનું કહ્યુ હતું. ભીરંડિયારા સરપંચ કમાલશા સૈયદે બન્ની-પચ્છમમાં સાડાસાત કરોડ જેટલી રકમ ફાળવાઇ હોવાનું કહ્યું હતું. જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ડાયરેક્ટર મનુભા જાડેજા, ભારતનગર મહેશ્વરી સમાજના પ્રમુખ વેલજીભાઇ જાટ ઉપસ્થિત રહ્યા હતા. બગીચાના લોકાર્પણ બાદ શાળાના બાળકોએ સ્વાગત ગીત, કાનાભાઇ રાણાભાઇ (ધ્રોબાણા)એ જોડિયા પાવાના સૂર રેલાવ્યા હતા.

સુમરાસરના સરપંચ આમદભાઇ શેખ, ગોરેવાલી સરપંચ કરમણભાઇ, દીનારા, ઝુરા વિ. ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દલિત અગ્રણી દુદાભાઇએ કચ્છી ભરતકામવાળી ગોદડી સાંસદને આપી સ્વાગત કર્યુ હતું. ખાવડા લોહાણા સમાજના પ્રમુખ હીરાલાલ રાજદેએ ઘડુલી-સાંતલપુર માર્ગ માટે સાંસદના યોગદાનને બિરદાવી પ્રવાસીઓને ભીરંડિયારામાં જ મંજૂરી મળે તે માટેના પ્રયાસોની સરાહના કરી આભારદર્શન કર્યું હતું. સાંસદ દ્વારા પ્રમુખસ્વામી નગર-ખાવડા, રૂા. પાંચ લાખ, મેઘપર બે લાખ, કકર (ખાવડા) બે લાખ, જામકુનરિયા બે લાખ, ખારી ગામે રૂા. બે લાખ, પ્રણવનગર કોલીવાસ ખાવડા બે લાખ, કોમ્યુનિટી હોલ માટે ફાળવાયા હતા, જ્યારે પચાસ હજાર બગીચામાં વિજળીકરણ માટે ફાળવાયા હતા.

કાળાડુંગર દત્તમંદિરે પ્રસાદ બાદ જામકુનરિયા, તુગામાં લોકસંપર્ક કરી લોરિયામાં ભાનુશાળી કોમ્યુનિટી હોલ માટે બે લાખ, મહેશ્વરી સમાજના સ્નાનઘાટ માટે એક લાખ ગ્રાન્ટ ફાળવી હતી. ઢોરીમાં મુસ્લિમ કોમ્યુનિટી હોલ માટે બે લાખ ફાળવ્યા હતા. પ્રવાસમાં હઠુભા, મનુભા, હીરાલાલ વિ. જોડાયા હતા.

ગામડું બોલે છે

લલિયાણાને જળ અને વીજળીની સમસ્યા

સામખિયાળી, તા. ૬ : ભચાઉ તાલુકાના લલિયાણા ગામે છેલ્લા દશ દિવસથી પાણી ન મળતું હોવાને કારણે ગ્રામજનોને ગંદા અને ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ કરવો પડતો હોવાનું ગામના સરપંચ કિરીટસિંહ જશુભા જાડેજાએ જણાવ્યું હતું.

ગંદા અને ક્ષારયુક્ત પાણીથી ગમે ત્યારે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ આ આગેવાને વ્યક્ત કરી હતી.

તાત્કાલિક પાણીપુરવઠા તંત્ર દ્વારા નર્મદાનું પાણી આપવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી પણ શ્રી જાડેજાએ આપી હતી.

સામખિયાળી ૧૩૨ કે.વી.માંથી વીજપુરવઠો મેળવતા ત્રણ હજારની જનસંખ્યાવાળા આ ગામે વીજળીના રીસામણા કાયમી હોય છે. ૨૪ કલાકમાંથી દસેક વખત વીજપુરવઠો કપાઇ જાય છે જેનાં કારણે બાળકો તથા વૃદ્ધોને વ્યાપક પ્રમાણમાં તકલીફનો સામનો કરવો પડે છે.

ગુજરાત વિદ્યુત બોર્ડની સામખિયાળી સ્થિત કચેરીએ આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઇ અર્થ સર્યો નથી.

તાત્કાલિક રાહે વીજપુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આ ગ્રામ્ય આગેવાને આપી હતી.

મોખા ફીડરના સાત ગામોમાં વીજળીના વ્યાપક ધાંધિયા : ગ્રામજનો હેરાન

મુંદરા તાલુકામાં મોખા ફીડર હેઠળના મોખા ઉપરાંત સાડાઉ, મંગરા, ભોરારા, ગુંદાલા, ટોડા, વિરાણિયા વિ. સાત ગામો છેલ્લા આઠેક દિવસથી વીજધાંધિયાને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.

ગુંદાલા સરપંચ રમેશભાઇ દેવરિયા તથા ટોડા ગ્રા. પં.ના માજી સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાએ નાયબ ઇજનેર મુંદરાને કરેલી ફરિયાદ મુજબ ઘણાં સમયથી ગુંદાલાપંથકમાં વીજ ધાંધિયા વ્યાપક બન્યા છે. તેમાં છેલ્લા સાત દિવસથી તો ગ્રામજનો ગરમી- બફારાને કારણે વીજળી વગર ખરા બપોરે કે રાત્રે ઊંઘી શકતા પણ નથી. મહિલા-બાળકો-વૃદ્ધો વિ.ને જાણે વીજતંત્રે બાનમાં લીધા છે.

બીજીતરફ ગ્રામજનોએ જણાવ્યું હતું કે, લોકોની વીજ સેવામાં કાપ મુકાય છે. જ્યારે કંપનીઓ- ઉદ્યોગોને સતત વીજ પુરવઠો અપાય છે. લોકોના ભોગે ઉદ્યોગોને વીજ પુરવઠો પૂરો પડાય તે યોગ્ય નથી ઉચ્ચ અધિકારીઓ ઘટતું કરે તેવી લોકોની માંગ છે.

પ્રા. શાળાઓમાં લાખો રૂપિયાનો વેડફાટ

એસ્પાયર એવોર્ડની રકમ વિજ્ઞાનને બદલે 'અન્ય' જગ્યાએ વપરાતી હોવાનો આક્ષેપ

ભુજ, તા. ૬ : પ્રાથમિક શિક્ષણના સ્તરેથી જ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષય તરફ અભિરુચિ વધે તેમજ વિજ્ઞાનના વિષયને લગતી સાધનસામગ્રી શાળા દ્વારા આસાનીથી ખરીદી શકાય તે હેતુથી સરકાર દ્વારા છાત્રોને અપાતા એસ્પાયર એવોર્ડનો પૂરતો અમલ ન થતો હોવાની અને જ્યાં થાય છે ત્યાં ખોટા વાઉચર દ્વારા નાણાંનો અન્ય હેતુ માટે ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ ઊઠ્યો છે. જો કે, શિક્ષણ તંત્રએ આવું થવાની શક્યતા સ્પષ્ટપણે નકારી કાઢીને જો આવી ફરિયાદ આવશે તો તપાસની હૈયાધારણ આપી હતી.

ખુદ કેટલાક નિષ્ઠાવાન શિક્ષકોએ આ ડિંડવણાનો પર્દાફાશ કરતાં આક્ષેપ કર્યો હતો કે, મોટાભાગની સરકારી શાળાઓમાં નાણાંનો દુર્વ્યય જોઇને દુઃખ થાય છે. શાળાના તેજસ્વી વિદ્યાર્થીની માર્કશીટના આધારે દરખાસ્ત પરથી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના માધ્યમથી નવી દિલ્હીમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગમાં તે મૂકવામાં આવે છે, જે મંજૂર થયા બાદ વિદ્યાર્થીના નામનો રૂા. ૫૦૦૦નો ચેક આવે છે. જે એસ્પાયર એવોર્ડની રકમ માત્ર વિજ્ઞાનના હેતુથી તેના વિકાસ, સાધનો અને વિદ્યાર્થીઓ માટે જ ખર્ચવાની હોય છે, પરંતુ ખોટા વાઉચરો બનાવી ખર્ચી નાખવામાં આવે છે. કોઇ તપાસ કરવાવાળું નથી. વધુમાં આ સૂત્રોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ કેન્દ્ર સરકારની યોજના છે અને જો વધુ અમલ થશે તો ગુજરાતને બદલે કેન્દ્રનું સારું લાગી જાય તે રાજકીય રીતે પોષાય તેમ ન હોવાથી હવે આ યોજનાનો અમલ ધીરો કરી દેવાની પણ ઉપરથી ખાનગી સૂચના આવી છે.

દરમ્યાન, આ સંબંધે ડાયેટના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે જગ્યા હાલ ખાલી હોવાનું જણાવાયું હતું. જો કે, સત્તાવાર સૂત્રોએ આપેલી આંકડાકીય માહિતી મુજબ ગત નાણાકીય વર્ષ દરમ્યાન ૫૪ લાખ રૂા. રકમ શાળાઓને અપાઇ હતી, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૧૦ શાળાઓને આ રકમ પાછળ રૂા. ૪૦,૫૦,૦૦૦/- ફાળવાયા છે એટલે ઓછા અમલની વાતમાં તથ્ય ન હોવાનો દાવો કરાયો હતો.

બીજી તરફ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છાયાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, હેતુ સિવાય શાળાઓ રકમ વાપરે એ શક્ય જ નથી, કારણ કે તેની કડક જોગવાઇઓ હોય છે. આમ છતાં ફરિયાદ આવશે તો ચોક્કસ તપાસ થશે.

એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીના વારસોને પેન્શન ચૂકવવાનો ફોરમનો હુકમ

ભુજ, તા. ૬ : એસ.ટી. નિગમના ભુજ વિભાગમાં કન્ડકટર તરીકે નોકરી કરતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા મોહમદ કરીમભાઇ મલેકના વારસોને પેન્શનની રકમ ચૂકવવા કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો હતો.

આ માટે શ્રી મલેકના પત્નીએ ફોરમમાં અરજી કરી હતી. ફોરમે આ માટે એસ.ટી. નિગમ અને મદદનીશ પી.એફ. કમિશનરને જવાબદાર ઠેરવી અરજદારને સાત વર્ષનું જમા પેન્શન એકીસાથે ત્રણ મહિનામાં ચૂકવવા હુકમ કર્યો હતો.

અરજદારની ફરિયાદ ફગાવાઇ

ગાંધીધામના પરિવહનકાર જગદીશસિંહ જાડેજાએ હપ્તાની તકરાર બાબતે ફાઇનાન્સ કંપની વિરુદ્ધ કરેલી અલગ અલગ પાંચ ફરિયાદ ફોરમે કાઢી નાખી ગ્રાહક વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. આ બન્ને કેસમાં અરજદારના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા અને દિદાર એમ. સવાણી રહ્યા હતા.

નખત્રાણામાં સિનિયર ડિવિઝન ન્યાયાલયની માગણી કરાઇ

નખત્રાણા, તા ૬ : પશ્ચિમ કચ્છના મુખ્ય મથક સમા આ ગામે સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ કરવા બાર એસોસિયેશનના પ્રમુખે માંગ કરી છે. બાર એસો.ના પ્રમુખ જે. એસ. ગોરે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આ અંગે માંગ કરતાં જણાવ્યું છે કે, જિલ્લાના ત્રીજા ભાગનો ભૂ ભાગ અને પ્રાંત અધિકારીની કચેરી ધરાવતા આ વિસ્તારમાં ઉદ્યોગોની સંખ્યા વધવા સહિતના કારણે આ વિસ્તારના કેન્દ્રબિંદુ સમાન નખત્રાણા ખાતે સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ થાય તો અજરદારોને રાહત મળી શકે તેમ છે.

ગોધરા ખાતે રાજપૂત જ્ઞાતિ સોશ્યલ ગ્રુપની સભામાં જટુભાઇ ડુડિયા અને નયન ગોયલનું સન્માન કરતા કાન્તિભાઇ ડુડિયા તથા નરેન્દ્ર વાઘેલા.

રાજપૂત જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ દ્વારા ગોધરા ખાતે સભા મળી : સન્માન કરાયું

ભુજ, તા. ૬ : અહીંના અખિલ કચ્છ રાજપૂત જ્ઞાતિ સોશ્યલ ગ્રુપની માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપના સર્વ સભ્યો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં સ્વ. કલ્પનાબેન એસ. બક્ષીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમની સ્મૃતિમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. રાજપૂત જ્ઞાતિના અગ્રણી સેવાભાવી જટુભાઇ ડુડિયાનું શાલ ઓઢાડી કાન્તિભાઇ ડુડીયા તેમજ સુરેશભાઇ ચૌહાણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર, રાજકોટથી આવેલા નરેશ બક્ષી, દિનેશભાઇ ગોહિલ, પિનાકિનને દેવેન્દ્રભાઇ ચૌહાણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

સોશ્યલ ગ્રુપના ઉપપ્રમુખ નયનભાઇ ગોહિલ કે જેઓ મોટર સાઇકલ દ્વારા ૫૫૦૦ કિ.મી.ના સળંગ પ્રવાસ લેહ-લદ્દાખ કરી આવ્યા તેમનું વિશિષ્ટ સન્માન નરેન્દ્ર વાઘેલા, શામજીભાઇ રાઠોડ, દાનસંગભાઇ મોખા દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી ટૂંક સમયમાં સોશ્યલ ગ્રુપ દ્વારા રિમાન્ડ હોમ, અંધશાળા, મહિલા આશ્રમમાં ફળ, સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવશે. નરેન્દ્ર વાઘેલા સહયોગી બન્યા હતા.

મુંદરાના વિદ્યુત પ્રશ્નો માટે ધારાસભ્ય દ્વારા ગાંધીનગર દરખાસ્ત મુકાઇ

ભાજપ પ્રતિનિધિ મંડળની તંત્રને રજૂઆત બાદ લેવાયેલું પગલું

મુંદરા, તા. ૬ : આ નગર તેમજ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વીજળીનો પ્રશ્ન વિકટ બનતા અહીંના ધારાસભ્ય રમેશ મહેશ્વરી સાથે મુંદરા ભાજપના પ્રતિનિધિમંડળએ મુંદરા વીજતંત્રની કચેરીએ જઇ નાયબ ઇજનેર શ્રી ચૌહાણ અને તેમની ટીમ સાથે બેઠક યોજી હતી. મુંદરા-૧ પીજીવીસીએલ સબ ડિવિઝનના ભાગલા (બાય ફરગેશન)ની દરખાસ્ત તૈયારી કરી રાજ્યના પેટ્રો કેમિકલ્સ અને ઊર્જામંત્રીને આ પછી મોકલાઇ હતી.

ધારાસભ્યએ દરખાસ્તમાં જણાવ્યું હતું કે મુંદરા વિધાનસભા મત વિસ્તારના આવેલ પીજીવીસીએલ મુંદરા-૧ સબ ડિવિઝન કચેરી હેઠળ ૩૬ ગામડાં છે. એ ગામડાઓને વીજપુરવઠો પૂરો પાડયો માટે ૧૮ ફીડરો તથા ૩ સબ સ્ટેશનો આવેલા છે. જેની એચ.ટી. લાઇનની લંબાઇ ૫૫૦ કિ.મી. છે.

મુંદરા ઔદ્યોગિક વિકાસના કારણે ગુજરાતનું મહત્ત્વનું મથક છે. આ કચેરી હેઠળ ૨૦ એચ.ટી. તથા જોડાણો આવેલા છે. કાલે મુંદરા સબ ડિવિઝનની એચ.ટી. ગ્રાહકો સાથે માસિક આવક ૮૧૦ લાખ રૂપિયા છે અને ફકત ૩૮ કર્મચારીઓ વચ્ચે એક જ ગાડી અપાઇ છે. જેના કારણે મહત્ત્વની કામગીરીના વીજપુરવઠાનું સાતત્ય, લીસીસ ઘટાડવા આવક વધારવા તથા નવા વીજજોડાણો આપવાની કામગીરીમાં વિલંબ થાય છે.

આ બધી કામગીરીને પહોંચી વળવા માટે બીજા પેટા વિભાગીય કચેરીની જરૂરત છે. જે માટે પીજીવીસીએલ મુંદરા-૧ સબ ડિવિઝન કચેરીને દરખાસ્ત મોકલવા જણાવેલું છે. ધારાસભ્ય સાથે મુંદરા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભુજની મુસ્લિમ એજ્યુકેશન હાઇસ્કૂલમાં ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી તરફથી ગાણિતિક કોયડાનો કાર્યક્રમ યોજાયો હતો. સોસાયટીના અક્ષયભાઇ મલ્હોત્રાએ ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ સમક્ષ ગણિતના તથા વ્યવહારુ કોયડાઓ રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય જે. આઇ. ટાંકે મહેમાનોનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન મ. શિ. આર. એમ. મેમણે કર્યું હતું.

પાવરનામું રદ કર્યા અંગેની જાહેર નોટિસ

આથી હું નીચે સહી કરનાર શ્રી નીલેશ જેરામભાઇ ભાનુશાલી, રહેવાસી : ગાંધીધામ-કચ્છવાળા જાહેર કરું છું કે, શ્રી ગુજરાત રાજ્યના, કચ્છ જિલ્લાના, મુંદરા તાલુકાના, ગામ બારોઇ મધ્યે આવેલ રેવન્યૂ સર્વે નંબર : ૨૦૧વાળી બિનખેતી થયેલ જમીનમાં પાડવામાં આવેલા પ્લોટો (સૃષ્ટિ પાર્ક) પૈકી પ્લોટ નંબર ૬૭થી ૭૦ તથા ૮૪થી ૯૦ જેના સબ પ્લોટો (વીસ)૨૦ જે સબપ્લોટો કુલે ક્ષેત્રફળે ચોરસ મીટર : ૧૨૭૧/૪૧ જેના ચોરસવાર : ૧૫૮૦/૮૮વાળા પરત્વે એક જનરલ પાવર ઓફ એટર્ની ભુજ-કચ્છના રહીશ શ્રી યાકુબભાઇ એહમદભાઇ ખત્રીએ મારી (શ્રી નીલેશ જેરામભાઇ ભાનુશાલી)ની તરફેણમાં તારીખ : ૧૭-૧૦-૨૦૦૯ના રોજ ગામ ભુજ-કચ્છ શ્રી પ્રવીણસિંહ આર. વાઢેર (નોટરી સાહેબ) સમક્ષ સિરીયલ નંબર : ૩૨૮૮થી કરી આપેલ છે. જે પાવર ઓફ એટર્ની અમો બંને પક્ષકારોએ પરસ્પર સમજુતીથી લેખિત લખાણથી રદ કરેલ છે. તેમજ આ પાવરનામાનો મેં પાવર સ્વીકારનારએ આજ દિન સુધી કોઇ ઉપયોગ કરેલ નથી તેમજ આ જાહેર નોટિસથી મારી તરફેણમાં કરેલ પાવરનામું હું રદ જાહેર કરું છું. જેની સર્વે એ સ્પષ્ટ નોંધ લેવી. તા. ૫-૭-૧૧

શ્રી નીલેશ જેરામભાઇ ભાનુશાલી
સાક્ષી : રશેષ મહેતા

અમારી મારફતે :
B. N. BHATT, ADVOCATE
BHACHAU-KUTCH.
M. 98250 91243

જાહેર નોટિસ

મોજે નાગોર, તા. ભુજ – કચ્છની સીમના રે.સર્વે નં. ૭૩/૧ વાળી ખેતીની જમીન જે ભરપે માપે હે. ૨-૧૩-૦૦ આરે બરાબર એ. ૫-૧૧ ગુંઠાના માલિક અને કબ્જેદારશ્રી બળવંતરાય ખનુભા જાડેજા રહે. રામણીયા, તા. મુન્દ્રા વાળા પાસેથી મારા અસીલે અઘાટ વેચાણ લેવા સાટા કરાર કરેલ છે. સદરહુ જમીન અન્વયે કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક-હિસ્સો, ચાર્જ, બોજો, ભાગ, લિયન, ગીરો, મોર્ગેજ વિ. હોય તો તેમણે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિવસ – ૭ (સાત)માં નીચે જણાવેલ સરનામે આધાર પુરાવા સહિત રજુઆત કરવી. જો કોઇના વર-વાંધા કે રજુઆત નહીં આવે તો મારા અસીલ સદરહુ ખેતીની જમીનનો અઘાટનો રજીસ્ટર્ડ દસ્તાવેજ બનાવી અને સ્થાનિકે કબ્જો સંભાળી લેશે અને તેઓ પ્રમાણિક ખરીદનાર ગણાશે જેની તમામે નોંધ લેવી. તા. ૬/૭/૧૧

જીતેન્દ્ર મુલચંદ ઝવેરી
તે ખરીદનારના એડવોકેટ

મારી મારફતેઃ
જીતેન્દ્ર મુલચંદ ઝવેરી એડવોકેટ
ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ – કચ્છ.
મોઃ ૯૮૨૫૨ ૫૭૯૧૬

સાટાકરાર રદ કર્યાની અંગેની જાહેર નોટીસ
મોજે ચાંદ્રાણી, તા. અંજારના રે.સર્વે નં. ૧૨૫/પૈકી ૩

આથી હું નીચે સહી કરનાર ગોવિંદ રતા ગોયલ, રહે. રાપર (ખોખરા) તા. અંજાર-કચ્છ વાળા સર્વે લાગતા વળગતાઓ તથા જાહેર જનતાને આ નોટીસથી જાણ કરૂ છું કે, મોજે ચાંદ્રાણી, તા. અંજાર-કચ્છના રે.સર્વે નં. ૧૨૫/પૈકી ૩, જમીન હેકટર ૨-૮૩-૩૦ પ્રતિઆરે વાળી સબંધે મામદ કાસુ કટીયા, રહે. ખીરસરા, તા. અંજાર-કચ્છ વાળા સાથે તા. ૧૫/૩/૨૦૧૧ ના રોજ સાટાકરાર કરવામાં આવેલ. જે સાટાકરાર મુજબ અવેજની બાકી રહેતી રકમ ત્રણ (૩) માસમાં ચુકવવાની હતી. જે મુદત તા. ૧૫/૬/૨૦૧૧ ના રોજ પુરી થયેલ છે. તેમ છતાં આજદિન સુધી મામદ કાસુ કટીયાએ અવેજની બાકીની રકમ ચુકવેલ નથી અને સાટાકરારનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલ છે. જેથી આ સાટાકરાર રદ કરવામાં આવે છે. અને સુથીની રકમ ફોરફીટ કરવામાં આવે છે. તે રીતે હવે પછી આ મિલ્કતમાં મામદ કાસુ કટીયાના કોઇ જ હકક કે અધિકાર રહેતા નથી. જેની સર્વેએ નોંધ લેવી.

અંજાર-કચ્છ તા. ૦૬/૦૭/૨૦૧૧ — L.H.T. OF ગોવિંદરતા ગોયલ

અમારી મારફતેઃ-

દિનેશ જે. રાવલ,
શૈલેષ સી. હર્ષ,સામતભાઈ ડી. ગઢવી
હાર્દિક એચ. રાવલ, હરેશ ડી. ચાવડા-એડવોકેટસ
તુરીયા વાડ, અંજાર-કચ્છ, ફોન નં. (ઓ) ૨૪૬૫૪૪

સુધારો

તા. ૬-૭-૧૧ના કચ્છમિત્ર લીગલ ડેસ્કમાં છપાયેલ કે. સી. ગણાત્રા વકીલ મારફતે ગામ ગુંદાલા, તા. મુંદરા કચ્છના ખેતર સર્વે નં. ૪૯૪માં નોટિસ આપનાર તરીકે જેઠાલાલ મૂળજી દેઢિયાને બદલે જેઠાલાલ કુંવરજી દેઢિયા સુધારીને વાંચવું.

જાહેર નોટીસ-ભુજ

કચ્છ જીલ્લાના શહેર ભુજ મધ્યે ભીડ બજાર, કંઢા ફરીયામાં આવેલ દુકાન ભુજ સીટી સર્વે વોર્ડ નાં.૩, સીટી સર્વે નાં.૧૭૨, ભુજ નગર રચના યોજના નાં.૩, અંતિમ ખંડ નાં.૧૬૨ પૈકી ૪૨.૦૦ ચો.મી.થી નોંધાયેલ દુકાન અને તે ઉપર આવેલ રૂમ-૧ તેના માલિક શ્રીમતી મૃદુલાબેન શંભુલાલ પોપટ, રહે. ભુજ વાળા પાસેથી ખાલી કબ્જાથી અઘાટ વેચાણ લેવા અમારા ગ્રાહકે સોદો નક્કી કરેલ છે.

સદર મિલ્કત ઉપર અન્ય કોઇનો પણ હક્ક, ભાગ, હિતસંબંધ, લેણું, લેખું, ભાર, બોજો, લીયન, ચાર્જ વિ. હોય તો દિવસ-૫ (પાંચ) માં નીચે લખ્યા સરનામે દસ્તાવેજી આધાર પુરાવા સહિત લેખીતમાં જાણ કરવી. મુદત વિત્યા બાદ પાકો દસ્તાવેજ કરાવી લેવામાં આવશે.

તા.૭/૭/૨૦૧૧

નરેન્દ્ર શિવજી ઠકકર
૧૨, કે.ડી.ચેમ્બર્સ,
જૂની મામલતદાર ઓફિસ પાસે,
ભુજ-કચ્છ. ફોન : ૨૫૨૭૨૨

Digitially Archived by: www.realpatidar.com/library

કૃષિ ચીજોના વાયદામાં બેતરફી વધઘટ

મુંબઇ, તા.૬ : એમસીએક્સે ૫ જુલાઈના રોજ પાકેલા સોનું-મિની વાયદાના પાકતી તારીખના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂા. ૨૧,૬૨૩ અને ચાંદીના કિલોદીઠ રૂા. ૫૦,૭૦૬ નિર્ધારિત કર્યા હતા.

છેલ્લા બે દિવસથી એમસીએક્સના પ્રથમ સત્રના વોલ્યુમમાં સતત ઊંચી સપાટી નોંધાઈ રહી છે. આજે ૪,૨૮,૯૨૭ સોદામાં રૂા. ૨૭,૦૦૮.૬૦ કરોડના વેપાર થયા હતા, જે ગઈકાલે રૂા. ૨૦,૪૮૦.૫૬ કરોડના નોંધાયા હતા. આજના કામકાજમાં સોના-ચાંદીનું વોલ્યુમ પણ રૂા. ૧૩,૧૪૨.૪૧ કરોડથી વધી રૂા. ૧૭,૦૦૧.૪૧ કરોડનું થયું હતું.

આજે સોનાના વેપારમાં સાધારણ વૃદ્ધિ પણ હતી. ચાંદીના વેપારમાં જંગી ઉછાળો આવ્યો હતો. સોનાનાં બધાં વાયદામાં ધીમો સુધારો હતો, જ્યારે ચાંદીનાં નજીકના વાયદા નરમ હતા. સપ્ટેમ્બર લાંબી મુદતના વાયદામાં તેજી હતી. હકીકતમાં તો આજથી શરૂ થયેલો મે-૧૨નો વાયદો આજે રૂા. ૧,૫૬૪ વધી રૂા. ૫૬,૩૨૧ થયો હતો, જે તાજેતરની ચાંદીનાં વાયદાની નવી ઊંચી સપાટી છે.

સોનાનાં વાયદામાં સુધારાની ચાલ જળવાઈ રહી હતી અને ભાવ રૂા. ૭થી રૂા. ૨૨૪ની રેન્જમાં વધ્યા હતા. ચાલુ વાયદામાં ઓગસ્ટ વાયદો રૂા. ૧૨ વધી રૂા. ૨૧,૯૮૦, ઓક્ટોબર રૂા. ૧૬ વધી રૂા. ૨૨,૨૫૭, ડિસેમ્બર રૂા. ૭૭ વધી રૂા. ૨૨,૫૯૬ અને ફેબ્રુઆરી-૧૨ રૂા. ૭૪ વધી રૂા. ૨૨,૯૫૩ રહ્યા હતા. મિની વાયદામાં ઓગસ્ટ રૂા. ૧૦ વધી રૂા. ૨૧,૯૮૫, સપ્ટેમ્બર રૂા. ૭ વધી રૂા. ૨૨,૧૩૬ અને ઓક્ટોબર રૂા. ૨૨૪ વધી રૂા. ૨૨,૨૭૭ રહ્યા હતા. ગિનીના ત્રણેય વાયદા રૂા. ૧૨થી રૂા. ૧૮ જેટલા વધ્યા હતા. જુલાઈ વાયદો રૂા. ૧૨ વધી રૂા. ૧૭,૬૧૪, ઓગસ્ટ રૂા. ૧૬ વધી રૂા. ૧૭,૭૬૬ અને સપ્ટેમ્બર રૂા. ૧૮ વધી રૂા. ૧૭,૯૨૦ રહ્યા હતા. પેટલના વાયદા રૂા. ૧થી રૂા. ૪ જેટલા વધ્યા હતા. સપ્ટેમ્બર વાયદો રૂા. ૪ વધી રૂા. ૨,૨૫૧ રહ્યો હતો.

ચાંદીમાં નજીકના વાયદામાં નરમાઈ હતી, જ્યારે લાંબી મુદતના મે-૨૦૧૨ના વર્ષના વાયદામાં તેજી હતી. આજે રૂા. ૯૩થી રૂા. ૧,૫૬૪ની રેન્જમાં વધઘટ હતી. ચાલુ વાયદામાં સપ્ટેમ્બર રૂા. ૧૫૮ ઘટી રૂા. ૫૩,૦૬૪, ડિસેમ્બર રૂા. ૧૫૭ ઘટી રૂા. ૫૪,૧૩૯, માર્ચ-૧૨ રૂા. ૯૩ ઘટી રૂા. ૫૫,૨૧૧ અને મે રૂા. ૧,૫૬૪ વધી રૂા. ૫૬,૩૨૧ રહ્યા હતા. મિની વાયદામાં ઓગસ્ટ રૂા. ૧૫૮ ઘટી રૂા. ૫૩,૦૮૬, નવેમ્બર રૂા. ૧૪૧ ઘટી રૂા. ૫૪,૧૭૪ અને ફેબ્રુઆરી-૧૨ રૂા. ૧૨૬ ઘટી રૂા. ૫૫,૨૯૬ અને એપ્રિલ-૧૨ રૂા. ૫૭૪ વધી રૂા. ૫૬,૪૯૨ રહ્યા હતા. માઈક્રો વાયદા રૂા. ૧૪૯થી રૂા. ૧૫૬ની રેન્જમાં ઘટ્યા હતા. ઓગસ્ટ વાયદો રૂા. ૧૫૬ ઘટી રૂા. ૫૩,૧૧૦ રહ્યો હતો.

કૃષિ અને અન્ય ચીજોમાં રિફાઈન્ડ સોયાતેલનો જુલાઈ વાયદો રૂા. ૨.૫૦ ઘટી રૂા. ૬૩૬.૫૦ બંધ રહ્યો હતો, જ્યારે ઓગસ્ટ રૂા. ૧.૨૦ અને સપ્ટેમ્બર રૂા. ૪.૬૫ વધીને બંધ થયા હતા. સીપીઓના ચારેય વાયદા રૂા. ૩.૪૦થી રૂા. ૬.૧૦ નરમ રહ્યા હતા. સીપીઓ જુલાઈ વાયદો રૂા. ૬.૧૦ ઘટી રૂા. ૪૬૮.૫૦ બંધ રહ્યો હતો. ચણા-દિલ્હીનો ઓગસ્ટ વાયદો રૂા. ૧ ઢીલો રહી બંધમાં રૂા. ૨,૭૨૪ના ભાવ રહ્યા હતા. એલચીમાં મિશ્ર વધઘટ હતી. એલચી જુલાઈ વાયદો રૂા. ૭.૫૦ અને ઓગસ્ટ રૂા. ૩.૯૦ ઘટવા સામે સપ્ટેમ્બર ૪૦ પૈસા અને ઓક્ટોબર રૂા. ૧.૨૦ વધીને બંધ રહ્યા હતા. ધાણાનો સપ્ટેમ્બર વાયદો રૂા. ૯૭ ઘટી બંધમાં રૂા. ૩,૯૪૯ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરનો જુલાઈ વાયદો રૂા. ૫ અને ઓગસ્ટ રૂા. ૮ ઘટ્યા હતા, જ્યારે સપ્ટેમ્બર વાયદો રૂા. ૯ના સુધારા સાથે બંધમાં રૂા. ૨,૭૯૯ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદાઓમાં જુલાઈ વાયદો રૂા. ૩ વધી રૂા. ૫૦૩.૩૦ થયો હતો, જ્યારે ઓગસ્ટ ૨૦ પૈસા અને સપ્ટેમ્બર ૬૦ પૈસા ઢીલા હતા. આ સામે બટેટા તારકેશ્વરના ત્રણેય વાયદા ૩૦ પૈસાથી રૂા. ૨.૩૦ નરમ રહ્યા હતા. બટેટા-આગ્રા જુલાઈ વાયદો રૂા. ૨.૩૦ ઘટી બંધમાં રૂા. ૪૭૯.૯૦ રહ્યો હતો. બદામનો સપ્ટેમ્બર વાયદો રૂા. ૧૧.૫૦ ઘટી રૂા. ૩૭૦.૫૦ બંધ રહ્યો હતો.

વ્યાપાર વર્તમાન

૦૬-૭-૨૦૧૧

ભુજ સોના-ચાંદી બજાર (સાંજે ૬ વાગ્યા પછી)

ચાંદી ચોરસા આર. આર.	૫૨૯૦૦ થી ૫૨૯૫૦
સોનું સ્ટાન્ડર્ડ	૨૨૨૬૦ થી ૨૨૨૮૦
સોનું દાગીના ૨૧ કેરેટ	૧૯૭૧૫
સોનું દાગીના ૨૨ કેરેટ	૨૦૬૩૦
સોનું હોલમાર્ક	૨૧૦૮૦
સોનું તેજાબી	૨૨૨૪૦ થી ૨૨૨૬૦
કેડબરી ૧૦૦ ગ્રામ	૨૨૨૮૦૦
૧૦૦ ગ્રામ બિસ્કિટ	૨૨૩૬૦૦

ભુજ સ્થાનિક બજાર (૧૦૦ કિ.)

ઘઉં નવા	૧૧૫૦ થી ૨૦૦૦
બાજરી	૧૦૮૦ થી ૧૨૦૦
ચોખાઆઇ.આર.	૧૫૫૦ થી ૧૬૫૦
ચોખાબેગમી	૧૯૦૦ થી ૨૦૦૦
ચોખા જીરાસર	૨૦૦૦ થી ૩૪૦૦
મગ	૫૧૦૦ થી ૫૫૦૦
મગફાડા	૫૨૦૦ થી ૫૫૦૦
મોગરદાળ	૫૯૦૦ થી ૬૧૦૦
તુવેરદાળ	૫૪૦૦ થી ૫૭૦૦
તુવેરદાળ રેંટિયો	૬૬૦૦ થી ૬૯૦૦
ચણાદાળ	૩૫૦૦ થી ૩૭૦૦
અડદદાળ	૫૮૦૦ થી ૬૪૦૦
ખાંડ કટ્ટા	૨૯૪૦ થી ૨૯૭૦
ખાંડ-એસ.	૨૯૪૦ થી ૨૯૬૦
ખાંડ-એમ.	૨૯૭૦ થી ૩૦૦૦
મહારાષ્ટ્ર	૩૦૨૫

ટીનના ભાવ / વેટ સહિત

સીંગતેલ ૧૫ લિટર	૧૫૫૦ થી ૧૫૭૦
સીંગતેલ ૧૫ કે.જી. નેટ	૧૬૦૦ થી ૧૬૬૦
વેજિટેબલ ૧૫ કે.	૧૦૨૦ થી ૧૦૭૦
કપાસિયા તેલ	૧૦૯૦ થી ૧૧૯૦
કપાસિયા તેલ ૧૫ લિટર	૧૧૩૦ થી ૧૧૩૫
કોપરેલ તેલ ૧૫ કિલો	૧૬૮૦ થી ૧૭૦૦
સોયાબીન	૧૦૫૦ થી ૧૦૫૫
પામોલીન	૮૮૦ થી ૮૮૨
સૂરજમુખી	૧૨૫૦ થી ૧૩૩૦

૨૦ કિલોના ભાવ

કોલ્હાપુર ગોળ	૬૫૦ થી ૭૩૦
યુ.પી. ભીલી	૫૭૫ થી ૫૮૫
મંડયા	૬૩૦ થી ૬૪૦

એક ગૂણીના ભાવ

ભૂસો ઝીણો	૪૩૦ થી ૪૮૦
બેસન ૫૦ કિલો	૧૮૪૦ થી ૨૨૪૦
કપા. ખોળ નવા	૬૧૦ થી ૬૨૦

વેટ સહિત

કપાસિયા જાડા	૭૫૦

ભુજ માર્કેટ યાર્ડ / ૧૦૦ કિલોના ભાવ

મઠ	૧૫૦૦ થી ૨૨૦૦
ગોવાર	૨૪૦૦ થી ૩૪૨૬
મગ	૧૭૫૦ થી ૪૪૦૦

૪૦ કિલોના ભાવ

એરંડા	૧૭૫૪ થી ૧૭૬૮
ઇસબગુલ	૧૫૫૦ થી ૨૧૦૦
તલી	૧૮૫૨ થી ૨૦૬૭
જીરૂં	૩૮૪૦ થી ૫૨૦૦
રાયડો	૯૦૦ થી ૯૫૦

મુંદરા માર્કેટયાર્ડ / ૧૦૦ કિલોના ભાવ

મગ	૨૪૫૦ થી ૪૩૬૮
ગોવાર	૨૮૫૦ થી ૩૩૨૧

૪૦ કિલોના ભાવ

એરંડા	૧૭૪૧ થી ૧૭૬૫

અંજાર માર્કેટ યાર્ડ / ૧૦૦ કિલોના ભાવ

ગોવાર	૨૬૦૦ થી ૩૪૦૦
બાજરી	૯૧૦ થી ૧૦૦૦

૪૦ કિલોના ભાવ

એરંડા	૧૭૫૨ થી ૧૭૬૮
તલી	૧૯૦૦ થી ૨૦૫૦
કપાસ	૮૫૦ થી ૧૦૦૦
જીરૂં	૪૦૦૦ થી ૫૨૦૦
મગફળી	૧૫૫૦ થી ૧૬૯૬

રાપર માર્કેટયાર્ડ / ૨૦ કિલોના ભાવ

ગોવાર	૫૫૦ થી ૫૬૦
એરંડા	૮૭૦
જીરૂં	૧૫૫૦ થી ૨૨૦૦

માંડવી માર્કેટયાર્ડ / ૧૦૦ કિલોના ભાવ

ઘઉં	૯૦૦ થી ૯૨૫
બાજરી	૯૦૦ થી ૯૩૫

ભચાઉ માર્કેટ યાર્ડ / ૨૦ કિલોના ભાવ

મગ	૫૮૧ થી ૬૦૦
એરંડા	૮૮૦ થી ૮૮૭
મઠ	૪૬૨ થી ૭૨૫
જીરૂ	૨૫૦૦ થી ૨૫૫૧

ગાંધીધામ એરંડા બિલ્ટી

એરંડા	૯૧૦
દિવેલ	૯૮૫

જામનગર

મગફળી જાડી	૭૨૫ થી ૭૫૦
મગફળી ઉનાળુ	૯૦૦ થી ૯૨૫
સીંગખોળ	૧૫૦૦૦
સીંગતેલ લૂઝ	૯૬૦
સીંગતેલ નવા ટીન	૧૫૧૫
સીંગતેલ તેલિયા	૧૪૭૫

મગફળીમાં ૩ હજાર ગૂણીના કામકાજ હતા.

જૂનાગઢ

મગફળી જાડી નવી	૭૭૫ થી ૭૮૦
ઉનાળુ મગફળી	૯૩૫ થી ૯૪૦
નવી જી-૨૦	૮૦૦ થી ૮૦૫
પિલાણબર	૭૧૦ થી ૭૧૫
સીંગખોળ	૧૫૨૦૦
મગફળીમાં	૪૫૦૦

સીંગખોળમાં ૫૦૦ ગૂણીના કામકાજ હતા.

સુરેન્દ્રનગર

કલ્યાણ ગાંસડી	૧૮૦૦૦
સંકર ગાંસડી	૩૮૦૦૦
કપાસિયા સંકર	૩૫૦
કપાસિયા કલ્યાણ	૩૮૦
કપાસિયા ખોળ	૬૫૦

અમદાવાદ સોનાચાંદી

ચાંદી ચોરસ	૫૨૫૦૦ થી ૫૩૦૦૦
રૂપુ	૫૨૩૦૦ થી ૫૨૮૦૦
સિક્કા જૂના નંગ ૧	૭૫૦ થી ૮૦૦
સિક્કા નવા નંગ ૧	૨૯૦ થી ૩૪૦
સોનું ૯૯.૯	૨૨૨૦૦ થી ૨૨૨૫૦
સોનું ૯૯.૫	૨૨૧૨૫ થી ૨૨૧૫૦
નવા દાગીના	૨૧૩૬૦

ખાંડ

મહારાષ્ટ્રમાં ૧૦ મિલોના ૮૦ હજાર ગુણીના વેંચાણની ધારણા

ખાંડ એસના રૂા. ૨૬૫૦ થી ૨૭૦૦

ખાંડ એમના રૂા. ૨૭૦૦ થી ૨૭૮૦

સોના-ચાંદીમાં વધુ વધારો

ખાંડ-સીંગતેલમાં વણથંભી તેજી એરંડા વાયદામાં કટપીસ ચાલ

ભુજ, તા. ૬ : ખાદ્યતેલ બજારમાં સીંગતેલમાં વણથંભી તેજી ચાલુ રહી હતી, જ્યારે સાઇડ તેલો ટકેલા હતા. વિદેશ ખાદ્યતેલોનાં વાયદા સહિત અહીંના વાયદામાં દરેક જણસીઓના ભાવ ઢીલા હોવા છતાં સીંગતેલમાં બ્રાન્ડવાળા લાવ-લાવ કરીને ભાવ વધારતા રહ્યા છે. મગફળીની આવકો ઘટી ગઇ હોવાથી મોટાભાગની મગફળી દાણામાં જઇ રહી છે જેથી તેની અસર થઇ રહી છે.

સ્થાનિક ખાદ્યતેલ બજારમાં સીંગતેલમાં વધુ રૂા. ૧૦નો વધારો થઇ પંદર લિટરના રૂા. ૧૫૫૦/૧૫૭૦, પંદર કિલોના રૂા. ૧૬૦૦/૧૬૬૦ થયા હતા જ્યારે સાઇડ તેલોમાં સ્થિર વલણ રહી કપાસિયા તેલ પંદર લિટરના રૂા. ૧૦૯૦/૧૧૯૦, પંદર કિલોના રૂા. ૧૧૩૦/૧૧૩૫, સોયાબીન તેલના રૂા. ૧૦૫૦/૧૦૫૫ અને પામોલીન તેલના રૂા. ૮૮૦/૮૮૨ સુધી ભાવ હતા. ધોરાજી-ઉપલેટા લાઇન તેલિયા વધુ વધીને રૂા. ૧૪૯૫/૧૪૯૬ અને લૂઝ તેલના રૂા. ૯૭૦/૯૭૫ થયા હતા. કામકાજ સાતથી આઠ ટેન્કરના હતા. કપાસિયા વોસ રૂા. ૬૩૫/૬૩૮ના મથાળે સ્થિર હતું. કામકાજ ૨૦/૨૫ ટેન્કરના હતા. કંડલા ખાતે હાજર પામોલીન તેલ રૂા. ૫૨૨/૫૨૩ અને સોયાબીન તેલના રૂા. ૬૧૫/૬૧૭ હતા.

મગફળી

કચ્છની ઉનાળું મગફળીનો મોટાભાગનો માલ બજાર થઇ ગયો છે. હવે જે થોડો ઘણો સ્ટોક વણવેચાયેલો પડ્યો છે તે મજબૂત ઘરોમાં છે જેથી વરસાદની અચોક્કસતા વચ્ચે માલ ઉપર પકડ જમાવીને બેઠા હોવાથી હાજરમાં વેંચવાલી નથી. ભાવની ધારણા ૧૪ દોઢુના રૂા. ૧૮૦૦/૧૮૦૫, ૧૪.૫ના રૂા. ૧૮૩૦/૧૮૩૫ અને ૧૫ દોઢુના રૂા. ૧૮૪૦/૧૮૪૫ સુધી હતા. એચ.પી.એસ. દાણાના ભાવ ટકેલા રહી ૮૦/૯૦ના રૂા. ૬૪ હજાર અને ૫૦/૬૦ના રૂા. ૬૮ હજાર હતા. સૌરાષ્ટ્રમાં હાજર મગફળીની ૨૫/૩૦ હજાર ગૂણીની આવકે રાજકોટ યાર્ડમાં ૭૨૦ ક્વીન્ટલની આવકે ઝીણીના રૂા. ૬૬૦/૮૮૧ અને જાડીના રૂા. ૬૭૧/૮૨૭, ગોંડલ ખાતે ૬૫૦૦ ગૂણીની આવકે ઝીણીના રૂા. ૬૪૦/૮૪૬ અને જાડીના રૂા. ૬૧૦/૮૩૬ સુધી હતા. જામનગર મિલ પહોંચ ત્રણ હજાર ગૂણીના વેચાણ જાડીના રૂા. ૭૨૫/૭૫૦ અને ઝીણીના રૂા. ૯૦૦/૯૨૫ અને જૂનાગઢ ખાતે ૪૫૦૦ ગૂણીના વેપાર જી-૨૦ના રૂા. ૮૦૦/૮૦૫, ઝીણીના રૂા. ૯૩૫/૯૪૦, જાડીના રૂા. ૭૭૫/૭૮૦ અને પિલાણ બરના રૂા. ૭૧૦/૭૧૫ સુધી ભાવ હતા.

એરંડા

એરંડાની આવકો ધીમી ગતિએ દબાતી રહી છે. બજારમાં વરસાદની શકયતા વધી રહી છે, જેથી મંદીવાળા સતત વેચી રહ્યા છે, જ્યારે જાણીતા એક જ શિપર્સ માલ કવર કરી રહ્યા છે. જેથ વાયદામાં લોલક જેવી સ્થિતિ રહી છે. દિવેલના ભાવ ઘટતા હોવાથી હાજરમાં ભાવ ઘટતા આજે ગાંધીધામ ખાતે મોટા વેપાર થયા હતા.

ગુજરાતમાં હાજર એરંડાની ૪૦/૪૫ હજારની ગૂણીની આવકે રૂા. ૮૭૫/૯૦૫ અને સૌરાષ્ટ્રમાં ૨૨/૨૩ સો ગૂણીની આવકે રૂા. ૮૪૦/૮૯૦ સુધી ભાવ હતા. ગાંધીધામ ખાતે રૂા. ૯૧૦ના મથાળે ૧૫૦ ગાડીના કામ થયા હતા. રાજકોટ સપ્ટે. રૂા. ૪૬૬૭ ખુલ્લી વધી રૂા. ૪૭૦૪ ઘટી રૂા. ૪૬૧૬ બંધ રૂા. ૪૬૫૭ થયો હતો. હાજરના રૂા. ૪૫૦૨ અને દિવેલના રૂા. ૯૬૦ ભાવ હતા.

ખાંડ

સ્થાનિક ખાંડ બજારમાં ખાંડની ચાર ગાડીની આવક હતી. આગામી મહિનો તહેવારોનો હોવાથી તેની અસરે ઉપાડ વધુ નીકળવાની ધારણ પાછળ અત્યારથી જ માલ પકડવાની ગણતરી રહી છે, જેથી ભાવમાં વધુ રૂા. ૨૦નો વધારો થઇ ખાંડ એસના રૂા. ૨૯૪૦/૨૦૬૦ એમના રૂા. ૨૯૭૦/૩૦૦૦ અને એમ કટ્ટાના રૂા. ૨૯૪૦/૨૯૭૦ સુધી થયા હતા. ગુજરાતમાં મિલોનાં કોઇ વેચાણ ન હતા. જ્યારે હાજર ડી.ઓ. ખાંડ એસના રૂા. ૨૭૬૦/૨૭૮૦ અને એમના રૂા. ૨૮૨૦/૨૮૫૦ સુધી હતા. મહારાષ્ટ્રમાં દસ મિલોના એંસી હજાર ગૂણીના ટેન્ડર હતા. ભાવની ધારણા ખાંડ એસના રૂા. ૨૬૫૦/૨૭૦૦ અને એમના રૂા. ૨૭૦૦/૨૭૮૦ સુધી હતા.

સોના-ચાંદી

સોના-ચાંદી બજારમાં વિદેશ પાછળ ફરી ધીમાં પગલે તેજી આગળ વધીને ચાંદીમાં વધુ રૂા. ૮૦૦ ઉછાળી રૂા. ૫૨૯૫૦ દસ ગ્રામ સોનામાં રૂા. ૧૪૦ વધી રૂા. ૨૨૨૬૦/૨૨૨૮૦ અને સો ગ્રામ બિસ્કિટમાં રૂા. ૧૪૦૦નો વધારો થઇ રૂા. ૨૨૩૬૦૦ થયા હતા. ન્યૂયોર્ક ડોલર મજબૂત હોવા છતાં યુરોપિયન દેશોમાં પોર્ટુગલનું રેટિંગ ઘટાડવાના પગલે ત્યાંની લેવાલી પાછળ સોનું વધુ ઊંચકાયી ૧૫૧૮ અને ચાંદીના ૩૫.૪૫ ડોલરના ભાવ હતા.

રાજકોટનો ટ્રંકકોલ

તેલિયા ટીન જૂના	૧૪૯૫ થી ૧૪૯૬
સીંગતેલલૂઝ ૧૦ કિ.ગ્રા.	૯૭૦ થી ૯૭૫
કપાસિયા તેલ	૬૩૫ થી ૬૩૮
સોનું સ્ટાન્ડર્ડ	૨૨૨૨૦
રાજકોટ ચાંદી	૫૨૧૦૦
મગફળી જાડી	૮૩૦ થી ૮૩૧
જી.ટુ.	-
ઉનાળુ મગફળી	૯૩૦ થી ૯૩૧
ખાંડ એમ	૨૮૯૦ થી ૨૯૪૦
ખાંડ એસ	૨૮૪૦ થી ૨૮૬૦

ઉત્તર ગુજરાતના બજારભાવ

હારીજ

રાયડો	૪૨૫ થી ૪૮૫
એરંડા	૮૫૦ થી ૯૦૧
જીરૂં	૨૦૦૦ થી ૨૮૧૭
બાજરી	૧૩૦ થી ૨૦૦
ઘઉં	૨૨૫ થી ૨૫૧
ગુવાર	૪૬૦ થી ૫૨૭
સુવા	૫૦૦ થી ૬૨૧
છાંછડિયો	૪૨૮
ચણા	૫૧૧ થી ૫૪૦
મઠ	૨૫૦ થી ૪૨૮
મેથી	૩૭૦ થી ૪૪૦

ડીસા

રાયડો	૪૮૩ થી ૫૦૭
એરંડા	૮૮૫ થી ૯૦૩
બાજરી	૧૭૫ થી ૨૦૭
ઘઉં	૧૮૭ થી ૨૪૧
મગફળી	૭૫૧ થી ૮૨૫
તમાકુ	૫૦૦ થી ૯૫૦
રાજગરો	૫૦૦ થી ૫૪૦

પાટણ

એરંડા	૮૬૦ થી ૯૦૭ (૫૫૫૧)
ઘઉં	૨૦૦ થી ૨૨૧ (૮૧૫)
બાજરી	૧૮૦ થી ૨૦૪ (૫૮૦)
રાયડો	૪૬૦ થી ૫૦૮ (૮૭૧)
જીરૂં	૧૮૦૦ થી ૨૭૦૪ (૧૩)
વરિયાળી	૮૦૦ થી ૧૪૭૫ (૨૪૫)
જુવાર	૩૩૩ થી ૯૩૦ (૬)
બંટી	૨૩૦ થી ૨૪૭ (૪)

રાધનપુર

ઘઉં	૧૬૫ થી ૨૫૦
બાજરી	૧૬૮ થી ૨૨૧
ચણા	૪૭૫ થી ૫૩૪
એરંડા	૮૩૦ થી ૮૬૫
જીરું	૧૯૦૦ થી ૨૯૦૧
રાયડો	૪૩૦ થી ૪૮૧
ઈસબગુલ	૯૬૫ થી ૧૦૦૦
ગોવાર	૫૬૦ થી ૬૭૦
જુવાર	૪૨૫ થી ૪૫૫
મગ	૪૫૦ થી ૬૦૦
મઠ	૩૨૫ થી ૪૫૦

ઊંઝા

જીરૂં	૧૫૯૦ થી ૩૦૮૫
વરિયાળી	૭૮૫ થી ૨૬૮૧
ઇસબગુલ	૯૫૦ થી ૧૧૯૩
રાયડો	૪૮૫ થી ૫૩૪
તલ	૭૯૧ થી ૧૧૦૦
સોયા	૫૩૦ થી ૬૪૧
સરસવ	૪૭૧ થી ૫૪૫
અજમો	૨૫૨૫ થી ૨૭૧૧
મેથી	૪૮૦ થી ૪૯૦

મહેસાણા

ઘઉં	૧૯૮ થી ૨૪૦
બાજરી	૧૭૪ થી ૨૧૩
જીરૂં	૨૩૫૦ થી ૨૫૦૨
વરિયાળી	૬૦૧ થી ૯૦૯
એરંડા	૮૫૫ થી ૯૧૦
સુવા	૪૭૧ થી ૫૮૦
રાયડો	૪૫૫ થી ૫૦૬
જવ	૨૩૦
મેથી	૪૨૪ થી ૪૬૭
અજમો	૧૦૦૦ થી ૧૭૭૫
જુવાર	૩૯૧ થી ૪૫૧
રંજકાના બી	૨૨૦૦ થી ૪૦૧૧
ધાણા	-

પાલનપુર

ઘઉં	૨૦૦ થી ૨૯૦
બાજરી	૧૬૭ થી ૨૦૩
એરંડા	૮૭૫ થી ૯૦૯
મગફળી	૬૮૦ થી ૮૮૫
રાયડો	૪૯૮ થી ૫૧૦
રાજગરો	૪૩૧ થી ૫૨૧
વરિયાળી	૮૮૦ થી ૧૩૫૦

શેરબજારમાં કચ્છ

આરતી ડ્રગ	૧૩૫.૩૫
આરતી ઈન્ડ.	૪૯.૫૦
અદાણી પાવર	૧૧૦.૦૫
એલાઇટ કોમ્પ્યુ. ઈન્ટ.	૩.૫૦
એસ્ટ્રોલ ચોક એન્ડ પ્રો.	૨.૭૭
આશાપુરા માઇનકેમ	૨૨.૯૫
એકસેલ ક્રોપ કેર	૧૬૪.૨૦
ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લી.	૧૯૦.૭૫
યુરો સિરામિક્સ	૨૩.૯૦
યુરો મલ્ટી વિઝન લી.	૧૦.૬૯
એવરેસ્ટ કાંટો	૯૦.૧૦
જીએમડીસી	૧૬૦.૮૫
ગુજરાત એનઆરઇ કોક	૪૭.૦૫
ગોકુલ રિફોઇલ્સ	૯૦.૫૫
હરીઆ એક્સપોર્ટ	૪.૭૨
ઇપ્કા લેબોરેટરી	૩૪૩.૯૫
જિંદાલ સો લિ.	૧૬૩.૦૦
કેસર એન્ટરપ્રાઇઝ	૫૦.૦૦
માન ઈન્ડ. (ઈન્ડિયા)	૧૪૩.૫૦
મુંદરા પોર્ટ	૧૬૧.૧૫
નવનીત પ્રકાશન	૬૪.૭૫
પીએસએલ લિ.	૭૧.૨૫
રામકો ઈન્ડસ્ટ્રીઝ લી.	૪૦.૮૦
રત્નમણિ મેટલ્સ	૧૦૧.૦૦
રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝ	૯૬.૪૦
સાલ સ્ટીલ લિ.	૭.૦૦
સાંઘી ઈન્ડસ્ટ્રીઝ	૧૮.૧૦
સુંદરમ મ્લટી પેપ	૪૨.૫૦
સુઝલોન એનર્જી	૫૧.૬૫
ટોકિયો પ્લાસ્ટ ઈન્ડ.	૧૫.૦૦
ટાટા પાવર	૧૨૯૧.૦૫
વિમલ ઓઇલ એન્ડ ફૂડ	૭૨.૪૦
વેલસ્પન ઈન્ડિયા	૪૩.૪૫

વીસ મુદ્દા અધ્યક્ષનો કાર્યક્રમ મુલતવી

ભુજ, તા. ૬ : રાજ્યના ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષનો કચ્છ પ્રવાસ મુલતવી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટર કચેરી તરફથી જણાવાયું હતું.

વિદેશી હૂંડિયામણ

	કરન્સી નોટ ખરીદ/વેચાણ	ટ્રાવેલર્સ ચેક ખરીદ/વેચાણ
ડોલર	૪૩.૩૦/૪૫.૧૦	૪૩.૫૫/૪૫.૦૦
પાઉન્ડ	૬૯.૪૫/૭૨.૭૫	૬૯.૮૦/૭૨.૫૫

સૌ. : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એન.આર.આઈ. બ્રાંચ, ભુજ.

ઈન્ડેક્સમાં વધઘટ

ઈન્ડેક્સ	આંક	વધ/ઘટ	ટકાવારી
સેન્સેક્સ	૧૮૭૨૬.૯૭	-૧૭.૫૯	૦.૦૯
બીએસઇ ૧૦૦	૯૮૦૩.૬૧	-૧૨.૪૩	૦.૧૩
બીએસઇ ૨૦૦	૨૩૧૯.૨૮	-૩.૦૯	૦.૧૩
બીએસઇ ૫૦૦	૭૨૮૯.૮૯	-૮.૧૩	૦.૧૧
શરિયાહ ૫૦	૧૧૬૦.૮૫	-૩.૨૧	૦.૨૮
બીએસઇ મિડકેપ	૬૯૬૧.૫૧	+૨.૬૦	૦.૦૪
બીએસઇ સ્મોલ કેપ	૮૩૫૭.૬૫	+૧૯.૨૩	૦.૨૩
નિફ્ટી	૫૬૨૫.૪૫	-૬.૬૫	૦.૧૨
નિફ્ટી જૂનિયર	૧૧૪૧૫.૭૫	+૧૮.૬૦	૦.૧૬
સીએનએક્સઆઇટી	૬૭૦૪.૧૦	-૪.૩૦	૦.૦૬
બેન્ક નિફ્ટી	૧૧૨૮૩.૦૫	૧૨૩.૦૫	૧.૦૮
સીએનએક્સ ૧૦૦	૫૫૫૦.૩૦	-૩.૯૨	૦.૦૭

શાકભાજીના ભાવ

ભુજ માર્કેટયાર્ડ

(એક કિલોના જથ્થાબંધ ભાવ)

રીંગણા	૨ થી ૫
ફુલાવર	૧૫ થી ૧૬
કોબી	૭ થી ૮
ટમેટા	૧૨ થી ૧૩
ભીંડા	૧૮ થી ૨૨
મરચાં	૧૨ થી ૧૫
ધાણા	૨૦ થી ૨૫
કાકડી	૫ થી ૮
ડુંગળી	૮ થી ૯
બટાટા	૭ થી ૮
પાલક	૬ થી ૧૦
ગોવાર	૧૫ થી ૨૪
લીંબુ	૧૨ થી ૧૩
ગિસોડી	૧૫ થી ૨૫
દુધી	૨ થી ૪
કારેલા	૮ થી ૧૦
આદુ	૩૧ થી ૩૨
સક્કરિયા	૮ થી ૧૨
ચોળા	૧૦ થી ૧૫
ગિલોડા	૧૦ થી ૧૧
મરચાં સિમલા	૨૨ થી ૨૫
કેળાં કાચા	૮ થી ૧૦
કેળાં પાકા	૧૦ થી ૧૧
ચીકુ	૧૫ થી ૨૫
પપૈયા કાચા	૩ થી ૪
પપૈયા પાકા	૪ થી ૫
સકરટેટી	૧૪ થી ૧૬

અંજાર માર્કેટયાર્ડ

(એક કિલોના જથ્થાબંધ ભાવ)

રીંગણા	૬ થી ૭
ફુલાવર	૧૫ થી ૧૬
કોબી	૭ થી ૮
ટમેટા	૧૨ થી ૧૩
ધાણા	૨૨ થી ૨૫
ભીંડા	૧૭ થી ૧૮
મરચાં	૧૨ થી ૧૫
કાકડી	૭ થી ૮
ડુંગળી	૧૧ થી ૧૨
બટાટા	૬ થી ૬.૫૦
પાલક	૮ થી ૧૦
ગોવાર	૨૦ થી ૨૨
આદુ	૨૫ થી ૨૬
ચોળા	૨૦ થી ૨૫
કેળા કાચા	૮ થી ૧૨
પપૈયા	૫ થી ૮
લસણ સફેદ	૮૦ થી ૧૦૦
લીંબુ	૭ થી ૮
ગિસોડી	૧૫ થી ૧૬
ચીકુ	૨૦ થી ૨૫
મરચાં સિમલા	૨૦ થી ૨૫
ગાજર	૧૫ થી ૧૬
ગિલોડા	૧૫ થી ૧૬
મૂળા	૨૦ થી ૨૫
મેથી	૩૦ થી ૩૨
સકરિયા	૮ થી ૧૦
કારેલા	૭ થી ૮
દુધી	૩ થી ૪
દાડમ	૨૫ થી ૩૦
કેસર કેરી	૩૦ થી ૪૦
ખારેક	૨ થી ૧૦
જાંબુ	૧૦ થી ૧૨

શેરબજારમાં ધીમા ઘટાડાનું વલણ

સેન્સેક્સ સાધારણ ૧૮ પોઇન્ટ નરમ : વોલ્યૂમમાં વધુ ઘટાડો

મુંબઇ, તા. ૬ : કૉર્પોરેટ ક્ષેત્રના ત્રિમાસિક ગાળાના પરિણામની મોસમ શરૂ થવાની હોઇ રોકાણકારોએ ઓછા મૂલ્યના શૅરોમાં રોકાણ કરવા માટે હેવીવેઇટ શૅરોનું વેચાણ કરતાં તેમજ વૈશ્વિક બજારોમાંના મોળા પ્રતિસાદને પગલે મુંબઇ શૅરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્ષ બુધવારે ૧૮ પોઇન્ટના સામાન્ય કરેકશન સાથે બંધ આવ્યો હતો.

વર્તમાન સપ્તાહમાં બજાર પરનું સેન્ટીમેન્ટ નબળું રહ્યું છે, તો સાથે વોલ્યુમમાં પણ મોટો ઘટાડો નોંધાવ્યો છે. એફ.આઇ.આઇ.ની સક્રિયતાને પગલે સત્રના શરૂઆતી ભાગમાં સેન્સેક્ષ ઊંચામાં ૧૮૮૨૩ પોઇન્ટ પર નોંધાયો હતો. એસ.બી.આઇ કેપિટલ સિક્યોરિટીના ડેરિવેટિવ્ઝ રિસર્ચ હેડ હેમંત ઠુકરાલનું કહેવું છે કે, આગામી ત્રણથી ચાર દિવસમાં બજાર રેંજ બાઉન્ડ રહેવાની ધારણા છે.

દેશની બીજી મોટી ખાનગી ક્ષેત્રની બૅન્ક એચ.ડી.એફ.સી બૅન્કના ૨૦૧૧ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામ મજબૂત આવવાની અપેક્ષા પર બૅન્કના શૅરનાં ભાવ સત્રના એક ભાગમાં વધીને બાવન સપ્તાહની ઊંચી સપાટી પર રૂા. ૨૫૫૭એ સ્પર્શ્યા બાદ અંતે આગલા બંધથી રૂા. ૪.૬૫ (૦.૧૮ ટકા) સુધરીને રૂા. ૨૫૪૫.૦૫ પર બંધ આવ્યા હતા. આ સાથે બજાર બૅન્કનું માર્કેટ કેપ રૂા. ૧૧૮૬૯૭ કરોડનું નોંધાયું હતું.

ઑટો પાર્ટ્સ ઉત્પાદક ભારતફોર્જે બી.એસ.ઇ પરના 'એ' ગ્રુપમાં સૌથી વધું વધનાર શૅર બની રહ્યા હતા, જેના શૅરનાં ભાવ બી.એસ.ઇ પર રૂા. ૧૪.૩૦ (૪.૩૪ ટકા) વધીને રૂા. ૩૨૨.૨૦ થયા હતા. તેની પાછળ ટૉરેન્ટ પાવર ૩.૬ ટકા વધીને રૂા. ૨૪૪.૬૫ તો યુનિટેક રૂા. ૩.૪૭ ટકા વધીને રૂા. ૩૪.૨૫ થયા હતા.

ટી ઇન્ડસ્ટ્રીઝે સ્પેશિયલ પર્પસ ટી ફંડ હેઠળ સબસિડીના દર વર્તમાન ૨૫ ટકાથી વધારીને ૪૦ ટકાનો કરવાની માંગ કરતા ચા કંપનીના શૅરો વધ્યાં હતા. જેમાં મુખ્યત્વે મેકલોઇડ, રશેલ, જયશ્રી ટી, ગુડરીકસ ગ્રુપ વગેરેનો સમાવેશ થાય છે. સેબીના આંકડા મુજબ ૨૦૧૧ના પ્રથમ છ મહિનામાં એફ.આઇ.આઇ.એ શૅર અને બોન્ડ સહિત ભારતીય બજારોમાં રૂા. ૧૭૦૦૦ કરોડ ઠાલવ્યા છે. એનાલિસ્ટોનું કહેવું છે કે, એફ.આઇ.આઇ.ની સક્રિયતા આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની ધારણા છે.

વધુમાં જાન્યુ.થી જૂનના ગાળામાં એફ.આઇ.આઇ.એ રૂા. ૪૬૯૫૧૧ કરોડના મૂલ્યની ઇકિવટી અને ડેબ્ટ સિકયોરિટી ખરીદી છે, તો સામે રૂા. ૪૫૨૭૩૧ કરોડના શૅરો અને બોન્ડનું વેચાણ પણ કર્યું છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સપ્તાહમાં રૂા. ૮૯૪૭ કરોડનું રોકાણ કર્યું છે, તો તેની સામે ડેબ્ટ માર્કેટમાંથી રૂા. ૨૩૨૪ કરોડ પાછા ખેંચી લીધા છે.

દેશના કૉર્પોરેટ ગૃહોએ મે મહિનામાં આઇ.પી.ઓ. અને રાઇટ ઇસ્યુ થકી રૂા. ૪૭૮૧.૮ કરોડ ઊભા કર્યા છે, જે ચાલુ વર્ષે એપ્રિલમાં ઊભા કરેલા નાણાંથી ૧૩૬ ટકા વધુ છે, એમ બજાર નિયામક સિક્યોરિટી ઍન્ડ એક્સ્ચેંજ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ના સાધનોએ જણાવ્યું હતું.

કચ્છ-મુંબઇની ત્રીજી ટ્રેનને આડેસર અને ચિત્રોડમાં સ્ટોપ આપવા રજૂઆત

ભુજ, તા ૬ : બજેટમાં કચ્છ માટે ત્રીજી ટ્રેન ફાળવવા બદલ આભાર વ્યક્ત કરતાં રાપર તાલુકાના એકપણ ગામને સ્ટોપ ન અપાયા અંગે જિલ્લા ભાજપ મહામંત્રીએ રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

મૂળ રાપર તાલુકાના વતની અને જિલ્લા ભાજપના મહામંત્રી પંકજ મહેતાએ રેલવેમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, રાપર તાલુકાના લોકોનો મુંબઇ સાથે સામાજિક વ્યવહાર છે. પરંતુ નવી ટ્રેનમાં રાપર તાલુકાના ગામને સ્ટોપ ન અપાતાં લોકોમાં નારાજગી ઊભી થઇ છે. વળી વિશ્વના નકશામાં સ્થાન પામનાર હડપ્પન સંસ્કૃતિના સ્થળ ધોળાવીરા જવા માટે પણ રાપર તાલુકામાં સ્ટોપ આપવો જરૂરી છે જેથી કચ્છને મળેલી મુંબઇ માટેની ત્રીજી ટ્રેનમાં ચિત્રોડ અને આડેસરને સ્ટોપ આપવા ભારપૂર્વક રજૂઆત કરાઇ છે. આ માગણીમાં 'રાડા'ના અધ્યક્ષ વાઘજી પટેલ, જિલ્લા મંત્રી બબીબેન સોલંકી, તા. ભાજપ પ્રમુખ વેલજીભાઇ રાઠોડ, વાઘજી પ્રજાપતિ, બળવંત ઠક્કર સહિતના તાલુકાના અગ્રણીઓએ પણ સૂર પૂરાવ્યો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

માંડવી બંદરના અધિકારીઓએ નિવૃત્ત કર્મ. સંઘ સાથે બેઠક યોજી

માંડવી, તા. ૬ : અહીં નવનિયુક્તિ બંદર અધિકારી તથા અધિક બંદર અધિકારી સાથે માંડવી બંદર જૂથ નિવૃત્ત કર્મચારી સંઘ વચ્ચે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા.

કર્મચારી સંઘના પ્રમુખ શિવજી ફોફંડીની યાદીમાં જણાવ્યાનુસાર બંદર અધિકારી રાકેશ મિશ્રા તથા અધિક બંદર અધિકારી શ્રી ડામોર સાથે તાજેતરમાં યોજાયેલી શુભેચ્છા બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓના વિલંબિત પ્રશ્નો અંગે વિગતે ચર્ચા બાદ ઉકેલની ખાતરી અપાઇ હતી. દરમ્યાન બેન્કમાં પેન્શન મેળવવા જતા નિવૃત્તોને લાઇનમાં ઊભવું પડતું હોવા અંગે રજૂઆત કરાતાં બેન્ક સત્તાવાળાઓએ વૃદ્ધોને હવે પછી લાઇનમાં નહીં ઊભવું પડે તેવી ખાતરી આપી હતી. આ રજૂઆતમાં મંત્રી સુરેશ દવે જોડાયા હતા.

દરમ્યાન કચ્છ જિલ્લા મજદૂર સંઘની એક અલગ યાદીમાં જણાવાયા મુજબ સંગઠનના પદાધિકારીઓને રક્ષિત કર્મચારી જાહેર કરાયા હતા. જેમાં જુવાનસિંહ વાઘેલા, વિજય વરુ તથા કરસન બિજલનો સમાવેશ થાય છે. આ નિર્ણય ગાંધીધામ શ્રમ આયુક્ત દ્વારા કરાતાં આ કર્મચારીઓને આગામી એક વર્ષ માટે રક્ષિત જાહેર કરાયા છે તેવું મંત્રી શ્રી દવેએ જણાવ્યું હતું.

એરંડા વાયદાની વધઘટ

સપ્ટે. વાયદો

ખુલી ૪૬૬૭.૦૦ ઘટી ૪૬૧૬.૦૦

વધી ૪૭૦૪.૦૦ બંધ ૪૬૫૭.૦૦

મુંબઇ એરંડા

હાજર ૪૭૪૫ દિવેલ૯૭૯

૯૮૮**સપ્ટે. વાયદો**

૪૬૫૦

એચ. આઇ. વી.ગ્રસ્ત લોકોને રોજગારી આપવા માંગ

ભુજ તા. ૬: કચ્છ એન પી પ્લસ ડ્રોપ ઇન સેન્ટર દ્વારા એચ. આઇ.વી.ગ્રસ્ત સાથે જીવન જીવતા લોકોને રોજગારી આપવાની માંગ કરાઇ હતી.

આ સંગઠન દ્વારા વિવિધ સ્થળે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. માનવ અધિકારનું રક્ષણ થાય તેવી માગણી સાથે ભુજમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ રાજુભાઇ ચૌહાણ, મંત્રી અનીશાબેન ખોજા, રેખાબેન વિશ્વકર્મા, કિંજલબેન કોછડીયા, કુંવરજીભાઇ વેકરીયા, હંસાબેન કોલી વગેરે રજૂઆતમાં જોડાયા હતા.

ભુજમાં અહિંસા રેલી બાદ ચાતુર્માસ અર્થે નગર પ્રવેશ કરનારા તેરાપંથી જૈન મુનિઓના સ્વાગત સમારોહનું દ્રશ્ય.

ભુજમાં અહિંસા રેલી બાદ તેરાપંથી મુનિઓનો ચાતુર્માસ પ્રવેશ કરાવાયો

ભુજ, તા. ૬ : અહીં રવિવારે આચાર્ય મહાશ્રમણજીના શિષ્ય આલોકકુમારજી આદિ ઠાણા-૪એ રાજસ્થાનથી ૧૦૦૦ કિ.મી.ની પદયાત્રા કરી ભુજમાં અહિંસા રેલી દ્વારા સભાભુવન ખાતે પ્રવેશ કર્યો હતો.

રેલી લગભગ એક કિલોમીટર લાંબી રહી હતી. જેમાં બાળક-યુવા-મહિલા અને વૃદ્ધજન જોડાયા હતા. સંઘના ઉપાધ્યક્ષ વાડીલાલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, જન-જનમાં અહિંસા તથા નૈતિક ચેતનાનું જાગરણ થાય એ માટેનો આચાર્ય મહાશ્રમણજીનો સંદેશ ફેલાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલી બાદ તુરત જ મુનિજીનો ચાતુર્માસ પ્રવેશ સ્વાગત સમારોહનું આયોજન ગાંધીધામ ચાતુર્માસ અર્થે આવેલા મુનિ ભૂપેન્દ્રકુમારજીના સાંનિધ્યમાં કરવામાં આવ્યું હતું. સ્વાગત સમારોહમાં અધ્યક્ષ સ્થાને જૈન સુખરાજજી સંઘવી તથા અતિથિવિશેષ કચ્છ ભાજપા મહામંત્રી પંકજભાઇ મહેતા રહ્યા હતા.

કાર્યક્રમનું મંગલાચરણ સંઘના કન્યા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત સંઘ અધ્યક્ષ ભરતભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. મુનિનો પરિચય અમૃત સાંસદ શાંતિભાઇ જૈન દ્વારા અપાયો હતો. મહિલા મંડળ ભુજ તરફથી ભાવના મહેતા, યુવક પરિષદ તરફથી નરેન્દ્ર મહેતા તથા સંઘના પૂરા કચ્છથી આવેલા જુદા જુદા ગામોના પ્રતિનિધિઓએ પ્રવચન કર્યા હતા.

મુનિ હિમકુમારજીએ ગીતિકાનું સંગાન તથા આલોકકુમારજી એવં મુનિ ભૂપેન્દ્રકુમારજીએ ચાતુર્માસમાં મુનિવૃંદનો પૂરો લાભ ઊઠાવી, ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા પોતાના આત્માને ભાવિત કરવા શીખ આપી હતી. કાર્યક્રમની સફળતા તથા પૂરા સમાજની ભોજન વ્યવસ્થા સંઘના સહમંત્રી જિતેન્દ્ર ધારશી શાહ તથા પરિષદના યુવાનોએ સંભાળી હતી. સંચાલન વાડીભાઇ મહેતાએ કર્યું હતું.

Digitially Archived by: www.realpatidar.com/library

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

નાના થરાવડાના લાલશાપીરના મેળામાં ઊમટેલી મેદની તસવીરમાં નજરે પડે છે. (તસવીર : ફકીરમામદ ચાકી)

નાના થરાવડામાં લાલશાપીરનો મેળો યોજાયો

કોટડા (ચ.) (તા. ભુજ), તા. ૫ : નજીકના નાના થરાવડા ગામે આવેલા કોમી એકતાના પ્રતીક સૂફી સંત લાલશાપીરના સ્થાનકે યોજાયેલા બે દિવસીય મેળા પ્રસંગે બાવન ગામના હિંદુ-મુસ્લિમોએ બાવન ચાદરો ચડાવી અનન્ય શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા. સંતવાણી દરમ્યાન દોઢેક લાખની ઘોર થઇ હતી.

પરંપરાગત રીતે દર વર્ષે યોજાતા આ બે દિવસીય મેળાના પ્રારંભે સિનુગ્રાના મૌ. સૈયદ મહંમદશા તથા આલમે દીન સૈયદ મૌ. કાસમશા બાપુએ તકરીરમાં કચ્છની કોમી એકતાને બિરદાવી હતી. રાત્રે યોજાયેલી ફરીદા મીરની સંતવાણીમાં ભાવિકો દ્વારા દોઢેક લાખની ઘોરની આવક થઇ હતી જે આયોજક કલંદર કમિટીએ દરગાહના વિકાસ માટે વાપરવાની જાહેરાત કરી હતી.

મેળામાં ભુજ, અંજાર, કંડલા, ગાંધીધામ સહિત બાવન ગામના પીરના હિંદુ-મુસ્લિમ અનુયાયીઓએ વારા ફરતી બાવન ચાદરો દરગાહે ચડાવી પીર લાલશા પ્રત્યે અનન્ય આસ્થાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે અનવરબાપુ, કાસમ હાજી વિ. ઢોલ પર પરંપરાગત કચ્છી રાસડા રજૂ કરી કચ્છની આગવી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

કલંદર કમિટી આયોજિત આ મેળામાં દરગાહ પરિસરમાં રૂમના બાંધકામ માટે તાલુકા પંચાયત સદસ્ય સજુભા જાડેજા, હાજી મીઠુ, જિ. પં. માજી સદસ્ય પાંચુભા જાડેજા, તા. પં.ના પૂર્વ ઉપપ્રમુખ પૂંજાભાઇ આહીર તેમજ સરપંચ બાબુલાલ પટેલે આર્થિક સહયોગની ખાતરી આપી હતી. હરિજન

બે દિવસીય મેળામાં કચ્છી રાસડા, ધમાલ, ચક્કરે ભારે આકર્ષણ જમાવ્યું

અગ્રણી લાલજી ભોજા, સુમારભાઇ, પાટીદાર અગ્રણી માજી સરપંચ સામજી ભગત તેમજ મોટા થરાવડાના તમામ સમાજના લોકોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. લગભગ ત્રણસો વર્ષ જૂની આ દરગાહની સ્થાપના લાલશાપીરના શિષ્યે કરી હોવાનું બુઝુર્ગોએ જણાવ્યું હતું. આ પ્રસંગે કચ્છી ધમાલ, ચક્કર જેવા કરતબોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આયોજક કમિટીના બાવલા ફકીરમામદ, જાનુ જુમા, હાજી રમજુ, આમદ નૂરાભાઇએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું. મુજાવર ઇબ્રાહીમ બાવા, હુશેન કારા તથા ઓસમાણ આમદે વ્યવસ્થા સંભાળી હતી.

કચ્છમાં વધુ ૧૮.૧૩ કરોડની ૮૦ હજાર ચો.મી. જમીન ખાલસા

ભુજ, તા. ૬ : જિલ્લા વહીવટી તંત્રે ગાંધીધામ અને રાપર તાલુકા પછી મુંદરા તાલુકાના ધ્રબ ગામ તરફ રૂખ કરી સર્વે નં. ૧૬૯ની ૮૦ હજાર ૨૩૫ ચો.મી. જમીન ખાલસા કરી છે. આ જમીનની કિંમત અંદાજે ૧૮ કરોડ ૧૩ લાખ અને ૩૧ હજાર રૂપિયા થવા જાય છે.

જિલ્લા કલેક્ટર એમ. થેન્નારસન અને અધિક કલેક્ટર સી.પી. નેમાના જણાવ્યા અનુસાર ચાર જુદા જુદા નામે ઔદ્યોગિક હેતુ માટે અપાયેલી જમીન શરતભંગના કિસ્સામાં

ધ્રબ ગામના ખરાબાની જમીન શરતભંગ થતાં તંત્રની લાલ આંખ

રાજ્યસાત કરાઇ છે.

ઔદ્યોગિક હેતુ માટે જેમને જમીન અપાઇ હતી, જેમાં ગણેશ ઇન્ડસ્ટ્રીઝ અંજાર ૨૦ હજાર ચો.મી. - રીખવ જગદીશ શાહ ગાંધીધામ ૨૦ હજાર ૨૩૫ ચો.મી., દીપ વિજય એન્ટરપ્રાઇઝ-અંજાર ૨૦ હજાર ચો.મી. અને આદિનાથ પોલી ફિલ્મ્સ પ્રા.લિ. ગાંધીધામને પણ ૨૦ હજાર ચો.મી. જમીન અપાઇ હતી.

કચ્છમાં અને ખાસ કરીને આ વિસ્તારમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એ માટે ૨૦૦૬માં જમીન અપાઇ હતી, પરંતુ રાજ્ય સરકારનો જે હેતુ હતો તે બર ન આવતાં મહેસૂલી અધિનિયમ ૭૯-એ હેઠળ કાર્યવાહી હાથ ધરી શરતભંગ સાબિત થતાં અપાયેલી જમીન બોજા રહિત સરકાર દાખલ કરવામાં આવી છે.

મહેસૂલી તંત્રના એપેલેટ અધિકારી તરીકે નિવાસી અધિક કલેક્ટર

ભુજ, તા. ૬ : જિલ્લા કલેક્ટરે એક સુધારા હુકમ જારી કરીને અગાઉ એપેલેટ અધિકારી તરીકે નિયુક્ત કરાયેલા નિવાસી નાયબ કલેક્ટરની જગ્યા હવેથી નિવાસી અધિક કલેક્ટર તરીકે અપગ્રેડ કરવામાં આવતાં માહિતી અધિનિયમ-૨૦૦૫ તળે જિલ્લાના મહેસૂલી તંત્રના એપેલેટ ઓથોરિટી (અપીલ અધિકારી તરીકે) નિયુક્ત કરેલ અધિક કલેક્ટર, કચ્છની જગ્યાએ હવે અપીલ અધિકારી તરીકે નિવાસી અધિક કલેક્ટર સી.પી. નેમાની નિયુકિત કરવામાં આવી છે.

જિલ્લામાં આપઘાત અકસ્માતમાં ચારનાં મોત

ભુજ , તા. ૬ : જિલ્લામાં આપઘાત અને અકસ્માતના જીવલેણ બનાવોનો સિલસિલો જારી રહેવા સાથે વિતેલા ચોવીસ કલાક દરમ્યાન આવી ચાર ઘટનામાં ચાર વ્યકિતઓની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી.

અપમૃત્યુની આ ઘટનાઓ પૈકી માંડવી તાલુકાના વાંઢ ગામે રસીલાબેન લધુ સંઘાર (ઉ.વ. ૩૫) નામની પરિણીતાએ જાતે સળગીને અકળ આપઘાત કરી લીધો હતો. તો નખત્રાણા તાલુકાના આમારા ગામે ધનજી શિવજી સીજુ (ઉ.વ.૨૦)એ પણ કોઇ અગમ્ય કારણોસર જાતે અગનપછેડી ઓઢી મોત વ્હાલું કરી લીધું હતું. આવા જ એક અન્ય કિસ્સામાં લખપત તાલુકાના પાનધ્રો મુકામે ૨૧ વર્ષની વયની કલ્પનાબેન મહેન્દ્ર સથવારાએ પણ અગન જવાળાઓમાં લપેટાઇ જીવનનો અંત આણ્યો હતો.

વાંઢની પરિણીતા અને પાન્ધ્રો તથા આમારાના યુવાને સામેથી મોત આણ્યા

જયારે મુંદરા તાલુકામાં નવીનાળ ખાતે વિધુત આંચકો લાગવાથી મુળ આંધ્રપ્રદેશના વતની એવા શ્રમજીવી કરણ બાહેલાલ ઝારીયા (ઉ.વ.૨૨)ને મોત આંબી ગયું હતું.

પોલીસે આ માહિતી આપતાં કહ્યું હતું કે, વાંઢ ગામે લધુ ખીમા સંઘારની પત્ની રસીલાબેને આજે સવારે તેના ઘરમાં અગ્નિસ્નાન કર્યું હતું કે, ગંભીર રીતે દાઝી જવાથી તેણે સ્થળ ઉપર જ દમ તોડયો હતો. મરનારે કેમ આમ કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. આ વિશે તપાસ શરૂ કરાઇ છે.

બીજીબાજુ આમારા ખાતે ધનજી સીજુ આજે સવારે તેના ઘરમાં સળગ્યો હતો. બાદમાં તેને સારવાર માટે ભુજ ખસેડાયો ત્યારે તેને મૃત જાહેર કરાયો હતો. આ બનાવમાં પણ નિમિત્ત બનેલા કારણો હજુ સ્પષ્ટ થયા નથી.

જયારે પાનધ્રોની કલ્પનાબેન સથવારા બે દિવસ પહેલા મોડીરાત્રે તેના ઘરમાં સળગી હતી. તેને પણ ભુજ સારવાર માટે ખસેડાઇ ત્યારે તેને મૃત જાહેર કરાઇ હતી.તેમ પોલીસે જણાવ્યું હતું.

દરમ્યાન નવીનાળ ખાતે કરણ ઝારીયા નામના પરપ્રાંતીય યુવકનુ અપમૃત્યુ થયું હતું. પોલીસે કહ્યું હતું કે, આ હતભાગી શાળા નજીક કામ કરી રહ્યો હતો તે પાણીના ટાંકામાં હાથ ધોવા ગયો ત્યારે તેને વીજ આંચકો લાગ્યો હતો. જે સારવાર મળે તે પહેલા જ તેના માટે યમદુત બન્યો હતો. તેમ પોલીસે ઉમેર્યું હતું.

ગોડપર નજીક યુટીલીટી પલ્ટી ખાતાં યુવાનનું મોતઃ અન્ય ત્રણ ઘવાયા

ભુજ, તા. ૬ : તાલુકામાં ભુજ માંડવી ધોરીમાર્ગ ઉપર ગોડપર ગામ નજીક આજે સાંજે પુરપાટ જઇ રહેલી યુટીલીટી જીપ પલ્ટી ખાઇ જતાં દહિંસરા ગામના શંકર ઉર્ફે ધનજી રામજી મહેશ્વરી (ઉ.વ.૧૬)નુ મોત થયું હતું. જયારે આ કુટુંબના અન્ય ત્રણ સભ્યો ઘવાયા હતા.

આ બનાવમાં ઘાયલ થયેલાં દહિંસરાના અશોક કરશન મહેશ્વરી (ઉ.વ.૩૦), દિનેશ કાનજી મહેશ્વરી (ઉ.વ.૧૬) અને કસ્તુરબેન અશોક મહેશ્વરી (ઉ.વ. ૨૭)ને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તપાસનીશ કેરા પોલીસ થાણાના સહાયક ફોજદાર ભૂરાભાઇ વલ્વીએ જણાવ્યું હતું કે, ઇજા પામનારી કસ્તુરબેનને તેના માવિત્રના ઘરેથી મેઘપરથી તેડીને આ સભ્યો દહિંસરા ઘરે જઇ રહયા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો.

છેલ્લા પાનાથી....

રાપરની મિલકતો

ગયેલું મકાન હોય કે કોઇ ટૂંપો ખાઇને એ મકાનમાં જીવ દઇ બેઠું હોય તો તેવું મકાન ડારિયા-ફૂલિયામાં મળી જાય, પણ આવું મકાન વહેમમાં જીવતા માણસો તો લે નહીં.

એકંદરે ૨૦૧૦ સુધીની મંદીની દબાયેલી સ્પ્રિંગ ઓચિંતી ઉછળતા આજની તારીખે રાપરમાં તેજીની આગે તીવ્ર રૂપ ધારણ કર્યું છે. ફરીને પાછો તેજીનો વાવટો વીંટાય અને મંદીનો માહોલ આવશે કે કેમ ? તે અંગે વર્તુળો કશું બોલતા નથી. આ તેજી શ્રીમોદીના નર્મદાના ભૂમિપૂજન-નહેરના શરૂ થયેલા કામો પછી જ આવી હોવાનું આ વર્તુળો જણાવે છે.

પેટ્રોલનો ધુમાડો ?

હતું કે, તબીબો સામે પગલાં લેવાની પંચાયતને કોઇ જ સત્તા છે નહીં એટલું જ નહીં આ કામગીરી બદલ ગાંધીનગર મંત્રાલયે ઠપકો આપીને તબીબોને ખલેલ નહીં કરવા તેમજ પ્રકરણનો અંત આણવાની સૂચના મળી હોવાનું જણાવ્યું હતું. આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સુરેન્દ્ર મોડનો સંપર્ક કરતાં તેમણે તપાસકીય કામગીરી બંધ કરી દેવાયાનું જણાવીને પંચાયતની સત્તા ન હોવા અંગેની વાતને સમર્થન આપ્યું હતું.

દરમ્યાન આરોગ્ય ચેરમેન જયંતીભાઇ ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કાર્યવાહીથી ડરી ગયેલા તબીબોએ ગાંધીનગરમાં પોતાની વગ વાપરવા પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં પંચાયતને તપાસ અને પગલાંની સત્તા હોવાની વાત દોહરાવી હતી. પોતે આ માટે આરોગ્ય મંત્રીને રૂબરૂ મળીને માર્ગદર્શન મેળવશે અને અન્ય વિસ્તારોમાં અધૂરી કામગીરી પૂર્ણ કરશે તેવું ઉમેર્યું હતું.

રાયણના વાડી વિસ્તારમાં ૩૧ હજારના શરાબ સાથે બે શખ્સો ઝડપી પડાયા

ભુજ,તા. ૬ : માંડવી તાલુકાના નાનીરાયણ ગામના વાડી વિસ્તારમાં દરોડો પાડી માંડવી પોલીસે ગઇરાત્રે આ વિસ્તારમાં રહેતા હરી રામ ગઢવી તથા નાનીરાયણ ગામમાં રહેતાં ગોપાલ ક્રશન ગઢવીની ૩૦૮૦૦ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે ધરપકડ કરી હતી.

બાતમીના આધારે હાથ ધરાયેલી આ કામગીરીમાં આ બન્ને આરોપી પાસેથી શરાબની ૮૮ બાટલી ઉપરાંત મોબાઇલ ફોન અને એક બાઇક મળી કુલ્લ ૫૧૮૦૦ રૂપિયાની માલ-મત્તા કબ્જે કરાઇ હતી.

માંડવી પી.આઇ. બી.બી. ઝાલાએ સ્ટાફના સહાયક ફોજદાર નુરમામદ મંઘરા તથા અન્યોને સાથે રાખીને આ દરોડો પાડયા બાદ

મોબાઇલ અને બાઇક પણ કબ્જે : આરોપીઓ રિમાન્ડ તળે

આજે બન્ને તહોમતદારોને અદાલતમાં રજુ કર્યા હતા.

પોલીસ સાધનોએ આ વિગતો આપતાં કહ્યું હતું કે, રિમાન્ડ હેઠળની પુછતાછમાં આ જથ્થો કયાંથી આવ્યો અને કયાં-કયાં જતો હતો તેના સહિતની વિગતો મેળવાશે.

ભાવભરી પુષ્પાંજલિ

પૂજ્ય મદારસંગજી વેસલજી જાડેજા, (ઉ.વ. ૮૦)
સ્વ. તા. ૨૯-૬-૨૦૧૧, બુધવાર, મોખા, તા. મુંદરા

नैनं छिन्दति शस्त्राणि नैनं दहति पावक : ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत : ।।

પૂજ્ય બાપુ, આપ આપણા સમગ્ર કુટુંબ પરિવાર માટે શીતલ વડલાની છાયા સમાન હતા. આપનું ક્ષાત્ર ધર્મ મુજબનું સદાચારી ધાર્મિક જીવન, સર્વે પ્રત્યે મમતાળુ, દયાળુ અને લાગણીભર્યા વર્તાવ અમો જીવનભર નહીં ભુલીયે. આપનું આદર્શ જીવન અમારા માટે જીવનભર પથદર્શક બની રહેશે. આપની વિદાય જીવનભર નહીં ભુલાય. જોગમાયા કુળદેવી મોમાય માતાજી સમક્ષ વંદના કે તે આપને તેમના ચરણોમાં સ્થાન આપે તેવી તેમની પાસે નતમસ્તકે વંદના. પ્રાર્થના. ૐ શાંતિ...

- ચાંદુભા મદારસંગજી જાડેજા - પુત્ર
- મહોબ્બતસિંહ મદારસંગજી જાડેજા-પુત્ર મો. નં. ૯૪૨૭૨ ૬૬૬૪૮
- રઘુવીરસિંહ ચાંદુભા જાડેજા - પૌત્ર
- જીલુભા હનુભા જાડેજા - ભત્રીજા
- ભરતસિંહ હનુભા જાડેજા - ભત્રીજા
- રાજુભા હનુભા જાડેજા - ભત્રીજા
- વિક્રમસિંહ હનુભા જાડેજા - ભત્રીજા
- કિરીટસિંહ બાલુભા જાડેજા - ભત્રીજા
- રાણાજી મહોબ્બતસિંહ સોલંકી- જમાઇ
- દાનુભા મેરામણજી તુંવર - સાળા
- લકીરાજસિંહ કરસનજી જાડેજા - પૌત્ર
- રામદેવસિંહ મહોબ્બતસિંહ જાડેજા-પૌત્ર
- કિરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા - પૌત્ર
- કરસનજી મદારસંગજી જાડેજા - પુત્ર
- મહેન્દ્રસિંહ મદારસંગજી જાડેજા - પુત્ર
- અનુવીરસિંહ ચાંદુભા જાડેજા - પૌત્ર
- સુરૂભા હનુભા જાડેજા - ભત્રીજા
- રણજિતસિંહ હનુભા જાડેજા - ભત્રીજા
- દશરથસિંહ હનુભા જાડેજા - ભત્રીજા
- ભૂપતસિંહ બાલુભા જાડેજા - ભત્રીજા
- જયદીપસિંહ અજીતસિંહ જાડેજા - પૌત્ર
- વેલુભા મેરામણજી તુંવર - સાળા
- જીવરાજસિંહ કરસનજી જાડેજા - પૌત્ર
- મહાવીરસિંહ મહોબ્બતસિંહ જાડેજા-પૌત્ર
- રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા - પૌત્ર
- બેચરજી કહાજી વાઘેલા - બનેવી (મોટી ચકુ)

તેમજ સમગ્ર જાડેજા મદારસંગજી વેરસલજી પરિવાર તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજ – મોખા, તા. મુંદરા-કચ્છ.
સ્વ. બાપુનું બેસણું દરબાર ડેલી, મોખા ખાતે રાખેલ છે.
તેમની ધાર્મિક વિધિ (બારસ) તા. ૯-૭-૧૧ના રાખવામાં આવેલ છે.

(મહોબ્બતસિંહ એમ. જાડેજા - સંપર્ક : ૯૪૨૭૨ ૬૬૬૪૮)

શ્રદ્ધાંજલિ

પીર શ્રી સૈયદ ઈમામશાહ બાવા(મુ. પીરાણા)નાં ૧૪માં (ચૌદમાં) સજ્જાદાનશીન (વારસ-ગાદીપતિ) અને સતપંથ સનાતન વૈદિક ધર્મના પીર શ્રી પીરઝાદા સૈયદ સમ્શુદીન બાવા સાહેબ ખાકીનો દેહાંત તા. ૧-૭-૨૦૧૧નાં રોજ થયેલ છે. આપશ્રીનો પાક આત્મા, અખંડ, અમન શાંતિ પામે એવી પરમાત્મા અને દરબારે ઈલાહીમાં તહે દિલ-અંતઃકરણ પૂર્વકની એટલી જ દુવાઓ..આમીન

વ્યથિત સતપંથ સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓ
નિષ્કલંકી નારાયણ ભગવાનનાં શ્રદ્ધાળુઓ

લોહાણા સમાજ દ્વારા ગણવેશ વિતરણ : ભુજ લોહાણા મહાજનના ઉપક્રમે રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા બુધવારે સાંજે જ્ઞાતિના ૭૫ જેટલા છાત્રોને મફત શાળા ગણવેશ વિતરણ કરાયું હતું. દાતા શશિકાંતભાઇ કેસરિયા, કિરણભાઇ ગણાત્રા, પ્રતાપભાઇ પવાણી અને શેખરચંદ શેઠિયાના આર્થિક સહયોગથી મહાજનના પ્રમુખ નરેન્દ્રભાઇ ઠક્કર, દાતા શશિકાંતભાઇ, વિષ્ણુભાઇ કેસરિયા, પ્રીતિબેન ઠક્કર, રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જયંત ઠક્કર વિગેરેના હસ્તે વિતરણ કરાયું હતું. આ પ્રસંગે દીપક ચંદે, હરેશ તન્ના, જિજ્ઞેશ ઠક્કર, વિજય પૂજારા, જિજ્ઞાબેન ઠક્કર વિગેરેએ સહયોગ આપ્યો હતો. (તસવીર : હર્ષદ ચૌહાણ)

મરણનોંધ

ભુજ : મ.ક.સ.સુ. નાનાલાલ સોલંકી (ઉ. વ. ૭૧) ગાભાભાઇ વાલજીભાઇના પુત્ર, પ્રેમજી મોરારજીના જમાઇ, કસ્તૂરબેનના પતિ, વિપુલ, અનિલ, હર્ષલ, સ્વ. પુષ્પા, ચંદ્રિકાના પિતા, દીનાબેન, હીનાબેન, ગિરીશ, કિશોર, સ્વ. રમેશના સસરા, હરિલાલભાઇ, સ્વ. દયારામભાઇના બનેવી, સ્વ. ઝવેરબેન, જશોદાબેન, વિજ્યાબેનના ભાઇ, કિરીટભાઇ કિશોરના પિતરાઇ કાકા તા. ૬-૭ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૭ શુક્રવારે ૫થી ૬ દરજી સમાજ વાડી, નાગર ચકલા ખાતે.

ભુજ : દ્વારકાદાસ ચાંપશી વેદ (માજી કર્મચારી ભુજ નગરપાલિકા) (ઉ. વ. ૭૨) તા. ૫-૭ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૭ના માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિરે સાંજે ૪થી ૫ (ભાઇઓ તથા બહેનોની સાથે).

ભુજ : પીંજારા કાસમ મામદ (ઉ. વ. ૫૫) તે મ. સુલેમાન મામદ, દાઉદ, ઇબ્રાહીમ, મ. રસીદના ભાઇ, જમીલાબાનુ, રોશનબાનુ, રૂકશાનાબાનુના પિતા તા. ૬-૭ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. ૯-૭ શનિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે કજલીનગર, ખારીનદી રોડ, નર્સરીની સામે.

ગાંધીધામ : માલી શ્રીમાળી જ્યોતિબેન (ઉ. વ. ૫૪) તે મોહનભાઇ સોલંકી (સંગીતકાર)ના પત્ની, ડી.જે. નેહલ, શ્રુતિ, ધ્વનિના માતા, મહેશકુમાર (શિક્ષક ઓમ વિદ્યામંદિર, ઇફકો), રાજેશકુમાર (દુબઇ), નિમિષાના સાસુ, ચંદુલાલ (પાણી પુરવઠા), નીલેશ, મુકેશના કાકી, સ્વ. અમૃતલાલ રામજી ભાટડિયા, બાબુભાઇના પુત્રી, પ્રકાશ, વિજય પાટડિયાના બહેન તા. ૬-૭ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. ૭-૭ના સવારે ૯-૩૦ વાગ્યે નિવાસસ્થાન ડી.બી.ઝેડ.-એન.-૩૮ ખાતેથી નીકળશે.

આદિપુર : સારસ્વત બ્રાહ્મણ ભચીમા (આણદાબાઇ) (ઉ. વ. ૧૦૧) તે સ્વ. દયારામ નારાણજી રાડિયા (રામપર અબડા અને શિરવા ભાનુશાલી મહાજનના થાનાઇ)ના પત્ની, કરસનદાસ, પુરુષોત્તમ, સ્વ. શાંતાબેનના માતા, વિદ્યાબેન, જયાબેન, લક્ષ્મીકાંત તુલસીદાસ પંડ્યા (અંજાર)ના સાસુ, વસંતભાઇ (નાગલપુર), તરુણ, ઉત્પલ (આદિપુર), નીતાબેન પ્રફુલ લહેરુ (તેરા), સ્વ. જયશ્રી રાજેન્દ્ર ખીરા (ભુજ), હીનાબેન ગિરીશ ધોલી (આદિપુર)ના દાદી, વંદનાબેન, તન્વીબેનના દાદી સાસુ, પ્રફુલભાઇ, ભાવેશ, હંસાબેન, ઇંદુબેન, ઉમા, ઉષાના નાની, મોહિત, તારિકા નીલેશ શિવ, મનાલી હેમલ ધતુરિયા, રિદ્ધિ, વિવેક, ઋત્વિક, ઊર્વિ, દક્ષેશના વડદાદી તા. ૬-૭ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ભુજ/નરેડી : હીરજી (વલ્લભજી) ધારશી નાગડા (ઉ. વ ૭૨) જેતબાઇ ધારશીના પુત્ર, રમીલાબેનના પતિ, લક્ષ્મીચંદ, કિશોર (કિશોર રોડલાઇન્સ- મુંદરા), દીપક, રંજન, રેખાના પિતા, ગઢશીશાના ટોકરશી વેરશીના જમાઇ તા. ૫-૭ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૭ના નરેડી જૈન મહાજનવાડી ખાતે સવારે ૯થી ૧૦-૩૦ તથા સાંજે ૫થી ૬ ભુજ ખાતે નવનીતનગરમાં.

સુખપર (ભુજ) : રામજી દેવશી ભેડેરી (ઉ. વ. ૯૨) તે સ્વ. પ્રેમબાઇ, સ્વ. માનબાઇના પતિ, સ્વ. નાનબાઇ દેવશી સામજી ભેડેરીના પુત્ર, સ્વ. જીણાભાઇ, સ્વ. અરજણભાઇ, સ્વ. ભાણબાઇ, સ્વ. દેવબાઇ, સ્વ. મેઘબાઇના ભાઇ, હરજીભાઇ, દેવજીભાઇ, રવજીભાઇ, કાનજીભાઇ, લાલજીભાઇ, માનબાઇ લાલજી ખેતાણી, વેલબાઇ હીરજી પાઘરા, જસુબેન ગોવિંદ ખેતાણીના પિતા તા. ૬-૭ના અવસાન પામ્યા છે. બેસણું તા. ૯-૭ શનિવારે સવારે ૭-૩૦થી ૮-૩૦ વાગ્યે નિવાસસ્થાન જૂનાવાસ, મોટી બજાર ખાતે.

માધાપર (તા. ભુજ) : સુમલબેન (ઉ. વ. ૮૫) તે સ્વ. જુમા હીરા જંજકના પત્ની, સામજીભાઇ, ગાંગજીભાઇ, મગનભાઇ, પરબતભાઇ, પાલીબાઇના માતા, નરશી, અનિલ, દિનેશ, રમેશના દાદી તા. ૬-૭ના અવસાન પામ્યા છે. તા. ૧૦-૭ રવિવારે આગરી તથા તા. ૧૧-૭ સોમવારે પાણિયારો નિવાસસ્થાન મતિયા કોલોની, જૂનાવાસ, માધાપર ખાતે.

જાંબુડી (તા. ભુજ) : કુંભાર આમદ (ઉ. વ. ૩૦) તે જુમા કારાના પુત્ર, રોમતબેનના પતિ, મામદ, કાસમ, હુસેન, જુસા, ઓસમાણ, અબ્દુલના ભાઇ, આસિફના પિતા, કુંભાર ઓસમાણ ઇસ્માઇલ (પટેલ-ભચાઉ)ના જમાઇ તા. ૫-૭ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. ૯-૭ના સવારે ૯-૩૦ વાગ્યે નિવાસસ્થાને.

માંડવી : ભા. ઠા. નરોત્તમભાઇ (ઉ. વ. ૯૨) (કચ્છ ઓઇલ મિલ-માંડવી) તે સ્વ. ધનજીભાઇના પુત્ર, કરસનદાસ ધનજી વેદના ભાઇ તા. ૫-૭ના હૈદરાબાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૭ના સાંજે ૫-૩૦થી ૬ વાગ્યે ભાટિયા મહાજનવાડી, પ્રાર્થના હોલ ખાતે.

લક્ષ્મીપુર (તરા) : ધન્વંતીબેન તે સ્વ. રતનશીભાઇ કરમશી ચૌધરીના પત્ની, નારણભાઇના માતા તા. ૪-૭ના અવસાન પામ્યા છે. સાદડી તા. ૮-૭ના સવારે ૮થી ૧૦ બે કલાક માટે લક્ષ્મીપુર (તરા) પાટીદાર સનાતન સમાજવાડી ખાતે.

મોટી નાગલપુર (તા. અંજાર) : પ્રેમુબેન (ઉ. વ. ૮૭) તે વરજાંગભાઇ રત્નાભાઇ ટાંકના પત્ની, મોહનલાલ, નૌતમલાલના માતા, રીટાબેન, વર્ષાબેન, કિરણ, હિતેશ, રિતેશ, પ્રશાંતના દાદી, મૃદુલાબેન, ભારતીબેનના સાસુ, ધીરજલાલ, પ્રભુલાલ, અશ્વિનકુમાર, કપિલકુમારના દાદીસાસુ તા. ૬-૭ના દુર્ગ (છત્તીસગઢ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭-૭ના હાટકેશ્વર મંદિર, નાગલપુર ખાતે સવારે ૧૦થી ૧૧ વાગ્યે.

આશાપર (તા. અબડાસા) : મૂળ તેરાના **ભાનુશાલી મનોજ દિલીપ ભદ્રા** (ઉ. વ ૨૫) તે ભાનુશાલી રમેશ ટોપણદાસ ગજરાના જમાઇ તા. ૪-૭ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તેમના ભાઇ શંભુરામ ટોપણદાસ ગજરાના નિવાસસ્થાને તા. ૭-૭ના સવારે ૧૧ વાગ્યા સુધી આશાપર ખાતે.

રેલડિયા મંજલ (તા. અબડાસા) : સોઢા ધનુબા મેઘજી (ઉ. વ. ૯૪) તે સ્વ. મેઘજી ભીમજીના પત્ની, માધુભા, વીરમજી, કાનજીભાના માતા, પ્રતાપસિંહ, બનુભા, દિલુભા, ઉમરસંગ, ભરતસિંહ, દેવેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, રાજદીપસિંહના દાદી, મોડકુબાના સ્વ. જાડેજા હરિસંગજી માલજીના પુત્રી, સ્વ. રૂપસંગજી, સ્વ. ભોજરાજજી, જીલુભાના બહેન તા. ૬-૭ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રેલડિયા મંજલ ખાતે.

મુંદરા તા.ના રાજપૂત અગ્રણીના નિધનથી શોક ફેલાયો

કોટડા (ચ.), તા. ૬ : મુંદરા તાલુકાના મોખા ગામના જ નહીં પણ મોખા વડાલા પંથકના જાણીતા ગૌભક્ત, સમાજ સેવા અને રાષ્ટ્રીય પક્ષી મોરના રક્ષણ માટે સદા લાગણી ધરાવતા મદારસંગજી જાડેજાના અવસાનથી મુંદરા રાજપૂત ક્ષત્રિય સમાજના ગામડાઓમાં શોકની લાગણી ફેલાઇ હતી.

સ્વ. મદારસંગજી તમામ સમાજ પ્રત્યે લાગણી રાખતા તેમજ સમાજને વ્યસનોથી દૂર રહી દીકરા-દીકરીઓને શિક્ષણ અપાવવા ભલામણ કરતા. પંથકના અગ્રણીઓ જાલુભા ઉમરસંગજી, હરિસંગજી હમીરજી જાડેજા, સરપંચ ચકુભા શિવુભા, રામસંગજી ઉંમરસંગજી તેમજ વાઘજીબાપુ, પ્રાગજી દાનસંગજી વગેરેએ સદ્દગતની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તેવું તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજના ઉપપ્રમુખ મહોબ્બતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

માંડવીના વેપારીને શ્રદ્ધાંજલિ અપાઇ

માંડવી, તા. ૬ : કચ્છ ઓઇલ મિલવાળા નરોત્તમ ધનજી વેદનું હૈદરાબાદ ખાતે અવસાન થતાં વેપારી આલમમાં શોક ફેલાયો હતો. સ્વ.ની પ્રાર્થનાસભા ભાટિયા મહાજન વાડીમાં યોજાઇ હતી, જેમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

કચ્છ-માંડવી મર્ચ. એસો.ના પ્રમુખ લીનેશ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશી, વેપારી અગ્રણી લહેરીકાંત શાહ, શરદભાઇ જોશી વિ.એ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મુંબઈની મરણનોંધ

મોટા લાયજાના **હરખચંદ છેડા** (ઉ. વ. ૬૭) તે સ્વ. હીરબાઈ ચત્રભુજના પુત્ર. માલાના પતિ. દામજી, નવીન, સ્વ. વિમળા, ઉર્મીલા, જયવંતીના ભાઈ. લાયજાના સ્વ. હાંસબાઈ જેઠા વસાયાના દોહીત્રી અવસાન પામ્યાં છે. નિ. : હરખચંદ છેડા, સોનલ ઍપાર્ટમેન્ટ, બી વિંગ, ૧૦૭, આનંદ નગર, છત્રપતિ શિવાજી રોડ, દહિંસર (પૂ.). ફો. ૨૮૪૮૫૦૯૭.

મેરાઉના **રતનબેન ટોકરશી** (ઉ. વ. ૭૨) તે સ્વ. મણીબેન ટોકરશી વેલજીની પુત્રી. સ્વ. ખેતબાઈ, પ્રભા, લક્ષ્મીચંદ, સ્વ. મૂલચંદ, સરસ્વતીના બેન. બાડાના સ્વ. મેઘબાઈ પોપટલાલ ઠાકરશીના દોહીત્રી અવસાન પામ્યાં છે. ફો. ૯૨૨૬૨૨૩૮૨૫. ચક્ષુદાન કર્યું છે.

નાના આસંબિયા **હીરજી માવજી ગાલા** (ઉ. વ. ૮૩) તે દેવકાબેન માવજી વેલજીના પુત્ર. સ્વ. સુંદરબેનના પતિ. વાસંતી, તિમિરના પિતા. કુંવરજી રસિક, રતનબેન, મણીલાલ નાનજી, પુષ્પાબેન વાડીલાલના ભાઈ. ભુજપુરના નરશી અરજણ પટેલના જમાઈ અવસાન પામ્યાં છે. નિ. : તિમિર ગાલા, શ્રી દત્ત ઍપાર્ટમેન્ટ, બ્લૉક નં. બી-૮, ૨જે માળે, કિશન રોડ, મલાડ (પ.). ફો. ૨૮૮૨૦૪૬૩.

નાગલપુરના **તેજશી મોતા** (ઉ. વ. ૮૪) તે લીલબાઈ વીરશી વાગાના પુત્ર. પાનબાઈના પતિ. નેમચંદ, હેમચંદ, જ્યોતિ, મુકેશ, હરેશ, હીના, દિલીપ, ભારતીના પિતા. રતનશી, ચાંપશી, (મણીબાઈ) નેણબાઈ મગનલાલ, શાંતાબેન લાલજી, મીનાબેન પ્રાણલાલ, બિન્દુ બિકેશના ભાઈ. કોડાય ભાણબાઈ વીરજીના જમાઈ અવસાન પામ્યાં છે. નિ.: તેજશી વેરશી, બાલ ગણપતિ એપા., ચરઈ, થાણા (પ.). ફો. : ૨૫૩૬૯૮૬૩.

નવાગામ ભચાઉના **ગડા ચાંપશી કુંવરજી** (ઉ. વ. ૬૩) તે સ્વ. રત્નાબેન કુંવરજી લખમણ ગડાના પુત્ર. અમતના પતિ. પરેશ, હેતલ, રોશનીના પિતા. મેઘજી, પ્રેમજી, વાડીલાલ, અરવિંદ, મોંઘી, જવેર, લીલાવતી, અમૃત, શાન્તુના ભાઈ. આધોઈના સ્વ. કામલબેન ભચૂ ખેતાના જમાઈ અવસાન પામ્યાં છે. ફો. : ૯૮૯૨૯૪૨૫૦૫.

(સૌ. : ક.વી.ઓ. જૈન ખબરપત્રિકા)

Digitially Archived by: www.realpatidar.com/library

સ્ક્રીનવિન્ડો

ઐશના બચાવમાં બિગ બીઃ મધુર પર નારાજ

'હિરોઇન' મામલે જામેલા વિવાદ બાદ નિર્દેશક મધુર ભંડારકરે ગઇ કાલે ઐશ્વર્યા રાયે પોતે ગર્ભવતી હોવાનું સત્ય છુપાવ્યાનું જણાવ્યા બાદ અમિતાભે પોતાની પુત્રવધૂની વહારે આવતાં કહ્યું કે ઐશને કારણે પ્રોડક્શન હાઉસને ૧૮ કરોડની ખોટ ગયાની બાબતમાં કોઇ દમ નથી. તેમણે કહ્યું કે દરેક કલાકારને લગ્ન કરવાનો અને માતા-પિતા બનવાનો હક છે. બધા જાણતા હતા કે ઐશના લગ્ન થઇ ચૂક્યાં છે. તો શું તે માતા બનવાની હોય એટલે તેણે ફિલ્મ ન કરવી જોઇએ? આ પ્રકારની શરત કોઇ પણ કોન્ટ્રાક્ટમાં હોય જ નહીં એમ કહેતાં તેમણે મધુરની ઝાટકણી કાઢી હતી. દરમ્યાન, એવા પણ હેવાલ છે કે મધુરે ભલે હોબાળો મચાવ્યો હોય, ઐશને આ ફિલ્મ માટે હજુ કોઇ રકમ મળી જ નથી!

૨૦૧૨માં અગ્નિપથ થિયેટરમાં

ઋત્વિક રોશનને ચમકાવતી ૧૯૯૦ની 'અગ્નિપથ'ની રિમેક ૧૩ જાન્યુઆરી ૨૦૧૨માં થિયેટરોમાં રજૂ થશે તેવી સત્તાવાર જાહેરાત નિર્દેશક કરણ જોહરે ઋત્વિકના પાત્રના ફોટા જાહેર કરવા સાથે કરી હતી. ઋત્વિકે દીવના લોકેશનો પર ઊતરેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને રાષ્ટ્રીય પુરસ્કાર જીતાડી દેનાર 'વિજય દિનાનાથ ચૌહાણ'ની ભૂમિકા ભજવી છે. પ્રિયંકા મુખ્ય અભિનેત્રીના રૂપમાં છે જોકે મિથુને ભજવેલી ભૂમિકા આ રિમેકમાંથી ગાયબ હશે. સંજય દત્ત મુખ્ય વિલન જ્યારે રિશી કપૂર પણ નકારાત્મક ભૂમિકામાં આ ફિલ્મમાં નજરે પડનાર છે.

પ્રીટી ઝિન્ટા પણ બની ફિલ્મ નિર્માતા

ફિલ્મ અભિનેત્રી પ્રીટી ઝિન્ટા હવે નિર્માતા બની છે. તેની નિર્માતાના રૂપની પ્રથમ ફિલ્મ બનીને તૈયાર પણ થઇ ગઇ છે. સુસ્મિતા સેન, લારા દત્તા અને અમિષા પટેલની જેમ જ પ્રીટીએ 'ઇશ્ક ઇન પેરિસ' બનાવી છે જેનું નિર્દેશન પ્રેમ સોનીએ કર્યું છે. જોકે તેમાં કોણ ભૂમિકા ભજવે છે તે અંગે વિગતો બહાર આવી નથી. પ્રીટીએ કહ્યું કે તે પોતાની પહેલી ફિલ્મની રજૂઆતને લઇને ઉત્સાહિત છે.

સલમાને રાજ બબ્બરને કાર ભેટ આપી

બોલીવૂડના દબંગ સલમાન ખાને અભિનેતા અને કોંગ્રેસી સાંસદ રાજ બબ્બરને એક લક્ઝરી કારની ભેટ આપી લોકોને ચોંકાવી દીધા છે. સલમાનની 'બોડીગાર્ડ'માં કરીના કપૂરના પિતાની ભૂમિકા શત્રુઘ્નસિંહાએ ના પાડીને લટકાવી દીધા બાદ રાજે તે સ્વીકારી હતી અને તે માટે એક પણ રૂપિયો ફી લીધી ન હતી. આ ઉપકારથી દબાયેલા સલમાને શૂટિંગના અંતિમ દિને અભિનેતાને આ કાર ભેટ આપીને ગળગળો બનાવી દીધો હતો.

દીપિકાએ કેટરિનાની નકલ કરી!

દીપિકા પાદૂકોણ 'આરક્ષણ' ફિલ્મમાં રણબીર કપૂરની પૂર્વ મિત્ર કેટરિના કૈફની જેમ જ એક ગીત ભજવશે. જાણવા મળ્યા પ્રમાણે દીપિકાએ નિર્દેશક પ્રકાશ ઝા પાસે ખાસ માગણી કરીને 'રાજનીતિ'ના 'મોરે પિયા' જેવું જ ગીત ફિલ્મમાં મુકાવ્યું છે.અભિનેત્રીએ કહ્યું કે મને તે ગીત બહુ ગમ્યું હતું એટલે મેં તેવા જ ગીતને મારા પર પણ ફિલ્માવવામાં આવે તેવી માંગ કરી હતી. આ ગીત દીપિકા અને સૈફઅલી ખાન પર ફિલ્માવવામાં આવશે.

મિથુનની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને સાજિદ ખાનની 'હાઉસફૂલ-૨'ના લંડન ખાતે ચાલી રહેલાં શૂટિંગ દરમ્યાન તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મિથુનને પેટમાં ભારે દુઃખાવા બાદ સારવાર હેઠળ લવાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેની તબિયત હવે સારી છે અને ચિંતાનું કોઇ કારણ ન હોવાનું નિર્માતા સાજિદ નડિયાદવાલાએ જણાવ્યું હતું.

ત્રીજી ટેસ્ટમાં ભારતનો મજબૂત પ્રારંભ

ડોમિનિકા, તા. ૬ : અહીં શરૂ થયેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં આજે પ્રવાસી ભારતીયોએ વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં માત્ર ૭૫ રને ત્રણ વિકેટ ઊડાડી દઇ મેચનો મજબૂત પ્રારંભ કર્યો હતો.

વન-ડે બાદ રમાતી ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને મહત્ત્વની મેચમાં ભારતે ટોસ જીતીને યજમાન વિન્ડિઝને દાવમાં ઉતારવાનું નક્કી કર્યું હતું. એ પછી ફરી ઇશાંત શર્મા ઝળક્યો હતો અને એક તબક્કે માત્ર ૩૫ રનમાં ત્રણ વિકેટે વિન્ડિઝની ટીમ સંઘર્ષ કરતી હતી પરંતુ બ્રેવો (અણનમ ૨૨) અને ચંદરપૌલ (અણનમ ૧૭)એ રાત્રે આ લખાય છે ત્યારે દાવને સંભાળી લીધો હતો.

વિન્ડિઝ પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૭૫ રન : ઇશાંત શર્મા બે વિકેટ

વિન્ડિઝ વતી ઓપનિંગમાં આવેલો બરાથ માત્ર ૧૨ રને શર્માના હાથે બોલ્ડ થયા બાદ પોવેલ પ્રવીણકુમારના દડામાં માત્ર ત્રણ રન બનાવી લક્ષ્મણના હાથ ઝીલાઇ ગયો હતો. એ પછી વધુ ૧૧ રનના ઉમેરામાં જ ફરી ઇશાંત શર્માના દડામાં એડવર્ડ માત્ર છ રન બનાવી ધોનીના હાથે કેચઆઉટ થઇ ગયો હતો.

પ્રવીણકુમારે ૧૯ રન આપી એક તથા ઇશાંત શર્માએ માત્ર ૨૩ રન આપી બે વિકેટ ખેરવી ભારતનો સબળ પ્રારંભ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. છેલ્લા હેવાલ મળ્યા ત્યારે વિન્ડિઝ ૩ વિકેટે ૭૫ રને સંઘર્ષ કરતું હતું. ઉલ્લેખનીય છે કે ભારત શ્રેણીમાં ૧-૦થી આગળ છે.

ડોમિનિકા ટેસ્ટના પહેલા સત્રમાં કિરોન પોવેલની વિકેટ પડ્યા બાદ ઉજવણી કરી રહેલી ટીમ ઇન્ડિયા.

પિકાસોના ચિત્રો ચોરાયાં

આર્ટ ગેલેરીમાંથી લાખો ડોલરના ચિત્રોની ઉઠાંતરીથી ખળભળાટ

સાન ફ્રાન્સિસ્કો, તા.૬ : સાન ફ્રાન્સિસ્કો આર્ટ ગેલેરીમાંથી પ્રસિદ્ધ ચિત્રકાર પાબ્લો પિકાસોના અતિમૂલ્યવાન ચિત્રની ચોરી થઇ ગયાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ચોરાયેલા પઇન્ટિંગ્સની કિંમત લાખો ડોલર હોવાનું પોલીસનું કહેવું છે.



પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે યુનિયન સ્ક્વેયરઆર્ટ ગેલેરીમાં કોઇ અજ્ઞાત શખ્સ ઘૂસી આવ્યો હતો અને તે પિકાસોનાં કેટલાંક કિંમતી ચિત્રોની ઉઠાંતરી કરીને ટેક્સી કેબમાં ફરાર થઇ ગયો હતો.

આર્ટ ગેલેરીના વિશેષજ્ઞોના કહેવા મુજબ 'ટેટે દી ફેમે' નામના આ બધાં ચિત્રો પિકાસોએ ૧૯૬૫માં બનાવ્યાં હતાં. આ ચિત્રોમાં ઓઇલ પેઇન્ટિંગ અને કલર્સની જગ્યાએ પેન્સિલ શેડોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પિકાસો ઉપરાંત માર્ક શેજેલ, સાલ્વાડોર ડાલી અને જોન મિરો જેવા કલાકારોના ચિત્રોની પણ ચોરી કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્રંબૌમાં મેઘવંશી મારૂ સમાજ ક્રિકેટ ટૂર્ના.માં આંબેડકર ટીમ વિજેતા

ત્રંબૌ (તા. નલિયા), તા. ૬ : ત્રંબૌના સૈયદ મામદછા પીર દરગાહ ગ્રાઉન્ડ ખાતે મેઘવંશી મારૂ સમાજ-ત્રંબૌ આયોજક સમિતિ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ રામદેવ ઇલેવન (ભાદરા) અને આંબેડકર ઇલેવન (નલિયા) વચ્ચે રમાઇ જેમાં આંબેડકર ઇલેવનનો વિજય થયો હતો. ફાઇનલ મેચમાં દેવજી મારવાડા (પિયોણી રામપર) મેન ઓફ ધી મેચ બન્યા હતા. યુવાનોને પ્રોત્સાહન ઇનામો મહેમાનો દ્વારા અપાયાં હતાં. તેમજ નલિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હાજી અલાના ભુંગર તેમજ રામપર અબડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ હિરજીભાઇ પી. સીજુ (લૈયારી) તેમજ પશ્ચિમ કચ્છ મેઘવંશી મારૂ યુવા સંઘના પ્રમુખ કુડેચા ભારમલ આર., સહમંત્રી હરિલાલ બડિયા, રામપર અબડા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ જાડેજા મેઘરાજનું તેમજ ત્રંબૌ ગામના આગેવાન પચાણ કે. સોધમ, લાલજી એસ. સોધમ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સમિતિમાં દેવજી પચાણ સોધમ, મેઘજી ગોવિંદ ખોખર અને દેવજી અરજણ સોધમ રહ્યા હતા.

પ્રયોગશીલ ફિલ્મકાર મણિ કૌલનું નિધન

નવી દિલ્હી, તા.૬ : આધુનિક ભારતીય સિનેમાના પ્રતિનિધિ લેખાતા જાણીતા ફિલ્મકાર મણિ કૌલનું લાંબી બીમારી બાદ આજે ૬૬ વર્ષની વયે અવસાન થતાં બોલીવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગઇકાલે જ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમને ઘરે લવાયા હતા જ્યાં તેમણે આજે બપોરે ૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા એમ તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.



રાજસ્થાનના જોધપુરમાં કાશ્મીરી પરિવારમાં જન્મેલા કૌલે આધુનિક સિનેમાની પ્રયોગાત્મક ફિલ્મ બનાવનારા ફિલ્મકારોમાં સ્થાન મેળવ્યું હતું.

કૌલે ૧૯૬૯માં 'ઉસકી રોટી'થી કારકિર્દી આરંભી હતી જેને ફિલ્મફેર ક્રિટીક્સ પુરસ્કાર મળ્યો હતો. કૌલે તે પછી 'અશદ કા એક દિન', 'દુવિધા' અને 'ઇડિયટ' જેવી ફિલ્મ બનાવી હતી જે તમામને પુરસ્કાર મળ્યા હતા.

રમતના રંગ

ત્રણ વિકેટ ઝડપીને શ્રીલંકાની છાવણીમાં તરખાટ મચાવનાર જેમ્સ એન્ડરસન.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પરથી સરકારી હસ્તક્ષેપ દૂર થશે

કરાચી, તા. ૬ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પી.સી.બી)એ આઇ.સી.સી.ના એ દીશા નિર્દેશને પડકારશે નહીં જેમાં તમામ સભ્ય દેશોને તેમના બોર્ડ પરથી સરકારનો હસ્તક્ષેપ હટાવી સ્વાયત્ત કરવાનું કહેવાયું છે. પી.સી.બી. તેના માળખામાં જરૂરી ફેરફાર કરવાના પ્રયાસ કરશે. શ્રીલંકાએ તો આઇ.સી.સી.નો આ આદેશ લગભગ સ્વીકારી જ લીધો છે અને સરકારી હસ્તક્ષેપ દૂર કરવાના ભાગરૂપે શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું માળખુ વિખેરી નાંખ્યું છે.

પી.સી.બી.ના મુખ્ય સંચાલન

આઇસીસીના આદેશની અસર : લંકા બોર્ડે માળખું વિખેરી નાખ્યું

અધિકારીએ આ બારામાં જણાવ્યું છે કે, આઇ.સી.સી.ના આ આદેશનું તમામ સભ્ય દેશો પાલન કરે અને તેનો અમલ કરે. આઇ.સી.સી.ના આ આદેશને પડકારવા કોર્ટમાં જવાની પી.સી.બી.ની કોઇ યોજના નથી.

પાક ક્રિકેટ બોર્ડમાં દેશના રાષ્ટ્રપતિ સરંક્ષક અને સુપ્રિમો હોય છે. તે કોઇને દેખરેખ માટે ચેરમેન બનાવે છે. જે મોટાભાગે સેનાના કોઇ નિવૃત્ત અધિકારી હોય છે. તેમાંથી સરકારી હસ્તક્ષેપ દૂર થશે. આવી જ રીતે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડનું સંચાલન દેશના ખેલ મંત્રાલય હસ્તક હતું, જેને હવે બરખાસ્ત કરવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડની ટી-૨૦ લીગમાં અરુલ સુપૈયાની પાંચ રનમાં છ વિકેટ

લંડન, તા. ૬ : કાઉન્ટી ક્લબ સમર સેટના એક સ્પિનર અરુલ સુપૈયાએ એક ટવેન્ટી-૨૦ મેચમાં ૬ વિકેટ લેવાના પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ તનવીરના વિક્રમને તોડી નાખ્યો છે. સુપૈયાએ ગ્લેમોર્ગન સામે ફ્રેન્ડસ લાઇફ ટી-૨૦ લીગના મેચમાં માત્ર પાંચ રન આપી ૬ વિકેટ ઝડપીને તનવીરના ૧૪ રનમાં ૬ વિકેટ લેવાના વિક્રમને તોડી નાખ્યો હતો. તનવીરે વર્ષ ૨૦૦૮માં આઇપીએલમાં રાજસ્થાન તરફથી રમીને ચેન્નાઇ વિરુદ્ધ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. સુપૈયાની ચમત્કારિક બોલિંગ સામે ગ્લેમોરગોનની ટીમ ૧૭.૪ ઓવરમાં ૯૮ રન કરી શકી હતી. જવાબમાં સમરસેટે ૨૧ દડા બાકી રાખી જીત મેળવી લીધી હતી. જેમાં કિરોન પોલાર્ડના ૨૦ દડામાં અણનમ ૩૧ રન મુખ્ય હતા.

ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમમાંથી વ્હાઇટને પડતો મુકાયો

સિડની તા. ૬ : ઓસ્ટ્રેલિયાએ તેના ઓલરાઉન્ડર કેમરૂન વ્હાઇટને આવતા મહિને શ્રીલંકાના પ્રવાસે જનારી વન ડે ટીમમાંથી બહાર કરી દીધો છે. પરંતુ તેને ટવેન્ટી-૨૦ ટીમના સુકાની તરીકે ચાલુ રખાયો છે. ૨૭ વર્ષીય વ્હાઇટના સ્થાને ઓસી. ટીમમાં શોન માર્શને સ્થાન મળ્યું છે. વ્હાઇટ વિશ્વકપમાં સારું પ્રદર્શન કરી શકયો ન હતો. આથી તેને શ્રીલંકાના પ્રવાસમાંથી પડતો મુકવામાં આવ્યો છે.

વિશ્વકપ બાદ વન ડેમાંથી નિવૃત્તિ લઇ લેનાર શોન ટેટના સ્થાને ડગ બોલિંગરની વાપસી થઇ છે. માઇકલ કર્લાકના સુકાનીપદ હેઠળની ટીમમાં વનડાઉન બેટ્સમેન તરીકે પોન્ટિંગને જાળવી રાખવામાં આવ્યો છે. જ્યારે પુનરાગમન કરનાર બ્રેટ લીને વન ડે અને ટી-૨૦ બન્ને ટીમમાં સ્થાન અપાયું છે.

લંકાના પ્રવાસ માટે ટીમ જાહેર : કેમરૂન, જો કે ટી-૨૦ના સુકાનીપદે યથાવત

જ્યારે ડેવિડ વોર્નરને ટી-૨૦ ટીમમાં ઓપનર તરીકે સ્થાન અપાયું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ સાત સપ્તાહના પ્રવાસમાં શ્રીલંકામાં બે ટવેન્ટી-૨૦ મેચ, પાંચ વન ડે અને ત્રણ ટેસ્ટ રમશે. ટેસ્ટ ટીમ બાદમાં જાહેર થશે.

વન ડે ટીમ : કર્લાક (સુકાની), વોટસન, બોલિંગર, જેવિયર ડોહતી, હેડિન (વિકેટકીપર), હેસ્ટિંગ, માઇકલ હસી, ડેવિડ હસી, જોનસન, બ્રેટ લી, જેમ્સ પેટિન્સન, પોન્ટિંગ અને સ્ટીવન સ્મિથ.

સોના અને ચાંદી બજારમાં તેજી

રાજકોટ, તા. ૬ : બુલિયન બજારમાં નીચલા સ્તરેથી ખરીદી નીકળતાં ઉછાળો આવ્યો હતો. યુરોપની દેવાની કટોકટીનું જોખમ હજુ ટળ્યું નથી અને ક્રૂડતેલના ભાવ પણ દિવસની તળિયાની સપાટીએથી ફરી ઊંચકાઇ જતાં વૈશ્વિક બજારમાં સલામત રોકાણ માટેની લેવાલીથી સોનું ૧૫૨૮ ડોલર અને ચાંદી ૩૫.૯૦ ડોલરની સપાટીએ પહોંચી હતી.

ડોપિંગ કાંડમાં કલમાડીનો હાથ ?

નવી દિલ્હી, તા. ૬ : કોમનવેલ્થ રમતોના કૌભાંડથી દેશને શરમજનક સ્થિતિમાં મૂકનારા સુરેશ કલમાડીએ ફરી એકવાર દેશને દગો દીધો હોવાની વાત બહાર આવી રહી છે. રમતગમત મંત્રી અજય માકને ખુલ્લો આક્ષેપ કર્યો છે કે હાલના ડોપિંગ કૌભાંડ પાછળ કોમનવેલ્થની આયોજન સમિતિના પૂર્વ અધ્યક્ષ કલમાડીનો હાથ છે.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં માકને જણાવ્યું હતું કે, ડોપિંગ કાંડ માટે કલમાડી જવાબદાર છે. આ કૌભાંડમાં કલમાડી અને તેમના સહયોગી સમિતિના મહામંત્રી લલિત ભનોટની સંદિગ્ધ ભૂમિકાની તપાસ કરવામાં આવશે. અનેક એથ્લેટોએ માકનની આ પહેલનું સ્વાગત કર્યું છે. જો કે, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ

ખેલમંત્રી માકનનો આક્ષેપ : સુરેશ અને વિનોદની ભૂમિકાની તપાસ થશે

ઇન્ડિયાએ ડોપિંગના આરોપો અંગે જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી કોમનવેલ્થ રમતોમાં ટેન્ડરોમાં ગેરરીતિ, સ્ટેડિયમોના નિર્માણમાં ગોટાળા વગેરેને લઇને કલમાડી હાલ તિહાર જેલમાં છે.

ગત એક સપ્તાહમાં જ આઠ એથ્લિટ ડોપિંગના દોષી પુરવાર થયા છે, જેમાં કોમનવેલ્થ રમતો અને એશિયાડ ભારત માટે સુવર્ણચંદ્રક જીતનારી ખેલાડી પણ સામેલ છે. ડોપિંગના કલંકથી ભારતીય રમતજગત માટે ક્ષોભની સ્થિતિ સર્જાઇ છે, તો લંડન ઓલિમ્પિકમાં ચંદ્રકોની આશાને પણ મોટો ફટકો પડ્યો છે. માકને ગઇકાલે જ વિદેશી એથ્લેટિક્સ કોચ યુક્રેઇનના યુરીની હકાલપટ્ટી કરી હતી.

વાગડ સાત ચોવીસી જૈન ક્રિકેટ સ્પર્ધામાં વિજયી થયેલી સંભવનાથ ઇલેવનના ખેલાડીઓ દેખાય છે.

વિદેશી એથ્લીટ કોચની હકાલપટ્ટી

નવી દિલ્હી, તા. ૬ : એથ્લીટોમાં ડોપ કૌભાંડની ગંભીર નોંધ લઇને સરકારે આજે ભારતના વિદેશી એથ્લેટીક્સ કોચ યૂરી ઓર્ગોડનીકની હકાલપટ્ટી કરી આ ફિયાસ્કોની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી. રમત-ગમત મંત્રી અજય માકને કહ્યું હતું કે, મેં યુરીની હકાલપટ્ટીનો આદેશ આપ્યો છે. જે એથ્લીટોના ડોપ પરીક્ષણ પોઝીટીવ આવ્યા છે એ તમામના વિદેશી કોચ હટાવવામાં આવશે.

માકને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, આઠ એથ્લેટોના ડોપ ટેસ્ટ

ખેલાડીઓના પરીક્ષણ નેગેટિવ આવ્યા બાદ ખેલમંત્રીની કડક કાર્યવાહી

પોઝીટીવ આવ્યા એ ખેલજગત અને સમગ્ર દેશ માટે કલંકની ઘટના છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના બને નહીં એ માટે અમે કોચ તથા અધિકારીઓ વિરુદ્ધ આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો છે. અમે આ ખેલાડીઓ સાથે સંકળાયેલા વિદેશી કોચ (યુક્રેઇનના યુટી ઓગ્રોડનીક)ને તાત્કાલિક અસરથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ કાંડમાં બીજા કોઇ અધિકારીઓ દોષિત હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

મેં રમત-ગમતના સચિવને હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા એનએડીએની શિસ્ત સમિતિના અધ્યક્ષના વડપણ હેઠળ એક તપાસ સમિતિ નીમવાનો પણ આદેશ આપ્યો છે. આ પેનલ ભવિષ્યમાં આવો ઘટનાક્રમ સર્જાય નહીં એ માટેના નક્કર પગલાં સૂચવશે.

દિલ્હી કોમનવેલ્થ રમતોમાં સુવર્ણચંદ્રક જીતનારી અશ્વિની અંકુજી અને પ્રિયંકા અનવરનું ડોપ પરીક્ષણ પોઝીટીવ આવ્યો હતો.

નકસલવાદ સામે લડતા દળો માટે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ

નવી દિલ્હી, તા. ૬ (પીટીઆઇ) : કેન્દ્ર સરકાર નકસલવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવા તૈનાત ૭૦ હજારથી વધુ અર્ધલશ્કરી દળોને ખાસ પ્રકારની હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડશે તેવું એક અહેવાલના આધારે જાણવા મળે છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયના ચકાસણી અહેવાલના આધારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ડાબેરી પાંખના અંતિમવાદ, ઉત્તર-પૂર્વમાં બળવાખોરી સામે લડાઇ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી જેવી ત્રણ 'વ્યૂહાત્મક' કાર્યવાહી માટે હવાઇ એમ્બ્યુલન્સ તૈનાત કરાશે.

સંચાર નિગમના કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો : ૧૨૦ જણે લીધેલો લાભ

ભુજ, તા. ૬ : ટેલિકોમ રિક્રિએશન ક્લબ ભુજ દ્વારા બીએસએનએલના કર્મચારી તથા તેમના પરિવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેલ્શિયમ ચેકઅપ, હિમોગ્લોબિન, ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની તપાસણી કરવામાં આવી હતી. જનરલ મેનેજર આશિષ ઠાકરે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રી મનીષ વૈદ્ય દ્વારા ટીઆરસીની પ્રવૃત્તિનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. ડીજીએમ એસ. વી. પટેલ તથા ડી. વી. ઓડેદરાએ અલગ અલગ પ્રવૃત્તિ કરવાના સૂચન કર્યાં હતાં. ૧૨૦ કર્મચારીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

મેડિકલ કેમ્પ વિશેની માહિતી એન. કે. પટેલે આપી હતી. આભારવિધિ પ્રમુખ પી. બી. વ્યાસે કરી હતી. ઇકબાલ બેકરીવાલા, પ્રકાશ ભટ્ટ, કે. સી. ભટ્ટ, તુલસી શાહ, એ. જે. ખોજા, કાંતિ દાવડા, અઝીઝ ખાવડા, નીતિન ઠક્કરે સહયોગ આપ્યો હતો.

સિદ્ધિને સલામ

નાના કપાયા અદાણી શાળાની છાત્ર પરિષદના ડેપ્યૂટી મેયર વરાયા

મુંદરા : નાના કપાયા ખાતે અંગ્રેજી માધ્યમની અદાણી ડી.એ.વી. પબ્લિક સ્કૂલમાં ધો. ૧૧માં અભ્યાસ કરતી સ્વપ્નીલ હિતેશ સ્વાલી શાળાની પરિષદમાં સતત પાંચમી વખત કાઉન્સિલ મેમ્બર તરીકે ચૂંટાઇ આવતાં હાલે તેને ડેપ્યૂટી મેયર તરીકે સન્માનવામાં આવ્યા ત્યારે કચ્છી પાઘડી પહેરાવી વિશેષ માન અપાયું હતું.

વાગડ સાત ચોવીસી જૈન ક્રિકેટ ટૂર્ના.માં સંભવનાથ ઇલેવન વિજેતા

ભુજ, તા. ૬ : વાગડ સાત ચોવીસી જૈન સમાજ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ફાઇનલમાં સંભવનાથ ઇલેવન તથા પદ્માવતી ઇલેવન વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં સંભવનાથની જીત થઇ હતી.

નરેન્દ્ર ચંદુરા, કૈલાસ મહેતા, મહેશ ગઢેચા, અમીષ મહેતા તથા પ્રતીક મહેતા દ્વારા મેચને સ્ટાર્ટ અપાયો હતો. સંભવનાથ ઇલેવને ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ વિપુલ મહેતાએ જેમણે ૧૬ બોલમાં ૪૫ રન કરી ટીમને વિજય અપાવ્યો હતો. જૈન સમાજના ભાઇ-બહેનો હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ટૂર્નામેન્ટમાં અમ્પાયરની સેવા નરેશ પરમાર તથા કીર્તિ પંડ્યાએ આપી હતી. સ્કોરરની સેવા પ્રશાંત ખંડોર અને કોમેન્ટેટર તરીકે અનિલ ડાભીએ સેવા આપી હતી. વિમલ ગાંધી, વર્ધમાન વોરા, દર્શન વોરા, રીતેશ ભણશાલી, રીતેશ સંઘવી તથા યુવા ગ્રુપના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન અને માર્ગદર્શન ક્રિકેટ કોચ જયેન્દુ શુક્લા તથા ગિરીશભાઇ ઝવેરીએ આપ્યું હતું.

Digitially Archived by: www.realpatidar.com/library

હવે બહેરા-મૂંગા લોકો ફોનથી વાત કરે છે !

વીડિયો કોલિંગથી આનંદ સાથે વાતચીત કરતા શૈલેશભાઇ અને અંજનાબેન તસવીરમાં નજરે પડે છે. (કચ્છમિત્ર ફોટો)

ઉદય અંતાણી દ્વારા

ગાંધીધામ, તા. ૬ : એલેકઝાન્ડર ગ્રેહામ બેલે ૧૮૭૬માં જ્યારે ટેલિફોનની શોધ કરી ત્યારથી સમયાંતરે સંદેશાવ્યવહાર ક્ષેત્રમાં આધુનિકતા સાથે એસ.ટી.ડી., આઇ.એસ.ડી., મોબાઇલ ફોન સહિતની ક્રાંતિ થતી રહી છે, પરંતુ આ સેવાઓનો ઉપયોગ બોલતા અને સાંભળતા લોકો જ કરી રહ્યા છે. તાજેતરમાં બીએસએનએલની થર્ડ જનરેશન (થ્રીજી)ની વીડિયો કોલિંગ સુવિધાથી જન્મથી જ શૂન્ય અવકાશ વચ્ચે ઘેરાયેલા બહેરા-મૂંગા લોકો પણ સંદેશાવ્યવહાર સાથે જોડાઇ શકે છે. ટૂંકમાં દૂરસંચારની વ્યવસ્થા આ લોકોને ફોનની શોધના સેંકડો વર્ષ પછી પહોંચી છે.

મૂળ માંડવીના અને કંડલા પોર્ટમાં ફરજ બજાવતા શૈલેશભાઇ

થ્રીજીની વીડિયો કોલિંગ સેવાનો લાભ લઇને હવે સમગ્ર પરિવાર જીવંત સંપર્ક સાધી શકે છે : ટેલિફોનની શોધના સેંકડો વર્ષ પછી સુવિધાથી આનંદ

દવે અને તેમના પત્ની અંજનાબેન જન્મથી કુદરતી કોપનો ભોગ બન્યા છે. લગભગ પખવાડિયા પૂર્વે જ થ્રીજી સુવિધા સાથેના બે મોબાઇલ ફોન ખરીદ્યા બાદ શૂન્ય અવકાશ વચ્ચે ઘેરાયેલા આ દંપતીના જીવનમાં ખુશીનો સૂરજ ઉગ્યો છે. જ્યાં સુધી થ્રીજી મોબાઇલ ન હતો ત્યાં સુધી શૈલેશભાઇ બહાર ગયા હોય કે નોકરી પર હોય તેમજ તેમના અન્ય પરિવારજનો સાથેનો સંપર્ક શક્ય જ ન હતો, પરંતુ થ્રીજી મોબાઇલ બાદ વીડિયો કોલિંગથી એ હવે શક્ય બન્યું છે.

'કચ્છમિત્ર'ની ટીમે તેમની મુલાકાત લીધી ત્યારે બંને દંપતીઓના ચહેરા પર થ્રીજી સેવાથી તેમના જીવનમાં આવેલી ખુશી સ્પષ્ટ જણાઇ આવતી હતી. અંજનાબહેનના જૂનાગઢ ખાતે રહેતા માતા-પિતા, ભાઇ, ભાભી, બહેન બધા બહેરા-મૂંગા છે. થ્રીજી મોબાઇલ આવ્યા બાદ હવે તેમના પરિવારજનો સાથે ઇશારાની ભાષાથી વાતચીત કરી જીવંત સંપર્ક શક્ય બન્યો છે. શૈલેશભાઇના સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ ખાતે ૩૦ જેટલા બહેરા-મૂંગા મિત્રો સાથે દરરોજ સંપર્ક શક્ય બનતાં તેઓમાં આનંદની લાગણી વ્યાપી છે. તેઓ ઘણા સમયથી બાઇક ચલાવે છે, પરંતુ હજુ સુધી અકસ્માત થયો ન હોવાનું તેમણે કહ્યું હતું.

શૈલેશભાઇના ભાઇ અને માંડવીના પૂર્વ નગરપતિ અનિરુદ્ધભાઇ દવેએ કહ્યું હતું કે, થ્રીજી મોબાઇલ સેવાના કારણે શૈલેશભાઇ અને અંજનાબેન ગાંધીધામ હોય ત્યારે તેમની સાથેનો સંપર્ક વધુ અવિરત સરળ રહ્યો છે. વીડિયો કોલિંગની સુવિધા બહેરા-મૂંગા વ્યકિતઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ હોવાની લાગણી તેમણે વ્યકત કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધી એસએમએસથી સંપર્ક થતો હતો, પરંતુ તેમાં સંપૂર્ણ રીતે વાતચીત થઇ શકતી ન હતી.

અત્યાર સુધી વિવિધ સંસ્થા કે મંડળો ગુજરાતના વિવિધ શહેરોમાં મિલન કે બેઠકનું આયોજન કરે ત્યારે જ બહેરા-મૂંગા લોકો તેમના મિત્રો સાથે સંપર્કમાં આવતા હતા, પરંતુ આ લોકો માટે સંદેશાવ્યવહાર ક્ષેત્રે હવે જ થયેલી થ્રીજીની શોધથી તેમનું સામાજિક જીવન શક્ય બન્યું છે, જે ખરેખર આનંદની વાત છે.

અંજારની શાળા નં. ૭ને રોટરી દ્વારા આર.ઓ. પ્લાન્ટની ભેટ અપાઇ

અંજારની શાળા નં. ૭ને આર.ઓ. પ્લાન્ટની ભેટના કાર્યક્રમમાં રોટરી પ્રમુખ પ્રવીણભાઇ સોરઠિયા, મંત્રી એલ.વી. વોરા વગેરે.

અંજાર, તા. ૬ : અહીંની નગર પ્રા. શાળા નં. ૭માં અભ્યાસ કરતા ઝૂંપડપટ્ટી વિસ્તારના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાને લઇને રોટરી ક્લબ તરફથી તા. ૨૭ના આર.ઓ. પ્લાન્ટની ભેટ અપાઇ હતી.

આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ પ્રવીણભાઇ સોરઠિયા, મંત્રી એલ.વી. વોરા, સભ્ય કાનજીભાઇ સોરઠિયા, કિશોરભાઇ દક્ષિણી, રવિભાઇ, શિરીષભાઇ હડિયા, પ્રા. શિક્ષણ સમિતિના શાસનાધિકારી કે.એસ. સિંધવ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર કિશોરભાઇ ખીમાણી હાજર રહ્યા હતા.

આચાર્ય હસમુખભાઇ પટેલે સ્વાગત કર્યું હતું. આર.ઓ. પ્લાન્ટનું ઉદ્ઘાટન મંત્રી શ્રી વોરાએ રોટરીની સેવાઓની માહિતી આપી હતી. શિક્ષિકા કુસુમબેન હડિયાએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું. અમરીશભાઇ પટેલે આભારવિધિ કરી હતી. મહેમાનોએ ભૂલકાઓને મીઠાઇનું વિતરણ કર્યું હતું.

મુખ્ય અધિકારીને ૫૦૦ની સત્તા!

ગાંધીધામ, તા. ૬ : અહીંની નગરપાલિકા વાર્ષિક ૮ કરોડનું અંદાજપત્ર ધરાવે છે પણ તેના મુખ્ય અધિકારીને માત્ર ૫૦૦ રૂપિયાની જ ખર્ચની સત્તા જયારે કારોબારી સમિતિને ૫૦૦૦ની સત્તા મળેલી છે. આ સંજોગોમાં વહીવટ ચલાવવો મુશ્કેલ હોવાથી શાસકોએ કામચલાઉ પણ લાંબા સમયથી વાર્ષિક કોન્ટ્રેક્ટનો હલ કાઢયો છે અલબત્ત ભુજ નગરપાલિકામાં ખાસ મંજૂરી મેળવીને આ સત્તા વધારાઇ છે તેથી ઠેઠ હવે તે દિશામાં જવાની વાત થઇ રહી છે.

નગરપાલિકાના સૂત્રોના કહેવા પ્રમાણે કચ્છની સૌથી મોટી ગણાતી આ સુધરાઇના અત્યાર સુધીના શાસકોએ કામચલાઉ રીતે જ વહીવટ ચલાવ્યે રાખ્યો. નગરપાલિકા અધિનિયમની જોગવાઇ સુધારવાની કોઇએ પહેલ ન કરી જેને જાણકારો તથા વિપક્ષ શંકાની નજરે જોઇ રહ્યા છે.

વિપક્ષી નેતા સંજય ગાંધીએ જણાવ્યું હતું કે ૪૫ ડી તળે પ્રમુખને મળતી સત્તાનો માત્ર

ગાંધીધામની કારોબારીને પણ માત્ર ૫૦૦૦ના જ ખર્ચની જૂની જોગવાઇ અવરોધરૂપ : નિયામકની મંજૂરી માગવા શાસકોની ખાતરી

આકસ્મિક કિસ્સામાં જ ઉપયોગ કરી શકાય પરંતુ તેને બદલે રોજિંદા કામો પણ આ જોગવાઈ તળે જ કરાઈ રહ્યા છે. જે શંકાસ્પદ ગણાય. કોંગ્રેસે આ અંગે અનેક વખત અવાજ ઉઠાવ્યો પણ શાસકો બહુમતીના જોરે ઠરાવો મંજૂર કરાવતા રહ્યા છે. ખરેખર ગાંધીધામે પણ ભુજની જેમ સત્તા વધારવા સામાન્ય સભામાં ઠરાવ લાવવો જોઇએ તેવું તેમણે ઉમેર્યું હતું. દર ત્રણ મહિને સામાન્ય સભા મળતી હોવાથી કોન્ટ્રેક્ટ ત્રણ મહિનાના જ થવા જોઇએ. વાર્ષિક કોન્ટ્રેક્ટ બાદ જો ભાવોમાં વધઘટ થાય તો તેવા કિસ્સામાં પાછળથી ભાવ તફાવત આપવો પડે જે સામાન્ય સભામાં લાવવો પડે. અન્યથા પાર્ટી કામ ન કરે તો કામ રખડી પડે.

કારોબારી ચેરમેન દીપક પારખે મુશ્કેલીનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં આ જૂની જોગવાઈ ચાલે નહીં. અમે સત્તા સંભાળી તે પહેલાંથી આ પદ્ધતિ ચાલે છે પરંતુ હવે કારોબારી અને મુખ્ય અધિકારીની ખર્ચની મર્યાદા વધારવા અમે સામાન્ય સભામાં ઠરાવ કરીને ગાંધીનગર કક્ષા એ મંજુરી અર્થે મોકલશું.

વાસ્તવિકતા તો એ છેકે આજે બજારમાં સ્ટ્રીટલાઈટનો બલ્બ પણ ૫૦૦ રૂપિયામાં આવતો નથી ત્યારે મુખ્ય અધિકારી પાસેથી કોઈ સમસ્યાના ઉકેલની અપેક્ષા વધુ પડતી ગણી શકાય.

નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો હવે ગંભીર બનીને આ પ્રશ્ને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા કટિબદ્ધ બને તે સમયની માંગ છે.

ચોપડવા ભંગાર ચોરી અંગે બે જણની થયેલી અટક

ગાંધીધામ, તા. ૬ : ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આવેલી એક ખાનગી કંપનીમાંથી રૂા. ૬૦૦૦ના ૩૦૦ કિલો ભંગારની ચોરી કરનાર એક ટવેરાચાલક અને ખાનગી સુરક્ષા કર્મીને પોલીસે પકડી પાડ્યો હતો. ચોપડવા નજીક આવેલી સુઝલોન નામની કંપનીમાંથી એસ.એસ. નંગ-૪, પ્લેટ નંગ-૫ એમ કુલ્લ ૩૦૦ કિલો ભંગાર કિંમત રૂા. ૬૦૦૦ની ચોરી થઇ હતી. ગઇરાત્રિએ થયેલી ચોરીના આ પ્રકરણમાં પોલીસે ટવેરાચાલક સુરેશ કેશુ સંઘાર (મણકા) અને ખાનગી સુરક્ષા કંપનીના સુપરવાઇઝર અમિત સિંઘ સદાશિવ સિંઘ રાજપૂતને પકડી પાડયા હતા. આ બંનેએ મળીને કંપનીમાંથી ભંગારની ચોરી કરી હતી. બંને પાસેથી ટવેરા ગાડી અને ચોરાયેલો તમામ ભંગાર કબજે કરવામાં આવ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અંજારની દશ શાળાને વોટર પ્લાન્ટ માટે ધારાસભ્યે પાંચ લાખ ફાળવ્યા

અંજાર, તા. ૬ : શહેર સુધરાઇની ૧૦ પ્રાથમિક શાળાનેમિનરલ વોટર આ વિસ્તારના ધારાસભ્યએ રૂા. પાંચ લાખની ફાળવણી કરી હતી.

અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને અંજાર નગરપાલિકાના અધ્યક્ષા કલ્પનાબેન એ. શાહે પત્ર પાઠવી અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના બાળકોને પીવા માટે સ્વચ્છ પાણી, મિનરલ વોટર પ્લાન્ટની સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરી હતી.

આ રજૂઆતને માન આપી ડો. શ્રીમતી આચાર્યએ અંજારની ૧૦ પ્રાથમિક શાળાઓને માટે મિનરલ વોટર પ્લાન્ટ માટે ૧ વોટર પ્લાન્ટના રૂા. ૫૦,૦૦૦/- લેખે ગ્રાન્ટ ફાળવી હતી.

ગઢશીશા
ગઢશીશા (તા. માંડવી), બસ સ્ટેન્ડની બાજુમાં, બેંક તેમજ હોસ્પિટલ લાયક ૧૨૦૦ ફૂટ એરિયા ભાડેથી આપવાનો છે.
સંપર્ક : ૯૫૩૭૪ ૪૮૪૫૬

મળી શકશે
ડો. શરદ ડોડિયા
પેશાબ પથરી તથા પ્રોસ્ટેટને લગતા રોગોના નિષ્ણાત
તા. ૦૮/૦૭/૨૦૧૧, શુક્રવાર
સમય : બપોરે ૩થી ૫ વાગ્યા સુધી
: સ્થળ :
શ્રી ક. લે. પ. એજ્યુ. એન્ડ મેડિ. ટ્રસ્ટ સંચાલિત
એમ. એમ. પી. જે. હોસ્પિટલ
મુંદરા રોડ, ભુજ. ફોન નં. ૨૩૧૧૨૨/૩૩

સ્કોર્પિયો/ઇનોવા આપવાની છે
સ્કોર્પિયો M-2-D.I. ૨૦૦૮
ઇનોવા G.4 ૨૦૦૫
સારી કન્ડિશનમાં વેચવાની છે.
સંપર્ક : ૯૮૯૮૨૧૯૯૯૯
૯૯૭૯૮ ૬૭૮૧૧

અ ભિ નં દ ન

ભરત યુ. બડગા
પ્રમુખશ્રી, શ્રી જલસેવા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી
આપશ્રી ઉપરોકત પદે નિયુકત થયા તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન.
- જખરાભાઇ ભીખા કુડેચા
- મનજીભાઇ દાના વારસુર
- નારણભાઇ જખુ લોંચા
- નવીનભાઇ બિજલ સીજુ
- માવજીભાઇ હમીર વારસુર
આદિપુર

અંતરના અભિનંદન

શ્રી રસિક પરસોત્તમ મારાજ
સહકન્વીનર, જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ
આપશ્રીની ઉપરોકત પદે થયેલ ગૌરવશાળી નિમણૂક બદલ ખૂબ-ખૂબ અભિનંદન. રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ.
નવીન મણિશંકર મોતા (આશાપુરા સાયકલ-માંડવી)
શાંતિલાલ નારાણજી નાગુ (ટોડા-મુંદ્રા)
જિગર શાંતિલાલ નાગુ (ટોડા-મુંદ્રા)
સહ પરિવાર

અભિનંદન

રાજેશ કે. ભટ્ટ (માંડવી-કચ્છ)
(એડવોકેટ)
આપશ્રી કૈલાસ માનસરોવરની યાત્રા ભોળાનાથની કૃપાથી સફળતા પૂર્વક પૂર્ણ કરી આવેલ તે બદલ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.
: શુભેચ્છક :
શૈલેશ જે. પંડ્યા - બનેવી
હિના શૈલેશ પંડ્યા - બેન
પ્રિયા વિરલ જોશી - દીકરી-જમાઇ
વિરલ, કિસન - ભાણેજ

હાર્દિક અભિનંદન

આપશ્રીએ વકીલાતની સનદ મેળવી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.. વકીલાત ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના..
ભુરૂભા રાણુભા જાડેજા
એડવોકેટ
ગામ : નાના રેહા, M. 96240 99144
- જાડેજા રણછોડજી સુરાજી
- જાડેજા પૃથ્વીરાજસિંહ સુરતાનજી
- જાડેજા સ્વરૂપસિંહ મનુભા
- જાડેજા બલવંતસિંહ ખેતુભા
- જાડેજા રૂપસંગજી ચાંદુભા
- જાડેજા મહિપતસિંહ ચનુભા
- જાડેજા દિલીપસિંહ લાધુભા
- સોઢા રાજુભા પૃથ્વીરાજસિંહ
- સોઢા શંકરસિંહ જંડુભા
- સોઢા ઇશ્વરસિંહ સોનાજી
- સોઢા દિલીપસિંહ સોનાજી
- સોઢા રણજીતસિંહ વેલુભા
ગામ : નાના રેહા, તા. ભુજ

CMS
Candidates required in Kutch for ATM Management Services Graduates / Under Graduates with basic computer skill. Age not beyond 30 years.
WALK IN ON 8th & 9th July 2011
CMS Securitas Ltd.
Shop No. 35, Plot No. 138, Sector No. 8, C. L. Sharma Complex, Near Oslo Cinema, Gandhidham-Kutch.
Contact : Mr. PREMJIT ZOLA-98795 03905
Guaranted Corporate Exposure

જાહેર ખુલાસો
આથી હું જગદીશ બી. ત્રિવેદી, રહે. ભુજ-કચ્છ વાળા લાગતા-વળગતાઓને જણાવું છું કે, 'સન ડેવલોપર્સ-ભુજ'માં હું ભાગીદાર કે અન્ય કોઇ પણ પ્રકારે જોડાયેલ નથી. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી. આપનો વિશ્વાસુ
તા. ૮-૭-૨૦૧૧ જગદીશ બી. ત્રિવેદી - ભુજ

તાત્કાલિક જોઈએ છે
- સેલ્સ એક્ઝીક્યુટીવ : ૬ (ટ્રેક્ટર માટે, અનુભવીને પ્રથમ પસંદગી)
- મિકેનિક : ૬ (ટ્રેક્ટર માટે)
- વર્કશોપ સુપરવાઇઝર : ૧

આકર્ષક પગાર + ઇન્સેન્ટીવ
- સેલ્સ એક્ઝીક્યુટીવ : ૬ જે.કે.ઓઇલ્સ, રિલાયન્સ, રેલસ્ટાર ઓઇલના કચ્છ ડિસ્ટ્રીબ્યુટર માટે તાલુકા વાઇસ (અનુભવીને પ્રથમ પસંદગી)
સંપર્ક : Mo : 99250 43935/36 સંપર્ક : Mo : 99740 35842
બાયોડેટા સાથે રૂબરૂ મળો : તા.૯/૭/૧૧ ના સવારે ૧૦ થી ૬, તા.૧૦/૭/૧૧ ના સવારે ૧૦ થી ૧૨
ઓથો.ડિલર સ્વરાજ ટ્રેક્ટર્સ મે.સતગુરૂ ટ્રેક્ટર્સ/જે.કે.ઓઇલ્સ રેલ્વે ક્રોસીંગ પાસે, હાઇવે રોડ, સુખપર, ભુજ-કચ્છ.

શ્રી આઠકોટી મોટી પક્ષ સ્થા. જૈન સંઘ-ભુજ
પૂ. પ્રતિભાબાઇ મ.સ.ઠા.ર. નું ચાતુર્માસ પ્રવેશ
તા. ૮/૭/૨૦૧૧, શુક્રવાર, સવારે ૮.૩૦ કલાકે પ્રાણસ્મૃતિ સ્થાનકથી રાજન શોરૂમ, અનમ રીંગ રોડ થઇ મોટા સ્થાનકમાં પધારશે.
: પ્રવેશ પ્રોગ્રામ તથા સંઘ જમણ :
- પ્રવેશ : સવારે ૯.૧૫ કલાકે
- સંઘ જમણ : બપોરે ૧૧.૧૫ કલાકે
- સ્થળ : શ્રી વાગડ બે ચોવીસી સમાજવાડી
સંઘ જમણ દાતાશ્રી પરિવારો તરફથી

શ્રી કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ-ભુજ
આષાઢી આઠમ પર મા વર્ષની ઉજવણી
આમંત્રણ
તા.૭/૭/૨૦૧૧, ગુરૂવારના રાત્રે ૯:૦૦ કલાકે સંતવાણી
તા.૮/૭/૨૦૧૧, શુક્રવાર : સવારે ૯:૩૦ કલાકે : રવાડી
બપોરે ૧૨:૩૦ કલાકે : સીરામણી (પ્રસાદ), સાંજે ૪:૩૦ કલાકે : હવન
મુખ્ય યજમાન : તેજશ શાન્તીલાલ રાઠોડ
સાંજે ૬ કલાકે : શ્રી રાજેશ પઢારીયા ગ્રુપ દ્વારા મહાઆરતી ત્યારબાદ મહાપ્રસાદ
આ પ્રસંગે ભુજ, માધાપર, મિરઝાપર, સુખપર, માનકુવા, કુકમા, નારાણપર, કેરા, બળદિયા તેમજ દહીંસરા ગામના જ્ઞાતિજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
પરમાનંદ (નંદુભાઇ) મીઠુભાઇ હંસોરા (મંત્રી) પરસોત્તમ વાલજી લુહાર (પ્રમુખ)
: શુભેચ્છક :
- પરસોતમભાઇ વાલજીભાઇ લુહાર
- અમૃતલાલ લખમશીભાઇ સિધ્ધપુરા
- પરમાનંદ (નંદુભાઇ) મીઠુભાઇ હંસોરા
- પ્રાણજીવન મુળજીભાઇ રાઠોડ
- શરદભાઇ રવજીભાઇ લુહાર
- કૈલાશભાઇ રતીલાલ પઢારીયા
- નરેન્દ્રભાઇ લખમશી ઉમરાણીયા
- ગોપાલજી ખીમજીભાઇ રાઠોડ
- રાઠોડ ઇન્જીનીયરીંગ વર્કસ (ભુજ)
- ગોપાલજી શાન્તીલાલ એન્ડ કું.
- વિપુલકુમાર ગોપાલજી એન્ડ કું.
- ચામુંડા મોટર ગેરેજ (નંદુભાઇ)
- મણીલાલભાઇ કરશનભાઇ પિત્રોડા
- વાઘેલા કન્ટ્રકશન કું.
- જય અંબે ગેરેજ
- મુન્નાભાઇ મહેશભાઇ પિત્રોડા
- ભારત મોટર ગેરેજ (જલુભાઇ)
- ચામુંડા વેલ્ડીંગ એન્ડ સ્પ્રીંગ વર્કસ
- ક્રિષ્ના મોટર ગેરેજ
- ભવાની મોટર ગેરેજ
- વિશ્વ ચામુંડા મોટર ગેરેજ (સુખપર)
- ગાયત્રી મેકેનિકલ વર્કસ
- ભગવાનજી લક્ષ્મીદાસ સિધ્ધપુરા
- રાઠોડ ઇન્જીનીયરીંગ વર્કસ (માધાપર)
- કર્મયોગ ઇન્ડસ્ટ્રીઝ (ભુજ)
- કર્મયોગ હાઇડ્રોલીક્સ (માધાપર)
- કરણ ઇન્જીનીયરીંગ (નારાણપર)
- લક્ષ્મી મોટર ગેરેજ (ટિલુભાઇ)
- પિયુષ વેલ્ડીંગ વર્કસ
- કૈલાશ મોટર રિપાવરીંગ
- માતૃકૃપા ટ્રકબોડી વર્કસ
- બકુલભાઇ અમૃતલાલ સિધ્ધપુરા
- ડી.ડી.એસ.ઓટો (ધીરૂભાઇ)
- જય ખોડિયાર વેલ્ડીંગ વર્કસ
- અમર ઇન્જીનીયરીંગ વર્કસ
- શ્રીરામ ઓટો (ઉમેશભાઇ)
- આદિત્ય જી.વાઘેલા (રત્નાપર)
- પિત્રોડા પ્રિન્ટર્સ & રેડિયમ (માધાપર)
- શિવ ઇન્જીનીયરીંગ (બાબુભાઇ)
- વિનોદ વિશ્રામભાઇ પિત્રોડા
- હર્ષદભાઇ મીઠુભાઇ પિત્રોડા
- નવનિર્માણ ટર્નીંગ વુડન વર્કસ
- શ્રી મોમાય મેકેનિકલ વર્કસ
- જેન્તીભાઇ મીઠુભાઇ પિત્રોડા
- બુટભવાની ઇન્જીનીયરીંગ વર્કસ
- પિત્રોડા ડિઝલ વર્કસ
- મહેશ મોહનજી પિત્રોડા (મારા વ્હાલા)
- કોમલ મોટર ગેરેજ
- નવદુર્ગા વેલ્ડીંગ વર્કસ
- અંબિકા વેલ્ડીંગ વર્કસ
- શ્રી અંબિકા ઇન્જીનીયરીંગ વર્કસ
- રમેશભાઇ કાન્તીલાલભાઇ વાઘેલા
- મુકેશ મોટર ગેરેજ
- નરોતમભાઇ રતનશીભાઇ પરમાર
- જેનીશ ઇન્જીનીયરીંગ વર્કસ
- ભાઇ ટ્રકબોડી વર્કસ
- વાઘેશ્વરી વેલ્ડીંગ વર્કસ
- જયદિપભાઇ નરોતમભાઇ વાઘેલા
- નવદુર્ગા મોટર એન્ડ હાઇડ્રોલીક્સ
- આનંદભાઇ કાન્તીલાલ ગોહિલ
- કષ્ટદેવ મોટર ગેરેજ
- અમૃતલાલ નરશીભાઇ ઉમરાણીયા
- ખુશાલભાઇ રામજી ઉમરાણીયા (સુખપર)
- સિધ્ધપુરા મેકેનિકલ વર્કસ
- તેજશ શાન્તીલાલ રાઠોડ
- આશા ઇન્જીનીયરીંગ (લાલ ટેકરી)
- મેહુલભાઇ શિવલાલભાઇ પિત્રોડા
- હિતેશ મોટર રિપાવરીંગ
- પિત્રોડા ઇન્જીનીયરીંગ વર્કસ
- હરિ ૐ ઇન્જીનીયરીંગ વર્કસ
- હસમુખલાલ હરિરામભાઇ ઉમરાણીયા
- પિયુષભાઇ માવજીભાઇ ગોહિલ
- માવજીભાઇ મહાદેવાભાઇ ગોહિલ
- લક્ષ્મી ઇન્જીનીયરીંગ વર્કસ (ગાંધીધામ)
- રમેશભાઇ ખીમજી પિત્રોડા (ગાંધીધામ)

રબ્બાની ટુર્સ & ટ્રાવેલ્સ-ભુજ
રજૂ કરે છે રમઝાન ઉમરા : દિવસ-૩૫, હરમ શરીફ થી ૧૦ થી ૧૨ મિનિટના અંતર ઉપર હોટલમાં રહેવાનું
પ્રવાસ ખર્ચ : રૂા.72,786/-
પાસપોર્ટ આપવાની છેલ્લી તા.૧૨/૭/૨૦૧૧
રવાનગી તા.૨૭ મી શાબાન ઇન્શાલ્લાહ
- મૌલાના અલીફ નકશબંદી : 97267 97392
- હાજી અલીભાઇ કુંભાર : 96873 74784

હાર્દિક અભિનંદન

માન. શ્રી મહેશભાઇ ઠકકર
આપશ્રીની કચ્છ કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉત્તરોત્તર રાજકીયક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામના.
શુભેચ્છક
મુસાભાઇ હાજી ઇબ્રાહીમ હીંગોરજા
ડેલીગેટ કચ્છ જિલ્લા કોંગ્રેસ
મો. ૯૮૨૫૧ ૮૭૭૯૬
આડેસર, તા. રાપર-કચ્છ.

REQUIRED
The security contractor For Steel Factory
Security
Please inform with total details.
: Contact address :
JAY BHARAT STEEL CORPORATION
S NO. 407, VILLAGE - DHAMADAKA.
TALUKA-ANJAR, DIST. KUTCH

REQUIRED
The security contractor For Steel Factory
Security
Please inform with total details.
: Contact address :
MONO STEEL INDIA LTD.
S NO. 374, 397/1, 397/2, 398 & 396/1, Paiki-2, DHAMADAKA.
TALUKA-ANJAR, DIST. KUTCH

।। विद्या कर्मसु कौशलम् ।।
અંજાર એજ્યુકેશન સોસાયટી
વોકઈન ઈન્ટરવ્યુ
અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની ઉચ્ચ. માધ્ય. શાળાઓમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમયે રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવું.

ક્રમ	જગ્યાનો પ્રકાર	શૈક્ષણિક લાયકાત
(૧)	શિક્ષણ સહાયક	B.Com./M.Com. B.Ed.

સરનામું:- અંજાર એજ્યુકેશન સોસાયટી, જી.એમ.ડી.સી. શૈક્ષણિક સંકૂલ, અંજાર-કચ્છ. પીન : ૩૭૦ ૧૧૦.
તારીખ અને સમયઃ- ૦૯/૦૭/૨૦૧૧, શનિવાર. સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦.
માનદ્ મંત્રી અંજાર એજ્યુકેશન સોસાયટી અંજાર-કચ્છ.
નોંધ :
૧) ઉમેદવારે પોતાની સંપૂર્ણ વિગતો સાથેની અરજીમાં શૈક્ષણિક પ્રમાણપત્રોની ખરી નકલ, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા ફોન/મોબાઇલ નંબર સાથે જોડવાના રહેશે.
૨) અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી ભાષામાં શીખવી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

આવકાર અને અભિનંદન

શ્રી સોનીયા ગાંધી

શ્રી અહેમદ પટેલ

શ્રી અર્જુન મોઢવાડીયા

શ્રી મહેશભાઇ ઠકકર
કચ્છના અનુભવી-અભ્યાસી અને કસાયેલા કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ ઠકકરને કચ્છ કોંગ્રેસનાં પ્રભારી નિયુકત કરવા બદલ વરિષ્ઠ આગેવાનોને અભિનંદન.... અને શ્રી મહેશભાઈ ઠકકરને હાર્દિક આવકાર સાથે અભિનંદન...
ભરતભાઈ એમ. ગોસ્વામી એન્ડ ફેમિલી, ભુજ-કચ્છ

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

રાપરની સ્થાવર મિલકતોમાં તેજીની આગ

રાપર, તા. ૬ : એમ કહેવાય છે કે ૫૦૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા-સોનાની બનાવી હતી. સોનાના મહેલ બનાવ્યા હતા. આજના જન્મનારા કૃષ્ણને કોઇ મહાનગરમાં બે રૂમ, રસોડાનો ફલેટ બનાવવો, લેવો હોય તો આંખે અંધારા આવી જાય તેવા ભાવો થતા જાય છે. રાપરમાં આ તેજીની ભભૂકી ઉઠેલી આગ છેલ્લા ૨૦૦૩થી ૨૦૧૦ સુધી નહોતી પહોંચી પણ ૨૦૧૦ પછી રાપર નગરના પ્લોટ-મકાનના ભાવ આસમાનમાં વાતું કરવા લાગ્યા છે.

રાપરના એકતાનગરમાં ઉપરાંત અયોધ્યાપુરીની

આઠ માસમાં ૩થી ૪ ગણા ભાવ : ગરીબ વર્ગ માટે મકાન દોહ્યલું

શરૂઆતની શેરીઓમાં તીવ્ર ગતિએ ભાવ વધી ગયા છે. કેટલાકે ભૂકંપ પહેલાં મોંઘા ભાવે લીધેલા, મંદીની માર સહન કરતાં ૨૦૧૦માં વેચ્યા તે આજે રાતે પાણીએ રોઇ રહ્યા છે. સાચવી-સાચવી એક વર્ષ ન સાચવી શકવાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.

તો એક મુંબઇવાસીએ ગઇ સાલે વેચેલો રૂા. પાંચ લાખનો પ્લોટ આજે ૨૦ લાખમાં પણ લેનાર આપવા તૈયાર નથી. મહેસૂલ ખાતામાં સારો હોદા ધરાવતા એક ઇસમે છ વર્ષ મકાન સાચવ્યું ૨૦૧૦ના આરંભમાં નવ લાખમાં વેચી નાખ્યું આજે એ મકાન ૨૦ લાખમાં નથી મળે તેમ ! આમ નગરમાં દિવસાદિવસ જમીન-પ્લોટ-મકાનના ભાવમાં તેજીની આગ ભભૂકી રહી છે.

હા, કોઇ કોણિયાત બની

(જુઓ પાનું ૯)

ગોરેવાલીના મુખ્ય શિક્ષક અને શિક્ષિકા દાઝી જતાં સારવાર તળે

ભુજ , તા. ૬ : તાલુકાના બન્ની વિસ્તારના ગોરેવાલી ગામે ગામની શાળાના મુખ્ય શિક્ષક મનુભાઇ શંકરલાલ પ્રજાપતિ (ઉ.વ.૩૨) અને શાળાના શિક્ષીકા ઇલાબેન રસિકલાલ મકવાણા (ઉ.વ. ૨૫) દાઝી જતાં તેમને સારવાર હેઠળ રખાયા છે.

પોલીસે આપેલી વિગતો મુજબ મુળ જિલ્લા બહારના વતની એવા આ મુખ્ય શિક્ષક અને શિક્ષીકા ગઇકાલે દાઝી ગયા હતા, પ્રથમ શિક્ષક દાઝયા હતા. તેમને બચાવવા જતાં શિક્ષીકા પણ દાઝી ગયા હતા. આ બન્નેને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

તબીબોની તપાસ માત્ર પેટ્રોલનો ધુમાડો ?

ભુજ, તા. ૬ : પોતાની સત્તા કે અધિકાર ન હોવા છતાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન જિલ્લા પંચાયતના આરોગ્યતંત્રે ભુજ, અંજાર અને ગાંધીધામમાં કુલ ૩૨૦ ખાનગી દવાખાના અને હોસ્પિટલોની તપાસ બાદ અંતે ગાંધીનગરથી આ કાર્યવાહી કરવા બદલ ઠપકો મળતાં સરવાળે હજારો રૂપિયાના પેટ્રોલના ધુમાડા સિવાય કોઇ ફળશ્રુતિ નીકળી ન હોવાનું જાણવા મળે છે. અલબત્ત, ચેરમેને કહ્યું હતું કે, તંત્રને ચેકિંગ સત્તા છે જ અને પગલાં લેવા પાછીપાની નહીં કરાય આમ બંને વચ્ચે વિરોધાભાસી વલણ જોવા મળ્યું છે.

થોડા દિવસ પૂર્વે ભુજમાં ૧૩૯ તબીબોની માહિતી એકત્ર કરાઇ ત્યારે ઇન્ડિયન મેડિકલ એસો.એ આ તપાસને રૂટીન

આરોગ્યતંત્ર કહે છે તેમને સત્તા જ નથી : ચેરમેન કહે છે પગલાં લેશું !

લેખાવી હતી અને શહેરમાં એમ.બી.બી.એસ., એમ.ડી. કે એમ.એસ. જેવા ડિગ્રીધારી તબીબો સામે પગલાં તો ઠીક તપાસ પણ કરવાની સત્તા પંચાયતી આરોગ્યતંત્રને ન હોવાની ચર્ચા ઊઠી હતી. જે તે વખતે તંત્રે વિગતો બે દિવસમાં જાહેર કરવાની અને જરૂર પડયે પોલીસ ફરિયાદની ખાતરી આપ્યાના દિવસો બાદ હવે આરોગ્યતંત્રને પારોઠના પગલાં ભરવા પડયાં છે.

તંત્રના સત્તાવાર વર્તુળોનો સંપર્ક કરતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું

(જુઓ પાનું ૯)

તા. ૯/૭/૧૧, શનિવારે મળી શકશે
ડૉ. ગૌરાંગ કદમ
(યુરો સર્જન)
પેશાબના તથા પથરીનાં રોગોના નિષ્ણાંત
નાણાવટી હોસ્પિટલ, ભુજ
ફોન : ૨૫૮૨૪૯

હાર્દિક અભિનંદન

હાજી જાફર હાજી ઈબ્રાહીમ હિંગોરા–ભુજ
આપશ્રી 'કચ્છ શકિત' એવોર્ડ-૨૦૧૧ના વિજેતા થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન...
•ઈશા જે. હિંગોરા
•મોહમદહનીફ જે.હિંગોરા (પો. હેડ કો. ભુજ સિટિ)
•અબ્દુલ કાદીર જે. હિંગોરા
સમસ્ત હિંગોરા પરિવાર ભુજ-કચ્છ.

દ્વિવાર્ષિક શ્રદ્ધાંજલિ

સ્વ. કરશન હરજી હાલાઈ, તા. ૭-૭-૨૦૦૯
શ્રી સ્વામીનારાયણ ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
ધર્મપત્ની : સ્વ હીરબાઈ કરશન હાલાઈ
પુત્ર : વાલજી કરશન હાલાઈ — પૌત્ર : દિનેશ વાલજી હાલાઈ
પુત્રવધૂ : દેવબાઈ વાલજી હાલાઈ — પૌત્રવધૂ : રમીલા દિનેશ હાલાઈ
પૌત્ર : રસિક વાલજી હાલાઈ, પૌત્રવધૂ : મંજુલા રસિક હાલાઈ
હિના, પ્રિયંકા, સ્નેહા, પીયૂષ, દિવ્યેશ, કિષ્ના બ્લોક ફેકટરી

ખેડૂતમિત્રો
આપના કપાસ તેમજ દરેક પાકમાં કોઇપણ ખાતર સાથે
M.B.F નું 'કાલા સોના' વાપરી ચમત્કારિક પરિણામ જુઓ
(પ્રમાણ બે થેલી ખાતર સાથે ૧ કિલો કાલા સોના મિક્સ કરી વાપરો)
વધુ માહિતી માટે Mo : 98252 25016, Mo : 93287 11999, Mo : 98250 39068
નજીકનાં પ્રખ્યાત વેપારી, સહકારી મંડળી, ડેપો પર મળી શકશે

હરસ-મસા

ઓપરેશન વગર ૧૦૦% આર્યુવેદિક પદ્ધતીથી
કોઇ આરામ નહીં, કોઇ દુઃખાવો નહીં. વાહન ચલાવીને ઘેર જાઓ.
રાજકોટ. મો. : ૯૮૨૫૦ ૨૬૨૬૫
સૌજન્ય દેવાયતભાઈ હુંબલ, રાજકોટ - ૯૮૭૯૧ ૪૮૭૫૫ અર્ચનાબેન રાવલ, રાજકોટ - ૯૬૦૧૬ ૩૯૦૯૦

હરસ-મસા

ઓપરેશન વગર ૧૦૦% આર્યુવેદિક પદ્ધતીથી
કોઇ આરામ નહીં, કોઇ દુઃખાવો નહીં. વાહન ચલાવીને ઘેર જાઓ.
રાજકોટ. મો. : ૯૮૨૫૦ ૨૬૨૬૫
સૌજન્ય કમલેશભાઈ ભુપતભાઈ, બનાસકાંઠા - ૯૯૭૯૦ ૦૩૩૨૨ અર્ચનાબેન રાવલ, રાજકોટ - ૯૬૦૧૬ ૩૯૦૯૦

ચાલો નેત્રા ।। બાપા દયાળુ ।। ચાલો નેત્રા
શ્રી ગુસેશ્વર મહાદેવ મંદિર (ભમનો ભોંયરો)
નેત્રા (માતાજીના) તા.નખત્રાણા

૨૯ મો વાર્ષિકોત્સવ, તા. ૭–૭–૨૦૧૧
•અભિષેક : સવારે ૯-૦૦ કલાકે
•સંગીતમય મહાઆરતી : સાંજે ૬-૩૦ કલાકે ધીરેન ઠક્કર તથા અલ્ટ્રાબીટ્સ ઓરકેસ્ટ્રા સંગાથે
•મહાપ્રસાદ : રાત્રે ૮-૦૦ કલાકે
•સંતવાણી : રાત્રે ૧૦-૦૦ કલાકે
•કલાકારો : રાજેશગિરિ-મોથાળાવાળા, દેવાભગત -નુંધાતડવાળા
નિમંત્રક :
શ્રી ગિરનારી યુવક મિત્ર મંડળ-નેત્રા | શ્રી જોગમૈયા મિત્ર મંડળ-નેત્રા
શ્રી શિવ મિત્ર મંડળ-નેત્રા | શ્રી દરિયાલાલ ઉત્સવ સમિતિ (રઘુવંશી ગ્રુપ)-નેત્રા

ઈસ્કોન સર્કલ અમદાવાદ પર બની નવી હોટલમાં આપનું સ્વાગત છે.

Hotel CORPORATE RESIDENCY
Feel the corporate touch.
215, Devarc Complex, Iscon Circle, S.G. Road, Ahmedabad-15. Tele.: +91 79 2692 1095 / 9601920449
Email : hotelcorporateresidency@yahoo.com
Website : www.hotelcorporateresidency.com
LUXURY STAY @ ONLY 1799/-*

મળી શકશે નહીં
ડો. ફહીમ લાલા
(આંખ અને આંખરોગ નિષ્ણાત)
તા. ૭/૭/૧૧થી તા. ૧૦/૭/૧૧ સુધી મળી શકશે નહીં. તા. ૧૧/૭/૧૧થી રાબેતા મુજબ મળી શકશે
સિટી આઈ હોસ્પિટલ
જી. કે. જનરલ હોસ્પિટલ સામે, લોટસ, ભુજ-કચ્છ.

શ્રી સચિયાય માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંતવાણીનું આયોજન કરેલ છે. તા. ૭/૭/૧૧ના રાત્રે ૧૦.૦૦ કલાકે ભજનના કલાકાર અલખના આરાધક શ્રી સમરથસિંહ સોઢા, સાહિત્યકાર કિશોરદાન ગઢવી (ચકારવાળા) સાથે અન્ય કલાકારો
નિમંત્રક
સોઢા ભેરજી કેસરસિંહ પરિવાર
સ્વ. સોઢા ભુરજી કેશરસિંહ પરિવાર
સ્થળ : ગણેશનગર કોમર્સ કોલેજ રિંગ રોડ, સ્વામિનારાયણ ગુરુકુળની સામે, ભુજ-કચ્છ.

પાંચમી વાર્ષિક પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ

સ્વ. કાનજીભાઈ કરશનભાઈ ડાંગર
સ્વ. તા. ૭/૭/૨૦૦૬
સેવા-સમર્પણ અને સાદગીના ગુણો સાથે આપશ્રી જીવનને સાર્થક કરતા ગયા. આપનો માયાળુ સ્વભાવ અને પરોપકારની ભાવના ક્યારેય ભુલાશે નહીં. પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના..
• રમેશભાઈ કાનજીભાઈ ડાંગર • નિરાલી કરણકુમાર
• સરસ્વતીબેન રમેશભાઈ ડાંગર • પૂજા રમેશભાઈ ડાંગર (પાયલોટ)
• નરેન્દ્રભાઈ કાનજીભાઈ ડાંગર • નિરવ નરેન્દ્રભાઈ ડાંગર
• મીનાબેન નરેન્દ્રભાઈ ડાંગર • ઝલક નરેન્દ્રભાઈ ડાંગર
તથા સમસ્ત ડાંગર પરિવાર • આઝાદ રમેશભાઈ ડાંગર

જોઈએ છે
પદ્ધર, તા. ભુજ સ્થિત BKT ઇન્ડસ્ટ્રીઝ લિ. કંપની માટે પદ્ધરમાં રહીને કામ કરી શકે તેવા લેબર કોન્ટ્રાકટર્સ જોઇએ છે
સેન્ટરીંગ કારપેન્ટર્સ
સળિયા કામના કોન્ટ્રાકટર્સ (ફીટર)
પ્લાસ્ટર/ચળતર કોન્ટ્રાકટર્સ
JMC પ્રોજેક્ટસ (ઈન્ડિયા) લિ. ઈન્જિનિયર્સ એન્ડ કન્સ્ટ્રકશન્સ
બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લિ. મુ.પો. પદ્ધર, ભુજ–ભચાઉ હાઈવે,તા.ભુજ
M.9327055513, 9377671496

અભિનંદન

શ્રી મહેશભાઈ ઠક્કર
પ્રભારીશ્રી, કચ્છ કોંગ્રેસ
આપશ્રીની ઉપરોકત પદે થયેલ ગૌરવશાળી નિમણૂક બદલ હાર્દિક અભિનંદન... રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતા રહો તેવી શુભકામના સહ...
શ્રી રૂપારેલ (ધારાણી) પરિવાર

KANHA SEEDS KANHA SEEDS COMPANY
રીસર્ચ દિવેલા - કાન્હા તાપી
■માળ લાંબી તથા ભરાવદાર
■પ્રત્યેક છોડ પર વધારે માળની સંખ્યા
■વજનદાર દાણા તથા ઉંચી તેલની ટકાવારી
■વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા
■સુકારાના રોગ સામે ઘણી જ પ્રતિકારક
દિવેલામાં લાવે ક્રાંતિ... કાન્હા તાપી

હાઈબ્રીડ દિવેલા
હાઈબ્રીડ બાજરી – રાજ ૧૧૧૧, ૨૨૨૨, ૪૪૪૪
કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ
ભીડ નાકા પાસે, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ઢેબા ફલીયા, ભુજ – કચ્છ.
ફોનઃ ૨૫૧૬૫૩, ૨૫૧૬૫૪, મોઃ ૯૮૨૫૦ ૬૧૬૫૪, ૯૮૨૫૧ ૫૬૫૦૦

INVITATION OF APPLICATIONS FOR SCHOOL TEACHER
AMW – a leading Automotive company dealing in Heavy Duty World Class Trucks, located in Bhuj is setting up a CBSE School in Bhuj.
The school aims at providing quality education to cater to the holistic development of the students.
Applications for following positions are invited
Principal : Minimum Qualification: M.Sc, B.Ed with more than 12 years of experience, out of which 5 years as a principal of a reputed Institution. Having vision to make the school a learning organization where in the students are equipped with the skills to face challenges.
TGT's & PRT's : For all subjects.
Kindergarten Teachers
Office Superintendent, Office Assistant, Office Accountant, Librarian, Music & Art teachers possessing relevant qualification and experience.
Remuneration: As per the qualification and experience.
CVs – To be sent as follows by 15 July '11
Mail your CVs to : majshiju.thomas@amwasia.com
Courier your CVs at following address:
Mr Sunil Dutt
603 , Kenson Tower, Jainagar Patiya, College Road, Bhuj – 370001

આપનું સ્વપ્ન, આપનું ઐશ્વર્ય....
પ બંગલાઓનું ભવ્ય આયોજન
બુકીંગ ચાલુ છે
૧૦૪ વારનો પ્લોટ
૩ બેડ હોલ-કિચન
: સ્થળ : સ્વામિનારાયણ નગર-૧, મેઈન રોડ ટચની નજીક, રઘુવંશી ચોકડી, રાવલવાડી, સ્વામિનારાયણ મંદિર પાછળ, ભુજ-કચ્છ.
સંપર્ક : જયેશ મોરારજી કેશરીયા Mo : 98982 46023
સાથે ઓધવ એવેન્યુ, મુન્દ્રા રિલો. મધ્યે બંગલાઓનું બુકીંગ ચાલુ છે

વિમલ મહા પેક
₹5માં 5 ગણો
₹ 5/- FOLD TWICE FROM HERE TO LOCK MAHA PACK For multiple use
केसर-युक्त विमल पान मसाला
₹ 5.00 પ્રતિ પાઉચ
દાણા દાણામાં કેસરનો દમ
નોંધ: ફક્ત કાગળ + એલ્યુમિનિયમ પાઉચમાં ઉપલબ્ધ (No Plastic Pouch)
પાન મસાલો ચાવવો સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. NOT FOR MINORS : 0% તમાકુ

આજથી નવપ્રસ્થાન-મુંદરા
શ્રી રામ ડીઝલ્સ મુંદરા
આથી અમારા સર્વે ગ્રાહકોને જણાવતાં આનંદ થાય છે કે અમારા વ્યવસાયિક પ્રતિષ્ઠાન શ્રી રામ ડીઝલ્સનું નવપ્રસ્થાન આજે કરી રહ્યા છીએ.
આપની ઉપસ્થિતિ અમારું ગૌરવ બની રહેશે.
તા. ૭-૭-૨૦૧૧, ગુરુવાર, સવારે ૧૧:૧૫ કલાકે
નૂતન સ્થળ
દુકાન નં. ૫૦, સિંગાપુર સિટી કોમ્પ્લેક્ષ, ઝીરો પોઈન્ટ, અદાણી પોર્ટ રોડ, નાના કપાયા, તા. મુંદરા.
મો : ૯૪૨૬૯ ૮૩૫૬૫, ૯૯૨૫૪ ૬૬૩૦૦
BOSCH MICO SERVICE ·ZEXEL·
સેલ્સ એન્ડ સર્વિસ, માઈક્રો એન્ડ બોસ પ્રોડક્ટ, બોસ એન્ડ ઝેક્સલ, લાઈન પંપ, V.E. પંપ તથા CRDI પંપ, નોઝલનું સર્વિસ સેન્ટર

જાહેર આમંત્રણ
ચાલો હબાય — ચાલો હબાય

અતિથિવિશેષ — ઉદ્‌ઘાટા — અતિથિવિશેષ


શ્રી વાસણભાઈ આહીર (માન. મંત્રીશ્રી)
શ્રી ધનજીભાઈ આર. ગાગલ (N.R.I.) (દાતા–ઉદ્‌ઘાટક)
શ્રી ત્રિકમભાઈ બી. છાંગા (પ્રમુખશ્રી, જિ. પં. કચ્છ)
હબાય ખાતે મા વાઘેશ્વરી અન્નક્ષેત્ર સેવા ટ્રસ્ટને ગામ : અટલનગર-ચપરેડીના દાતાશ્રી ધનજીભાઈ રાણાભાઈ ગાગલ દ્વારા તેમના માતુશ્રી સ્વ. લક્ષ્મી મા તથા પિતાશ્રી સ્વ. રાણાભાઈ વસ્તાભાઈ ગાગલના સ્મરણાર્થે બાંધકામ કરી બનાવી આપેલ છે. આ અન્નક્ષેત્રનું ઉદ્‌ઘાટન તા. ૮/૭/૧૧ (શુકવાર) અષાઢ સુદ આઠમના દિવસે સવારે ૧૦.૧૫ કલાકે રાખેલ છે. જેમાં સર્વે ધર્મપ્રેમી જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
અન્નક્ષેત્રના ઉદ્‌ઘાટા : શ્રી ધનજીભાઈ આર. ગાગલ (N.R.I.) ગામ : ચપરેડી (અટલનગર)
દીપ પ્રાગટ્ય : શ્રી વાસણભાઈ આહીર (મંત્રીશ્રી) ● શ્રી ત્રિકમભાઈ છાંગા (પ્રમુખશ્રી, જિ. પં. કચ્છ)
મહાપ્રસાદ : બપોરે ૧૧.૩૦ કલાકે
સ્થળ : શ્રી મા વાઘેશ્વરી મંદિર હબાય, તા. ભુજ-કચ્છ.
નિમંત્રક : મહંતશ્રી લક્ષ્મણગિરિ ગોપાલગિરિ તથા મા વાઘેશ્વરી સેવા ટ્રસ્ટ અને માતાજીના સેવકગણ

Digitially Archived by: www.realpatidar.com/library

કચ્છમિત્ર

ગુરુવાર ● ભુજ - તા. ૦૭-૦૭-૨૦૧૧ ● ૧

ભીતરનો સંતાપ કેમ મિટે ?

ગુરુ વિશેષ

જેવી રીતે શેરીમાં બાળકને કોઇ મારે અને બાળક કહે છે કે,'ઉભો રહે, મારી મા આવશે.' સાધક કહે છે, 'હે ખલ ! હે દુર્ગુણ ! હું નહીં મિટાવી શકું પણ ઉભો રહે, મારા ગુરુ આવશે. એ 'ખલબન પાવક' છે. એ મારી આસ્થા છે. એ મિટાવશે જ.' અને વિભીષણને તો પૂછવામાં આવ્યું કે તું ખલમંડળીમાં વસે છે... એ વિભીષણ માટે તો ઠીક છે કે ચારે બાજુ વાક્ષસ... પરંતુ આપણી દશા તો એવી છે કે આપણા જીવનની લંકા કંઇક એવી છે કે આપણે ખલમંડળીમાં નથી વસતાં, ખલમંડળી આપણામાં વસી રહી છે !

મમ હૃદય ભવન પ્રભુ તોરા,
તહઁ બસે આઇ બહુ ચોરા ।

ગોસ્વામીજી 'વિનય'માં ફરમાવશે છે, પ્રભુ, આ હૃદય તમારું ભુવન છે. મેં તમારે નામે હૃદય કરી દીધું છે. છે તો મારું પરંતુ આપના નામે કરી દીધું અને પછી આપના નામે જે હૃદયનો દસ્તાવેજ થયો અને ત્યાં ચોર આવીને વસે છે ! તો પ્રભુએ તુલસીદાસજીને પૂછયું કે તું લડતો કેમ નથી ? તો બોલ્યા, કેમ લડું ? હું એલો. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર છ...! વારંવાર આક્રમણ કરી રહ્યા છે. હું શું કરું ? અને કહ્યું, હવે મકાન આપના નામે કરી દીધું છે અને ત્યાં એ અડ્ડો જમાવે ! અવેધ કબજો લઇ લે ! એમાં આપની ઇજ્જતનો સવાલ છે !

'ખલ બન પાવક...' સદ્ગુરુ આપણી ખલતાને, આપણી દુષ્ટતાને બાળી નાખે છે. કોઇ સદ્ગુરુ નિરંતર અગ્નિની ઉપાસના કરે તો એ એના કર્મકાંડ નથી, પોતાના આશ્રિતોની ખલતાની આહૂતિ આપે છે. કર્મકાંડ નથી. કર્મકાંડમાં બહુ રુચિ નથી. કર્મકાંડ નથી. કર્મનું તો ફળ મળે છે. કોઇ પણ કર્મ કરો. કર્મકાંડ ફળ દેશે. સદ્ગુરુઓમાં કર્મની પાછળ કોઇ ફળની આકાક્ષા નથી હોતી. મારા આશ્રિતોની ખલતા બળી જાય, એમની આસ્થા સફળ થાય, એના માટે...

પ્રનવઉં પવનકુમાર ખલબન
પાવક ગ્યાન ઘન ।
જાસુ હૃદય આગાર બસહિં
રામ સર ચાપ ધર ॥

આપણે એ વિચારીએ કે જેમનાં ચરણોમાં

આપણી આસ્થાછે, તો પહેલી આસ્થા એ હોવી જોઇએ કે એ આપણા દુર્ગુણોને મિટાવે છે, કેમકે આપણાથી નહીં મિટે. 'માનસ'માં સ્પષ્ટ લખ્યું છે-

યહ ગુન સાધન તેં નહિં હોઇ ।
તુમ્હારી કૃપા પાવહી કોઇ કોઇ ॥

હવે જુઓ ભાઇ, પગમાં કીડા પડે ને તો આંખો ત્યાં પહોંચે છે. ને તમે કાઢી પણ શકો છો. હાથમાં કીડા પડે કે કોઇ ફરફોલા થઇ જાય તો ત્યાંથી તમે કાઢી શકો છો, છાતીમાં પડે તો કદાચ નજર પહોંચી જાય અને છાતીમાંથી કાઢી શકો છો, પરંતુ અહીં (મસ્તિષ્કમાં) કીડા પડે તો ? દેખાતા નથી ! ત્યાં તો કોઇનો હાથ આવી જાય અને માનસિક કીડાને કાઢે...! એક એક કરીને કાઢે એટલે મારા ગોસ્વામીજી કહે છે-

યહ ગુન સાધન તેં નહિ હોઇ ।
તુમ્હરી કૃપા પાવ કોઇ કોઇ ॥

એક બીજા હિન્દી પ્રાન્તમાંથી આવેલા શ્રોતાએ પૂછયું છે, 'બાપુ, કામવાસના ઓછી નથી થાતી. કથામાં જવા છતાં ય દ્રષ્ટિ પવિત્ર નથી રહેતી. કાંઇક બતાવો.' બસ, આ જ ચોપાઇ...

યહ ગુન સાધન તેં નહિ હોઇ ।
તુમ્હરી કૃપા પાવ કોઇ કોઇ ॥

કોઇની કૃપા પૂર્ણ રૂપની કોઇની કૃપાનો આશ્રય લઇ જાશે. પતન સુધી નહિ જવા દે. સાધક ડામાડોળ જરૂર થઇ જાય છે પરંતુ પતન સુધી નહિ જાય. જાળવી લેશે. મારા ગુરુ 'ખલ બન પાવક' છે એ આસ્થા હોવી જોઇએ. હું કમજોર છું, એ સબળ છે.

નાભાજીના ગુરુ અગ્રદાસની કથા છે ને,

હેં ! એ વણિકનું જહાજ... એ વણિકનું જહાજ ફસાઇ ગયું. એ વણિક અગ્રદાસજીનો આશ્રિત હતો. અને અહીં નાભાજી પંખો નાખી રહ્યા હતા અને ત્યાંથી વણિક પોકાર કર્યો.... એ ગુરુ... બચાવો... બચાવો.... બચાવો....! બાપ ! બચાવો....બચાવો...બચાવો....! હવાની દિશા બદલી'તી. ગુરુ તો ધ્યાનમાં હતા. નાભાજી અવાજ ઓળખી ગયા કે કોઇ ગુરુબંધુ ગુરુને પોકાર કરે છે. અને ગુરુ અવાજ સાંભળશે.

તો એમના ધ્યાનમાં ભંગ થશે. હું શિષ્ય શું કામનો ? હું સેવા ન કરું ? તો પંખાથી ગુરુને હવા નાખી રહ્યા'તા એ પંખાની દિશા બદલી નાખી. પંખાની દિશા બદલી નાખી તો સમુદ્રમાં વાયુની દિશા બદલી ગઇ અને જહાજ કિનારે આવી

ગયું ! આ ચમત્કાર નથી. ચૈતસિક જગતમાં આવી ઘટનાનો બની શકે છે, બની શકે છે, બની શકે છે. એને હું ચમત્કાર નહીં, એને હું આધ્યાત્મિક કહીશ. એ થઇ શકે છે.

ઠાકુર રામકૃષ્ણનો એક પ્રસંગ ગંગાના તટ ઉપર ધોબી કોઇને કોરડા મારે છે અને ઠાકુર નૌકામાં જઇ રહ્યા હતા. શિષ્યોને રોકીને કહે છે, 'મને કોરડા લાગે છે, મને કોરડા લાગે છે ! મને કોઇ કોરડા મારે છે !' શિષ્યો બોલ્યા, 'બાબા, અમે ભજન ગાઇ રહ્યા છીએ. આપ વચ્ચે બેઠા છો અને આપને...!' કહે, 'નહીં, ખબર નહીં, મને કોરડા મારી રહ્યું છે. જુઓ,એ ધોબી કોઇને મારી રહ્યો છે, એને ચોટ નથી લાગી, મને...!' બોલ્યા, 'આટલી સહાનુભૂતિ !' કહે, 'આ સહાનુભૂતિથી નથી થતું બેટા, આ

પ્રસાદ
મોરારિબાપુ

ચૈતસિક સમાનુભૂતિથી થાય છે !' સહાનુભૂતિ નહીં. સહાનુભૂતિ બે કોડીની હોય છે. એ પણ દુનિયાએ રાખવી જોઇએ. પરંતુ સાધુઓની પાસે ખોખલી સહાનુભૂતિ નથી હોતી, સમાનુભૂતિ...! ત્યાં ચોટ લાગી, અહીં અસર થઇ, હેં ! કષ્ટ ત્યાં, આંસુ અહીંયા ! ગુરુને ખબર પડે છે કે મારો આશ્રિત દુઃખી છે, તો ગુરુ રડે છે. એમની સમાનુભૂતિ હોય છે. હસવાની છૂટ તો વરદાનમાં શિષ્યોને આપી છે. ગુરુઓના ભાગ્યમાં રોવાનું હોય છે ! પરંતુ 'આન જીવ પાઁવર કા જાના'... અમારી તો પામરતા છે. અમારી આસ્થા બે કોડીની છે.

પ્રલોભનની ફૂંકથી ઉડી જાય ! એ રાખ હોય છે, ભભૂતિ નથી હોતી. રાખ હોઇ શકે, માટી હોઇ શકે. 'ખલ બન પાવક'...

યહ ગુન સાધન તે નહિ હોઇ...

દ્રષ્ટિનો દોષ મનની કામનાઓ. આપણે પ્રયાસ જરૂર કરીએ, પરંતુ પરિણામ તો કૃપા લાવશે. પરિણામ કૃપા લાવે છે, બીજું કોઇ નહીં. કૃપાથી પરિણામ મળે છે. તો શિષ્યોને માટે આસ્થાનું પ્રથમ સ્થાન જે મારી સમજમાં છે એ તમારી સેવામાં...'ખલ બન પાવક'. એ પાકી આસ્થા હોય કે (જુઓ પાનું ૨)

મારા ગુરુ મારી ખલનાને... અને ખલ તો અમારી અંદર છે, બહાર કયાં ખલ છે ? કયારેક કામ... કયારેક ક્રોધ...કયારેક દ્વેષ...કયારેક રાગ... કયારેક આ બધું... જે આપણા સૌની દશા...! હું તમારી સાથે સાથે જ ચાલી રહ્યો છું. અંદર શોધો....! એનાથી કોણ મુકત કરશે ? હવે બહાર આગ લાગે તો બંબા બોલાવો. પાણીનાં ટેન્કર બોલાવો. પરંતુ અંદર સંતાપ લાગે તો કયા પાણીથી એને બૂઝાવશો ? ત્યાં તો કૃપાલેપન જ કામ કરે છે, બીજી કોઇ ચીજ કામ નથી આવતી, હા. તો પહેલી આસ્થા, હું જે સમજી રહ્યો છું કે મારા ગુરુ મારા વિકારોને મિટાવશે, પરંતુ જ્યારે ગુરુમાં દૃઢ ભાવ હોય ત્યારે જ એ બને. આસ્થા બદલી, ગુરુ નથી હટતા, તમે હટી જાવ છો ! છતાં પણ ગુરુ દૂરથી નજર રાખે

નારાયણસરોવર-કોટેશ્વર પ્રવાસનક્ષેત્રે સજ્જ થઇ રહ્યાં છે

પુરાણ પ્રસિદ્ધ નારાયણસરોવર હવે ન માત્ર ધાર્મિક આસ્થાળુ કે યાત્રિકોને આકર્ષશે. પરંતુ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનું 'ધામ' બનવા તરફ પગલાં માંડી રહ્યું છે. ખારી અને રેતાળ હવાના આક્રમણે સદીઓ પુરાણા બાંધકામને ભારે ઘસારો પહોંચ્યો હતો. રસ્તા અને ઉતારા આવાસની કોઇ સરકારી સગવડ ન હતી. આવી સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવા રાજ્યના પ્રવાસન મંત્રાલય દ્વારા આખાય યાત્રાધામની કાયાપલટ કરવાનું કાર્ય છેલ્લા એક વર્ષથી ધમધોકાર ચાલી રહ્યું છે.

જૂની ઇમારતોની મરમ્મતથી લઇ આંતરિક રસ્તા, પ્રવેશદ્વાર, યાત્રિક ઉતારા, સ્નાનાગાર, બગીચા, સ્ટેશન, બાલક્રીડાંગણ સાથે વૃક્ષારોપણનો સમાવેશ

દેશની સુરક્ષા અને નાપાક પ્રવૃત્તિઓને નજરમાં રાખવા વ્યૂહાત્મક રીતે મહત્ત્વના કોટેશ્વર બંદરે મંદિર અને જેટીની દિવાલને સલામત સ્તરે લઇ જવાયા છે તો સહેલાણીઓ માટે પાણીની વ્યવસ્થા, ચાલવા, બેસવા, દરિયા કિનારે ભોજન-આરામ કરવા વિશેષ પ્રકારના ડોમ બનાવાયા છે. સ્થળની પૌરાણિકતા અને સ્થાપત્ય જળવાઇ રહે તે માટે ખાસ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરાયો છે. ગામમાં પ્રવેશતાં જ બંનેબાજુ વૃક્ષારોપણના ગાર્ડ નજરે પડે છે. ડાબી બાજુ મૂળ સરોવરને ફરતે ૧૨૦૦ મીટર લાંબી આકર્ષક બાઉન્ડ્રી વોલ તીર્થ સ્થળને આગવો 'ટચ' આપે છે. સાડાપાંચ મીટર ઊંચી દીવાલમાં કોતરણી કરેલા પથ્થરો જીવંત બન્યા છે. સરોવર અંદર સ્નાનવિધિ કે, તર્પણક્રિયા કર્યા બાદ વસ્ત્રો બદલવા સહિતની ક્રિયાઓ માટે 'પે એન્ડ યુઝ' શૌચાલય- સ્નાનાગાર- નિર્માયું છે. ૧૫૦૦૦ ચો. મીટરનું મેલાગ્રાઉન્ડ જેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કથા, વ્યાખ્યાન માટે બસો ચો.મી.વાળો ઓપનએર કલામંચ સગવડથી ભરપૂર છે.

ગામના પ્રવેશદ્વારને ડબલ આર્ચ (કમાન)માં રૂપાંતરિત કરવાનું કાર્ય પ્રગતિમાં છે. જેની પહોળાઇ ૨૩ મી., ઊંચાઇ ૧૨ મીટર છે. સૌથી અગત્યના પાસાંમાં સહેલાણીને તીર્થસ્થાન તેમજ આવવા- રહેવા, આજુબાજુના પર્યટન સ્થળોની રજેરજની માહિતી મળે તે માટે ૧૪૦ ચો.મી.નું પ્રવાસી માહિતી કેન્દ્ર બનાવાઇ રહ્યું છે. બે બસ સ્ટોપ, પોલીસ ચોકી, ૧૦ કવાર્ટર જેમાં નારાયણસરોવર અને કોટેશ્વરમંદિરોના પૂજારી રહી શકશે.

કોટેશ્વરના દરિયા કિનારાને નયનરમ્ય બનાવવાઇ રહ્યો છે

તીર્થાટન
વસંત પટેલ

રાજાશાહીના સમયમાં સર્જાયેલ ગામગઢની ૪૮૦ મીટર લાંબી અને ૧૦ મીટર ઊંચી કિલ્લા દીવાલને સલામત તબક્કે લઇ જવાઇ છે. કોટેશ્વર મંદિરના રીનોવેશન, લક્ષ્મણ ગુફાથી નારાયણસરોવર વચ્ચેના ૬૫૦ મીટર રસ્તાને આકર્ષક બનાવાઇ રહ્યો છે. બંને તીર્થ વચ્ચેના ૧૮૦૦ મીટર રસ્તાને ૨૭ મીટર જેટલો પહોળો બનાવી બંને બાજુ બેસવા, નાસ્તો કરવા, આરામ કરવાની સગવડ રખાઇ છે. આકર્ષક અને શોભાયમાન કરતી ડિઝાઇનથી બનાવાયેલા આ રસ્તાની એકબાજુ ૨૧મી×૧૧મીનો પ્રવેશદ્વાર સહિત ત્રણ ગેટ છે. આખાય પરિસરના ધમધમાટને જોતાં ત્રણ હજાર ચો.મી. પાર્કિંગ, બારસો મીટર ચોક, એપ્રોચ રોડ મંદિર અને મુખ્ય રસ્તાને જોડશે.

હજારો યાત્રાળુઓના ઉતારા આવાસ માટે યાત્રી કોમ્પ્લેક્સ પણ બનાવાયું છે. સ્થાનિક ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીના પ્રયાસોથી ગામ અને કાર્ય વચ્ચે સુસંકલન સ્થાપિત થયું છે. વરસોથી સ્થાયી નાની-મોટી દુકાનો કે રોજગારીના સંસાધનોને વધુ બળ આપવા પ્રયાસ કરાયાં છે. સરહદી સલામતીને નજરમાં રાખવા બી.એસ.એફ.ના કમાન્ડન્ટ ચીફની સલાહ લેવાઇ છે. તેમની જરૂરિયાતોને અગ્રતા અપાઇ છે. સરપંચ હાસમ ભડાલાના જણાવ્યા પ્રમાણે સમગ્ર તીર્થનું જે રીતે કાર્ય ચાલી રહ્યું છે તે મુજબ આગામી છ માસમાં રોનક બદલાઇ જશે. પ્રવાસીઓની સગવડમાં વધારો થવાથી સંખ્યા પણ વધવાની આશા રાખી શકાય તેમ કહ્યું હતું. વિકાસ કાર્યના ઠેકેદારે સગૌરવ જણાવ્યું કે કચ્છના યાત્રાધામનો વિકાસ સરકાર દ્વારા થતો હોય ત્યારે સારું કાર્ય કરવાની અમારી પણ નૈતિક ફરજ બને છે.

પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલ, પ્રવાસન રાજ્યમંત્રી જયસુખ સુખડિયા પણ પ્રસંગોપાત અહીં આવ્યા છે. જરૂરી સૂચનો કરી કાર્યને વધુ ગુણવત્તાસભર બનાવ્યું છે. ક્યાંય અસંતોષને વકરવા અપાયો નથી તે સમગ્ર વિકાસકાર્યનું

નારાયણસરોવરના નૂતન પ્રવેશદ્વારનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે

પહેલાં પ્રાપ્તિ કે પહેલાં યોગ્યતા. આ બે મહત્ત્વના પ્રશ્ન છે. ઘણીવાર લોકો યોગ્યતા વિના જ ઘણી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરી લે છે અથવા તો માગી લે છે, પણ તેને પચાવવાની યોગ્યતા તેમની પાસે નથી હોતી તેથી તે પ્રાપ્તિ જ તેમના વિનાશમાં કારણ બની જાય છે. એટલે પહેલાં વસ્તુ નહીં, વસ્તુને પચાવવાની યોગ્યતા હોવી જરૂરી છે.

રાજા સૃંજયને બે મિત્રો હતા-એક પર્વત અને બીજો નારદ. બંને ઋષિકુમારો આનંદપૂર્વક રહેતા હતા. તેવામાં એક દિવસ એક કન્યા ત્યાં આવી ચઢી. તેનું રૂપ અને યૌવન છલોછલ હતું. તેથી આકર્ષાઇને મહર્ષિ પર્વતે કહ્યું કે ''આ કન્યા મને પ્રાપ્ત થાઓ. હું એને પત્ની બનાવવા માગું

સોનાનો રાજકુમાર

છું.'' બીજી તરફ નારદને પણ તેવી જ ઇચ્છા થઇ. બંને ઋષિઓ પેલી કન્યાને પોતપોતાની પત્ની બનાવવા માગતા હતા. બંને લડી પડ્યા. સ્ત્રીનું એક રૂપ મોહિની પણ છે. અથવા કહો કે તેનું મુખ્ય રૂપ જ મોહિની છે. તેને જોતાં જ લોકો મોહિત થઇ જાય. તેમાં ઋષિમુનિઓ પણ આવી જાય. સ્ત્રી જ્યારે મોહિની રૂપ ધારણ કરે ત્યારે ડુબાડનારી થઇ જાય પણ એ જ સ્ત્રી જ્યારે દુર્ગા રૂપ ધારણ કરે ત્યારે મારનારી થઇ જાય. બંને ઋષિઓએ એકબીજાને શાપ આપ્યો કે ''તું સ્વર્ગ નહીં જઇ શકે.'' મોહિત પુરુષ જ્યારે પોતાનો મોહ પૂરો કરવા કોઇ સ્ત્રીને પામવા પ્રયત્નો કરતો હોય ત્યારે વચ્ચે જે આડો આવે તેના ઉપર તેને તીવ્ર ક્રોધ આવે જ. એટલે શાણા પુરુષને આવા પ્રસંગે આડા ન થવું.

મહાભારતની જીવનકથાઓ
સ્વામી સચ્ચિદાનંદ

રાજા સૃંજયને પુત્ર ન હતો તેથી દુઃખી હતો. તેણે બ્રાહ્મણોને ખૂબ ભકિતભાવથી જમાડી સારી એવી દક્ષિણા આપી પ્રસન્ન કર્યા. પોતાને ઘેર પ્રસંગ હોય અને લોકોને આમંત્રણ આપીને બોલાવ્યા હોય તો તેમને યોગ્ય આદરસત્કાર કરીને રાખવા અને પૂર્ણ સંતુષ્ટ કરીને વિદાય કરવા. વિદાય થતાં તેમનું મન કચવાય નહિ તેનું ધ્યાન રાખવું. ઘણા લોકો વિદાય બગાડી દેતા હોય છે. જેથી આવનારા અસંતુષ્ટ થઇને કચવાતે મને વિદાય થતા હોય છે. આ યોગ્ય ન કહેવાય.

રાજાના વ્યવહારથી અને ઉદારતાથી બ્રાહ્મણો ખુશ થયા. તેમણે રાજાને આશીર્વાદ આપ્યો કે ''તારી જે ઇચ્છા હોય તે માગી લે'' રાજા સૃંજયે માગ્યું કે ''મને એવો પુત્ર આપો કે જેનાં મળ-મૂત્ર-લીંટ-પરસેવો વગેરે બધું જ સોનાનું થઇ જાય. મુનિએ તથાસ્તુ કહ્યું. પછી તો પુત્રનું બધું જ સુવર્ણમય થવા લાગ્યું. તે રડે તો તેનાં આંસુ પણ સોનાનાં જ આવે. રાજાના ઘરમાં તો સોનું જ સોનું થઇ ગયું. પોતાના પુત્રનું બધું જ સોનું થવા લાગ્યું. મળ-મૂત્ર બધું જ સોનું. સોનામાંથી ગંધ નીકળતી હોય છે. જો સોનાને બરાબર છુપાવતાં ન આવડે તો દૂર દૂર સુધી તેની ગંધ પ્રસરે છે. સોનાની ગંધ લૂંટારાઓને આવી ગઇ. કારણ કે રાજાએ મહેલમાં પલંગ-ખુરશી, વાસણ-કુસણ બધું જ સોનાનું બનાવી દીધું હતું. એક રાત્રે ચોરો મહેલમાં ઘૂસી ગયા. તેમણે પેલા રાજકુમારનું જ હરણ કરી લીધું. અને આમાં જ બધું સોનું ભર્યું છે તેમ સમજીને તેને મારી નાખ્યો. તેના ટુકડા કરીને જોયું તો ક્યાંય સોનું ન હતું. છેવટે એ બધા અંદર અંદર લડી મર્યા.

સોનું પેદા કરનાર પુત્રની હત્યાથી રાજા સૃંજયને ઘણો આઘાત લાગ્યો. નારદજી આવ્યા અને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. સોનું પ્રાપ્ત કરવાથી માણસ સુખી નથી થતો. રક્ષા કરતાં અને પચાવતાં ન આવડે તો મહાદુઃખનું કારણ પણ બની શકે છે.

નાગરાદિ શિખર પરંપરા

ગુજરાતમાં ઇસુની અગિયારમી-બારમી સદી દરમ્યાન ઉત્તમ દેવાલયોનું નિર્માણ થયું છે. આ સમયમાં વાસ્તુવિદ્યાના અમૂલ્ય ગ્રંથોની પણ રચના થઇ છે. માળવાના પરાક્રમી અને વિદ્વાન રાજા પરમાર ભોજદેવે (ઇ.સ. ૧૦૧૮-૧૦૬૦) 'સમરાંગણ સૂત્રધાર' નામનો ગ્રંથ લખ્યો હોવાનું વિદ્વાનો માને છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, પૃ. ૪૨૬), બીજો મહત્ત્વનો ગ્રંથ 'અપરાજિત પૃચ્છા' સોલંકી રાજા કુમારપાળના સમયમાં (ઇ.સ. ૧૧૪૪-૧૧૭૪) ભુવનદેવ આચાર્ય દ્વારા બારમી શતાબ્દીના ત્રીજા ચરણમાં લખાયો છે. ('મધુસૂદન ઢાકી અને હરિશંકર શાસ્ત્રી 'સૂર્યમંદિર' વિશેષાંક, પૃ. ૯૨, ૧૯૬૪,) 'દીપાર્ણવ'ના મૂળ ગ્રંથની રચના વિશ્વકર્માએ કરી હોવાનું માનવામાં આવે છે પરંતુ તેની ભાષાનો અભ્યાસ કરતાં આજના 'દીપાર્ણવ'ની રચના બારમી- તેરમી શતાબ્દીથી આગળ મૂકી શકાય તેમ નથી તેવું મંતવ્ય ક.મા. મુન્શી ધરાવે છે. (દીપાર્ણવ, પૃ. ૬, ૧૯૬૦)

'દીપાર્ણવ'માં દેવાલય નિમાર્ણ માટે અતિ ઉપયોગી માહિતી આપવામાં આવી છે. દેવાલય (પ્રાસદ)નો મંડોવર પૂરો થયા પછી

પુરાતત્ત્વ
દિનકર મહેતા

છાદ્ય કે પ્રહારના થર પછી શિખર શરૂ થાય છે. શિખરના મૂળ આડી રેખાના જેટલા ભાગ પાડવામાં આવે તે મુજબ શિખરનો પ્રકાર જાણી શકાય છે. જેમ કે પાંચ ભાગ પાડવામાં આવે તો પંચનાશક, સાત ભાગ પાડવામાં આવે તો સપ્તનાશક અને નવ ભાગ પાડવામાં આવે તો નવનાશક શિખર કહી શકાય. આ પ્રકારના શિખર કઇ રીતે બની શકે તેની વિગત તપાસીએ.

સાંધાર અને નિરંધાર પ્રાસાદના શિખર માટે તેનું નિયત પ્રમાણ લક્ષ્યમાં લઇ શિખરની પાયાની આડી રેખા નિશ્ચિત કરવામાં આવે છે. પંચનાશક શિખરની વાત કરીએ તો આ આડી રેખાના કુલ બત્રીસ ભાગ કરવા. મધ્યની રેખાને ભદ્ર અને તે સિવાયની રેખાને વાસ્તુગ્રંથોમાં ફાલના નામ આપવામાં આવેલાં છે. તે મુજબ પ્રથમ ફાલના બે ભાગ, બીજી ફાલના ત્રણ ભાગ, ત્રીજી ફાલના ચાર ભાગ અને આખું ભદ્ર ચૌદ ભાગનું કરવાનું હોય છે. દરેક ફાલના નિકાળા પા પા આંગળ રાખવાનું વિધાન છે. (આ બાબત સમજવા માટે રેખાચિત્ર વિશેષ ઉપયોગી થશે.) પંચનાશકની જેમ સપ્તનાશક અને નવનાશક શિખરનું નિર્માણ થઇ શકે.

શિખરના પાયાની વિગત પછી શિખરના ઉર્ધ્વમાન વિશે વાત કરીએ. સામાન્ય રીતે ઉર્ધ્વમાન પાયાના માપથી સવાયું, દોઢું કે બેગણું હોય તે ઇચ્છનીય છે. શિખરની ઉર્ધ્વરેખા જ્યાં સમાપ્ત થાય તેને સ્કંધ કહે છે. આ શિખરની પહોળાઇ સ્કંધ પાસે પાયાની પહોળાઇના સંદર્ભમાં પાંચ, સાડાપાંચ કે છ ભાગની હોવી જોઇએ. તેનાથી વધારે પહોળાઇના શિખર સુંદર લાગતા નથી. માનો કે સ્કંધ પાંચ ભાગનો કરવો છે તો સર્વ પ્રથમ પાયાની પહોળાઇના દશ ભાગ કરીએ. પાયાની રેખા અને ઉર્ધ્વરેખાને જોડીએ તો એક લંબચોરસ બનશે. હવે પાંચ ભાગના સ્કંધ માટે ઉપરના બંને બાજુના છેડેથી અઢી અઢી ભાગ છોડવાથી સ્કંધનું પ્રમાણ નક્કી થશે. બંને બાજુ જે ભાગ છોડવામાં આવે તેને વાસ્તુવિદ્યાના ગ્રંથમાં નમણ કહે છે. (રેખાકૃતિ જોવાથી વિશેષ સ્પષ્ટતા થશે.) આ રીતે નમણ છોડવાથી શિખર કમળપુષ્પની કળી જેવું સુંદર દ્રષ્ટિગોચર થશે.



શિખરની ઉપર કંઠ અથવા ગ્રીવા, તે પછી આમલક અથવા આમલસારા અને તેના પર કળશ આવે છે. અહીં ઉર્ધ્વમાને મંદિર પૂરું થાય છે. શિખરની રેખાના અનેક પ્રકાર વાસ્તુવિદ્યાના ગ્રંથમાં આપેલા છે. પરંતુ તેમાં ત્રણ મુખ્ય છે જે શિખરની અંતિમ રેખા સ્કંધ પાસે અટકી જાય તેને સ્કંધાંત રેખા કહે છે. આ સ્થિતિમાં આમલક સ્કંધના માપથી મોટું બહાર નીકળતું હોય છે. બીજો પ્રકાર ઘંટાંત છે. આ પ્રકારમાં રેખા સ્કંધથી આગળ નીકળી આમલક પાસે અટકી જાય છે અહીં આમલક સ્કંધથી નાનું થાય છે અને ત્રીજા પ્રકારમાં રેખા આમલકથી આગળ વધી કળશ સુધી જાય છે. અહીં આમલક વધારે નાનું થતું જાય છે. આને શિખાંત પ્રકાર કહે છે. આ પ્રકારો સામાન્ય રીતે પ્રાસાદની જાતિ પર આધારિત હોય છે. પ્રથમ પ્રકારનો ઉપયોગ નાગરાદિ જાતિના પ્રાસાદ માટે થાય છે જ્યારે બીજા અને ત્રીજા પ્રકારનો ઉપયોગ વિરાટ, ભૂમિજ અને વલભી આદિ જાતિના પ્રાસાદ માટે કરવામાં આવે છે. ગુજરાતમાં નાગરાદિ જાતિના પ્રાસાદ વિશેષ હોઇ અહીં સ્કંધાંત પ્રકારના શિખરની યોજના જોવા મળે છે.

Digitally Archived by: www.realpatidar.com/library

JANMABHOOMI GROUP

કચ્છમિત્ર

realpatidar.com

તા. ૦૭-૦૭-૨૦૧૧ ■ ગુરુવાર

શિષ્ટતા અને શાલીનતા વિનામૂલ્યે મળે છે, પરંતુ તેનાથી બધું જ ખરીદી શકાય છે.

કાળા નાણાંમાં કડકાઈ

વિદેશોમાં જમા કાળા નાણાંની તપાસ અને તેને દેશમાં પરત લાવવાના ઉપાયો પર દેખરેખ રાખવા માટે એક ઉચ્ચ કક્ષાની ખાસ તપાસ ટુકડીની રચના કરીને સર્વોચ્ચ અદાલતે એવો આડકતરો સંદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ગંભીર નથી. આ બાબતે અદાલતે સોઈ ઝાટકીને કહી દીધું છે કે કાળા નાણાં સંદર્ભે સરકારે લીધેલા પગલાં સામે તેને ભારે વાંધો છે. સર્વોચ્ચ અદાલતને એમ પણ જણાયું છેકે કાળા નાણાંની તપાસ સાવ અટકેલી છે. દેશની ટોચની અદાલતના આવા કડક વલણ બાદ સરકાર કયા મોઢે એમ કહી શકે કે તે કાળા નાણાં અંગે ગંભીર છે ? જો તે કાંઈ કહે તો પણ તેની વાત પર કોઈને ભરોસો થાય તેમ નથી. એ આશ્ચર્ય ન થવું જોઈએ કે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ સરકાર મોં છૂપાવતી હોવાનું જણાતી હતી, તેને બચાવ માટે કોઈ શબ્દ મળતા ન હોય તેમ કહેવું પડયું હતું કે અદાલતના નિર્ણયની નકલ મળી જાય પછી જ તે કોઈ પ્રતિભાવ આપી શકશે. પોતાની આવી દયનીય હાલત માટે સરકાર પોતે જ જવાબદાર છે. એમ જણાય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને અંકુશમાં લેવા માટે શું કરવાની જરૂરત છે તે સમજવા માટે સરકાર તૈયાર જ નથી. ભ્રષ્ટાચાર અને તેના બીજા સ્વરૂપ સમા કાળા નાણાં અંગે દેશના લોકો ક્ષુબ્ધ છે, પણ પોતે આ બાબતે ગંભીર હોવાની વાતો કરીને સરકાર પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી છે. સરકાર જો ખરેખર ગંભીર હોય તો આ મોરચે કશું નક્કર થતું કેમ જણાતું નથી ? એ વાત સાચી છે કે કાળા નાણાંને રાતોરાત ખતમ કરી શકાય તેમ નથી પણ સરકાર આ મુદ્દે સર્વોચ્ચ અદાલતને સંતુષ્ટ કરવામાં નિષ્ફળ શા માટે રહી છે ? સર્વોચ્ચ અદાલતે જે રીતે ખાસ તપાસ ટુકડી રચીને તેમાં વડી અદાલતના બે નિવૃત્ત ન્યાયાધીશોને સ્થાન આપવાની સાથે કહ્યું છે કે આ ખાસ ટુકડી કાળા નાણાંને પહોંચી વળવા માટે એક વ્યાપક કાર્યયોજના તૈયાર કરે - તેનાથી એમ સ્પષ્ટ રીતે જણાય છે કે તેને સરકાર પાસે જરા પણ આશા રહી નથી. આ બાબતની વધુ એક ખાતરી અદાલતે ખાસ તપાસ ટીમને કાળા નાણાંને લગતા તમામ મામલા તેના હાથમાં લઈ લેવા આપેલા આદેશથી થાય છે. સર્વોચ્ચ અદાલતે આ આદેશ કરતી વખતે તેની જરૂરત પર પ્રકાશ પાડયો છે - તેનાથી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે સરકારે આ મામલે રચેલી ત્રણ સભ્યોની સમિતિ દેખાવ માત્રની છે. આ પરિસ્થિતિમાં ખાસ તપાસ ટીમે વિદેશોમાં જમા કાળા નાણાંની તપાસ કરવા અને તેને પરત લાવવાના ઉપાયો કરવાની સાથે એમ પણ તપાસે કે કાળું નાણું કઈ રીતે એકઠું થાય છે અને તે પછી તેને કઈ રીતે દેશની બહાર લઈ જવાય છે. કાળા નાણાંના આ દુષ્ચક્રને તોડયા વગર દેશની અકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. એવી પણ આશંકા છે કે વિદેશી બેંકોમાં જમા કાળું નાણું દેશને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે. એ નિરાશાજનક છે કે લોકોની સાથે સર્વોચ્ચ અદાલત જે મુદ્દે ટોચની પ્રાથમિકતા આપી રહી છે તેના પર કેન્દ્ર સરકારને કોઈ ચિંતા જણાતી નથી.

બાંગલાદેશનો ભાંગરો

થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મનમોહનસિંહે તંત્રીઓ સાથેની બેઠકમાં બાંગલાદેશ અંગે કરેલું વિધાન આમ જોઈએ તો સરકારી નીતિનું પ્રતિબિંબ પાડતું નથી. આ વિધાન બાદ એક સરકારી નિવેદનમાં આ પાડોશી દેશ અંગે આપણા સંબંધોનું મહત્વ દર્શાવીને આ સંદર્ભમાં જાગેલા વિવાદનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વડાપ્રધાનના આ અસહજ વિધાનથી બન્ને દેશોના સંબંધોમાં થોડી ખટાશ તો જરૂર ઊભી થઈ છે. મનમોહનસિંહ એમ કહ્યું હતું કે બાંગલાદેશમાં જમાતે ઈસ્લામી સાથે ૨૫ ટકા લોકો ભારત વિરોધી અને આઈ.એસ.આઈ.ના નિયંત્રણ હેઠળ છે. હકીકતમાં જોઈએ તો આ આંકડા ઓછા કે વધુ હોઈ શકે છે પણ એ વાતથી ઈન્કાર થઈ શકે તેમ નથી કે બાંગલાદેશમાં આઈ.એસ.આઈ.ના સતત પ્રયાસોના પરિણામે ત્યાં ધીરે ધીરે કટ્ટરવાદી અને ભારત વિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. હાલે ત્યાં પરિસ્થિતિ એવી છે કે શેખ હસીનાને પણ તેમની સત્તા કાયમ રાખવા માટે થઈને ઘણી વખત પોતે ભારત વિરોધી હોવાનો દેખાવ કરવો પડે છે, જ્યારે હકીકતમાં તેઓ ભારત સાથે સારા સંબંધોના હિમાયતી ગણાય છે. આમે પણ શેખ હસીનાની સરકારની નીતિ ભારત સાથે સારા સંબંધ રાખવાની રહી છે. સત્તામાં આવ્યા બાદ આ સરકારે બાંગલાદેશની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃત્તિનું સંચાલન ન થવા દેવાનું વચન પાળીને ઉલ્ફા જેવા સંગઠનની કમર તોડી નાંખી હતી. ઉલ્ફાનો એક મોટો વર્ગ આજે આસામના વિકાસમાં સહભાગી થવા ઉત્સુક બન્યો છે તેનું મુખ્ય કારણ તેમને બાંગલાદેશમાંથી હાંકી કઢાયાનું છે. આ ઉપરાંત નદી જળ કરાર વગેરેમાં પણ શેખ હસીનાની સરકારનું વલણ ભારત માટે હકારાત્મક રહ્યું છે. આગામી થોડા દિવસમાં વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા ઢાકા જવાના છે અને આ વર્ષે વડા પ્રધાનના પોતાના બાંગલાદેશ પ્રવાસની વાત છે તેવામાં તેમનું આવું વિધાન સાવ બિનજરૂરી હતું. વળી આવા વિધાનોથી ભારતવિરોધી વાતાવરણને હવા મળતી હોય છે. જમાતે ઈસ્લામીએ આ વિધાનને મુદ્દો બનાવીને બાંગલાદેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. આમ જોઈએ તો ત્યાં જમાતે ઈસ્લામીની કોઈ ખાસ રાજકીય તાકાત નથી, પરંતુ તે ત્યાં બી.એન.પી.ની સાથે મળીને વાતાવરણને ડહોળી જરૂર શકે છે. સત્તાની બહાર રહેલા ખાલીદા ઝિયા આવી કોઈ તકની રાહમાં જ છે. શેખ હસીનાની સરકારનું અસ્તિત્વ આપણા માટે ફાયદાકારક હોવાથી આપણે એવું કશું કરવું જોઈએ નહિ કે જેનાથી ઢાકામાં અસ્થિરતા જાગે. આપણી વડાપ્રધાને પણ આ પ્રકારની ટિપ્પણી કરવાથી ખાસ દૂર રહેવું જોઈએ.

વરિષ્ઠ નાગરિકો માટે ઈન્ફલેશન ઈન્ડેક્સ્ડ બૉન્ડ - સમયનો તકાજો

મની પાવર

એસ. એસ. તારાપોર

ફુગાવાની સૌથી માઠી અસર પામતા હોય તો તે છે વરિષ્ઠ નાગરિકો. તેમને વધતા ફુગાવાની સામે કોઈ રક્ષણ નથી. કામ કરનારા લોકોનો અલ્પ હિસ્સો વધતાં જીવન નિભાવ ખર્ચની સામે ટકી શકે છે. બાકીના લોકો વધતા ફુગાવાની આગમાં શેકાઈ રહ્યા છે.

વરિષ્ઠ નાગરિકોની આવકનો મુખ્ય આધાર તેમની નાની-મોટી બચત પર મળતાં અલ્પ વળતરનો હોય છે. જ્યારે તેમની બચતના વાસ્તવિક મૂલ્યનું ધોવાણ થાય ત્યારે તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આવા સિનિયર સિટિઝનો માટે એક બચત યોજના સરકારે બનાવી છે, જેમાં પાંચ વર્ષ માટેની ડિપૉઝિટ પર તેમને વાર્ષિક નવ ટકા લેખે વ્યાજ મળે છે. આ રીતે વધુમાં વધુ રૂપિયા પંદર લાખ સુધીની રકમ મૂકી શકાય છે.

ફુગાવાનો વાર્ષિક દર ૭ ટકાનો ધારીએ તો સિનિયર સિટિઝનને ૬૦ વર્ષની વયથી આ ડિપૉઝિટ સુવિધાનો લાભ મળવો શરૂ થાય છે. તે ૬૫ વર્ષની વયનો થાય ત્યારે તેની રૂા. ૧૦૦ની મૂડીનું વાસ્તવિક મૂલ્ય ઘટીને રૂા. ૭૧ અને તે ૭૦ વર્ષનો થાય ત્યારે વધુ ઘટીને રૂા. ૬૫ થઈ ગયું હોય છે. તે ૭૫ વર્ષ સુધી જીવ્યો તો મૂડીનું મૂલ્ય ઘટીને માત્ર રૂા. ૩૬ રહ્યું હોય છે. આ રીતે વરિષ્ઠ નાગરિકો બહુ ઝડપથી કંગાળ બનતા જાય છે.

વરિષ્ઠ નાગરિકોની રૂા. ૧૫ લાખની બચત પર નવ ટકાના લેખે વર્ષે રૂા. ૧,૩૫,૦૦૦ અથવા દર મહિને રૂા. ૧૧,૨૫૦ વ્યાજ મળે છે. અત્યારની મોંઘવારીનો દર ૭ ટકા ચાલતો હોય ત્યારે વરિષ્ઠ નાગરિકોને ખરેખરું વળતર માત્ર બે ટકાનું મળે છે. બીજા શબ્દોમાં સિનિયર સિટિઝનના હાથમાં વળતર તદ્દન ઓછું હોય છે.

દેશમાં ઈન્ડેક્સ્ડ બૉન્ડ બહાર પાડવાની ચર્ચા છેલ્લાં ૧૫ વર્ષથી ચાલતી રહી છે. નેવુંના દાયકામાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ડેવલપમેન્ટ રિસર્ચ ગ્રુપ (ડીઆરજી) વતી ડૉ. વિકાસ ચિત્રે અને અન્યોએ આ માટે વિશેષ અહેવાલ તૈયાર કર્યો હતો. સરકાર આ દરખાસ્તને તપાસી રહી હતી ત્યારે તેના એક અધિકારીએ તેને ફગાવી દીધી એવું કહીને કે ફુગાવો કાબૂમાં નહીં લઈ શકાય તેથી સરકાર માટે ઈન્ડેક્સ્ડ બૉન્ડ બહાર પાડવાનું મોંઘું પુરવાર થશે.

આ ઉપરાંત એવી દલીલ પણ થઈ કે આવી યોજના વધતી જશે અને ઈન્ડેક્શેશન બૉન્ડ વ્યાપક બની જશે. ઈટલીમાં સિત્તેર અને એંસીના દાયકામાં ઉદ્ભવી હતી તેવી સ્કાલા મોબાઈલ (ફુગાવાને એડજસ્ટમેન્ટ કરવાની પ્રક્રિયા) પરિસ્થિતિ ભારતમાં પણ ઉદ્ભવે તેવો ડર બતાવવામાં આવ્યો. આ પ્રક્રિયામાં તમામ ચીજવસ્તુઓને ઈન્ડેક્ષની સાથે જોડી દેવામાં આવી, જેણે જબરદસ્ત ફુગાવાનું નિર્માણ કર્યું હતું.

ઈન્ડેક્સ્ડ બૉન્ડનો મુદ્દો ફરીથી ૨૦૦૩માં જાગ્યો. એ વેળા દાદા-દાદી બૉન્ડ નામે ઈન્ડેક્સ્ડ બૉન્ડ બહાર પાડવાનું વિચારવામાં આવ્યું હતું, પરંતુ ૨૦૦૪માં સરકાર બદલાતાં આ વિચાર પડતો મૂકવામાં આવ્યો.

આ એક દુઃખદ વિરોધાભાસ છે કે સરકારી અર્થશાસ્ત્રીઓ કેન્દ્ર, રાજ્ય સરકારના તથા પીએસયુ કંપનીઓના અને કૉર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓને ફુગાવાથી બચાવવાનું જરૂરી સમજે છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોને આવું રક્ષણ આપવાની વાત આવે ત્યારે તેઓ જાતજાતની ચિંતા અને ડર બતાવે છે.

કેટલાક નીતિ ઘડવૈયાઓએ સાચું નિદાન કર્યું છે કે ભારતે ફુગાવાનો સ્વીકાર્ય દર વાર્ષિક પાંચ ટકાથી વધારીને સાત ટકા કર્યો છે. ઘડવૈયાઓ ફુગાવો ઘટાડવાની જોરશોરથી હિમાયત કરતા હોય છે, પરંતુ સાથે એવુંય કહે છે કે ફુગાવો ડામવા જતાં આર્થિક વિકાસને અસર થવી જોઈએ નહીં. જો ઊંચા આર્થિક વિકાસદરનો લક્ષ્યાંક રાખવો હોય તો ફુગાવાનો દર નીચો રાખવો પડશે. ફુગાવો ડામવાનાં સંગીન પગલાં લીધાં વિનાં ઊંચો વિકાસદર પ્રાપ્ત કરી શકાશે, એવું માનવું ભૂલભરેલું છે.

ઈન્ડેક્સ્ડ બૉન્ડ કેવી રીતે કામ કરે ? નિષ્ણાતોની એ દલીલ સાચી છે કે અર્થતંત્રના વાસ્તવિક વિકાસદર કરતાં વાસ્તવિક વ્યાજદર ઊંચા હોય તો આર્થિક વિકાસદર ઘટે. અર્થતંત્રમાં મધ્યમ ગાળામાં વિકાસદર ૮ ટકાથી વધુ રહે તેવું લગભગ બધા અંદાજો સૂચવે છે. એવું કોઈ નથી કહેતું કે ઈન્ડેક્સ્ડ બૉન્ડે ૮ ટકાના દરે વાસ્તવિક ખાતરીબદ્ધ વ્યાજ ચૂકવવું જોઈએ. આપણે ચાર ટકાના વાસ્તવિક વ્યાજદર ચૂકવવાથી શરૂઆત કરીએ તો પણ તે પૂરતું ગણાશે. ફુગાવાના ૮ ટકાના દરની સરખામણીએ આ વ્યાજદર સાધારણ ગણાય.

અત્યારની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમની જેમ ઈન્ફલેશન ઈન્ડેક્સ્ડ બૉન્ડની રોકાણમર્યાદા પણ રૂા. ૧૫ લાખની હોવી જોઈએ. પાછલા વર્ષના ફુગાવાના દરના આધારે બૉન્ડના વ્યાજદરમાં ફુગાવાના દરનું એડજસ્ટમેન્ટ કરી શકાય. ઈન્ડેક્સ્ડ બૉન્ડ જો ચાર ટકાનો વાસ્તવિક વ્યાજદર ચૂકવવા માગતા હોય અને ફુગાવો ૭ ટકાનો હોય તો બૉન્ડધારકને હાથમાં ૧૧ ટકાનું વ્યાજ મળવું જોઈએ. ફુગાવો વધીને ૮ ટકા થાય તો બૉન્ડધારકને ૧૨ ટકાનું વ્યાજ મળે. ફુગાવાનો કયો દર-જથ્થાબંધ (હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ-ડબ્લ્યુપીઆઈ) કે ગ્રાહક (કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્ષ-સીપીઆઈ)નો સંદર્ભ જોડવામાં આવે તેની સ્પષ્ટતા પણ હોવી જરૂરી છે.

ફુગાવાનો સરેરાશ દર સાત ટકા હોય તો બૉન્ડધારકને પાકતી મુદતે એક સો રૂપિયાના રૂા. ૧૪૦ મળવા જોઈએ.

બીજા શબ્દોમાં બોન્ડધારકને મૂડી અને વળતરમાં ફુગાવાની સામે રક્ષણ મળવું જોઈએ. સત્તાવાળા ઈન્ફલેશન ઈન્ડેક્સ્ડ બૉન્ડ બહાર પાડે તો ફુગાવો ઘટાડવાના તેના મક્કમ ઈરાદાનું પ્રતિક ગણાશે. સરકારને ફુગાવો ઘટાડવા માટે પ્રોત્સાહન મળશે. વરિષ્ઠ નાગરિકોને ફુગાવા સામે રક્ષણ નહીં આપવું કે એ વરિષ્ઠો પ્રતિ અસંવેદનશીલ સમાજનું લક્ષણ છે. સિનિયર સિટિઝનો માટે ઈન્ડેક્સ્ડ બૉન્ડ બહાર પાડવાનો સમય આવી ગયો છે.

(સિન્ડિકેટેડ)

પ્રાસાદિક શૈલીની ટૂંકી વાર્તાનો સંગ્રહ



ગ્રંથ સમીપે

રજનીકાંત સોની

ટૂંકીવાર્તા સાહિત્યનો ખૂબ છેતરામણો પ્રકાર છે. દેખીતી રીતે સાવ સરળ એવી એની રચના હોય છે પરંતુ એનું કાઠું એવું નાજુક છે કે જરા સરખો બિનજરૂરી ભાર એને કથળાવી શકે છે. છતાં જેનામાં સર્જનશક્તિ હોય એને આ પ્રકાર આકર્ષ્યા વિના રહેતો નથી અને એ રીતે જ આપણને એના સર્જકો મળતા રહે છે.

કચ્છના જાણીતા તબીબ ડૉ. પુલિન વસાએ પણ ટૂંકીવાર્તા પર હાથ અજમાવ્યો છે. પુરાતત્ત્વ ક્ષેત્રે તેમનું પ્રદાન જાણીતું છે. નાની રાયણમાં સંશોધન કરીને તેમણે સિંધુકાલીન સભ્યતાથી લઈને ઈસુ પછીના ૬૦૦ વર્ષ સુધીના અતિ સુસંસ્કૃત માનવ વસવાટના તથા રોમ અને મધ્ય-પૂર્વ સાથેના વેપારી સંબંધોના પુરાવા ભેગા કરી જમીનમાં દટાયેલી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી છે.

તબીબીક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. હૃદયરોગની ઘેરબેઠાં સસ્તી સારવાર વિશેનો તેમનો શોધ નિબંધ હૃદયરોગની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સ્વીકારાયો હતો. આમ, લેખન પર તેમનો પ્રથમથી જ કાબૂ છે. વિવિધ રોગોની સરળ સમજ આપતું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે.

તેમનો ટૂંકીવાર્તાનો સંગ્રહ 'મેઘા' હાલમાં પ્રકાશિત થયો છે. કુદરત અને જીવનને નજીકથી અનુભવતી આ વાર્તાઓ સરળ અને પ્રાસાદિક શૈલીમાં લખાઈ છે. લેખકે પોતે નોંધ્યું છે કે માનવની શાશ્વત આકાંક્ષા, આશા, નિરાશા, પ્રેમ અને લાગણીની આ વાતો છે.

અહીં કુલ ૧૨ વાર્તા છે. એમાં પ્રકૃતિની સાથે તાદાત્મ્ય કેળવતી વાર્તા વટવૃક્ષ અને આનંદી વેલ છે. આ વાર્તામાં કોઈ માનવ પાત્ર નથી. લેખક પોતે એક વડ અને એક આનંદી વેલની વાત કરે છે. 'ચકલો' વાર્તામાં પણ ગામડામાં નોકરી માટે ગયેલી એક મહિલા તબીબને જીવનના કંટાળામાં 'ચકલા'એ કેવું પરિવર્તન આવ્યું તેની કથા છે.

માનવ સંબંધોની, સંવેદનની વાત કરતી વાર્તા 'મેઘા',

'માનસી', 'તંદ્રા', 'હંસા', 'જિજીવિષા' અને 'ડોસો'માં કથાનું તત્ત્વ તો છે પરંતુ લાગણીઓને વ્યક્ત કરવા માટે લેખકનું કથન વધુ જોવા મળે છે. સંવાદો પણ પ્રમાણમાં ઓછા છે.

'રાધારાણી' અને 'બુદ્ધ'ની વાર્તા જૂના સમયને લઈને આવી છે. રાધારાણીની કથા તો અનેક મધ્યકાલીન તેમજ આધુનિક કવિઓ આલેખતા જ રહ્યા છે. કૃષ્ણ ગોકુળ-વૃંદાવન છોડીને ગયા તે પછીની રાધાની મનોસ્થિતિનું અહીં સુંદર વર્ણન છે. તો 'બુદ્ધ'માં ગૌતમ બુદ્ધ જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કરી ગયા તે પછી તેમની પત્ની યશોધરાએ કઈ રીતે પોતાના પતિના આ પગલાંને ઉચિત ગણ્યું તેની સરસ વાત છે. એકંદરે આ વાર્તાઓ વાચનક્ષમ છે.

(મેઘા. ડૉ. પુલિન વસા, પ્રકાશક : પોતે, ૧૮, નંદનવન સોસાયટી, માંડવી-કચ્છ, પ્રાપ્તિસ્થાન : દર્શના પ્રિન્ટરી, જૈનપુરી પાછળ, એમ.ટી. માર્ગ, માંડવી-કચ્છ, પ્ર.આ. એપ્રિલ-૨૦૧૧, કિંમત રૂા. ૧૫૦)

મર્યો હોય ઈ જ મારગી

બુધવારની પરાગ પૂર્તિમાં નિયમિત રીતે આવતી 'મારગ' કટારના પ્રથમ ૫૭ લેખોનો સંચય પ્રગટ થઈ ચૂક્યો છે. આ ગ્રંથનો અગાઉ વિગતવાર પરિચય અપાઈ ગયો છે તેથી પુનરુક્તિ કરવી જરૂરી નથી. હવે આ પુસ્તક ઉપલબ્ધ છે. લેખક : જસુભાઈ સોની, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, ભુજમાં સસ્તા દરે પ્રાપ્તિસ્થાન : સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, મિરજાપર રોડ, ભુજ-કચ્છ, પ્ર.આ. ૨૦૧૧, કિંમત રૂા. ૩૫૦.

કચ્છી ભાષામાં ઉચ્ચાર અને લેખનમાં 'ફરક'

આરપાર

પ્રભાશંકર ફડકે

આષાઢી બીજ પૂર્તિમાં તંત્રીસ્થાને અંતર્ગત એક વિરલ વિષય પર આગવું ચિંતન પ્રસ્તુત કર્યું છે. સંસ્કૃત-પંડિત તેમજ મધ્યયુગીન સાહિત્યના વિરલ તજજ્ઞ, મુ. લાભશંકર પુરોહિતના પ્રવચનમાં વ્યકત થયેલી મૌલિક સંશોધન-મુદ્દો એમણે આજે ટાંક્યો છે. 'કચ્છીઓની તીવ્ર અને જબ્બર ભાષા જિજીવિષા તેમજ નિષભાષા તરફના અનન્ય લગાવ અંગે, જિત હિકડો કચ્છી વસે ઉતે ડિયાણી કચ્છ-એ કારાણી ઉકિત સાર્થક થવામાં કચ્છીઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં માદરે જબાનને લઈ ગયા અને સદીઓથી સાચવતા રહ્યા એ હકીકતનો મુખ્ય ફાળો છે. ધનજીભાઈ ભાનુશાલીએ ખાસ શોધખોળ કરીને મેળવેલો દેશ-વિદેશમાં વ્યાપ્ત કચ્છી ભાષીઓનો આંકડો હજી મોટો હોવાનો પૂરો સંભવ છે. કોઈએ આ વિષય પર પીએચ.ડી. કરવા જેવું છે.

લેખમાં સાથે સંત હરિદાસજી મહારાજના સંશોધનની નિપજ રૂપ અપૂર્વ નિષ્કર્ષ ટાંક્યો છે કે, કચ્છ એ 'શ્રોતીય' (શ્રવણ આધારિત) ભાષા હોઈ એની તુલના રુદ્રી સાથે થઈ શકે. આવું મૌલિક સંશોધન એક સંતની પાસેથી સાંપડે એ અત્યંત આદરપાત્ર ઘટના છે.

ભાષાશાસ્ત્રીઓ તો એટલી હદે કહે છે કે, કોઈ પણ ભાષાને સો ટકા ઊચ્ચાર અનુસાર લિપિબદ્ધ કરવાનું એટલે કે લેખનમાં ઉતારવાનું શક્ય નથી બનતું. સિંધીનેય આ મુશ્કેલી નડે છે. ખુદ અંગ્રેજીમાં ઉચ્ચાર અને લેખન વચ્ચે કેટલું બધું અંતર ડગલે ને પગલે આવતું હોય છે ? પણ એનાથી આપણે ટેવાઈ ગયા છીએ. એના BUT બટ અને PUT પુટ વચ્ચે દેખીતો ફરક છે. આપણા કવિ-પંડિત પ્રતાપરાય ત્રિવેદીએ આના કારણમાં 'બટ' સંસ્કૃત બત અને PUT (સંપુટના) પુટમાંથી આવ્યું હોવાનું વડોદરા યુનિ. જર્નલમાં એક લેખમાં જણાવેલ છે એવાં ઘણા ઉદાહરણો મળે. ઉચ્ચાર અને લેખનમાં અંગ્રેજી જેવી વિશ્વવ્યાપી ભાષામાં જાણે કે અરાજકતા જ છે ! Station શબ્દ હિન્દી પટ્ટાવાળા શિક્ષિતોને પણ ઈસ્ટેશન/અસ્ટેશન બોલવો પડે છે. એ લોકોમાં કેટલાક 'સ્થિર'ને 'અસ્થિર' કરી નાખે છે ! ફ્રેન્ચ ભાષાનો પક્ષી માટેનો શબ્દ 'oiseau' એમ લખાય પણ બોલાય 'વાઝો' ! પણ અંગ્રેજીમાં 'નોલેજ'માં આપણને ત્રણ અક્ષર ઘટક જણાય પણ લખાય knowledge એમ નવ નવ અક્ષરોમાં. (આના મૂળમાં 'જ્ઞા' ધાતુ પડેલો હોય પછી) એમાં slough સ્લફ (સર્પની કાંચળી), thought-થોટ, though-ધો અને bough-બાઉ એમ બોલાય તો cough-કફ ! ને through-થ્રૂ જ્યારે thorough-થર/થરો બોલાય.

તો ભારતીય ભાષાઓમાં ઊડીને આંખે વળગે, ચડે એવો દાખલો બંગાળી ભાષાનો છે. ત્યાં પ્રણવ મુખરજી 'પ્રોનોબ' બોલાય પણ લખાય અંગ્રેજીમાં પણ 'Pranab'. રવીન્દ્રનાથ 'રોબીન્દ્રો' બોલાય. ભજનના આમંત્રણથી હરખભેર ગયેલા પરભાષી 'ભોજન' વગર ના (ઘરે પણ) રહેલા-એવો વિનોદ મુંબઈમાં અમે સાંભળતા ! બાંગલામાં 'અ'નો ઉચ્ચાર 'અ' અને 'ઓ'ની વચ્ચેનો થાય છે. લખે 'ખાબ' (ખાઈશું), બોલે 'ખાબો' ! ત્યાં હ્રસ્વ ને દીર્ઘ 'ઇ-ઉ'નો એક જેવો જ ઉચ્ચાર થાય. 'એકેતાન' ત્યાં 'ઓઈકતાન' બોલાય. નિત્ય, 'નિત્તો'. તો અનુસ્વારનું ઉચ્ચારણ 'ગ' સાથે : 'હિમાંશુ' હિમાંગ્શુ' બોલાય. 'ક્ષ' તે 'ખ' રૂપે જ બોલાય.

ક્ષિતિજ ને ક્ષમા 'ખિતિજ' ને 'ખમા'(કચ્છીની જેમ જ) બોલાય. 'ણ'નો 'ન' બને, તો 'વ'નો 'બ' પણ લખવામાં નહીં. કોઈકે એક મહાનુભાવને કહેલું : 'યહાં હર કોઈ 'બકતા' હૈ, આપ ભી...'-એવી સ્થાનિક બોલી જેવું જ આ છે, કચ્છીની જેમ 'યાત્રા' 'જાત્રા' ને 'સિંહાસન' 'સિંઘાસન', પણ કચ્છી વિદ્વાનોની માફક લખવામાં એવો આગ્રહ ન રાખે.

આપણે કચ્છીભાષીઓ (વાચાળ વર્ગ) આપણી પોતાની ઉચ્ચરિત ભાષા અંગે વધુ પડતા સંવેદનશીલ અને 'ટચી' છીએ અને લિપિમાં -જોડણી પરત્વે સંપૂર્ણતાવાદી થવાના નાહક પ્રયત્ન કરતા જ રહી, કરતા જ રહીને standardisation (માનકીકરણ-પ્રમાણીકરણ)ને વિ...લ...મ્બમાં નાખતા રહ્યા છીએ. ૧૯૭૩માં સ્થપાયેલ કચ્છી ભાષાના એજન્ડામાં પ્રથમાગ્રતા આ લેખનની એકવાક્યતા -હતી, એમ 'કચ્છ કલામ'ની ફાઈલ ઉથલાવતાં ધ્યાનમાં આવ્યું ! વસ્તુતઃ લેખન એ બોલાતી ભાષાને અનુસરે છે અને ઉચ્ચારમાં પરિવર્તન આવતાં લેખને પણ વહેલા-મોડા એ અપનાવવું પડે છે, એમાં 'ખોટાં'-'સાચા'ના ભેદ લુપ્ત થાય છે.

બાકી 'લાભુદાદા'એ (મોરારિબાપુ આમ કહે)ના માનવીય મૌલિક ચિંતનના મુદ્દા ઉપસાવીને લેખમાં વાંચકોને લાભાન્વિત કર્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની આધ્યાત્મિક ભૂગોળ તૈયાર કરીને આ દિશામાં વિશેષ સંશોધન કરવાનો જે અનુરોધ કર્યો છે, તે મૂલ્યવાન છે અને અમારા જેવા વ્યાખ્યાન સમયે ઉપસ્થિત ન રહેનારની તરસ અંશતઃ છીપાવે છે. (જોકે, મુરબ્બીશ્રીએ સમય ચોરીને પણ ૧૫-૨૦ મિનિટ જાતે દર્શન-શ્રવણનો લાભ આપી ગયા એ પણ સદ્ભાગ્ય ગણીએ.)

ફરિયાદ

સ્વાગત કાર્યક્રમમાં મુંદરાને અન્યાય

કચ્છમિત્રના તા. ૨૪/૬ના અંકમાં સ્વાગત કાર્યક્રમમાં માંડવી તાલુકાના ૨૮માંથી ૨૬ પ્રશ્નોનો નિવેડો એ શીર્ષક હેઠળ તથા તા. ૨૫/૬ના અંકમાં નખત્રાણા તાલુકાના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત વિવિધ ૧૦ પ્રશ્નો રજૂ થયા વિગેરે સમાચાર વાંચ્યા. મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના ઓનલાઈન કાર્યક્રમમાં પ્રજાના વિવિધ પ્રશ્નોનો નિકાલ થાય અને વહીવટ પ્રજાલક્ષી બને એવા હેતુથી ગ્રામ્ય સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવે છે. હાલમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એ હેઠળ પ્રજાલક્ષી વહીવટ માત્ર ગુજરાતમાં જ શરૂ થયો છે. પરંતુ મુંદરા તાલુકામાં આ બાબતે જે અનુભવ થયેલા છે તે મુજબ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી, જેની ઓફિશિયલી પહોંચ પણ મેળવેલી હોવા છતાં જે તારીખે સ્વાગત કાર્યક્રમ હતો ત્યારે હાજર રહેવા માટે પત્રથી જાણ પણ કરવામાં આવી ન હતી. આ કાર્યક્રમ ઓનલાઈન હોવા છતાં જે બન્યું છે તે વિચારણા માગી લે છે.

મુંદરા -તુલસીદાસ એન. સ્વાલી

ગેસનો બાટલો રૂા. ૪૫૦માં ?

ભુજ તાલુકાની આહીરપટ્ટી પંથકના ગામડાઓમાં ઈન્ડેન ગેસ બોટલની કિંમત વસૂલવા વિતરકો મનમાની કરતા હોવાની બૂમરાણ ઊઠવા પામી છે. આ પંથકના ગામડામાં ગેસ વિતરક એજન્સી દ્વારા ગેસના બાટલાના રૂા. ૪૧૮નું બિલ આપવામાં આવે છે, પરંતુ ગ્રાહક પાસેથી રૂા. ૪૫૦ વસૂલ કરવામાં આવે છે. અન્ય એજન્સીના ગેસ બોટલ બિલની કિંમત પ્રમાણે મળતા હોય ત્યારે અમુક એજન્સીઓ આ વધારે રકમ વસૂલે તે યોગ્ય નથી. તંત્ર આ અંગે તપાસ કરી આ મનમાની નાબૂદ કરે તેવી લોકમાંગ ઊઠી છે.

રાયધણપર - કોઠારી સમીર પી.

પ્રસન્નતા



સ્વામી વિદિતઆત્માનંદજી

શાસ્ત્રો કહે છે કે સુખ કાંઈ બહાર નથી, સુખ તો મનુષ્યનો સ્વભાવ છે. મન જ્યારે શાંત હોય ત્યારે આ સ્વાભાવિક સુખનો અનુભવ તેને થતો હોય છે.

હું પૈસા એકઠા કરવા માટે જૂઠનો, પ્રપંચનો, અપ્રામાણિકતાનો આશ્રય લઉં. એ દ્વારા કદાચ હું ઘણા બધા પૈસા એકઠા કરવામાં સફળ થાઉં, પરંતુ આ પૈસા ભેગા કરવા પાછળનો હેતુ શો હતો ? હું આનંદમાં, સુખમાં રહું, પણ હું સુખી ક્યારે રહી શકું ? જ્યારે મારું મન સ્વસ્થ હોય, શાંત હોય ત્યારે, પરંતુ સુખપ્રાપ્તિ માટેની પ્રક્રિયામાં જીવનનાં મૂલ્યોનો ભોગ આપીને હું મનમાં સંઘર્ષો વહોરી લેતો હોઉં, મનની શાંતિ-સ્વસ્થતા જ જો ગુમાવી દેતો હોઉં, મન જ ખોઈ બેસતો હોઉં તો જીવનમાં સગવડ તો બધી જ મળશે, પરંતુ શાંતિ, સુખ નહીં મળે એટલે ધર્મથી, જીવનનાં મૂલ્યોના આચરણથી જે પ્રાપ્ત થાય છે તે શાંતિ, સ્વસ્થતા, પ્રસન્નતા, સરળતા, સિદ્ધિ. પરંતુ આ ગુમાવીને આપણે બાહ્ય વસ્તુઓ, ધનસંપત્તિ, માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ તો પણ તેમનો કોઈ ઉપયોગ વ્યાવહારિક રીતે છે જ નહીં. ધનથી આપણે પુસ્તકો ખરીદી શકીએ, પરંતુ એ પુસ્તકોનું કરવાનું શું ? માત્ર છાજલીઓ જ શણગારવાની, કારણકે વાંચવા જેટલી મનની સ્વસ્થતા તો હું ગુમાવી બેઠો છું. આમ, પૈસાથી પુસ્તક ખરીદી શકાય, પરંતુ જ્ઞાન મેળવી શકાય નહીં. ધર્મના પાલન દ્વારા જ મનની સ્વસ્થતા અને તે થકી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, તેથી ધર્મ એ જ એકમાત્ર વ્યાવહારિક વસ્તુ છે. ધર્મનો ભોગ એટલે મારો પોતાનો જ ભોગ, તેથી ભગવાન કહે છે નિયતં કુરુ કર્મ ત્વમ્। ધર્મ પર આધારિત કર્મ કરવું એ જ તારે માટે યોગ્ય છે અને એ જ તારી ફરજ છે.

આમ સમપર્ણની, યજ્ઞની, ત્યાગની ભાવના ધર્મમાં અપેક્ષિત છે. પ્રામાણિકતા કે અહિંસાના પાલન માટે કોઈ ત્યાગની અપેક્ષા રહેવાની જ. સત્યનું પાલન કરવું હોય તો અસત્યનો ત્યાગ કરવો જ પડે અને અસત્યથી જે કાંઈ બાહ્ય લાભ મળવાનો હોય તે લાભનો પણ ત્યાગ કરવો પડે. અહિંસાનું પાલન કરવું હોય તો કોઈને ઈજા પહોંચાડવાથી મને જે લાભ મળતો હોય તેનો ત્યાગ કરવો જ પડે, તેથી ધર્મ મનુષ્ય પાસે સતત ત્યાગની અપેક્ષા રાખે છે. રામાયણ-મહાભારતમાં આપણે જોઈએ છીએ કે સત્યના પાલન માટે શ્રીરામચંદ્રજીને કે યુધિષ્ઠિરને કેટકેટલું સહન કરવું પડ્યું. શ્રીરામચંદ્રજીને ચૌદ વર્ષ વનમાં જવાની જરૂર શી ? વનમાં જવાનું પિતાજીએ સીધેસીધું કહ્યું નથી, માતાજીએ કહ્યું છે. પિતાજીએ આવી આજ્ઞા સ્પષ્ટ રીતે કરી હોત તો વાત જુદી હતી, છતાં એને પિતાના વચન તરીકે સ્વીકારીને ભગવાન વનમાં ચાલ્યા ગયા. અયોધ્યાના સઘળા લોકોએ એમને આગ્રહપૂર્વક કહ્યું કે, 'મહારાજ ! વનમાં ન જશો !' અર્વાચીન યુગમાં શ્રીરામચંદ્રજીની જગ્યાએ બીજો કોઈ હોય તો તરત કહે, 'રાજ્યની પ્રજા મારી સાથે છે માટે હું જ રાજ્યગાદી ઉપર બેસીશ, વનમાં નહીં જાઉં.' પરંતુ શ્રીરામચંદ્રજીએ આમ નથી કર્યું, કારણકે તેમને વચનનું કે ધર્મનું મૂલ્ય છે. તે જાણે છે કે ધર્મપાલન જ હિતકારી છે. તેમના મનમાં કેવી પ્રસન્નતા છે ! તુલસીદાસજી વર્ણન કરે છે કે રાજ્યાભિષેક થવાનો હતો તેથી તેમના મુખ પર હર્ષનો કોઈ આવેગ ન આવ્યો કે વનવાસમાં જવાનું છે જાણી જરાસરખી પણ ગ્લાનિ ન આવી. શ્રીરામચંદ્રજીના શ્રીમુખની પ્રસન્નતામાં કાંઈ જ પરિવર્તન નથી. ધર્મથી આપણે આ પ્રકારનું બળ પ્રાપ્ત કરી શકીએ છીએ.

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

જિલ્લાનોંધ

ભુજ : ગઢવી મહિલા મંડળ-કચ્છ : બેઠક તા. ૭ના સાંજે ૫ વાગ્યે વિરામહોટલ ખાતે. તમામ ગઢવી બહેનોની ઉપસ્થિતિમાં.

શેઠ ડી.એલ. લો કોલેજ : વર્ષ ૨૦૧૦-૧૧ના થર્ડ એલએલ.બી.ના મોન્સૂન સત્રમાં પ્રવેશ માટે તા. ૬થી ૯ સુધી સવારે ૯થી ૧૧.૩૦ દરમ્યાન ઓળખકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, ફી સાથે કાર્યાલયનો સંપર્ક કરવો.

વડનગરા નાગર મહિલા મંડળ : ગરબા તા. ૭ના સાંજે ૫.૩૦ વાગ્યે તાપી સાતમ નિમિત્તે હાટકેશ કોમ્પ્લેક્સ, છત્રીબારી ખાતે નાગર તેમજ નાગર બ્રાહ્મણ બહેનોની ઉપસ્થિતિમાં.

લોહાણા મહાજન સંચાલિત રઘુવંશી મેરેજ બ્યૂરો : લગ્ન ઇચ્છુક ઉમેદવારી ફોર્મ દર ગુરુવારે સાંજે ૪થી ૬ વાગ્યે, કતિરા પાર્ટી પ્લોટ, નવી લોહાણા મહાજનવાડી ખાતે બે પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે સંપર્ક : લતાબેન તન્ના-૯૮૭૯૦ ૧૪૨૭૫, જયાબેન ઠક્કર-૯૪૨૬૨ ૭૫૧૩૬.

રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો : સાપ્તાહિક બેઠક તા. ૭ના રાત્રે ૮.૩૦ વાગ્યે બાલભવન, ખેંગારપાર્ક ખાતે.

દિવ્ય જીવન સંઘ : સત્સંગ સભા તા. ૯ના સવારે ૧૦ વાગ્યે કિરીટભાઇ પાઠકના નિવાસસ્થાન, જૂની સિટીપોસ્ટ ઓફિસ સામે, નાના વોકળા ફળિયા ખાતે. ભજનામૃત બાદ જયંત પાઠક કબીર સાહેબના દોહાનું પઠન તથા સંસ્થા દ્વારા યોજાયેલી નિબંધ સ્પર્ધાના ગુરુપૂર્ણિમાના દિવસે ઇનામ વિતરણ અંગે ચર્ચા.

રામકૃષ્ણ યુવક મંડળ : વાર્ષિક સાધારણ સભા તા. ૧૦/૭ના સવારે ૧૦ વાગ્યે રામકૃષ્ણ પ્રાર્થના મંદિર સંસ્કારનગર મધ્યે.

દશનામ ગોસ્વામી સમાજ : કારોબારી/સલાહકાર સભ્યો, યુવક મંડળ તથા મહિલા મંડળની સરસ્વતી સન્માન માટેની સંયુક્ત બેઠક તા. ૮ના રાત્રે ૮ કલાકે સમાજવાડીમાં.

કચ્છ મેઘમારૂ વણકર મૈત્રીમંડળ ઉગમણું-પરગણું : સરસ્વતી સન્માન સમારંભ માટે માટે ધો. ૧થી ૧૨ અંગ્રેજી, ગુજ. માધ્યમ અને કોલેજના વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ તથા રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવનારે માર્કશીટની ઝેરોક્ષ ગામ પ્રતિનિધિ મારફત મંત્રી જે. પી. કુદેચા, મફતનગર ભુજોડી અથવા સીજુ દેવજી પચાણ-ભુજ ૯૯૭૯૭ ૧૬૨૯૨ને તા. ૧/૮ સુધી પહોંચાડવી.

SELF PRIMING MUD MONOBLOCK PUMP
BOREWELL/OPENWELL SUBMERSIBLE
SILVER®
PUMPS & MOTORS
PANKAJ ENGINEERS
DBZ-S-153, G.DHAM - (P) 231022

જોડી નં. 1
AMARON
હોમ ઈન્વર્ટર + ટ્યૂબ્યુલર બેટરી
અમૃતલાલ દેસાઈ એન્ડ કંુ.
સ્ટેશન રોડ, ભુજ. Ph.: 250055, 250207
ટાગોર રોડ, ગાંધીધામ. Ph.: 02836-222491

ક.વી.ઓ. જૈન મહાજન સંચાલિત પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી સાર્વજનિક દવાખાનાં : નવનીતનગર કોવઇનગર મધ્યે સોમથી શનિ ડો. કમલાબેન ગૌરી સવારે ૧૦થી ૧૨, ડો. મોહન ગઢવી (જનરલ પ્રેક્ટિસનર) સાંજે ૫થી ૭ સેવા રાહતદરે, માહિતી માટે સંપર્ક ૨૨૩૮૨૧, ૯૪૨૮૨ ૯૩૮૧૧.

ક. દ. શ્રી જૈન વણિક જ્ઞાતિ : મુંબઇ જ્ઞાતિ તરફથી લગ્નોત્સુકોની પત્રિકા જ્ઞાતિના કુટુમ્બોએ નકલ જ્ઞાતિની વાડીમાંથી કચેરીના સમય દરમિયાન મેળવી લેવી.

લોહાણા મહાજન શિક્ષણ સમિતિ : પુસ્તકો સાંજે ૫થી ૭ દરમ્યાન કાર્યાલયમાં જમા કરાવી જવા અને સરસ્વતી સન્માનના ફોર્મ પણ અપાશે, વધુ માહિતી માટે સંપર્ક જુગલ પૂજારા ૯૦૯૯૪ ૮૮૪૪૦, રાહુલ પૂજારા ૯૭૨૫૨ ૭૭૧૭૧.

રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર : સોમથી શનિ સવારે ૯થી ૧૧ સાંજે ૪.૩૦થી ૬.૩૦ દંતરોગ, સાંજે ૫.૩૦થી ૬.૩૦ હોમિયોપેથની સેવા રાહત દરે મેડિકલ સ્ટોર, એક્સ-રે, લેબોરેટરી, એમ્બ્યુલન્સ સેવા મળશે. ફરતું દવાખાનું સોમ, ગુરુ સવારે ૯થી ૧૦ મહાવીરનગર, ૧૦થી ૧૧ વાલદાસનગર, ૧૧થી ૧૨ કારીતાસનગર, ગણેશનગર, મંગળ અને શુક્ર સવારે ૯થી ૧૦ હુશેની ચોક, ૧૦થી ૧૧ ડી.પી. ચોક, ૧૧થી ૧૨ જીઆઇડીસી અભિયાન આવાસ, બુદ્ધ-શનિ ૯થી ૧૦ સંજોગનગર, ૧૦થી ૧૧ અંબાજી મંદિર પાસે, ૧૧થી ૧૨ ખ્વાજા ચોક, રહીમનગરી (જનરલ પ્રેક્ટિસનર)ની સેવા રાહત દરે સંપર્ક : ૨૨૩૮૨૧, ૯૪૨૮૨ ૯૩૮૧૧.

જિલ્લા મા. અને ઉ.મા. શાળાના આચાર્યો જોગ : ધો. ૧૨/૧૦ પૂરક પરીક્ષા જુલાઇ-૧૧ની રસીદ મેળવવામાં બાકી રહી ગયેલી શાળાઓએ દિન-૨માં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતેથી મેળવી લેવી.

માંડવી મૈત્રીવૃંદ-ભુજ : તા. ૧૧ના પાલારા ખાતે બેઠક. નામ નોંધાવવા સંપર્ક દક્ષાબેન ઝવેરી-૨૫૫૯૭૪, પુષ્પાબેન-૨૨૫૨૬૦.

મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ (યજ્ઞશાળા) : તા. ૮ના સાંજે ૬થી ૭ દરમ્યાન શક્રાદયના પાઠ, પાઠશાળા ખાતે જ્ઞાતિજનોની ઉપસ્થિતિ.

અમન-એ-હિંદ સેવા સાર્વજનિક ટ્રસ્ટ : શહેરના મુસ્લિમ સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ધો. ૧૦, ૧૨માં ૬૦ ટકા કે તેથી વધુ માર્ક મેળવેલ છે. તેમને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ માટે પ્રમાણપત્રની ખરી નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો અને સરનામા સહિત તા. ૧૪ સુધી મોહંમદહનીફ અલીમામદ કુરેશી- ૯૯૭૦૫ ૦૧૭૭૦, અ.શાહિદ સમેજા (એડવોકેટ)- ૯૮૨૫૮ ૫૭૩૩૫ને આપી જવી.

ક. ગુ. લોહાર યુવક મંડળ : સરસ્વતી સન્માનમાં ભાગ લેવા ધો. ૫થી કોલેજ સુધી ૫૫ ટકાથી ઉપર માર્કે પાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ લોહારવાડી, મહેશ પિત્રોડા, પિત્રોડા પ્રિન્ટર્સ, નવાવાસ-માધાપર તથા મેહુલ પિત્રોડા, શિવ કલેકશન, જૂનાવાસ-માધાપરને આપી જવી. સંપર્ક :૯૭૨૭૮ ૬૨૮૩૪.

ગાંધીધામ : દરરોજ આયુર્વેદ સર્વરોગ નિદાન શિબિર : લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક પ્રકારના રોગોનું આયુર્વેદિક પદ્ધતિ દ્વારા નિદાન દરરોજ સાંજે ૬.૩૦થી ૮ સુધી લાઇફ લાઇન આયુર્વેદિક મેડિકલ ડી.બી.ઝેડ. (સાઉથ) ૧૪૮, ઝંડાચોકની બાજુમાં, ઓમ કોર્નરની સામે (૦૨૮૩૬) ૨૨૫૦૩૦ પર સુરેશ મહેતાનો સંપર્ક કરવો.

અંજાર : આર્ટ ઓફ લિવિંગ : ડીએસએન ગુરુપૂજન તા. ૧૫થી ૧૭ દિવ્ય સમાજ નિર્વાણ કોર્સ રિપોર્ટિંગ તા. ૧૪ના સાંજે ૫ વાગ્યે ગુરુપૂજન-સત્સંગ તા. ૧૫ના સાંજે ૬થી ૭ વાગ્યે સંપર્ક : મનીષ સચદે-૯૮૨૫૫ ૦૯૯૮૫, ભાવિની પંડ્યા-૮૯૧૧૧ ૧૦૪૧૨.

અંજાર તા. તલાટી સહમંત્રી જોગ : બેઠક તા.૭ના જેમાં વર્ષ ૨૦૧૦/૧૧ના સામાન્ય રોકડમેળ નમૂના નં. ૩, વાર્ષિક સરવૈયા અને વાર્ષિક વહીવટી અહેવાલ સાથે ઉપસ્થિતિ.

મુંદરા : મહાવીર ખીચડીઘર : તા. ૭ના સાંજે ૫ વાગ્યે ગરીબો, મજૂરોની વસાહતમાં સેવબુંદી વિતરણ. સંપર્ક : હેમલતાબેન શાહ-૯૮૭૯૩ ૩૮૦૦૯.

નખત્રાણા : મારૂ કંસારા સોની જ્ઞાતિ યુવક મંડળ : સરવતી સન્માન તા. ૩૧ના યોજાશે - જેમાં ધો. ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની માર્કશીટની ઝેરોક્ષ પૂરાં સરનામાં સાથે પ્રફુલભાઇ કંસારા (ઉદય સ્ટેશનરી માર્ટ), પ્રકાશ કટ્ટા (હરિ ૐ વોચ)ને તા. ૮ સુધી આપી જવી.

નખત્રાણા : ગ્રામસભા : તા. ૭ના ૪ વાગ્યે ગ્રામ પંચાયત કચેરી ખાતે.

રાયણપર (ભુજ) : ચંદે (કોઠારી) પરિવાર આશાપુરા માતાજી મંડળ : તા. ૮ના માતાજીની પેડી ધીરજલાલ ઉમરશીં દ્વારા હવન, શ્રીફળ હોમ બપોરે ૧૨ વાગ્યે સમૂહપ્રસાદ બપોરે ૧ વાગ્યે.

માધાપર : દાદા ભગવાનનો સત્સંગ : તા. ૭ના રાત્રે ૯થી ૧૦.૩૦ વાગ્યા સુધી, નવી લાઇન. માહિતી માટે સંપર્ક : ૯૯૭૯૪ ૦૭૪૧૫.

આજનું પંચાંગ -ધરાદેવ

તારીખ : ૭-૦૭-૨૦૧૧, વાર : ગુરુવાર
તિથિ : અષાઢ સુદ ૭ (૨૫.૧૦ સુધી)
વિક્રમ સંવત : ૨૦૬૭, શાલિવાહન શાકે : ૧૯૩૩
હીજરી તા. ૫-૦૮-૧૪૩૨.
સૂર્યોદય : (ભુજ) આજે : ૬.૧૧, સૂર્યાસ્ત : (ભુજ) આજે : ૧૯.૪૧
સૂર્યોદય : (ભુજ) આવતીકાલે : ૬.૧૧.
-વિવસ્ત સપ્તમી.
ચંદ્ર નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની સ્ટા.ટા. ૧૬.૧૧ પછી હસ્ત.
યોગ : વરિયાન સ્ટા.ટા. ૨૩.૧૯ પછી પરિઘ.
કરણ : ગર સ્ટા.ટા. ૧૪.૨૦ સુધી.
આજનો દિવસ : શુભ છે.
ચંદ્ર રાશિ : કન્યા (પ.ઠ.ણ.)

આપની આજ

Ganeshaspeaks™ astrology by bejan daruwalla www.GaneshaSpeaks.com

ગુરુવાર, તા. ૦૭-૦૭-૨૦૧૧

મેષ (અ.લ.ઈ.)
આર્થિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્યવસાયમાં પણ નવી યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે.

તુલા (ર.ત.)
આજે આપે આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. માનસિક સ્વસ્થતા પણ ઓછી રહે. અવિચારી અને બેફામ વલણ આપને આફતમાં મૂકી શકે છે. વાણી પર સંયમ રાખવો પડશે. નહીંતર કોઇ સાથે ઝઘડો થવાની સંભાવના છે.

વૃષભ (બ.વ.ઉ.)
મહેનતના પ્રમાણમાં અલ્પ પરિણામ મળે છતાં આપ નિષ્ઠાપૂર્વક કામ આગળ વધારશો. આપના વિસ્તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો.

વૃશ્ચિક (ન.ય.)
ગણેશજીના આશીર્વાદથી નોકરી ધંધા અને વ્યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્ત્રોત વધશે.

મિથુન (ક.છ.ઘ.)
વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે નિર્ણયશક્તિનો અભાવ વર્તાશે.

ધન (ભ.ફ.ધ.ઢ.)
આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. પરોપકારની ભાવના આજે પ્રબળ રહેશે. આનંદ-પ્રમોદ સાથે આપનો દિવસ પસાર થાય.

કર્ક (ડ.હ.)
આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે. તેના કારણે આપનો આનંદ ઉત્સાહ બમણો થશે. મન તાજગી અને પ્રફુલિતા અનુભવશે. મિત્રો સગા સંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ પર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય.

મકર (ખ.જ.)
બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારસરણી અમલમાં મૂકશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્મકતા દેખાશે. છતાં મનના કોઇક ખૂણે આપને અસ્વસ્થતા અનુભવશો.

સિંહ (મ.ટ.)
લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામાં મુકશે. કાર્યમાં ધારી સફળતા ન મળે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્નેહીજનો સાથેના સંદેશાવ્યવહાર લાભદાયી નીવડે.

કુંભ (ગ.સ.શ.)
નકારાત્મક વિચારોથી મનમાં હતાશા જન્મશે, આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણીનો અનુભવ કરશો. ખર્ચ વધશે. વાણી પર સંયમ ન રહેવાના કારણે પરિવારમાં મનદુઃખ અને ઝઘડો થવાની સંભાવના છે.

કન્યા (પ.ઠ.ણ.)
આપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉપયોગી નીવડશે. વૈચારીક સમૃદ્ધિ વધશે. વેપાર-ધંધામાં લાભ સાથે સફળતા મળે, તન, મનનું આરોગ્ય જળવાશે. મિત્રો, સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય.

મીન (દ.ચ.ઝ.થ.)
ગણેશજીના આશીર્વાદથી આપનો વર્તમાન દિવસ (સુખશાંતિથી પસાર થશે) વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય છે. પતિ-પત્ની વચ્ચે દાંપત્યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્વજનો સાથે મિલન, મુલાકાત થાય.

ધો. ૧૦/૧૨ના પરીક્ષાર્થીઓએ શાળામાંથી રસીદ મેળવી લેવી

ભુજ, તા. ૬ : ધો. ૧૦/૧૨ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ રસીદ વિવિધ શાળાઓમાંથી મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.

ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ : રસીદ શાળામાંથી ૭.૩૦થી ૧૨.૩૦ સુધી મેળવી લેવી.

મા આશાપુરા અંગ્રેજી/ગુજરાતી માધ્યમ હાઇસ્કૂલ : પરીક્ષા પ્રવેશપત્ર ધો.૧૦ના વર્ગશિક્ષક પાસેથી શાળા સમય દરમ્યાન મેળવી લેવું.

શેઠ વી.ડી. હાઇસ્કૂલ : પરીક્ષાની ફી રસીદ શાળામાંથી તા. ૭થી ૮/૭ સુધી મેળવી લેવી.

બીએમસીબી પબ્લિક સ્કૂલ : વિદ્યાર્થીઓએ સવારે ૯થી ૧૧ દરમ્યાન પૂરક પરીક્ષાની રસીદો મેળવી લેવી.

કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ : રસીદ તા. ૭ સુધી શાળા સમય દરમ્યાન મેળવી લેવી.

માંડવી : રામકૃષ્ણ હાઇસ્કૂલ : ધો. ૧૦ની પરીક્ષા રસીદ શાળા સમય દરમ્યાન લઇ જવી.

માંડવી : ધો. ૧૦/૧૨ના વિદ્યાર્થીઓએ પ્રવેશિકા શાળામાંથી દેવુભા પાસેથી તા. ૮ સુધી મેળવી લેવી.

દયાપર (તા. લખપત) : સારસ્વતમ સંચાલિત હાઇસ્કૂલ : પૂરક પરીક્ષાના પરીક્ષાર્થીઓની પ્રવેશિકા તા. ૭ના રૂબરૂ મેળવી લેવી.

મુંદરા : આર.ડી. હાઇસ્કૂલ : ફી રસીદ ધો. ૧૦ની એમ.એચ. ઠક્કર તથા ધો.૧૨ની કે.જે. બારિયા પાસેથી તા. ૭ના શાળા સમય દરમ્યાન મેળવી લેવી. ધો. ૧૨ના ફોર્મ ભર્યા નથી તેમણે પણ રસીદ મેળવી લેવી.

ભચાઉ : લે.પા.બો. સંચાલિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા : ધો. ૧૦-૧૨ની રસીદ શાળા સમય દરમ્યાન મેળવી લેવી.

કચ્છ જિ. કેળવણી ખાતાના કર્મચારીઓની મંડળીની સામાન્યસભામાં ઉપસ્થિત અગ્રણીઓ, ઇન્સેટમાં ઓસમાણભાઇનું હજ કરવા બદલ સન્માન કરતા પ્રજ્ઞેશ છાયા.

જિલ્લા કેળવણી ખાતાના કર્મચારીઓની શરાફી મંડળીની સામાન્યસભા યોજાઇ

ભુજ, તા. ૬ : કચ્છ જિલ્લા કેળવણી ખાતાના કર્મચારીઓની શરાફી મંડળીની સામાન્યસભામાં મંડળીના સેવકનું હજ કરવા બદલ તેમજ દાન આપનાર સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મંડળીના પ્રમુખ પ્રજ્ઞેશ છાયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સંસ્થાના સેવક ઓસમાણભાઇનું હજ કરવા બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંડળીને આર્થિક યોગદાન આપનાર સજ્જનસિંહ જાડેજા, સુરેશ ગોર (માનદમંત્રી), કિશોર ચૌહાણ, શિવશંકર નાકર, ભગવતીબેન તન્ના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

દશરથ કાપડી, શાંતિલાલ ઠક્કર, હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ મંડળીની સહભાગિતા અને ઓડિટમાં સતત અ-વર્ગ જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભુજ તા. પ્રા.શિ.સ.ના પ્રમુખ વસંત ગોર, મહેશ ગોસ્વામી, જિતેન્દ્ર ઠક્કર, મહેશ રાજદે, ફતુભા જાડેજા, રોહિત ગોર, નીલેશ ગોર, મૃદુલાબેન ગોસ્વામી વિ.એ આયોજનમાં સહભાગી રહ્યા હતા. ધીરજ ઠક્કર, મમતાબેન અધિકારી, જરદોશ યોગેશ, ગૌરીશંકર, હિતેન સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન રાજેશ ગોરે તથા આભારવિધિ રશ્મિ ઠક્કરે કર્યા હતા.

ભુજમાં નેશનલ સાયન્સ સેમિનારનું ૩૦મીએ આયોજન

ભુજ, તા. ૬ : તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાના મુખ્ય હેતુથી નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યૂઝિયમ-મુંબઇ, નેહરુ સાયન્સ સેન્ટર-મુંબઇ, નેશનલ સાયન્સ સેન્ટર-દિલ્હી અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા નેશનલ સાયન્સ સેમિનાર-૧૧નું આયોજન કરાયું છે. જેમાં કચ્છ જિલ્લામાં સેમિનાર તા. ૩૦ના શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે યોજાશે. જેનું આયોજન ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર સંભાળશે.

આ સેમિનારનો વિષય માનવ કલ્યાણ માટે રસાયણ વિજ્ઞાન : આશાઓ અને ચિંતાઓ રહેશે જેમાં દરેક સ્કૂલમાંથી ધો.૮થી ૧૦ (મા. વિભાગ)નો એક વિદ્યાર્થી ભાગ લઇ શકશે. તાલુકા બહારથી આવતા વિદ્યાર્થી-શિક્ષકોને બસ ભાડું ચૂકવાશે. જિલ્લામાંથી પહેલા બે વિજેતાઓ રાજ્યકક્ષાના સેમિનારમાં ભાગ લેશે. ભાગ લેવા ઇચ્છતી શાળાઓએ વિદ્યાર્થી-શિક્ષકનું નામ તા. ૨૬ સુધી ધી ઇન્ડિયન પ્લેનેટરી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, બાલભવન, ખેંગારપાર્ક ખાતે મોકલવા. માહિતી માટે સંસ્થાનો ૩૨૬૩૪૩, ૯૯૨૫૧ ૩૯૪૨૫નો સંપર્ક કરવો.

શેઠ ડોસાભાઇ લાલચંદની જન્મજયંતી ઉજવાઇ

ભુજ, તા. ૬ : સત્યમ્ અને નરસિંહ મહેતાનગરના ઉપક્રમે દાનવીર શેઠ ડોસાભાઇ લાલચંદની જન્મજયંતી ઉજવાઇ હતી. આ પ્રસંગે બાળકો માટે વિવિધ સ્પર્ધા યોજાઇ હતી તેમજ પ્રતિમાને દર્શક અંતાણી, અનવર નોડે વિગેરેએ વંદના કરી હતી. કુંડા-કુંડી અને પક્ષીઘરનું વિતરણ કરાયું હતું. વિજેતા બાળકોને નગરસેવક દિલીપભાઇ શાહ અને માજી નગરસેવિકા હંસાબેન લાલન દ્વારા ઇનામો જે નગરપતિ શંકરભાઇ, ઉપપ્રમુખ મંજુલાબેન વોરા અને મુખ્ય અધિકારી ચેતન ડુડિયાના હસ્તે અપાયાં હતાં.

ભુજમાં ચાકી સમાજ પ્રમુખની સેવાઓને બિરદાવી સન્માન

કોટડા (ચકાર), તા. ૬ : ભુજ ખાતે મહેંદી કોલોની ખાતે જિલ્લા ચાકી સમાજની સમાજવાડીમાં બે મુદ્દત સુધી પ્રમુખ પદે રહેનારા અલીમામદ હારૂન માસ્તરની સેવાઓની સમાજે સન્માન કરીને નોંધ લીધી હતી.

તેમના હોદ્દાના સમય દરમ્યાન સમાજવાડીમાં નવીનીકરણ કરીને સમાજના દાતાઓના સહકારથી (જમાતખાના) ધાર્મિક-સાર્વજનિક પ્રસંગોએ અલગ બેસવા માટે તેમજ પડથાર સહિતના નવીનીકરણના કામો કરાવ્યા હતા. તેમણે જિલ્લાભરના સમાજમાં અંટશો-મનદુઃખો-મતભેદોના નિવારણ માટે પણ સહયોગ આપ્યો હતો. પ્રમુખ હાજી આરબ તેમજ સમાજના અગ્રણીઓ આદમભાઇ ચાકી, ફકીરમામદ ચાકી (પત્રકાર), હનીફ ચાકી સહિતના અગ્રણીઓએ અલીમામદ માસ્તર શહેર પ્રમુખ હાજી આમદભાઇ તેમજ હાજી લતીફના સન્માન કરીને સમાજે તેમની સેવાઓની નોંધ લઇ સન્માન કર્યા હતા.

રોટરી એજ્યુ. સોસાયટી દ્વારા કચ્છી ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા યોજાઇ

હરિપર (તા. ભુજ), તા. ૬ : આષાઢી બીજ - કચ્છી નવા વર્ષને આવકારવા રોટરી એજ્યુકેશન સોસાયટી દ્વારા 'કચ્છી ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પિટીશન' રોટરી અંગ્રેજી સ્કૂલ હરિપર ખાતે યોજાઇ હતી. જેમાં ભુજની વિવિધ શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત મેનેજિંગ ટ્રસ્ટી કિશોરભાઇ તન્ના, ક્લબના પ્રમુખ રાજેશ ઠક્કર, ઇલેક્ટેડ ગવર્નર આશિષ દેસાઇ, દિલીપ ઠક્કર તથા શાળાના પ્રિન્સિપાલ ગોપી ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્યથી કરાઇ હતી. નિર્ણાયક તરીકે લતાબેન તન્ના તથા કાજલબેન પરમારે સેવા આપી હતી. સ્પર્ધામાં ૩થી ૮ વર્ષના ગ્રુપ એમાં નિશી ઠક્કર, જય વેકરિયા, અયાન મોગલ તથા ૯થી ૧૪ વર્ષના ગ્રુપ બી.ના વિજેતા જિજ્ઞેશ ઠક્કર, હેતી ઠક્કર, મીરા ખંડોલ રહ્યા હતા.

ટીવી પરદે આજનું રૂપેરી રંજન



ઝી સિનેમા પર રાત્રે નવ કલાકે અપહરણ.

ઝી ક્લાસિક : ૯.૦૦-સુબહ ઓ-શ્યામ, ૧૨.૩૦-જેલયાત્રા, ૪.૩૦-સઝા, ૭.૩૦-જીવન મૃત્યુ, ૧૧.૧૫-ધોતી, લોટા ઔર ચોપાટી, **ઝી સિનેમા :** ૭.૩૦-મેરી બીવી કા જવાબ નહીં, ૧૧.૦૦-પેઇંગ ગેસ્ટ, ૨.૦૦-ક્યું કી...ઇટ્સ ફેટ, ૫.૩૦-પ્યાર તો હોના હી થા, ૯.૦૦-અપહરણ, **સ્ટાર ગોલ્ડ :** ૭.૦૦-મા-બેટી, ૧૦.૦૦-તેરે સંગ, ૧.૩૦-સ્વર્ગ, ૫.૩૦-હાઉસફુલ, ૯.૦૦-જાન, **સેટમેક્સ :** ૮.૩૦-સડક, ૧૧.૩૦-ક્રાંતિ, ૪.૦૦-યે કૈસા કર્ઝ, ૮.૦૦- રિશ્તે, ૧૨.૦૦-જવાબ, **સ્ટાર મૂવીઝ :** ૮.૩૦-પ્રિન્સ ઓફ પર્શીઆ, ૧૦.૩૦-મમી રિટર્ન્સ, ૧.૩૦-રાઇડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક, ૩.૩૦-ઓક્ટોપસી, ૬.૩૦-ડાઇ હાર્ડ ૪.૦, ૯.૦૦-રેમ્બો : ફર્સ્ટ બ્લડ પાર્ટી-ટુ, ૧૧.૦૦-ફોર યોર આઇઝ ઓન્લી.

કચ્છનું રૂપેરીરંજન



ભુજ		
સૂરમંદિર	■ દિલ્લી બેલી : ૧૨.૪૫, 3.30, 6.30, ૯.૪૫	
મોડર્ન	■ ડબલ ધમાલ : ૧૨.૪૦, 3.30, 6.30, ૯.૪૦	
રવિ	■ મસ્તાની ભાભી : ૧૧.૩૦, ૧.૦૦, 3.30, 6.30, ૮.૩૦	
સેવન સ્કાય	■ દિલ્લી બેલી : ૧૨.૪૫, ૩.૪૫, ૬.૪૫, ૯.૪૫	
	બુઢ્ઢા હોગા તેરા બાપ : ૧૨.૩૦, ૩.૩૦, ૬.૩૦, ૯.૩૦	
	ડબલ ધમાલ : ૧૨.૩૦, ૩.૩૦, ૬.૩૦, ૯.૩૦	
માધાપર		
સિતારા	■ બુઢ્ઢા હોગા તેરા બાપ : ૧૨.૪૫, ૩.૪૫, ૬.૪૫, ૯.૪૫	
અંજાર		
લક્ષ્મી	■ પ્રાઇવેટ સેક્રેટરી : સવારે ૧૦.૩૦	
	સમુંદર કે લૂટેરે : ૧૨.૩૦, ૩.૩૦, ૬.૩૦, ૯.૩૦	
આદિપુર		
વિનય	■ ડબલ ધમાલ : સવારે ૧૧.૦૦, ૧.૩૦	
	દિલ્લી બેલી : ૪, ૬.૧૦, ૧૦.૩૦ - બુઢ્ઢા હોગા તેરા બાપ : ૮.૧૦	
ગાંધીધામ		
ઓમ સિનેપ્લેક્સ	■ સ્ક્રીન-૧ : દિલ્લી બેલી : ૧૨.૪૫, ૩.૪૫, ૬.૦૦, ૮.૦૦, ૧૦	
	સ્ક્રીન-૨ : ડબલ ધમાલ : ૧૨.૩૦, ૭.૪૫ - બુઢ્ઢા હોગા તેરા બાપ : ૩.૧૫, ૫.૩૦, ૧૦.૧૫	
માંડવી		
લક્ષ્મી	■ ડબલ ધમાલ : ૨.૧૫, ૬.૧૫, ૯.૧૫	

આકાશવાણી

તા. ૭-૭-૧૧ ગુરુવાર

સવારે : ૬.૦૫ વિચારબિન્દુ : યોગ, ૬.૦૬ આરાધના, ૬.૩૦ અને ૧.૧૫ કૃષિ માહિતી : પાકમાં આંતરખેડનું મહત્ત્વ, ૬.૩૫ રામચરિત માનસ, ૬.૫૦ પ્રાદેશિક સમાચાર, ૭.૧૫ વંદના, ૭.૩૦ નિહારિકા : અમારી વિજ્ઞાનયાત્રા વિશે કુ. રિદ્ધિ વોરાનો વાર્તાલાપ, ૮.૩૦ વસુંધરા : જળ પ્રદૂષણ અને સમાજ : માલતી ભટ્ટ, ૮.૫૦ અને ૯.૦૫ ગીત સુધા, ૯.૧૫ મનોરંજન, ૯.૩૦ પ્રાયોજિત કાર્યક્રમ, ૯.૪૫ શાસ્ત્રીય સંગીત : પં. બસવરાજ રાજગુરુ : કંઠ્ય.

બપોરે : ૧૨.૩૦ પનઘટ, ૧.૩૦ જય ભારતી, ૨.૨૦ પ્રાદેશિક સમાચાર, ૨.૩૦ હિન્દી સમાચારનો સંકલિત કાર્યક્રમ, ૩.૦૦ ગીત ગુર્જરી : પરેશ ભટ્ટ, ૩.૧૫ કચ્છી લોકગીતો : હીરબાઇ મૂળજી અલાયા અને સાથી.

સાંજે : ૫.૦૫ ગુલમહોર, ૫.૩૦ સિન્ધી કાર્યક્રમ, ૫.૪૫ ગુજરાતી ભજન : ખેતશી દેવશી મહેશ્વરી, ૬.૩૦ યુવવાણી : રસનિધિ અંતાણીની જાગૃતિ કેસરિયા સાથે વાતચીત, ૭.૨૧ ગામજો ચોરો : ચોમાસુ ભૂતડીજી ખેતી : ૮.૦૦ ચિત્રપટ સંગીત, ૮.૩૦ હિન્દી સુગમ સંગીત, ૯.૧૬ વાર્તાલાપ, ૯.૩૦ રૂપક : કચ્છનું વણાટકામ : લે. ઉમરશી પરમાર, રજૂ. બિપિન ધોળકિયા, ૧૦.૦૦ આપણા પ્રશ્નો ડોક્ટરનું માર્ગદર્શન : મલેરિયા અંગેના શ્રોતાઓએ ફોન પર પૂછેલા પ્રશ્નોના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર મોંડે આપેલા ઉત્તરોનું સંકલન-સંકલન શ્રી જયેશ રાવલ, ૧૦.૩૦ શાસ્ત્રીય સંગીત : ૧. નકુલ મિશ્રા : તબલાવાદન, ૨. અનંતલાલ : શહેનાઇવાદન.

ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ભુજ, તા. ૬ : કચ્છમાં વિવિધ સ્થળોએ જૈન મુનિ, સાધ્વીજીઓના ચાતુર્માસ પ્રવેશની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે જેમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

વર્ધમાનનગરમાં વિમલનાથ-દાદાની પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત ચૈત્યપરિપાટી સહ પદયાત્રા સંઘનું આયોજન તા. ૯ શનિવારે કરાયું છે.

આચાર્યદેવ વિજય-ભક્તિસૂરિજી મ.સા. સમુદાયના જય-લાવણ્ય-સત્યાનંદજી મ.સા.ના શિષ્યા સાધ્વી અક્ષયાનંદજી મ.સા. આદિ ઠાણા-૫ના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ભુજ દાદાવાડી મધ્યેથી સવારે પાંચ વાગ્યે શરૂ થનાર પદયાત્રા સવારે ૮ વાગ્યે વર્ધમાનનગર પહોંચશે. જ્યાં જૈન સંઘ દ્વારા સામૈયું થશે. સવારે ૮.૩૦ કલાકે ઉપાશ્રયે માંગલિક શ્રવણ યોજાશે. નવકારશી સવારે ૯ કલાકે દર્શનના શ્રેયાર્થે હસ્તે સુલોચનાબેન ચમનલાલ શાહ તથા આયુષી, પ્રાયુષી, શ્રેયા હસ્તે પલ્લવીબેન ડુંગરશી ઠક્કર પરિવારો દ્વારા યોજાશે.

આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ : પ્રતિભાબાઇ મ.સ. ઠા. ૨નો ચાતુર્માસ પ્રવેશ તા. ૮/૭ શુક્રવારે સવારે 'પ્રાણ સ્મૃતિ આરાધના ભવન'થી ગામના મોટા સ્થાનકમાં સવારે ૯ કલાકે પધારશે. પ્રવેશ પ્રસંગે તથા સંઘ જમણ વાગડ બે-ચોવીસી સમાજવાડી ખાતે યોજાશે.

લુણી (તા. મુંદરા) : ગાદિપતિ પ્રાણલાલજી મ.સા. તથા કાર્યવાહક રમેશચંદ્રજી મ.સા.ના ચાતુર્માસ પ્રવેશ તા. ૯ના સવારે ૯.૧૫ વાગ્યે આઠ કોટિ મોટી પક્ષ જૈન ધર્મસ્થાનક ખાતે યોજાશે.

ભુજ તા. કોંગ્રેસ દ્વારા કાલે બેઠક

ભુજ, તા. ૬ : તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરજણભાઇ ભુડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ તથા તા.પં. વિપક્ષી નેતા સજુભા જાડેજાની ઉપસ્થિતિમાં તા. ૮ના ૧૧ કલાકે લોહાણા ભવન, વી. ડી. હાઇસ્કૂલ પાસે બેઠક યોજાશે. જેમાં પક્ષના સંગઠન, આગામી કાર્યક્રમો વિ. બાબતે ચર્ચા-વિચારણા હાથ ધરાશે. જેમાં વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બૂથ લેવલના ડેલિગેટ વિ. ઉપસ્થિત રહેશે.

મેરાઉ ગ્રામવાસીઓએ કચ્છી નવા વર્ષની ઉજવણી કરી

મેરાઉ (તા. માંડવી), તા. ૬ : મેરાઉ ગ્રામવાસીઓએ આષાઢી બીજની અનોખી ઉજવણી રૂપે ગામ પર જેમની કૃપા છે એવા સર્વમાન્ય હુસેનછા પીર પાસે કચ્છ અને રાષ્ટ્રમાં સારો વરસાદ થાય અને સર્વત્ર કુદરતની મહેર થાય તે માટે દુવા માંગી હતી. સર્વ જ્ઞાતિના ગ્રામવાસીઓએ વાસુપૂજ્ય જિનાલયથી મેરાઉ ગામના સરપંચ કરશન એમ. પિંડોરિયાની આગેવાની હેઠળ જુલૂસ આકારે વાજતે-ગાજતે પીરની દરગાહ પર ગયા હતા અને તેમણે સૌની ભલાઇ માટે બંદગી કરી હતી. ગ્રામવાસીઓએ ધણીબાવા અને હુસેનછા પીર પર પ્રસાદ-નિયાઝ ધરેલ એમ શ્યામ શાહે જણાવ્યું હતું.

શબ્દ વ્યાયામ

૧	૨		■	૩	■	૪		૫
૬		■	૭		૮		■	
■	૯	૧૦		■	■	■	૧૧	
૧૨			■	૧૩		૧૪		■
	■	૧૫	૧૬	■	■	૧૭		૧૮
૧૯	૨૦	■	૨૧		૨૨		■	
■	૨૩	૨૪		■	■	■	૨૫	
૨૬			■	૨૭		૨૮		■
	■	૨૯		■	■	૩૦		

આડી ચાવી
૧. દાણાદાર ખાંડ (૩)
૪. ......નો ગુલાલ (૩)
૬. ... યાત્રા કરી આવેલા હાજી તરીકે ઓળખાય છે (૨)
૭. રખેવાળ, ચોકિયાત (૪)
૯. પૂજા કરનાર પુરુષ (૩)
૧૧. 'નારી'નો વિરોધી (૨)
૧૨. તાપ (૩)
૧૩. પારકા પર જીવનારું (૪)
૧૫. દારૂગોળો ફેંકવાનું સાધન (૨)
૧૭. માનવજાતનો એ પૂર્વજ ગણાય છે (૩)
૧૯. એક ગ્રહ (૨)
૨૧. મોટો અકસ્માત (૪)
૨૩. ચારે તરફ (૩)
૨૫. હાથી (૨)
૨૬. એક કઠોળ (૩)
૨૭. સદ્ધર, સમૃદ્ધ (૪)
૨૯. ધર્મ પ્રમાણેનું આચરણ (૨)
૩૦. જળવાળું (૩)

ઊભી ચાવી
૧. ... માનવીની મતિને ભ્રમિત કરે છે (૨)
૨. રાગે ચડ્યો ... છુપે નહીં (૪)
૩. આંખની પૂતળી (૨)
૪. ફળની અંદરનો ગર્ભ (૨)
૫. બરાબર પરોવાયેલું (૩)
૭. ચોરનો ધંધો (૨)
૮. દાન કરનારું (૩)
૧૦. પાકો બંદોબસ્ત (૩)
૧૧. નવું (૩)
૧૨. આજ્ઞા (૩)
૧૪. ચોમાસામાં ...નો ઉપદ્રવ વધી જાય છે (૩)
૧૬. ત્રણ કલાક (૩)
૧૮. વિનોદ, મશ્કરી (૩)
૨૦. તાત્પર્ય, સાર (૩)
૨૨. રૂપાનું (૩)
૨૪. કથાઓમાં મોટી માનવ ... ઊમટે છે (૩)
૨૫. ... સરી ને વૈદ્ય વેરી (૩)
૨૬. આંસુ (૨)
૨૮. બે બાળકો ... છે (૨)

-કૃષ્ણકાંત ભાટીઆ

ઘ	મા	લ	■	ફા	ટ	ક	■	કા
■	ગ	પ	ગો	ળો	■	બા	દ	લું
સા	■	કા	ળ	■	કી	ટ	લી	■
ધુ	તા	રો	■	ની	ચ	■	લ	ક્ષ
■	રી	■	બ	ર	ક	ત	■	ણ
ક	ફ	■	હે	■	■	મા	જી	■
ડ	■	આ	રો	વા	રો	■	વ	ચ્ચે
વા	દ	ળ	■	■	શ	હી	દ	■
■	સ	સ	■	મા	ની	■	ચા	દ

Digitially Archived by: www.realpatidar.com/library

2011-07-07 -Kutch Mitra -Shamshuddin Obituary [412]

કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળીથી ઔદ્યોગિક ગાંધીધામ સુધીના સિક્સ લેન રોડનું કામ શરૂ થયું છે જે તસવીરમાં નજરે ચડે છે, રસ્તાની જર્જરિતતાનાં દર્શન પણ થાય છે. (તસવીર : દિલીપ ઠક્કર)

છ લેન માર્ગના ધમધમાટથી ગાજતો ભચાઉ તાલુકો

ભચાઉ, તા. ૬ : કચ્છના ઉંબરા સમાન ભચાઉ તાલુકાનું અનેરું મહત્ત્વ છે. ડુંગર, દરિયો અને રણની વચ્ચે આવેલા આ જિલ્લાના પ્રવેશદ્વારને અનેક ફાયદા મળે છે. કુદરતી રીતે ભૂકંપ બાદ સારા વરસાદે ખેતીનો વિકાસ કર્યો છે. મુંબઇ સાથેનો વાગડવાસીનો ધંધાકીય વહીવટ, ઉદ્યોગ, ખેતી, રેલવે, રસ્તા સુવિધા વધારે છે. વિશેષમાં કંડલા-સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ થઇ રહ્યું છે તે પણ આ તાલુકાને વિશેષ ઉપયોગી બનશે, પણ તે પહેલાં ભચાઉ શહેર અને તાલુકાના ગામડાંના માર્ગો, પુલ-પાપડી, રેલવે ફાટક, ખુલ્લા ફાટક, ઉબડખાબડ માર્ગોનું તાકીદે સમારકામ અને કેટલાક નવા માર્ગો ખૂબ જ જરૂરી છે.

પાંચેક વર્ષ પહેલાં કેન્દ્ર-રાજ્યની ખાસ ગ્રાન્ટમાંથી રાજ્યભરમાં જે શહેરોમાંથી રાજ્ય-રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોય તેને સુધારણા કરી વધુ પહોળા કરવા અને ફૂટપાથ, વિદ્યુત સ્ટ્રીટલાઇટથી સુંદર બનાવવાની વિકાસપથ યોજના હતી અને ભચાઉમાં સરકારી દવાખાનાં, કસ્ટમ ચોકડીથી રેલવે સ્ટેશન, રેલવે ક્રોસિંગ થઇ નવા ભચાઉ જતા ભૂકંપ પછી બનેલા રિંગ રોડ સુધી આ માર્ગ બંધાયો. હવે ફૂટપાથ ફાટી ગઇ છે. ડિવાઇડર હલકા સિમેન્ટના કારણે લગભગ છૂટા થઇ ગયા છે. ઉપરાંત દવાખાનાંથી રેલવે સ્ટેશન, વિસામા (શ્રીયુત મિત્રમંડળના વિશ્રાંતિગૃહ) સુધી રસ્તાની વચ્ચે તરફ વિદ્યુત પોલ ઊભા કરી સ્ટ્રીટલાઇટો મુકાઇ છે. જે દિવસે ખૂબ જ સુંદર લાગે છે પણ રાત્રે અંધારું જ રહે છે. આ લાઇટો માત્ર બે વખત ઝળહળી છે. એક સ્વર્ણિમ ગુજરાતના ઉજવણીના પ્રારંભે અને વિકાસપથના ઉદ્ઘાટન વખતે રાજ્યના મંત્રીઓ આવ્યા ત્યારે, તથા પછી કોઇ દિવસ બત્તી થઇ નથી. સરકારના દસેક લાખ રૂપિયા જેવી રકમ વેડફાઇ હોવાનો નગરનો આક્ષેપ છે.

વીજળીના આકર્ષક પોલની હાલત પણ દયાજનક છે, ક્યાંક પવનચક્કીના પાંખડાને લઇને પસાર થતા તોતિંગ વાહનોએ તોડી નાખ્યા છે, કોઇ જગ્યાએ ખટારાએ આડાટેળા કર્યા છે. કોઇ બત્તી પાલિકા કે અન્ય કચેરીવાળા લઇ ગયા છે. વીજબિલના પ્રશ્ને નગરપાલિકા મીટર જોડાણ ન લઇ શક્તાં યોજના પડી ભાંગી - સરકારના પૈસા વેડફાયા. આ યોજના વખતે તેનું સમારકામ અને વીજબિલના ખર્ચને કારણે રાજ્યમાં ઘણા શહેરો કે જ્યાં સ્ટ્રીટલાઇટ પડતી મુકાઇ હતી પરંતુ ભચાઉમાં જે તે વખતે પાલિકાના સત્તાવાળાઓની દરમ્યાનગીરીથી યોજના સાર્થક થઇ, પરંતુ તેને વીજપ્રવાહ ન મળતાં તો ક્યારેય ઝળહળી નહીં. આ માર્ગે ખૂબ જ વસ્તી હોવાથી લાઇટ જરૂરી છે. ભૂકંપ પછી કસ્ટમ તરફ નગરનો વિકાસ થયો, રેલવે સ્ટેશન-ભટપાળિયા, તાલુકા પંચાયત, પાવરહાઉસ, આણંદપુર અને બન્ને વચ્ચેની નવી વસાહતો, ઉદ્યોગ ફેક્ટરી, મીઠા કામદાર સહિતની અવરજવર વધી ગઇ છે, ત્યારે આ યોજના પુનઃ કોઇ નવા સ્વરૂપે શરૂ થાય તે જ જરૂરી છે.

ભચાઉની ભીતર

મનસુખ ઠક્કર

ભચાઉ નાનકડું ગામડું હતું તે વખતે ૧૯૫૦માં મીટરગેજ રેલવે લાઇન નખાઇ હતી, ત્યારે નવા ભચાઉ-ભવાનીપુર જતા માર્ગે ગાડા - ઢોરઢાંખર, ખેતરવાડીએ જઇ આવી શકે અને એ વિસ્તારના શિકરા-આંબરડી-બંધડી સહિતના ગામડાઓ માટે બંધાયેલા નાલા હવે ખૂબ જ નાના પડે છે. પુષ્કળ વરસાદ વરસે છે ત્યારે નાલા નકામા બને છે. કેટલાયે જણે બોર્ડિંગવાળા નાલામાં જીવ ગુમાવ્યા છે, ત્યારે આ નાલામાંથી વાહનવ્યવહાર સરળતાથી પસાર થઇ શકે તેવા મોટા બનાવવા જોઇએ. ઉપરાંત નવા ભચાઉ ફાટક ૨૪ કલાકમાં અનેક વખત બંધ હોય છે તેથી અહીં પુલ જરૂરી છે. નવા ભચાઉ ઉપરાંત યુરો સહિત અનેક ફેક્ટરી, ગ્રામ્યવિસ્તાર તેમજ વાડી-ખેતર જવાવાળા વર્ગને નવા ભચાઉ ફાટક ઉપર સમય ગુમાવવો પડે છે, જો રેલવે સ્ટેશનથી સામેના ભાગે ઠેઠ જૈન-પટેલ બોર્ડિંગ સુધી વસાહતો થઇ છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલ આવેલી છે. તે તમામને મુખ્ય ગામમાં આવવા ફાટક, રેલવે, નાલા અગવડ ભર્યા છે, વિસ્તૃતિકરણ જરૂરી છે. ભૂકંપ બાદ બટિયા-માનસરોવર જૈન-પટેલ બોર્ડિંગ વચ્ચે રિંગ રોડ બન્યા છે, તે સ્થળે ફાટક બંધાયું છે. સ્ટાફ ક્વાર્ટર તૈયાર છે પરંતુ ફાટક શરૂ ન થવાથી રોડનો કોઇ હેતુ સરતો નથી, માટે માનસરોવર વસાહત ફાટક શરૂ કરવાની તાતી જરૂર છે.

શાળા છે વાહન સંભાળીને ચલાવો

ભચાઉમાં નવા બસસ્ટેશન સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગની પેલેપાર સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી શાળા આવેલી છે, જ્યાં ગ્રામ્ય વિસ્તાર અને નગરના ૬૦૦થી વધુ વિદ્યાર્થી અવરજવર કરે છે. ઉપરાંત ભૂકંપ બાદ લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાએ દાનમાં બંધાવી આપેલું લાયન્સનગર, એ.બી. ઉપરાંત ખાનગી પ્લોટોમાં વસાહતો બંધાઇ છે. તેમને જવા-આવવા પાકા માર્ગની તાતી જરૂર છે. રાત્રે અંધારામાં કાચા માર્ગે એકલદોકલને ચાલીને જવું પડે, રિક્ષા જાય નહીં, જાય તો અમદાવાદ-ભાચાઉ જેટલું ભાડું થાય. આ સમસ્યા હલ થવી જરૂરી છે.

રસ્તો તદ્દન ભંગાર

ઉપરાંત નવા ભચાઉ-નવાગામ હાઇવેને જોડતો રસ્તો સાવ ભંગાર થયો છે. ઠેઠ મોરગર, કુંભારડી, દુધઇ સુધીના લોકો આ માર્ગે નીકળે છે. દિવસભર 'શટલ' તરીકે ઓળખાતા છકડા દોડે છે, તેમને પરેશાની થાય છે. આ માર્ગ અગાઉ રિંગ રોડ બનવાનો હતો, હવે ચાલવું દુષ્કર છે.

નગરના બહારી વિસ્તાર જ્યાં ટી.પી. સ્કીમ હતી નહીં ત્યાં રહી ગયેલા માર્ગો બંધાયા, કેટલાક સ્થળે સુંદર માર્ગ બંધાયા છે પરંતુ કેટલાક રહીશો પોતાના ઘરે પાણીની લાઇન હોય છતાં બીજી બારોબાર લેવા આ માર્ગ તોડે છે જે વાજબી નથી.

કંડલા-સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગનું વિસ્તૃતિકરણ વધુ સમૃદ્ધિ લાવશે પણ અન્ય નાના રસ્તા, પુલની જર્જરિત હાલત સુધારવામાં આવે તેવી ઊઠતી માંગ

દબાણ પૂરજોશમાં

નગરમાં ઠેરઠેર પાકા માર્ગો ઉપર ભેલપુરી, ચા, વગેરેના ધંધાર્થીઓ એંઠવાડ ઢોળે છે, ગંદકી તો ખરી પરંતુ સારા માર્ગ ભંગાર કરે છે. ઘણા ગટર યોજના હોવા છતાં - પોતાના ખાળ-કૂવા હોવા છતાં ઘરના વાસણકુસણ, કપડાંલતાં સાફ કરી પાણી રસ્તામાં વહાવે છે, જે સુંદરતા બગાડી અને ગંદકી કરે છે.

ઉપરાંત સામખિયાળી-જંગી-વાંઢિયા માર્ગ ભંગાર છે. કટારિયા લાકડિયા, ઉ. ગુજરાત, રાજસ્થાનના અને સૌરાષ્ટ્રના વાહનોને જોડતા ટૂંકા માર્ગની દશા ખરાબ છે. વોંધડા-વિજપાસર માર્ગ સુધારવાની જરૂર છે. મેઘપર-લાખાવટ ઉબડખાબડ માર્ગે છે. પુલિયા - વરસાદી પાપડી બંધાણી નથી, તો સામખિયાળી ઇ.ટી. કંપનીથી રામદેવપીર સુધી અને ત્યાંથી ભચાઉ-ચીરઇ, નંદગામ તથા ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળ સુધી રિંગ રોડ સાઇડમાં અનેક વાહનો દોડે છે, જે ભય પ્રેરે છે. જૂનાવાડા પાસે પુષ્કળ લોકો વસે છે. ત્યાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ નીકળે છે. ખાસ પોલીસ ગોઠવીને આવા બેફામ દોડતાં વાહનો પર રોક લગાવાય તેવી માંગ છે.

જમીન અને વાતાવરણ માફક આવવાના કારણે કચ્છમાં દેશી અને વિદેશી ખારેકના ઝાડનો આ રીતે લચી પડે તેટલો વિકાસ થયો છે. (તસવીર : રમેશ રોશિયા)

ખારેકની ખેતી કચ્છી કિસાનો માટે લાભદાયી

દેવપર ગઢ (તા. માંડવી), તા. ૬ : કચ્છના કિસાનોએ છેલ્લા બે દાયકાઓથી પરંપરાગત રોકડિયા પાકની ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ ઢળી ઉજ્જ્વળ ભવિષ્ય તરફ સફળતાથી પ્રગતિ કરવા લાગ્યા છે. એકતરફ ઔદ્યોગિ-કરણના કારણે જમીનોના વધતા જતા ભાવ અને બીજીતરફ ખેતપેદાશોના ઓછા ભાવના કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે આ પંથકના ધરતીપુત્રોએ બંજર જમીન પર આગવી કોઠાસૂઝથી ખારેકની બાગાયતી ખેતીક્ષેત્રે સોનેરી સિદ્ધિ મેળવી વૈશ્વિક બજારમાં કચ્છનો ડંકો વગાડયો છે.

વિદેશીને ટક્કર મારે તેવી દેશી ખારેકનું ઉત્પાદન અહીંના કિસાન દેવજી નિસર કરી કચ્છી મેવાનો મોસમમાં ગઢશીશાથી મુંબઇ સુધીની બજારમાં નામના મેળવી ખેડૂત તરીકે ગૌરવભેર જણાવે છે કે સાહસ કરવું એ કચ્છી કિસાનની નસેનસમાં સમાયેલું છે અને એટલે જ આ પંથકમાં પ્રારંભે કેસર કેરી અને ત્યારબાદ દેશી ખારેકમાં પણ સફળતા મળી છે.

સૂકા મુલક કચ્છમાં તાલુકાના મઉં મોટી અને આસપાસનો પંથક હરિયાળી માટે જાણીતો છે. શાકભાજીથી લઇને ફળફળાદિ માટે અહીંની જમીન અને પાણી બેય માફક આવતાં ખેતીવાડીમાં સારું ઉત્પાદન મળતું રહ્યું છે. પોલડિયા તરફના માર્ગે મકડા નજીક રત્નાપરના દેવજીભાઇ વાસાણીએ કચ્છની બાગાયતી ખેતીક્ષેત્રે કાઠું કાઢી સો એકર જમીનમાં ઇઝરાયલની વખણાયેલી બરાહી જાતની ખારેકના ૭૦૦૦ પ્લાન્ટ ઊભા કરી 'કચ્છી મેવા'નું ઉત્પાદન કરી રહ્યા છે.

માંડવી, નખત્રાણા અને ભુજ તાલુકામાં મોટાપાયે વાવેતર

કચ્છમાં ખારેકના ઉત્પાદન સંદર્ભેની માહિતી આપતાં મોહનભાઇ વાસાણીએ કહ્યું કે, કિસાન એવા ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલની પ્રેરણાથી અમે વર્ષ-૨૦૦૬ના પ્રારંભમાં ખાસ ઇઝરાયલથી ૪૦૦૦ રોપા મંગાવી ત્યાંના વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં અમે સો ટકા ડ્રીપ ઇરિગેશનથી વાવેતર કર્યું હતું. 'બરાહી' જાતની ખારેકની વિશેષતા સંદર્ભે આ ધરતીપુત્રનું કહેવું છે કે, પીળા રંગના ખારેકના ફળનો દેખાવ અને મીઠાશ એકસરખા હોય છે. વળી, ફળ ભરાવદાર હોઇ ઉત્પાદનમાં પણ સારો ફાયદો થાય છે. ખારેકના ઉત્પાદન સંદર્ભે આ કિસાનોનું માનવું છે કે ચાલુ વર્ષે વાતાવરણની આડઅસર છતાં પણ એક ઝાડ પર અંદાજે પચાસ કિલોનું ઉત્પાદન થશે જેથી સરેરાશે સોથી એકસો વીસ ટન ઉત્પાદન થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ઉત્પાદન બાદ દેશમાં અમદાવાદની સાથે પૂના, મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ અને બેંગ્લોર સુધી તો ગત વર્ષે લંડન મોકલાવેલા સેમ્પલ પાસ થતાં પ્રથમ વખત લંડનમાં પણ અહીંની ખારેક જશે. ગઢશીશાથી કોટડી મહાદેવપુરી તરફ જતા માર્ગે ચારેબાજુ ડુંગરાળ જમીન વચ્ચે આવેલી આ હરિયાળી વાડીમાં દરરોજ પચાસ ઉપરાંતના મજૂરો કામ કરી ગુજરાન ચલાવે છે. ઇઝરાયલની ઢબે કરાતી આધુનિક પેકિંગની વિવિધતા ધરાવતા શીતખંડ સહિત વૈજ્ઞાનિક ઢબે ચાલતા આ સીમલા ફાર્મની મુલાકાતે દેશના નામાંકિત કૃષિ વૈજ્ઞાનિકો ઉપરાંત ફ્રાન્સ સહિત વિદેશના વૈજ્ઞાનિકોએ અવારનવાર આવી બાગાયતી ખેતી વિષયક જાણકારી મેળવી છે. તો રાજ્યના કૃષિમંત્રીથી લઇને ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના કૃષિમંત્રીઓએ પણ મુલાકાત લઇ આધુનિક ખેતીથી પ્રશંસિત થયા હતા. કિસાનોએ ખારેકના ઝાડ પરના ફળને માખી, મચ્છર અને ભેજવાળા વાતાવરણથી બચાવવા ફળની લૂમ ફરતે પ્લાસ્ટિકની થેલીઓ વીંટાળી સુરક્ષા ઊભી કરી છે.

બરાહી ખારેકનું કચ્છમાં મઉં-રત્નાપર ઉપરાંત આસંબિયા, નખત્રાણા તાલુકાના વેરસલપર (રોહા), ભુજના રેલડી, બળદિયા અને રેહા સહિતના ગામડાંના ખેડૂતોએ મોટાપાયે વાવેતર કર્યું છે.

આષાઢી બીજે મુંદરામાં ટ્રાફિકના પાઠ શીખવાયા

ભુજ, તા. ૬ : કચ્છી નવા વર્ષને વિવિધ સંસ્થાઓએ નવતર કાર્યક્રમો સાથે આવકાર આપ્યો હતો. મુંદરામાં ટ્રાફિકના અભિનવ પાઠ શીખવવા તાલીમાર્થીઓએ ગુલાબના ફૂલથી અભિવાદન કર્યું હતું. ભુજમાં જાદુગરોએ જાદુકળા શીખવી હતી, તો પુનડી રોડ ખાતેના યોગ હોલમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ સમીક્ષકે નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

પુનડી રોડ પરના નવજીવન નેચર ક્યોર સેન્ટરમાં ફિલ્મ સમીક્ષક અમૃત ગંગરે નવા વર્ષની શુભકામના પાઠવી હતી. મણિલાલ ગાલાએ કચ્છી ગીત રજુ કર્યું હતું. સંસ્થાના સી.ઇ.ઓ ડો. સંતોષે ગોળપાપડી અને લાડુથી સૌને નવા વર્ષની શુભેચ્છા સાથે મોઢું મીઠું કરાવ્યું હતું. ચાર્લી ચેપ્લિનની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજુ કરાઇ હતી. આદિપુરના તબીબ અશોક આસરાનીએ ચાર્લી સર્કલ અને ચાર્લીના જીવન પ્રસંગોની જાણકારી આપી હતી. જાણીતા નાટ્ય કલાકાર એલ. એલ. ચિન્યારા ઉપસ્થિત રહ્યા હતા.

મુંદરામાં રોટરી કલબના ઉપક્રમે પીટીસી કોલેજના આદ્રા ઇન્ટર્નશિપ ગ્રુપ અને ધ્રબ શાળાના વિદ્યાર્થીઓએ ડો. આંબેડકરની પ્રતિમાને સ્નાનાદિ અને ફૂલહાર કરી દેશમાંથી મુંદરા તરફ આવતા વાહનચાલકો અને રાહદારીઓને ગુલાબનાં ફૂલ સાથે બ્રહ્માકુમારીઝના ટ્રાફિક સૂત્રો લખેલા શુભેચ્છા કાર્ડ સાથે મીઠું મોં કરાવી ટ્રાફિક શિક્ષણના અભિનવ પાઠ શીખવી કચ્છી નવા વર્ષની અનોખી ઉજવણી કરી હતી.

ભુજમાં જાદુગરોએ જાદુકળા શીખવી : પુનડીમાં ફિલ્મ સમીક્ષકે શુભકામના પાઠવી

પ્રારંભે અદિતી પરિવારવર્તુળના અધ્યક્ષ ભૂપેન્દ્ર મહેતા, રોટરી પ્રમુખ અ. ગનીભાઇ તુર્કના શુભેચ્છા સંદેશ બાદ સૌએ 'મુંજી માતૃભૂમિ કે નમન' કચ્છી રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. સચિનભાઇ ગણાત્રાએ આ અભિનવ પ્રયોગ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી જ્યારે હુસેનભાઇ તુર્કે કચ્છી નવા વર્ષની પૂર્વ ભૂમિકા સમજાવી હતી.

કોલેજના ગ્રુપના માર્ગદર્શક ડો. કેશુભાઇ મોરસાણિયા, ગ્રુપ લીડર કુ. હિના નંદાણિયા અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કવિ ઘરાનાએ સંચાલન કર્યું હતું. પોલીસ સ્ટાફ સહિત ખીમરાજભાઇ ગઢવી, ડો. હિતેશભાઇ કગથરા, હિતેષભાઇ પટેલ અને વાલજીભાઇ ગઢવી, ધ્રબના ઉપસરપંચ સુલતાનભાઇ અને સતારભાઇ મીઠાણી ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ અબ્દુલગનીભાઇ તુર્કે કરી હતી. ભુજમાં કચ્છના જાદુગરોએ કચ્છી નવા વર્ષની સંધ્યાએ કચ્છની જાદુકલા લોકોને ટાઉનહોલના પટાંગણમાં મફતમાં જાદુઇ શિક્ષણ આપ્યું હતું. મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો. જાદુનું શિક્ષણ જાદુગર જ્વાલા, જાદુગર રોબર્ટ, જાદુગર મયૂર, જાદુગર દિનેશ, ભરતવાળા તથા જાદુગર કૌશિકે આપ્યું હતું. આભારવિધિ જગદીશ ગોર ઉર્ફે જાદુગર જેન્ગોએ કરી હતી.

મુંદરામાં આષાઢી બીજે રોટરી કલબના ઉપક્રમે ટ્રાફિક નિયમોના પાલન માટે વાહનચાલકોને ગુલાબના ફૂલ અપાયા હતા ત્યારની તસવીર.

ભુજના પ્રમુખસ્વામી નગર અને મુંદરા રિલો. સાઇટના પ્રશ્નો ઉકેલવા માંગ કરાઇ

ભુજ, તા. ૬ : પ્રમુખ સ્વામી નગર અને મુંદરા રિલોકેશન સાઇટના લોકો લાઇટ ધાંધિયા, રસ્તાઓ, ઢોરો અને તેને જીવદયા રૂપે અપાતા રંજકા, ગટર ઊભરાવી વિ. પ્રશ્નોથી ત્રસ્ત થયા છે.

થોડા સમયથી ઉપરોકત વિસ્તારોમાં વીજતંત્ર દ્વારા રાત્રે તથા વહેલી સવારે લાઇટ કાપ અપાતાં વિદ્યાર્થીઓ સાથે સવારે નિત્યક્રમમાં પ્રવૃત્ત લોકો પરેશાન થાય છે. તેમજ રસ્તાના કામ દરમ્યાન ધૂળના ઢગલા અંગે અને રસ્તાની સફાઇ કરાવવા વિસ્તારના નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં કાંઇ થયું નથી. મુખ્ય રસ્તા પર થતી જીવદયા પ્રવૃત્તિમાં પશુઓને અપાતા રંજકાથી મુશ્કેલી સર્જાય છે. ઘણીવાર આખલાઓ જંગે ચડે છે ત્યારે લોકોની હાલત કફોડી થાય છે. સમગ્ર વિસ્તારમાં સફાઇના અભાવે કચરાના ગંજ ખડકાયા છે, તો ડસ્ટબીનો પણ નિયત જગ્યાએ ફરી મુકાતી નથી અને લોકો પણ કચરો બહાર જ ફેંકે છે. એકાદ માસથી આનંદ-મંગલ સામે વારેઘડીયે ગટર ઊભરાય છે, જેની અનેક વખત રજૂઆત પણ કરાઇ છે. અવારનવાર નગરપાલિકાના કર્મચારીઓ આવે છે અને જોઇને ચાલ્યા જાય છે અને આ પ્રશ્નોનો કોઇ ઉકેલ જ આવતો નથી. વરસાદ નજીક જ હોતાં નિયમિત સફાઇ થાય તેમજ અન્ય પ્રશ્નોનો પણ સત્વરે નિકાલ કરાય તેવી રજૂઆત કરતાં વિસ્તારના અગ્રણી જાદવજીભાઇ ઠક્કર (જાદુબાપા)એ યાદીમાં જણાવ્યું હતું.

સંસ્થા સમાચાર

દયાપર સમસ્ત બ્રહ્મસમાજ

દયાપર (તા. લખપત) : દયાપર સમસ્ત બ્રહ્મસમાજની કારોબારીના પ્રમુખ તરીકે વિનોદભાઇ ઝેડ. ગોર, મંત્રી : મુકેશભાઇ ટી. જોશી, ખજાનચી : વિશાલ એલ. ગોરની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

દયાપર પરશુરામ સના

દયાપર (તા. લખપત) : પરશુરામ સેનાની રચના કરાતાં પ્રમુખ તરીકે અનિલ એલ. જોશી, મંત્રી : પ્રશાંત ડી. જોશી, ખજાનચી : સની એસ. ગોરની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

રોટરી કલબ ઓફ માંડવી

માંડવી : આગામી વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરાતાં પ્રમુખ અરવિંદભાઇ શાહ, પાસ્ટ પ્રમુખ ડો. હર્ષદભાઇ ઉદ્દેશી, મંત્રી વસંતબેન સાયલ, પ્રમુખ ઇલેકટ સંદીપભાઇ શાહ, ઉપપ્રમુખ ડો. નિમિષભાઇ મહેતા, સહમંત્રી હસનભાઇ રાયમા, ખજાનચી હિમાન્સુભાઇ જેશરાણી, સાર્જન્ટ પ્રા. ડો. રાજેશભાઇ બસિયા, બોર્ડના પાંચ સહિત અન્ય હોદ્દેદારો વરાયા હતા.



રાજકીય નિમણૂક

ભચાઉ શહેર રાહુલ ગાંધી યુથ બ્રિગેડ

ભચાઉ : નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ : મહેન્દ્રસિંહ પી. જાડેજા, ઉપપ્રમુખ : રમેશભાઇ પી. શર્મા, મહામંત્રી : નકુલસિંહ કે. ઝાલા, મંત્રી : પ્રવીણદાન બી. ગઢવી.

ગાંધીધામ હોટેલ-રેસ્ટોરેન્ટ એસો.

ગાંધીધામ : હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિયેશનના નવા હોદ્દેદારોની નિમણૂક કરાઇ હતી જેમાં પ્રમુખ તરીકે શ્યામસિંહ રાઠોર (ફન એન્ડ ફૂડ), ઉપપ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ (જખુભા) જાડેજા (હોટલ આશાપુરા ઇન્ટરનેશનલ), નવીન એચ. આથા (હોટલ બોનાન્ઝા), મંત્રી તરીકે નંદલાલ ગોયલ (ચિરૂઝસ ફાસ્ટ ફૂડ), સહમંત્રી તરીકે શરદ શેટ્ટી (ચાવલા હોટલ), લલીત નવાની (જય રેસિડેન્સી), ખજાનચી તરીકે અતુલ મેસુરાની (હોટલ ગાંધીધામ) તેમજ નવ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી.

ભાજપ મીડિયા સેલના સહકન્વીનર વરાયા

ભુજ : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના સહ-કન્વિનર તરીકે જયંત સી. ઠક્કરની નિમણૂક કરાઇ છે.

ગાંધીધામ શિવસેના

ગાંધીધામ : તાલુકાના શિવસેનાના ઉપપ્રમુખ તરીકે મહેશ વેલજીભાઇ ચાવડાની અને આદિપુર વોર્ડ ૨/એ ૨/બીના શાખા પ્રમુખ તરીકે સુકેતુ વિનોદ જોશીની સર્વાનુમતે વરણી કરાઇ છે.

Digitially Archived by: www.realpatidar.com/library